"વેપારની કુંચી" માળા'

વિલાયતની હુંડીના હિસાબના તૈયાર કોઠાઓ.

"હુંડી ગણિત દર્પણ"

૦)ા આનાના ચડતા ભાવે

૧ શીલીંગ ૩ાા પેનીથી ૧ શીલીંગ ૪ાા પેની સુધી

દરેક ભાવના

પૌંડના રૂપીઆ અને રૂપીઆના પૌંડ

બનાવનાર

અલાદીન એમ. એચ. મેહેરઅલી.

પુસ્તકો વેચનાર—પ્રગટ કરનાર અને કમીશન એજંટ.

ડુંગરી બજાર પાસે—મુંબઈ.

આવૃત્તિ ૧ લી.

ઈ૦ સ૦ ૧૯૦૪ મે.

ધી રોયલ પ્રીન્ટીંગ પ્રેસમાં

ઇસુફઅલી અબદુલ તૈયબે છાપ્યું.

કીંમત રૂ. ૧.

એમ. એચ. મેહેરઅલીનાં પુસ્તકો.

ખાસ વાંચવા લાયક નવું પુસ્તક.

" કલજુગના કૌતક. "

સોનેરી ટોળી-વેપારી દાવપેચ વિચિત્ર અને ખરા બનાવ ફેસનની
ફિસ્યારી વગેરે.

રમુજ સાથે અકલ અને બોધ દુખીનો દોસ્ત, સુખીનો સાથી,
ફરમાસુ ચીના ટાકી વગેરે.

ખાસ ૩૦ ચિત્રો સાથે-કી. રૂ. ૧ વી. પી. પો. ૦)॥

લોકપ્રિય પુસ્તક.

" અરેબીયન નાઇટ્સ. "

સુંદર નવા ચિત્રોવાળી—આખી-બેઉ ભાગ સાથે
દરેક સ્ત્રી પુરૂષે આ તક ખોવી નહી.

કીમત રૂ. ૩ તોપણ હાલ રૂ ૧॥ વી પી. પો. રૂ. ૦।–

" પહેલું સુખ જે જાતે નર્યા " માટે ખરીદો.

" ટેબલ હકીમુ. "

રોજના ખોરાકની ચાલુ વસ્તુઓના ગુણ અવગુણ દરશાવનાર
ગુજરાતીમાં આ એકજ પુસ્તક.

કીમત રૂ. ૦॥ વી. પી પો ૦)=

જંગબાર-સ્વાહીલી કીનારા તરફ નવા જનારાઓ માટે
ગુજરાતી અક્ષરમાં.

" જંગબારી ભાષા. "

કી. ૦।= વી. પી. પો. ૦)=

વધુ વીગત પુસ્તકોનું લીસ્ટ મફત મગાવી વાંચો.

અલાદીન. એમ. એચ. મેહેરઅલી.

પુસ્તકો વેચનાર—પ્રગટ કરનાર અને કમીશન એજંટ.

કુંભારી બજાર પાસે—મુંબઈ.

વિલાયતની હુંડીઓપર લગાડવાના સ્ટેમ્પનો દર.

સને ૧૮૭૯ ના એક્ટ નંબર ૧ લા પ્રમાણે.

લંડનમાં પાઊંડ ઉપર.		એકજ બીલ ઉપર.		બે જોડાયલાં બીલ એક એક પર.		૩ જોડાયલા બીલ એક એક પર.	
રકમ કરતાં વધારે નહીં.		રૂ.	આ.	રૂ.	આ.	રૂ.	આ.
રૂપીઆ ૨૦૦	પાઊંડ ૨૦	...	૨	...	૧	...	૧
૪૦૦	૪૦	...	૪	...	૨	...	૨
૬૦૦	૬૦	...	૬	...	૩	...	૨
૧,૦૦૦	૧૦૦	...	૧૦	...	૫	...	૪
૧,૨૦૦	૧૨૦	...	૧૨	...	૬	...	૪
૧,૬૦૦	૧૬૦	૧	૧	...	૮	...	૬
૨,૫૦૦	૨૫૦	૧	૮	...	૧૨	...	૮
૫,૦૦૦	૫૦૦	૩	...	૧	૮	૧	...
૭,૫૦૦	૭૫૦	૪	૮	૨	૪	૧	૮
૧૦,૦૦૦	૧,૦૦૦	૬	...	૩	...	૨	...
૧૫,૦૦૦	૧,૫૦૦	૯	...	૪	૮	૩	...
૨૦,૦૦૦	૨,૦૦૦	૧૨	...	૬	...	૪	...
૨૫,૦૦૦	૨,૫૦૦	૧૫	...	૭	૮	૫	...
૩૦,૦૦૦	૩,૦૦૦	૧૮	...	૯	...	૬	...
૪૦,૦૦૦	૪,૦૦૦	૨૪	...	૧૨	...	૮	...
૫૦,૦૦૦	૫,૦૦૦	૩૦	...	૧૫	...	૧૦	...
૬૦,૦૦૦	૬,૦૦૦	૩૬	...	૧૮	...	૧૨	...
૭૦,૦૦૦	૭,૦૦૦	૪૨	...	૨૧	...	૧૪	...
૮૦,૦૦૦	૮,૦૦૦	૪૮	...	૨૪	...	૧૬	...
૯૦,૦૦૦	૯,૦૦૦	૫૪	...	૨૭	...	૧૮	...
૧,૦૦,૦૦૦	૧૦,૦૦૦	૬૦	...	૩૦	...	૨૦	...

પારીસમાં ફ્રાંન્કસ ઉપર.		એકજ બીલ ઉપર.		બે જોડાયલાં બીલ એક એક પર.		૩ જોડાયલા બીલ એક એક પર.	
રકમ કરતા વધારે નહીં.		રૂ.	આ.	રૂ.	આ.	રૂ.	આ.
રૂપીઆ ૨૦૦	ફ્રાં. ૫૦૦	...	૨	...	૧	...	૧
૪૦૦	૧,૦૦૦	...	૪	...	૨	...	૨
૬૦૦	૧,૫૦૦	...	૬	...	૩	...	૨
૧,૦૦૦	૨,૫૦૦	...	૧૦	...	૫	...	૪
૧,૨૦૦	૩,૦૦૦	...	૧૨	...	૬	...	૪
૧'૬૦૦	૪,૦૦૦	૧	...	...	૮	...	૬
૨,૫૦૦	૬.૨૫૦	૧	૮	...	૧૨	...	૮
૫,૦૦૦	૧૨,૫૦૦	૩	...	૧	૮	૧	...
૭,૫૦૦	૧.૮૭૫૦	૪	૮	૨	૪	૧	૮
૧૦,૦૦૦	૨,૫૦૦૦	૬	...	૩	...	૨	...
૧૫,૦૦૦	૩૭.૫૦૦	૯	...	૪	૮	૩	...
૨૦,૦૦૦	૫.૦૦૦૦	૧૨	...	૬	...	૪	...
૨૫,૦૦૦	૬,૨૫૦૦	૧૫	...	૭	૮	૫	...
૩૦,૦૦૦	૭,૫૦૦૦	૧૮	...	૯	...	૬	...
૪૦,૦૦૦	૧;૦૦,૦૦૦	૨૪	...	૧૨	...	૮	...
૫૦,૦૦૦	૧,૨૫,૦૦૦	૩૦	...	૧૫	...	૧૦	...
૬૦,૦૦૦	૧,૫૦,૦૦૦	૩૬	...	૧૮	...	૧૨	...
૭૦,૦૦૦	૧,૭૫,૦૦૦	૪૨	...	૨૧	...	૧૪	...
૮૦,૦૦૦	૨,૦૦,૦૦૦	૪૮	...	૨૪	...	૧૬	...
૯૦,૦૦૦	૨,૨૫,૦૦૦	૫૪	...	૨૭	...	૧૮	...
૧,૦૦,૦૦૦	૨,૫૦,૦૦૦	૬૦	...	૩૦	...	૨૦	...

(વીલાયતની હુંડી.) પૌંડનાં રૂપીઆ

પેન્સ	રૂપીઆ.	આ	પૈ.	દા	પાઊંડ	રૂપીઆ	આ	પા.	દા.
શી. ૧-૩ પેન્સ ૮ ચાનં.					૧-૩ ૭/૮ પે. (૧-[illegible])				
૧		૧		૩૮૭	૪	૬૧	૧૪	૧૧	૬૧૩
૨		૨	.	૭૭૪	૫	૭૭	૬	૮	૫૧૭
૩		૩	૧	૧૬૧	૬	૯૨	૧૪	૫	૪૨૦
૪		૪	૧	૫૪૮	૭	૧૦૮	૬	૨	૩૨૪
૫		૫	૧	૯૩૬	૮	૧૨૩	૧૩	૧૧	૨૨૭
૬		૬	૨	૩૨૩	૯	૧૩૯	૫	૮	૧૩૦
૭		૭	૨	૭૧૧	૧૦	૧૫૪	૧૩	૫	૦૩૩
૮		૮	૩	૦૯૮	૨૦	૩૦૯	૧૦	૧૦	૦૬૫
૯		૯	૩	૪૮૫	૩૦	૪૬૪	૮	૩	૦૯૭
૧૦		૧૦	૩	૮૭૨	૪૦	૬૧૯	૫	૮	૧૨૯
૧૧		૧૧	૪	૨૫૮	૫૦	૭૭૪	૩	૧	૧૬૧
શીલીંગ ૧		૧૨	૪	૬૪૬	૬૦	૯૨૯	..	૬	૧૯૩
૨	૧	૮	૯	૨૯૨	૭૦	૧,૦૮૩	૧૩	૧૧	૨૨૫
૩	૨	૫	૧	૯૩૭	૮૦	૧,૨૩૮	૧૧	૪	૨૫૭
૪	૩	૧	૬	૫૮૨	૯૦	૧,૩૯૩	૮	૯	૨૯૦
૫	૩	૧૩	૧૧	૨૨૭	૧૦૦	૧,૫૪૮	૬	૨	૩૨૨
૬	૪	૧૦	૩	૮૭૨	૨૦૦	૩,૦૯૬	૧૨	૪	૬૪૫
૭	૫	૬	૮	૫૧૭	૩૦૦	૪,૬૪૫	૨	૬	૯૬૮
૮	૬	૩	૧	૧૬૨	૪૦૦	૬,૧૯૩	૮	૯	૨૯૧
૯	૬	૧૫	૫	૮૦૭	૫૦૦	૭,૭૪૧	૧૪	૧૧	૬૧૪
૧૦	૭	૧૧	૧૦	૪૫૩	૬૦૦	૯,૨૯૦	૫	૧	૯૩૭
૧૧	૮	૮	૩	૦૯૯	૭૦૦	૧૦,૮૩૮	૧૧	૪	૨૬૦
૧૨	૯	૪	૭	૭૪૩	૮૦૦	૧૨,૩૮૭	૧	૬	૫૮૩
૧૩	૧૦	૧	...	૩૮૮	૯૦૦	૧૩,૯૩૫	૭	૮	૯૦૬
૧૪	૧૦	૧૩	૫	૦૩૪	૧,૦૦૦	૧૫,૪૮૩	૧૩	૧૧	૨૨૯
૧૫	૧૧	૯	૯	૬૮૦	૧,૫૦૦	૨૩,૨૨૫	૧૨	૧૦	૮૪૪
૧૬	૧૨	૬	૨	૩૨૫	૨,૦૦૦	૩૦,૯૬૭	૧૧	૧૦	૪૫૯
૧૭	૧૩	૨	૬	૯૭૦	૩,૦૦૦	૪૬,૪૫૧	૯	૯	૬૮૪
૧૮	૧૩	૧૪	૧૧	૬૧૫	૪,૦૦૦	૬૧,૯૩૫	૭	૮	૯૦૭
૧૯	૧૪	૧૧	૪	૨૬૧	૫,૦૦૦	૭૭,૪૧૯	૫	૮	૧૩૧
પાઊંડ ૧	૧૫	૭	૮	૯૦૩	૧૦,૦૦૦	૧,૫૪,૮૩૮	૧૧	૪	૨૬૨
૨	૩૦	૧૫	૫	૮૦૬	૨૦,૦૦૦	૩,૦૯,૬૭૭	૬	૮	૫૨૪
૩	૪૬	૭	૨	૭૧૦	૪૦,૦૦૦	૬,૧૯,૩૫૪	૧૩	૫	૦૪૮

શી. ૧–૩ પેન્સ ૮ આના.					શી. ૧–૩ ½ પે. (૧·૩.૧)				
પૈ.ભ	પાઉંડ.	શી.	પે	ફાર	રૂપીઆ	પાઉંડ	શી.	પે.	ફાર
૧				૦ ૩૨૩	૮		૧૦	૪	
૨				૦ ૬૪૬	૯		૧૧	૭	૨.
૩				૦ ૯૬૯	૧૦		૧૨	૧૧	
૪				૧ ૨૯૨	૨૦	૧	૫	૧૦	
૫				૧ ૬૧૬	૩૦	૧	૧૮	૯	
૬				૧ ૯૩૯	૪૦	૨	૧૧	૮	
૭				૨ ૨૬૨	૫૦	૩	૪	૭	
૮				૨ ૫૮૫	૬૦	૩	૧૭	૬	
૯				૨ ૯૦૮	૭૦	૪	૧૦	૫	
૧૦				૩ ૨૩૨	૮૦	૫	૩	૪	
૧૧				૩ ૫૫૫	૯૦	૫	૧૬	૩	
આના ૧				૩ ૮૭૮	૧૦૦	૬	૯	૨	
૨			૧	૩ ૭૫૩	૨૦૦	૧૨	૧૮	૪	
૩			૨	૩ ૬૨૮	૩૦૦	૧૯	૭	૬	
૪			૩	૩ ૫૦૩	૪૦૦	૨૫	૧૬	૮	
૫			૪	૩ ૩૭૮	૫૦૦	૩૨	૫	૧૦	
૬			૫	૩ ૨૫૩	૬૦૦	૩૮	૧૫	...	
૭			૬	૩ ૧૨૭	૭૦૦	૪૫	૪	૨	
૮			૭	૩ ૦૦૩	૮૦૦	૫૧	૧૩	૪	
૯			૮	૨ ૮૭૮	૯૦૦	૫૮	૨	૬	
૧૦			૯	૨ ૭૫૩	૧,૦૦૦	૬૪	૧૧	૮	
૧૧			૧૦	૨ ૬૨૮	૧,૫૦૦	૯૬	૧૭	૬	
૧૨			૧૧	૨ ૫૦૩	૨,૦૦૦	૧૨૯	૩	૪	
૧૩		૧	...	૨ ૩૭૮	૩,૦૦૦	૧૯૩	૧૫	૦	
૧૪		૧	૧	૨ ૨૫૩	૪,૦૦૦	૨૫૮	૬	૮	
૧૫		૧	૨	૨ ૧૨૮	૫,૦૦૦	૩૨૨	૧૮	૪	
રૂપીઆ ૧		૧	૩	૨	૧૦,૦૦૦	૬૪૫	૧૬	૮	
૨		૨	૭	૦	૨૦,૦૦૦	૧,૨૯૧	૧૩	૪	
૩		૩	૧૦	૨	૩૦,૦૦૦	૧,૯૩૭	૧૦	...	
૪		૫	૨	૦	૪૦,૦૦૦	૨,૫૮૩	૬	૮	
૫		૬	૫	૨	૫૦,૦૦૦	૩,૨૨૯	૩	૪	
૬		૭	૯	૦	૧,૦૦,૦૦૦	૬,૪૫૮	૬	૮	
૭		૯	...	૨	૨,૦૦,૦૦૦	૧૨,૯૧૬	૧૩	૪	

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી૧-૩-પેન્સ ૮।. આના					૧—૩ ૩૩/૬૪	(૧—૩॥૦।)			
પેન્સ	રૂપીઆ	આ	પા.	દા.	પૌંડ	રૂપીઆ	આ	પા.	દા.
૧		૧	...	૩૭૪	૪	૬૧	૧૩	૧૧	૬૩૭
૨		૨	...	૭૪૯	૫	૭૭	૫	૫	૫૪૭
૩		૩	૧	૧૨૪	૬	૯૨	૧૨	૧૧	૪૫૬
૪		૪	૧	૪૯૯	૭	૧૦૮	૪	૫	૩૬૬
૫		૫	૧	૮૭૩	૮	૧૨૩	૧૧	૧૧	૨૭૫
૬		૬	૨	૨૪૮	૯	૧૩૯	૩	૫	૧૮૪
૭		૭	૨	૬૨૩	૧૦	૧૫૪	૧૦	૧૧	૦૯૪
૮		૮	૨	૯૯૭	૨૦	૩૦૯	૫	૧૦	૧૮૭
૯		૯	૩	૩૭૨	૩૦	૪૬૪	...	૯	૨૮૧
૧૦		૧૦	૩	૭૪૬	૪૦	૬૧૮	૧૧	૮	૩૭૫
૧૧		૧૧	૪	૧૨૧	૫૦	૭૭૩	૬	૭	૪૬૯
શીલીંગ ૧		૧૨	૪	૪૯૫	૬૦	૯૨૮	૧	૬	૫૬૩
૨	૧	૮	૮	૯૯૧	૭૦	૧,૦૮૨	૧૨	૫	૬૫૭
૩	૨	૫	૧	૪૮૬	૮૦	૧,૨૩૭	૭	૪	૭૫૧
૪	૩	૧	૫	૯૮૨	૯૦	૧,૩૯૨	૨	૩	૮૪૪
૫	૩	૧૩	૧૦	૪૭૭	૧૦૦	૧,૫૪૬	૧૩	૨	૯૩૬
૬	૪	૧૦	૨	૯૭૩	૨૦૦	૩,૦૯૩	૧૦	૫	૮૭૩
૭	૫	૬	૭	૪૬૮	૩૦૦	૪,૬૪૦	૭	૮	૮૧૦
૮	૬	૨	૧૧	૯૬૪	૪૦૦	૬,૧૮૭	૪	૧૧	૭૪૬
૯	૬	૧૫	૪	૪૫૯	૫૦૦	૭,૭૩૪	૨	૨	૬૮૨
૧૦	૭	૧૧	૮	૯૫૫	૬૦૦	૯,૨૮૦	૧૫	૫	૬૧૯
૧૧	૮	૮	૧	૪૫૦	૭૦૦	૧૦,૮૨૭	૧૨	૮	૫૫૬
૧૨	૯	૪	૫	૯૪૬	૮૦૦	૧૨,૩૭૪	૯	૧૧	૪૯૨
૧૩	૧૦	૦	૧૦	૪૪૧	૯૦૦	૧૩,૯૨૧	૭	૨	૪૨૯
૧૪	૧૦	૧૩	૨	૯૩૭	૧૦૦૦	૧૫,૪૬૮	૪	૫	૩૬૫
૧૫	૧૧	૯	૭	૪૩૨	૧૫૦૦	૨૩,૨૦૨	૬	૮	૦૪૮
૧૬	૧૨	૫	૧૧	૯૨૮	૨૦૦૦	૩૦,૯૩૬	૮	૧૦	૭૩૧
૧૭	૧૩	૨	૪	૪૨૩	૩૦૦૦	૪૬,૪૦૪	૧૩	૪	૦૯૭
૧૮	૧૩	૧૪	૮	૯૧૮	૪૦૦૦	૬૧,૮૭૩	૧	૯	૪૬૨
૧૯	૧૪	૧૧	૧	૪૧૩	૫૦૦૦	૭૭,૩૪૧	૬	૨	૮૨૮
પૌંડ ૧	૧૫	૭	૫	૯૦૯	૧૦,૦૦૦	૧,૫૪,૬૮૨	૧૨	૫	૬૫૬
૨	૩૦	૧૪	૧૧	૮૧૯	૨૦,૦૦૦	૩,૦૯,૩૬૫	૮	૧૧	૩૧૨
૩	૪૬	૬	૫	૭૨૮	૪૦,૦૦૦	૬,૧૮,૭૩૧	૧	૧૦	૬૨૫

શી. ૧.–૩ પેન્સ ૮૧ આના.						૧–૩૧ ૩૩/૬૪ પે. (૧–૩॥૦।)					
પાઇ	પાઉંડ	શી.	પે.	ફાર		રૂપીઆ.	પાઉંડ	શી	પે	ફાર	
૧				૦	૩૨૩	૮		૧૦	૪	૦	૫૦૦
૨				૦	૬૪૭	૯		૧૧	૭	૨	૫૬૩
૩				૦	૯૭૦	૧૦		૧૨	૧૧	૦	૬૨૫
૪				૧	૨૯૩	૨૦	૧	૫	૧૦	૧	૨૫૦
૫				૧	૬૧૬	૩૦	૧	૧૮	૯	૧	૮૭૫
૬				૧	૯૪૦	૪૦	૨	૧૧	૮	૨	૫૦૦
૭				૨	૨૬૩	૫૦	૩	૪	૭	૩	૧૨૫
૮				૨	૫૮૬	૬૦	૩	૧૭	૬	૩	૭૫૦
૯				૨	૯૦૯	૭૦	૪	૧૦	૬	૦	૩૭૫
૧૦				૩	૨૩૩	૮૦	૫	૩	૫	૧	
૧૧				૩	૫૫૬	૯૦	૫	૧૬	૪	૧	૬૨૫
આના ૧			૦	૩	૮૭૯	૧૦૦	૬	૯	૩	૨	૨૫૦
૨			૧	૩	૭૫૮	૨૦૦	૧૨	૧૮	૭	૦	૫૦૦
૩			૨	૩	૬૩૭	૩૦૦	૧૯	૭	૧૦	૨	૭૫૦
૪			૩	૩	૫૧૬	૪૦૦	૨૫	૧૭	૨	૧	
૫			૪	૩	૩૯૫	૫૦૦	૩૨	૬	૫	૩	૨૫૦
૬			૫	૩	૨૭૪	૬૦૦	૩૮	૧૫	૯	૧	૫૦૦
૭			૬	૩	૧૫૨	૭૦૦	૪૫	૫		૩	૭૫૦
૮			૭	૩	૦૩૧	૮૦૦	૫૧	૧૪	૪	૨	
૯			૮	૨	૯૧૧	૯૦૦	૫૮	૩	૮	૦	૨૫૦
૦			૯	૨	૭૯૦	૧૦૦૦	૬૪	૧૨	૧૧	૨	૫૦૦
૧૧			૧૦	૨	૬૬૯	૧૫૦૦	૯૬	૧૯	૫	૧	૭૫૦
૧૨			૧૧	૨	૫૪૮	૨૦૦૦	૧૨૯	૫	૧૧	૧	
૧૩		૧	૦	૨	૪૨૭	૩૦૦૦	૧૯૩	૧૮	૧૦	૩	૫૦૦
૧૪		૧	૧	૨	૩૦૬	૪૦૦૦	૨૫૮	૧૧	૧૦	૨	
૧૫		૧	૨	૨	૧૮૫	૫૦૦૦	૩૨૩	૪	૧૦	૦	૫૦૦
રૂપીઆ ૧		૧	૩	૨	૦૬૩	૧૦૦૦૦	૬૪૬	૯	૮	૧	
૨		૨	૭	૦	૧૨૫	૨૦૦૦૦	૧૨૯૨	૧૯	૪	૨	
૩		૩	૧૦	૨	૧૮૮	૩૦૦૦૦	૧૯૩૯	૯	૦	૩	
૪		૫	૨	૦	૨૫૦	૪૦૦૦૦	૨૫૮૫	૧૮	૯	૦	
૫		૬	૫	૨	૩૧૩	૫૦૦૦૦	૩૨૩૨	૮	૫	૧	
૬		૭	૯	૦	૩૭૫	૧૦૦૦૦૦	૬૪૬૪	૧૬	૧૦	૨	
૭		૯	૦	૨	૪૩૮	૨૦૦૦૦૦	૧૨૯૨૯	૧૩	૯	૦	

(વીનાયની) કુંડી પૌંડના રૂપીઆ

શી. ૧-૪ પેન્સ ૮॥ આના					(૧-૩ ૧૭/૩૪ (૧-૩॥૦॥)				
પેન્સ	રૂપીઆ	આના	પા	દો.	પૌંડ	રૂપીઆ.	આના	પા	દો
૧	...	૧	--	૩૬૨	૪	૬૧	૧૨	૧૧	૬૮૫
૨	...	૨	...	૭૨૪	૫	૭૭	૪	૨	૬૦૬
૩	...	૩	૧	૦૮૬	૬	૯૨	૧૧	૫	૫૨૭
૪	...	૪	૧	૪૪૮	૭	૧૦૮	૨	૮	૪૪૮
૫	...	૫	૧	૮૧૦	૮	૧૨૩	૯	૧૧	૩૭૦
૬	..	૬	૨	૧૭૩	૯	૧૩૯	૧	૨	૨૯૧
૭	...	૭	૨	૫૩૫	૧૦	૧૫૪	૮	૫	૨૧૪
૮	...	૮	૨	૮૯૭	૨૦	૩૦૯		૧૦	૪૨૭
૯	...	૯	૩	૨૫૯	૩૦	૪૬૩	૯	૩	[illegible]
૧૦	..	૧૦	૩	૬૨૧	૪૦	૬૧૮	૧	૮	૮૫૮
૧૧	...	૧૧	૩	૯૮૩	૫૦	૭૭૨	૧૦	૨	૦૭૪
શીલીંગ ૧	...	૧૨	૪	૩૪૫	૬૦	૯૨૭	૨	૭	૨૮૯
૨	૧	૮	૮	૬૯૧	૭૦	૧૦૮૧	૧૧	૦	૫ ૫
૩	૨	૫	૧	૦૩૭	૮૦	૧,૨૩૬	૩	૫	[illegible]
૪	૩	૧	૫	૩૮૪	૯૦	૧,૩૯૦	૧૧	૧૦	૯૩૫
૫	૩	૧૩	૯	૭૩૦	૧૦૦	૧૫૪૫	૪	૪	[illegible]
૬	૪	૧૦	૨	૦૭૬	૨૦૦	૩,૦૯૦	૮	૮	૩૦૫
૭	૫	૬	૬	૪૨૨	૩૦૦	૪,૬૩૫	૧૩	..	૪૫૮
૮	૬	૨	૧૦	૭૬૮	૪૦૦	૬,૧૮૧	૧	૪	૬૧૧
૯	૬	૧૫	૩	૧૧૪	૫૦૦	૭,૭૨૬	૫	૮	૭૬૪
૧૦	૭	૧૧	૭	૪૬૧	૬૦૦	૯,૨૭૧	૧૦	..	૯૧૭
૧૧	૮	૭	૧૧	૮૦૭	૭૦૦	૧૦,૮૧૬	૧૪	૫	૦૭૦
૧૨	૯	૪	૪	૧૫૩	૮૦૦	૧૨,૩૬૨	૨	૯	૨૨૩
૧૩	૧૦	...	૮	૫૦૦	૯૦૦	૧૩,૯૦૭	૭	૧	૩૭૬
૧૪	૧૦	૧૩		૮૪૬	૧,૦૦૦	૧૫૪૫૨	૧૧	૫	૫૨૯
૧૫	૧૧	૯	૫	૧૯૩	૧,૫૦૦	૨૩,૧૭૯	૧	૨	૨૯૩
૧૬	૧૨	૫	૯	૫૩૯	૨,૦૦૦	૩૦,૯૦૫	૬	૧૧	૦૫૯
૧૭	૧૩	૨	૧	૮૮૫	૩ ૦૦૦	૪૬,૩૫૮	૨	૪	૧૮૭
૧૮	૧૩	૧૪	૬	૨૩૦	૪,૦૦૦	૬૧,૮૧૦	૧૩	૧૦	૧૧૬
૧૯	૧૪	૧૦	૧૦	૫૭૬	૫,૦૦૦	૭૭,૨૬૩	૯	૩	૬૪૪
પૌંડ ૧	૧૫	૭	૨	૯૨૨	૧૦,૦૦૦	૧,૫૪,૫૨૭	૨	૭	૨૮૯
૨	૩૦	૧૪	૫	૮૪૩	૨૦,૦૦૦	૩,૦૯,૦૫૪	૫	૨	૫૭૭
૩	૪૬	૫	૮	૭૬૪	૪૦,૦૦૦	૬,૧૮,૧૦૮	૧૦	૫	૧૫૩

શી. ૧–૩ પેન્સ ૮॥ આનો						૧–૩ ૩ ૧/૧૬ (૧–૩॥૦॥)					
પાઇ	પાઉંડ	શી.	પે	ફાર		રૂપીઆ	પાઉંડ	શી	પે	ફાર	
૧				૦	૩૨૪	૮		૧૦	૪	૧	
૨				૦	૬૪૮	૯		૧૧	૭	૩	૧૨૫
૩				૦	૯૭૧	૧૦		૧૨	૧૧	૧	૨૫૦
૪				૧	૨૯૫	૨૦	૧	૫	૧૦	૨	૫૦૦
૫				૧	૬૧૮	૩૦	૧	૧૮	૯	૩	૭૫૦
૬				૧	૯૪૨	૪૦	૨	૧૧	૯	૧	
૭				૨	૨૬૬	૫૦	૩	૪	૮	૨	૨૫૦
૮				૨	૫૯૦	૬૦	૩	૧૭	૭	૩	૫૦૦
૯				૨	૯૧૪	૭૦	૪	૧૦	૭	૦	૭૫૦
૧૦				૩	૨૩૭	૮૦	૫	૩	૬	૨	
૧૧				૩	૫૬૦	૯૦	૫	૧૬	૫	૩	૨૫૦
આના ૧				૩	૮૮૩	૧૦૦	૬	૯	૫	૦	૫૦૦
૨			૧	૩	૭૬૬	૨૦૦	૧૨	૧૮	૧૦	૧	
૩			૨	૩	૬૪૯	૩૦૦	૧૯	૮	૩	૧	૫૦૦
૪			૩	૩	૫૩૧	૪૦૦	૨૫	૧૭	૮	૨	
૫			૪	૩	૪૧૪	૫૦૦	૩૨	૭	૧	૨	૫૦૦
૬			૫	૩	૨૯૬	૬૦૦	૩૮	૧૬	૬	૩	
૭			૬	૩	૧૭૯	૭૦૦	૪૫	૫	૧૧	૩	૫૦૦
૮			૭	૩	૦૬૧	૮૦૦	૫૧	૧૫	૫		
૯			૮	૨	૯૪૪	૯૦૦	૫૮	૪	૧૦	૦	૫૦૦
૧૦			૯	૨	૮૨૭	૧,૦૦૦	૬૪	૧૪	૩	૧	
૧૧			૧૦	૨	૭૧૦	૧ ૫૦૦	૯૭	૧	૪	૩	૫૦૦
૧૨			૧૧	૨	૫૯૩	૨,૦૦૦	૧૨૯	૮	૬	૨	
૧૩		૧	...	૨	૪૭૬	૩,૦૦૦	૧૯૪	૨	૯	૩	
૧૪		૧	૧	૨	૩૫૮	૪,૦૦૦	૨૫૮	૧૭	૧		
૧૫		૧	૨	૨	૨૪૧	૫,૦૦૦	૩૨૩	૧૧	૪	૧	
રૂ. ૧		૧	૩	૨	૧૨૫	૧૦,૦૦૦	૬૪૭	૨	૮	૨	
૨		૨	૭	૦	૨૫૦	૨૦,૦૦૦	૧,૨૯૪	૫	૫		
૩		૩	૧૦	૨	૩૭૫	૩૦,૦૦૦	૧,૯૪૧	૮	૧	૨	
૪		[illegible]	૨	૦	૫૦૦	૪૦,૦૦૦	૨,૫૮૮	૧૦	૧૦		
૫		૬	૫	૨	૬૨૫	૫૦,૦૦૦	૩,૨૩૫	૧૩	૬	૨	
૬		૭	૯	૦	૭૫૦	૧,૦૦,૦૦૦	૬,૪૭૧	૭	૧		
૭		૯	...	૨	૮૭૫	૨,૦૦,૦૦૦	૧૨,૯૪૨	૧૪	૨		

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧—૩પેન્સ—૮ાા આના					૧—૩ ૩૫/૬૪ (૧—૩ાા૦ાાા)				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દ્દા	પૌંડ	રૂપીઆ	આ	પા	દ્દા
૧	...	૧	...	૩૫૦	૪	૬૧	૧૧	૧૧	૭૫૯
૨	...	૨	...	૭૦૦	૫	૭૭	૨	૧૧	૬૯૯
૩	...	૩	૧	૦૪૯	૬	૯૨	૯	૧૧	૬૩૯
૪	..	૪	૧	૩૯૯	૭	૧૦૮	...	૧૧	૫૭૯
૫	..	૫	૧	૭૪૮	૮	૧૨૩	૭	૧૧	૫૧૯
૬	..	૬	૨	૦૯૮	૯	૧૩૮	૧૪	૧૧	૪૫૮
૭	...	૭	૨	૪૪૭	૧૦	૧૫૪	૫	૧૧	૩૯૭
૮	...	૮	૨	૭૯૭	૨૦	૩૦૮	૧૧	૧૦	૭૯૪
૯	...	૯	૩	૧૪૭	૩૦	૪૬૩	૧	૧૦	૧૯૧
૧૦	..	૧૦	૩	૪૯૭	૪૦	૬૧૭	૭	૯	૫૮૮
૧૧	...	૧૧	૩	૮૪૭	૫૦	૭૭૧	૧૩	૮	૯૮૫
શીલીંગ ૧	...	૧૨	૪	૧૯૭	૬૦	૯૨૬	૩	૮	૩૮૨
૨	૧	૮	૮	૩૯૪	૭૦	૧,૦૮૦	૯	૭	૭૭૯
૩	૨	૫	..	૫૯૧	૮૦	૧,૨૩૪	૧૫	૭	૧૭૬
૪	૩	૧	૪	૭૮૮	૯૦	૧,૩૮૯	૫	૬	૫૭૩
૫	૩	૧૩	૮	૯૮૫	૧૦૯	૧,૫૪૩	૧૧	૫	૯૭૦
૬	૪	૧૦	૧	૧૮૨	૨૦૦	૩,૦૮૭	૬	૧૧	૯૪૦
૭	૫	૬	૫	૩૭૯	૩૦૦	૪.૬૩૧	૨	૫	૯૦૯
૮	૬	૨	૯	૫૭૬	૪૦૦	૬,૧૭૪	૧૩	૧૧	૮૭૯
૯	૬	૧૫	૧	૭૭૩	૫૦૦	૭.૭૧૮	૯	૫	૮૪૯
૧૦	૭	૧૧	૫	૯૭૦	૬૦૦	૯,૨૬૨	૪	૧૧	૮૧૮
૧૧	૮	૭	૧૦	૧૬૭	૭૦૦	૧૦,૮૦૬	૦	૫	૭૮૮
૧૨	૯	૪	૨	૩૬૪	૮૦૦	૧૨,૩૪૯	૧૧	૧૧	૭૫૮
૧૩	૧૦	૦	૬	૫૬૧	૯૦૦	૧૩,૮૯૩	૭	૫	૭૨૮
૧૪	૧૦	૧૨	૧૦	૭૫૮	૧,૦૦૦	૧૫,૪૩૭	૨	૧૧	૬૯૮
૧૫	૧૧	૯	૨	૯૫૫	૧,૫૦૦	૨૩,૧૫૫	૧૨	૫	૪૯૬
૧૬	૧૨	૫	૭	૧૫૨	૨,૦૦૦	૩૦,૮૭૪	૫	૧૧	૩૯૭
૧૭	૧૩	૧	૧૧	૩૪૯	૩,૦૦૦	૪૬,૩૧૧	૮	૧૧	૦૯૫
૧૮	૧૩	૧૪	૩	૫૪૬	૪,૦૦૦	૬૧,૭૪૮	૧૧	૧૦	૭૯૪
૧૯	૧૪	૧૦	૭	૭૪૩	૫,૦૦૦	૭૭,૧૮૫	૧૪	૧૦	૪૯૨
પાઉંડ ૧	૧૫	૬	૧૧	૯૪૦	૧૦,૦૦૦	૧,૫૪,૩૭૧	૧૩	૮	૯૮૫
૨	૩૦	૧૩	૧૧	૮૭૯	૨૦,૦૦૦	૩,૦૮,૭૪૩	૧૧	૫	૯૭૦
૩	૪૬	૪	૧૧	૮૧૯	૪૦,૦૦૦	૬,૧૭,૪૮૭	૬	૧૧	૯૪૦

રૂપીઆના પૌંડ

શી. ૧—૩ પેન્સ ૮।।।						૧-૩ ૧૩/૧૬ પે. ૧-૩॥૦।।।					
પાઇ	પૌંડ	શા.	પે	ફાર		રૂપીઆ	પૌંડ.	શી	પે.	ફાર	
૧					૩૨૪	૮		૧૦	૪	૧	૫૦૦
૨					૬૪૮	૯		૧૧	૭	૩	૬૮૭
૩					૯૭૨	૧૦		૧૨	૧૧	૧	૮૭૫
૪				૧	૨૯૫	૨૦	૧	૫	૧૦	૩	૭૫૦
૫				૧	૬૧૯	૩૦	૧	૧૮	૧૦	૧	૬૨૫
૬				૧	૯૪૩	૪૦	૨	૧૧	૯	૩	૫૦૦
૭				૨	૨૬૭	૫૦	૩	૪	૯	૧	૩૭૫
૮				૨	૫૯૧	૬૦	૩	૧૭	૮	૩	૨૫૦
૯				૨	૯૧૪	૭૦	૪	૧૦	૮	૧	૧૨૫
૧૦				૩	૨૩૭	૮૦	૫	૩	૭	૩	
૧૧				૩	૫૬૨	૯૦	૫	૧૬	૭	૦	૮૭૫
આના ૧				૩	૮૮૭	૧૦૦	૬	૯	૬	૨	૭૫૦
૨			૧	૩	૭૭૪	૨૦૦	૧૨	૧૯	૧	૧	૫૦૦
૩			૨	૩	૬૬૦	૩૦૦	૧૯	૮	૮	૦	૨૫૦
૪			૩	૩	૫૪૭	૪૦૦	૨૫	૧૮	૨	૩	
૫			૪	૩	૪૩૪	૫૦૦	૩૨	૭	૯	૧	૭૫૦
૬			૫	૩	૩૨૦	૬૦૦	૩૮	૧૭	૪	૦	૫૦૦
૭			૬	૩	૨૦૭	૭૦૦	૪૫	૬	૧૦	૩	૨૫૦
૮			૭	૩	૦૯૪	૮૦૦	૫૧	૧૬	૫	૨	
૯			૮	૨	૯૮૦	૯૦૦	૫૮	૬	૦	૦	૭૫૦
૧૦			૯	૨	૮૬૭	૧.૦૦૦	૬૪	૧૫	૬	૩	૫૦૦
૧૧			૧૦	૨	૭૫૪	૧,૫૦૦	૯૭	૩	૪	૧	૨૫૦
૧૨			૧૧	૨	૬૪૦	૨,૦૦૦	૧૨૯	૧૧	૧	૩	
૧૩		૧	૦	૨	૫૨૭	૩,૦૦૦	૧૯૪	૬	૮	૨	૫૦૦
૧૪		૧	૧	૨	૪૧૪	૪,૦૦૦	૨૫૯	૨	૩	૨	
૧૫		૧	૨	૨	૩૦૦	૫,૦૦૦	૩૨૩	૧૭	૧૦	૧	૫૦૦
રૂપીઆ ૧		૧	૩	૨	૧૮૭	૧૦,૦૦૦	૬૪૭	૧૫	૮	૩	
૨		૨	૭	૦	૩૭૫	૨૦,૦૦૦	૧,૨૯૫	૧૧	૫	૨	
૩		૩	૧૦	૨	૫૬૩	૩૦,૦૦૦	૧,૯૪૩	૭	૨	૧	
૪		૫	૨	૦	૭૫૦	૪૦,૦૦૦	૨.૫૯૧	૨	૧૧	૦	
૫		૬	૫	૨	૯૩૭	૫૦,૦૦૦	૩,૨૩૮	૧૮	૭	૩	
૬		૭	૯	૧	૧૨૫	૧,૦૦૦૦૦	૬,૪૭૭	૧૭	૩	૨	
૭		૯	૦	૩	૩૧૨	૨,૦૦૦૦૦	૧૨,૯૫૫	૧૪	૭	૦	

(વીલાયતી હુંડી) પૌંડના રૂપીઆ

શી ૧-૩ પેન્સ ૯ આના					૧-૨ ૫/૧૬ (૧-૩॥-)				
પેન્સ.	રૂપીઆ.	આ	પા.	દે.	પાઊંડ	રૂપીઆ	આ	પા.	દે
૧		૧		૩૩૭	૪	૬૧	૧૦	૧૧	૮૫૫
૨		૨	...	૬૭૫	૫	૭૭	૧	૮	૮૧૯
૩		૩	૧	૦૧૨	૬	૯૨	૮	૫	૭૮૩
૪		૪	૧	૩૪૯	૭	૧૦૭	૧૫	૨	૭૪૭
૫		૫	૧	૬૮૬	૮	૧૨૩	૫	૧૧	૭૧૧
૬		૬	૨	૦૨૩	૯	૧૩૮	૧૨	૮	૬૭૫
૭		૭	૨	૩૬૦	૧૦	૧૫૪	૩	૫	૬૩૯
૮		૮	૨	૬૯૭	૨૦	૩૦૮	૬	૧૧	૨૭૯
૯		૯	૩	૦૩૪	૩૦	૪૬૨	૧૦	૪	૯૧૯
૧૦		૧૦	૩	૩૭૨	૪૦	૬૧૬	૧૩	૧૦	૫૫૩
૧૧		૧૧	૩	૭૧૦	૫૦	૭૭૧	૧	૪	૧૯૨
શીલીંગ ૧		૧૨	૪	૦૪૮	૬૦	૯૨૫	૪	૯	૮૩૦
૨	૧	૮	૮	૦૯૬	૭૦	૧,૦૭૯	૮	૩	૪૬૯
૩	૨	૫	...	૧૪૪	૮૦	૧,૨૩૩	૧૧	૯	૧૦૭
૪	૩	૧	૪	૧૯૨	૯૦	૧,૩૮૭	૧૪	૨	૭૪૬
૫	૩	૧૩	૮	૨૪૦	૧૦૦	૧,૫૪૨	૨	૮	૩૮૫
૬	૪	૧૦	...	૨૮૮	૨૦૦	૩,૦૮૪	૫	૪	૭૭૧
૭	૫	૬	૪	૩૩૭	૩૦૦	૪,૬૨૬	૮	૧	૧૫૬
૮	૬	૨	૮	૩૮૫	૪૦૦	૬,૧૬૮	૧૦	૯	૫૪૧
૯	૬	૧૫	..	૪૩૩	૫૦૦	૭,૭૧૦	૧૩	૫	૯૨૭
૧૦	૭	૧૧	૪	૪૮૨	૬૦૦	૯,૨૫૩	...	૨	૩૧૨
૧૧	૮	૭	૮	૫૩૦	૭૦૦	૧૦,૭૯૫	૨	૧૦	૬૯૮
૧૨	૯	૪	...	૫૭૮	૮૦૦	૧૨,૩૩૭	૫	૭	૦૮૩
૧૩	૧૦	...	૪	૬૨૬	૯૦૦	૧૩,૮૭૯	૮	૩	૪૬૮
૧૪	૧૦	૧૨	૮	૬૭૪	૧,૦૦૦	૧૫,૪૨૧	૧૦	૧૧	૮૫૫
૧૫	૧૧	૯	...	૭૨૨	૧,૫૦૦	૨૩,૧૩૨	૮	૫	૭૮૨
૧૬	૧૨	૫	૪	૭૭૦	૨,૦૦૦	૩૦,૮૪૩	૫	૧૧	૭૧૦
૧૭	૧૩	૧	૮	૮૧૮	૩,૦૦૦	૪૬,૨૬૫	૦	૧૧	૫૬૫
૧૮	૧૩	૧૪	...	૮૬૬	૪,૦૦૦	૬૧,૬૮૬	૧૧	૧૧	૪૨૦
૧૯	૧૪	૧૦	૪	૯૧૪	૫,૦૦૦	૭૭,૧૦૮	૬	૧૧	૨૭૫
પાઊંડ ૧	૧૫	૬	૮	૯૬૩	૧૦,૦૦૦	૧,૫૪,૨૧૬	૧૩	૧૦	૫૫૧
૨	૩૦	૧૩	૫	૯૨૭	૨૦,૦૦૦	૩,૦૮,૪૩૩	૧૧	૯	૧૦૫
૩	૪૬	૪	૨	૮૯૧	૪૦,૦૦૦	૬,૧૬,૮૬૭	૭	૬	૨૦૮

શી. ૧-૩ પેન્સ ૯ આના						૧-૩ $\frac{9}{16}$ (૧-૩॥~					
પાઇ	પાઉંડ	શી	પે	ફા	ર	રૂપીઆ.	પાઉંડ	શી	પે.	ફા	ર
૧				૦	૩૨૪	૮		૧૦	૪	૨	
૨				૦	૬૪૮	૯		૧૧	૮	૦	૨૫૦
૩				૦	૯૭૨	૧૦		૧૨	૧૧	૨	૫૦૦
૪				૧	૨૯૭	૨૦	૧	૫	૧૧	૧	
૫				૧	૬૨૧	૩૦	૧	૧૮	૧૦	૩	૫૦૦
૬				૧	૯૪૫	૪૦	૨	૧૧	૧૦	૨	
૭				૨	૨૬૯	૫૦	૩	૪	૧૦	૦	૫૦૦
૮				૨	૫૯૩	૬૦	૩	૧૭	૯	૩	
૯				૨	૯૧૮	૭૦	૪	૧૦	૯	૧	૫૦૦
૧૦				૩	૨૪૨	૮૦	૫	૩	૯	૦	
૧૧				૩	૫૬૬	૯૦	૫	૧૬	૮	૨	૫૦૦
આના ૧				૩	૮૯૦	૧૦૦	૬	૯	૮	૧	
૨			૧	૩	૭૮૧	૨૦૦	૧૨	૧૯	૪	૨	
૩			૨	૩	૬૭૨	૩૦૦	૧૯	૯	૦	૩	
૪			૩	૩	૫૬૩	૪૦૦	૨૫	૧૮	૯	૦	
૫			૪	૩	૪૫૩	૫૦૦	૩૨	૮	૫	૧	
૬			૫	૩	૩૪૪	૬૦૦	૩૮	૧૮	૧	૨	
૭			૬	૩	૨૩૫	૭૦૦	૪૫	૭	૯	૩	
૮			૭	૩	૧૨૫	૮૦૦	૫૧	૧૭	૬	૦	
૯			૮	૩	૦૧૫	૯૦૦	૫૮	૭	૨	૧	
૧૦			૯	૨	૯૦૫	૧,૦૦૦	૬૪	૧૬	૧૦	૨	
૧૧			૧૦	૨	૭૯૬	૧,૫૦૦	૯૭	૫	૩	૩	
૧૨			૧૧	૨	૬૮૬	૨,૦૦૦	૧૨૯	૧૩	૯	૦	
૧૩		૧	૦	૨	૫૭૭	૩,૦૦૦	૧૯૪	૧૦	૭	૨	
૧૪		૧	૧	૨	૪૬૮	૪,૦૦૦	૨૫૯	૭	૬	૦	
૧૫		૧	૨	૨	૩૫૯	૫,૦૦૦	૩૨૪	૪	૪	૨	
રૂપીઆ ૧		૧	૩	૨	૨૫૦	૧૦,૦૦૦	૬૪૮	૮	૯		
૨		૨	૭	૦	૫૦૦	૨૦,૦૦૦	૧,૨૯૬	૧૭	૬		
૩		૩	૧૦	૨	૭૫૦	૩૦,૦૦૦	૧,૯૪૫	૬	૩		
૪		૫	૨	૧	૦૦૦	૪૦,૦૦૦	૨,૫૯૩	૧૫	૦		
૫		૬	૫	૩	૨૫૦	૫૦,૦૦૦	૩,૨૪૨	૩	૯		
૬		૭	૯	૧	૫૦૦	૧,૦૦,૦૦૦	૬,૪૮૪	૭	૬		
૭		૯	૦	૩	૭૫૦	૨,૦૦,૦૦૦	૧૨,૯૬૮	૧૫			

(વીલાયતી હુંડી) પૌંડના રૂપીઆ

થી ૧-૩ પેન્સ ૯ા આના					૧-૩ ૩૭/૬૪ (૧-૩ાના)				
પેન્સ.	રૂપીઆ	આ	પા.	દો.	પાઉંડ	રૂપીઆ	આ	પા.	દો.
૧		૧	૦	૩૨૫	૪	૬૧	૯	૧૧	૯૭૬
૨		૨	૦	૬૫૦	૫	૭૭	૦	૫	૯૭૦
૩		૩	૦	૯૭૫	૬	૯૨	૬	૧૧	૯૬૪
૪		૪	૧	૩૦૦	૭	૧૦૭	૧૩	૫	૯૫૮
૫		૫	૧	૬૨૫	૮	૧૨૩	૩	૧૧	૯૫૨
૬		૬	૧	૯૫૦	૯	૧૩૮	૧૦	૫	૯૪૬
૭		૭	૨	૨૭૫	૧૦	૧૫૪	૦	૧૧	૯૪૦
૮		૮	૨	૬૦૦	૨૦	૩૦૮	૧	૧૧	૮૮૦
૯		૯	૨	૯૨૫	૩૦	૪૬૨	૨	૧૧	૮૧૯
૧૦		૧૦	૩	૨૫૦	૪૦	૬૧૬	૩	૧૧	૭૫૯
૧૧		૧૧	૩	૫૭૫	૫૦	૭૭૦	૪	૧૧	૬૯૯
શીલીંગ ૧		૧૨	૩	૮૯૯	૬૦	૯૨૪	૫	૧૧	૬૩૯
૨	૧	૮	૭	૭૯૯	૭૦	૧,૦૭૮	૬	૧૧	૫૭૮
૩	૨	૪	૧૧	૬૯૯	૮૦	૧,૨૩૨	૭	૧૧	૫૧૮
૪	૩	૧	૩	૫૯૯	૯૦	૧,૩૮૬	૮	૧૧	૪૫૮
૫	૩	૧૩	૭	૪૯૮	૧૦૦	૧,૫૪૦	૯	૧૧	૩૯૮
૬	૪	૯	૧૧	૩૯૮	૨૦૦	૩,૦૮૧	૩	૧૦	૭૯૬
૭	૫	૬	૩	૨૯૮	૩૦૦	૪,૬૨૧	૧૩	૧૦	૧૯૫
૮	૬	૨	૭	૧૯૮	૪૦૦	૬,૧૬૨	૭	૯	૫૯૩
૯	૬	૧૪	૧૧	૦૯૭	૫૦૦	૭,૭૦૩	૧	૮	૯૯૧
૧૦	૭	૧૧	૨	૯૯૭	૬૦૦	૯,૨૪૩	૧૧	૮	૩૮૯
૧૧	૮	૭	૬	૮૯૭	૭૦૦	૧૦,૭૮૪	૫	૭	૭૮૭
૧૨	૯	૩	૧૦	૭૯૬	૮૦૦	૧૨,૩૨૪	૧૫	૭	૧૮૬
૧૩	૧૦	૦	૨	૬૯૬	૯૦૦	૧૩,૮૬૫	૯	૬	૫૮૪
૧૪	૧૦	૧૨	૬	૫૯૫	૧,૦૦૦	૧૫,૪૦૬	૩	૫	૯૮૨
૧૫	૧૧	૮	૧૦	૪૯૫	૧,૫૦૦	૨૩,૧૦૯	૦	૧૪	૯૭૩
૧૬	૧૨	૫	૨	૩૯૫	૨,૦૦૦	૩૦,૮૧૨	૬	૧૧	૯૬૪
૧૭	૧૩	૧	૬	૨૯૫	૩,૦૦૦	૪૬,૨૧૮	૧૦	૫	૯૪૬
૧૮	૧૩	૧૩	૧૦	૧૯૫	૪,૦૦૦	૬૧,૬૨૪	૧૩	૧૧	૯૨૮
૧૯	૧૪	૧૦	૨	૦૯૪	૫,૦૦૦	૭૭,૦૩૧	૧	૫	૯૧૦
પાઉંડ ૧	૧૫	૬	૫	૯૯૪	૧૦,૦૦૦	૧,૫૪,૦૬૨	૨	૧૧	૮૧૯
૨	૩૦	૧૨	૧૧	૯૮૮	૨૦,૦૦૦	૩,૦૮,૧૨૪	૫	૧૧	૬૩૭
૩	૪૬	૩	૫	૯૮૨	૪૦,૦૦૦	૬,૧૬,૨૪૮	૧૧	૧૧	૨૭૫

શી ૧-૩ પેન્સ ૯ા આના						શી ૧-૩ $\frac{3}{6}\frac{7}{8}$ પેન્સ (૧-૩ાા-ા)				
	પાઈ	પાઊંડ	શી	પે.	ફાર	રૂપીઆ	પાઊંડ.	શી	પે.	ફાર
	૧				૩૨૫	૮		૧૦	૪	૨ ૫૦૦
	૨				૬૪૯	૯		૧૧	૮	૦ ૮૧૨
	૩				૯૭૪	૧૦		૧૨	૧૧	૩ ૧૨૫
	૪				૧ ૨૯૮	૨૦	૧	૫	૧૧	૨ ૨૫૦
	૫				૧ ૬૨૩	૩૦	૧	૧૮	૧૧	૧ ૩૭૫
	૬				૧ ૯૪૭	૪૦	૨	૧૧	૧૧	૦ ૫૦૦
	૭				૨ ૨૭૨	૫૦	૩	૪	૧૦	૩ ૬૨૫
	૮				૨ ૫૯૬	૬૦	૩	૧૭	૧૦	૨ ૭૫૦
	૯				૨ ૯૨૧	૭૦	૪	૧૦	૧૦	૧ ૮૭૫
	૧૦				૩ ૨૪૬	૮૦	૫	૩	૧૦	૧
	૧૧				૩ ૫૭૦	૯૦	૫	૧૬	૧૦	૦ ૧૨૫
આના	૧				૩ ૮૯૫	૧૦૦	૬	૯	૯	૩ ૨૫૦
	૨			૧	૩ ૭૮૯	૨૦૦	૧૨	૧૯	૭	૨ ૫૦૦
	૩			૨	૩ ૬૮૪	૩૦૦	૧૯	૯	૫	૧ ૭૫૦
	૪			૩	૩ ૫૭૮	૪૦૦	૨૫	૧૯	૩	૧
	૫			૪	૩ ૪૭૩	૫૦૦	૩૨	૯	૧	૦ ૨૫૦
	૬			૫	૩ ૩૬૭	૬૦૦	૩૮	૧૮	૧૦	૩ ૫૦૦
	૭			૬	૩ ૨૬૨	૭૦૦	૪૫	૮	૮	૨ ૭૫૦
	૮			૭	૩ ૧૫૬	૮૦૦	૫૧	૧૮	૬	૨
	૯			૮	૩ ૦૫૧	૯૦૦	૫૮	૮	૪	૧ ૨૫૦
	૧૦			૯	૨ ૯૪૫	૧,૦૦૦	૬૪	૧૮	૨	૦ ૫૦૦
	૧૧			૧૦	૨ ૮૪૦	૧,૫૦૦	૯૭	૭	૩	૦ ૭૫૦
	૧૨			૧૧	૨ ૭૩૪	૨,૦૦૦	૧૨૯	૧૬	૪	૧
	૧૩		૧	૦	૨ ૬૩૦	૩,૦૦૦	૧૯૪	૧૪	૬	૧ ૫૦૦
	૧૪		૧	૧	૨ ૫૨૫	૪,૦૦૦	૨૫૯	૧૨	૮	૨
	૧૫		૧	૨	૨ ૪૧૯	૫,૦૦૦	૩૨૪	૧૦	૧૦	૨ ૫૦૦
રૂપીઆ	૧		૧	૩	૨ ૩૧૪	૧૦,૦૦૦	૬૪૯	૧	૯	૧
	૨		૨	૭	૦ ૬૨૫	૨૦,૦૦૦	૧,૨૯૮	૩	૬	૨
	૩		૩	૧૦	૨ ૯૩૭	૩૦,૦૦૦	૧,૯૪૭	૫	૩	૩
	૪		૫	૨	૧ ૨૫૦	૪૦,૦૦૦	૨,૫૯૬	૭	૧	૦
	૫		૬	૫	૩ ૫૬૨	૫૦,૦૦૦	૩,૨૪૫	૮	૧૦	૧
	૬		૭	૯	૧ ૮૭	૧,૦૦,૦૦૦	૬,૪૯૦	૧૭	૮	૨
	૭		૯	૧	૦ ૧૮૭	૨,૦૦,૦૦૦	૧૨૯૮૧	૧૫	૫	૦

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી.૧-૩ પેન્સ ૯ા આના					શી ૧-૩ ૯/૧૬ પેન્સ (૧-૩ાા-ાા)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દોકડા.	પૌંડ	રૂપીઆ	આ	પ..	દો
૧		૧	૦	૩૧૩	૪	૬૧	૯	૦	૧૨૦
૨		૨	૦	૬૨૫	૫	૭૬	૧૫	૩	૧૫૦
૩		૩	૦	૯૩૮	૬	૯૨	૫	૬	૧૮૦
૪		૪	૧	૨૫૦	૭	૧૦૭	૧૧	૯	૨૧૦
૫		૫	૧	૫૬૩	૮	૧૨૩	૨	૦	૨૪૦
૬		૬	૧	૮૭૫	૯	૧૩૮	૮	૩	૨૭૦
૭		૭	૨	૧૮૮	૧૦	૧૫૩	૧૪	૬	૩૦૦
૮		૮	૨	૫૦૦	૨૦	૩૦૭	૧૩	૦	૬૦૧
૯		૯	૨	૮૧૩	૩૦	૪૬૧	૧૧	૬	૯૦૧
૧૦		૧૦	૩	૧૨૬	૪૦	૬૧૫	૧૦	૧	૨૦૨
૧૧		૧૧	૩	૪૩૯	૫૦	૭૬૯	૮	૭	૫૦૨
શીલીંગ ૧		૧૨	૩	૭૫૧	૬૦	૯૨૩	૭	૧	૮૦૩
૨	૧	૮	૭	૫૦૩	૭૦	૧,૦૭૭	૫	૮	૧૦૩
૩	૨	૪	૧૧	૨૫૪	૮૦	૧,૨૩૧	૪	૨	૪૦૪
૪	૩	૧	૩	૦૦૬	૯૦	૧,૩૮૫	૨	૮	૭૦૪
૫	૩	૧૩	૬	૭૫૭	૧૦૦	૧,૫૩૯	૧	૩	૦૦૫
૬	૪	૯	૧૦	૫૦૯	૨૦૦	૩,૦૭૮	૨	૬	૦૧૨
૭	૫	૬	૨	૨૬૦	૩૦૦	૪,૬૧૭	૩	૯	૦૧૮
૮	૬	૨	૬	૦૧૨	૪૦૦	૬,૧૫૬	૫	૦	૦૨૪
૯	૬	૧૪	૯	૭૬૩	૫૦૦	૭,૬૯૫	૬	૩	૦૩૦
૧૦	૭	૧૧	૧	૫૧૫	૬૦૦	૯,૨૩૪	૭	૬	૦૩૬
૧૧	૮	૭	૫	૨૬૬	૭૦૦	૧૦,૭૭૩	૮	૯	૦૪૨
૧૨	૯	૩	૯	૦૧૮	૮૦૦	૧૨,૩૧૨	૧૦	૦	૦૪૮
૧૩	૧૦	૦	૦	૭૬૯	૯૦૦	૧૩,૮૫૧	૧૧	૩	૦૫૪
૧૪	૧૦	૧૨	૪	૫૨૧	૧૦૦૦	૧૫,૩૯૦	૧૨	૬	૦૬૦
૧૫	૧૧	૮	૮	૨૭૨	૧,૫૦૦	૨૩,૦૮૬	૨	૯	૦૯૦
૧૬	૧૨	૫	૦	૦૨૪	૨,૦૦૦	૩૦,૭૮૧	૯	૦	૧૨૦
૧૭	૧૩	૧	૩	૭૭૫	૩,૦૦૦	૪૬,૧૭૨	૫	૬	૧૮૦
૧૮	૧૩	૧૩	૭	૫૨૭	૪,૦૦૦	૬૧,૫૬૩	૨	૦	૨૪૦
૧૯	૧૪	[illegible]	૧૧	૨૭૮	૫૦૦૦	૭૬,૯૫૩	૧૪	૬	૩૦૦
પૌંડ ૧	૧૫	૬	૩	૦૩૦	૧૦,૦૦૦	૧,૫૩,૯૦૭	૧૩	૦	૬૦૧
૨	[illegible]	[illegible]	[illegible]	[illegible]	૨૦,૦૦૦	૩,૦૭,૮૧૫	૧૦	૧	૨૦૨
૩	૪૬	[illegible]	[illegible]	૦૯૦	૩૦,૦૦૦	[illegible]	૪	૨	૪૦૪

શી. ૧-૩ પેન્સ ૯॥ આના.						શી. ૧-૩ ૨૭/૩૨ પે. (૧-૩॥-॥)					
પાઈ	પૌંડ	શી	પે	ફ.ર.		રૂપીઆ.	પૌંડ.	શી.	પે	ફાર.	
૧				૦	૩૨૫	૮		૧૦	૪	૩	
૨				૦	૬૫૦	૯		૧૧	૮	૧	૩૭૫
૩				૦	૯૭૫	૧૦		૧૨	૧૧	૩	૭૫૦
૪				૧	૩૦૦	૨૦	૧	૫	૧૧	૩	૫૦૦
૫				૧	૬૨૪	૩૦	૧	૧૮	૧૧	૩	૨૫૦
૬				૧	૯૪૯	૪૦	૨	૧૧	૧૧	૩	
૭				૨	૨૭૪	૫૦	૩	૪	૧૧	૨	૭૫૦
૮				૨	૫૯૯	૬૦	૩	૧૭	૧૧	૨	૫૦૦
૯				૨	૯૨૪	૭૦	૪	૧૦	૧૧	૨	૨૫૦
૧૦				૩	૨૪૯	૮૦	૫	૩	૧૧	૨	
૧૧				૩	૫૭૪	૯૦	૫	૧૬	૧૧	૧	૭૫૦
આના. ૧				૩	૮૯૮	૧૦૦	૬	૯	૧૧	૧	૫૦૦
૨			૧	૩	૭૯૭	૨૦૦	૧૨	૧૯	૧૦	૩	
૩			૨	૩	૬૯૫	૩૦૦	૧૯	૯	૧૦	૦	૫૦૦
૪			૩	૩	૫૯૩	૪૦૦	૨૫	૧૯	૯	૨	
૫			૪	૩	૪૯૧	૫૦૦	૩૨	૯	૮	૩	૫૦૦
૬			૫	૩	૩૮૯	૬૦૦	૩૮	૧૯	૮	૧	
૭			૬	૩	૨૮૭	૭૦૦	૪૫	૯	૭	૨	૫૦૦
૮			૭	૩	૧૮૬	૮૦૦	૫૧	૧૯	૭	૦	
૯			૮	૩	૦૮૫	૯૦૦	૫૮	૯	૬	૧	૫૦૦
૧૦			૯	૨	૯૮૩	૧,૦૦૦	૬૪	૧૯	૫	૩	
૧૧			૧૦	૨	૮૮૨	૧,૫૦૦	૯૭	૯	૨	૨	૫૦૦
૧૨			૧૧	૨	૭૮૧	૨,૦૦૦	૧૨૯	૧૮	૧૧	૨	
૧૩		૧	૦	૨	૬૮૦	૩,૦૦૦	૧૯૪	૧૮	૫	૧	
૧૪		૧	૧	૨	૫૭૮	૪,૦૦૦	૨૫૯	૧૭	૧૧		
૧૫		૧	૨	૨	૪૭૬	૫,૦૦૦	૩૨૪	૧૭	૪	૩	
રૂપીઆ ૧		૧	૩	૨	૩૭૫	૧૦,૦૦૦	૬૪૯	૧૪	૯	૨	
૨		૨	૭	૦	૭૫૦	૨૦,૦૦૦	૧.૨૯૯	૯	૭		
૩		૩	૧૦	૩	૧૨૫	૩૦,૦૦૦	૧.૯૪૯	૪	૪	૨	
૪		૫	૨	૧	૫૦૦	૪૦,૦૦૦	૨,૫૯૮	૧૯	૨		
૫		૬	૫	૩	૮૭૫	૫૦,૦૦૦	૩,૨૪૮	૧૩	૧૧	૨	
૬		૭	૯	૨	૨૫૦	૧,૦૦,૦૦૦	૬,૪૯૭	૭	૧૧		
૭		૯	૧	૦	૬૨૫	૨,૦૦,૦૦૦	૧૨ ૯૯૪	૧૫	૧૦		

(વીઃ૧યની હુંડી) પૌંડના રૂપીઆ

થી. ૧-૩ પેન્સ ૯ાા આના					શા ૧-૩ [illegible] પેન્સ(૧-૩ાા~ાાા)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દેકડ	પાઊંડ	રૂપીઆ.	આ	પા	
૧		૧	૦	૩૦૦	૪	૬૧	૮	૦	૨૮૯
૨		૨	૦	૬૦૧	૫	૭૬	૧૪	૦	૩૬૦
૩		૩	૦	૯૦૧	૬	૯૨	૪	૦	૪૩૨
૪		૪	૧	૨૦૧	૭	૧૦૭	૧૦	૦	૫૦૫
૫		૫	૧	૫૦૧	૮	૧૨૩	૦	૦	૫૭૭
૬		૬	૧	૮૦૨	૯	૧૩૮	૬	૦	૬૪૯
૭		૭	૨	૧૦૨	૧૦	૧૫૩	૧૨	૦	૭૨૧
૮		૮	૨	૪૦૨	૨૦	૩૦૭	૮	૧	૪૪૧
૯		૯	૨	૭૦૩	૩૦	૪૬૧	૪	૨	૧૬૨
૧૦		૧૦	૩	૦૦૩	૪૦	૬૧૫	૦	૨	૮૮૩
૧૧		૧૧	૩	૩૦૩	૫૦	૭૬૮	૧૨	૩	૬૦૪
શીલીંગ ૧		૧૨	૩	૬૦૪	૬૦	૯૨૨	૮	૪	૩૨૪
૨	૧	૮	૭	૨૦૭	૭૦	૧,૦૭૬	૪	૫	૦૪૬
૩	૨	૪	૧૦	૮૧૧	૮૦	૧,૨૩૦	૦	૫	૭૬૬
૪	૩	૧	૨	૪૧૪	૯૦	૧,૩૮૩	૧૨	૬	૪૮૬
૫	૩	૧૩	૬	૦૧૮	૧૦૦	૧,૫૩૭	૮	૭	૨૦૭
૬	૪	૯	૯	૬૨૨	૨૦૦	૩,૦૭૫	૧	૨	૪૧૪
૭	૫	૬	૧	૨૨૫	૩૦૦	૪,૬૧૨	૯	૯	૬૨૧
૮	૬	૨	૪	૮૨૯	૪૦૦	૬,૧૫૦	૨	૪	૮૨૮
૯	૬	૧૪	૮	૪૩૨	૫૦૦	૭,૬૮૭	૧૧	૦	૦૩૫
૧૦	૭	૧૧	૦	૦૩૬	૬૦૦	૯,૨૨૫	૩	૭	૨૪૨
૧૧	૮	૭	૩	૬૪૦	૭૦૦	૧૦,૭૬૨	૧૨	૨	૪૪૯
૧૨	૯	૩	૭	૨૪૩	૮૦૦	૧૨,૩૦૦	૪	૯	૬૫૬
૧૩	૯	૧૫	૧૦	૮૪૭	૯૦૦	૧૩,૮૩૭	૧૩	૪	૮૬૩
૧૪	૧૦	૧૨	૨	૪૫૦	૧,૦૦૦	૧૫ ૩૭૫	૬	૦	૦૭૦
૧૫	૧૧	૮	૬	૦૫૪	૧,૫૦૦	૨૩,૦૬૨	૭	૦	૧૦૫
૧૬	૧૨	૪	૯	૬૫૮	૨,૦૦૦	૩૦,૭૫૦	૧૨	૦	૧૪૦
૧૭	૧૩	૧	૧	૨૬૧	૩,૦૦૦	૪૬,૧૨૬	૨	૦	૨૧૦
૧૮	૧૩	૧૩	૪	૮૬૫	૪,૦૦૦	૬૧,૫૦૧	૮	૦	૨૮૦
૧૯	૧૪	૯	૮	૪૬૮	૫,૦૦૦	૭૬,૮૭૬	૧૪	૦	૩૫૧
પાઊંડ ૧	૧૫	૬	૦	૦૭૨	૧૦,૦૦૦	૧,૫૩,૭૫૩	૧૨	૦	૭૦૧
૨	૩૦	૧૨	૦	૧૪૪	૨૦,૦૦૦	૩,૦૭,૫૦૭	૮	૧	૪૦૧
૩	૪૬	૨	૦	૨૧૬	૪૦,૦૦૦	૬,૧૫,૦૧૫	૦	૨	૮૦૨

(વીલાયતની હુંડી.) રૂપીઆના પૌંડ

શી. ૧.–૭ પેન્સ ૬ાાા આના.						શી. ૧-૩ ૩૯/૬૪ પે. (૧–૩ાા–ાાા)					
પાઈ	પૌંડ	શી	પે	ફાર		રૂ.	પૌંડ	શી.	પે	ફાર	
૧					૩૨૫	૮		૧૦	૪	૩	૫૦૦
૨					૬૫૦	૯		૧૧	૮	૧	૯૩૮
૩					૯૭૬	૧૦		૧૩	૦	૦	૩૭૫
૪				૧	૩૦૧	૨૦	૧	૬	૦	૦	૭૫૦
૫				૧	૬૨૬	૩૦	૧	૧૯	૦	૧	૧૨૫
૬				૧	૯૫૧	૪૦	૨	૧૨	૦	૧	૫૦૦
૭				૨	૨૭૬	૫૦	૩	૫	૦	૧	૮૭૫
૮				૨	૬૦૨	૬૦	૩	૧૮	૦	૨	૨૫૦
૯				૨	૯૨૭	૭૦	૪	૧૧	૦	૨	૬૨૫
૧૦				૩	૨૫૨	૮૦	૫	૪	૦	૩	
૧૧				૩	૫૭૭	૯૦	૫	૧૭	૦	૩	૩૭૫
આના ૧				૩	૯૦૨	૧૦૦	૬	૧૦	૦	૩	૭૫૦
૨			૧	૩	૮૦૫	૨૦૦	૧૩	૦	૧	૩	૫૦૦
૩			૨	૩	૭૦૭	૩૦૦	૧૯	૧૦	૨	૩	૨૫૦
૪			૩	૩	૬૦૯	૪૦૦	૨૬	૦	૩	૩	
૫			૪	૩	૫૧૨	૫૦૦	૩૨	૧૦	૪	૨	૭૫૦
૬			૫	૩	૪૧૪	૬૦૦	૩૯	૦	૫	૨	૫૦૦
૭			૬	૩	૩૧૬	૭૦૦	૪૫	૧૦	૬	૨	૨૫૦
૮			૭	૩	૨૧૯	૮૦૦	૫૨	૦	૭	૨	
૯			૮	૩	૧૨૧	૯૦૦	૫૮	૧૦	૮	૧	૭૫૦
૧૦			૯	૩	૦૨૩	૧,૦૦૦	૬૫	૦	૯	૧	૫૦૦
૧૧			૧૦	૨	૯૨૬	૧,૫૦૦	૯૭	૧૧	૨	૦	૨૫૦
૧૨			૧૧	૨	૮૨૮	૨,૦૦૦	૧૩૦	૧	૬	૩	
૧૩		૧	૦	૨	૭૩૦	૩,૦૦૦	૧૯૫	૨	૪	૦	૫૦૦
૧૪		૧	૧	૨	૬૩૩	૪,૦૦૦	૨૬૦	૩	૧	૨	
૧૫		૧	૨	૨	૫૩૫	૫,૦૦૦	૩૨૫	૩	૧૦	૩	૫૦૦
રૂપીઆ ૧		૧	૩	૨	૪૩૮	૧૦,૦૦૦	૬૫૦	૭	૯	૩	
૨		૨	૭	૦	૮૭૫	૨૦,૦૦૦	૧,૩૦૦	૧૫	૭	૨	
૩		૩	૧૦	૩	૩૧૩	૩૦,૦૦૦	૧,૯૫૧	૩	૫	૧	
૪		૫	૨	૧	૭૫૦	૪૦,૦૦૦	૨,૬૦૧	૧૧	૩	૦	
૫		૬	૬	૦	૧૮૮	૫૦,૦૦૦	૩,૨૫૧	૧૯	૦	૩	
૬		૭	૯	૨	૬૨૫	૧,૦૦,૦૦૦	૬,૫૦૩	૧૮	૧	૨	
૭		૯	૧	૧	૦૬૩	૨,૦૦,૦૦૦	૧૩,૦૦૭	૧૬	૩	૦	

વીલાયતી હુંડી) પૌંડના રૂપીયાં

શી ૧-૩ પેન્સ ૧૦ આના					શી. ૧-૩ $\frac{5}{8}$ પે. (૧-૩ આના)				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો	પૌંડ	રૂપીઆ	આ	પા.	દો.
૧		૧	૦	૨૮૮	૪	૬૧	૭	૦	૪૮૦
૨		૨	૦	૫૭૬	૫	૭૬	૧૨	૯	૬૦૦
૩		૩	૦	૮૬૪	૬	૯૨	૨	૬	૭૨૦
૪		૪	૧	૧૫૨	૭	૧૦૭	૮	૩	૮૪૦
૫		૫	૧	૪૪૦	૮	૧૨૨	૧૪	૦	૯૬૦
૬		૬	૧	૭૨૮	૯	૧૩૮	૩	૧૦	૦૮૦
૭		૭	૨	૦૧૬	૧૦	૧૫૩	૯	૭	૨૦૦
૮		૮	૨	૩૦૪	૨૦	૩૦૭	૩	૨	૪૦૦
૯		૯	૨	૫૯૨	૩૦	૪૬૦	૧૨	૯	૬૦૦
૧૦		૧૦	૨	૮૮૦	૪૦	૬૧૪	૬	૪	૮૦૦
૧૧		૧૧	૩	૧૬૮	૫૦	૭૬૮	૦	૦	
શીલીંગ ૧		૧૨	૩	૪૫૬	૬૦	૯૨૧	૯	૭	૨૦૦
૨	૧	૮	૬	૯૧૨	૭૦	૧,૦૭૫	૩	૨	૪૦૦
૩	૨	૪	૧૦	૩૬૮	૮૦	૧,૨૨૮	૧૨	૯	૬૦૦
૪	૩	૧	૧	૮૨૪	૯૦	૧,૩૮૨	૬	૪	૮૦૦
૫	૩	૧૩	૫	૨૮૦	૧૦૦	૧,૫૩૬			
૬	૪	૯	૮	૭૩૬	૨૦૦	૩,૦૭૨			
૭	૫	૬	૦	૧૯૨	૩૦૦	૪,૬૦૮			
૮	૬	૨	૩	૬૪૮	૪૦૦	૬,૧૪૪			
૯	૬	૧૪	૭	૧૦૪	૫૦૦	૭,૬૮૦			
૧૦	૭	૧૦	૧૦	૫૬૦	૬૦૦	૯,૨૧૬			
૧૧	૮	૭	૨	૦૧૬	૭૦૦	૧૦,૭૫૨			
૧૨	૯	૩	૫	૪૭૨	૮૦૦	૧૨,૨૮૮			
૧૩	૯	૧૫	૮	૯૨૮	૯૦૦	૧૩,૮૨૪			
૧૪	૧૦	૧૨	૦	૩૮૪	૧,૦૦૦	૧૫,૩૬૦			
૧૫	૧૧	૮	૩	૮૪૦	૧,૫૦૦	૨૩,૦૪૦			
૧૬	૧૨	૪	૭	૨૯૬	૨,૦૦૦	૩૦,૭૨૦			
૧૭	૧૩	૦	૧૦	૭૫૨	૩,૦૦૦	૪૬,૦૮૦			
૧૮	૧૩	૧૩	૨	૨૦૮	૪,૦૦૦	૬૧,૪૪૦			
૧૯	૧૪	૯	૫	૬૬૪	૫,૦૦૦	૭૬,૮૦૦			
પૌંડ ૧	૧૫	૫	૯	૧૨૦	૧૦,૦૦૦	૧,૫૩,૬૦૦			
૨	૩૦	૧૧	૬	૨૪૦	૨૦,૦૦૦	૩,૦૭,૨૦૦			
૩	૪૬	૧	૩	૩૬૦	૪૦,૦૦૦	૬.૧૪.૪૦૦			

શી. ૧—૩પેન્સ ૧૦ આના						શી. ૧-૩ ૫/૮ પે. (૧-૩॥≈)					
પાઇ.	પૌંડ.	શી	પે	ફાર		રૂપીઆ	પૌંડ	શી	પે	ફાર	
૧				૦	૩૨૫	૮		૧૦	૫		
૨				૦	૬૫૧	૯		૧૧	૮	૨	૫૦૦
૩				૦	૯૭૬	૧૦		૧૩	૦	૧	
૪				૧	૩૦૨	૨૦	૧	૬	૦	૨	
૫				૧	૬૨૭	૩૦	૧	૧૯	૦	૩	
૬				૧	૯૫૩	૪૦	૨	૧૨	૧		
૭				૨	૨૭૮	૫૦	૩	૫	૧	૧	
૮				૨	૬૦૪	૬૦	૩	૧૮	૧	૨	
૯				૨	૯૨૯	૭૦	૪	૧૧	૧	૩	
૧૦				૩	૨૫૪	૮૦	૫	૪	૨		
૧૧				૩	૫૭૯	૯૦	૫	૧૭	૨	૧	
આના ૧				૩	૯૦૬	૧૦૦	૬	૧૦	૨	૨	
૨			૧	૩	૮૧૨	૨૦૦	૧૩	૦	૫		
૩			૨	૩	૭૧૮	૩૦૦	૧૯	૧૦	૭	૨	
૪			૩	૩	૬૨૪	૪૦૦	૨૬	૦	૧૦		
૫			૪	૩	૫૩૦	૫૦૦	૩૨	૧૧	૦	૨	
૬			૫	૩	૪૩૬	૬૦૦	૩૯	૧	૩		
૭			૬	૩	૩૪૨	૭૦૦	૪૫	૧૧	૫	૨	
૮			૭	૩	૨૪૮	૮૦૦	૫૨	૧	૮		
૯			૮	૩	૧૫૪	૯૦૦	૫૮	૧૧	૧૦	૨	
૧૦			૯	૩	૦૬૦	૧,૦૦૦	૬૫	૨	૧		
૧૧			૧૦	૨	૯૬૬	૧,૫૦૦	૯૭	૧૩	૧	૨	
૧૨			૧૧	૨	૮૭૨	૨,૦૦૦	૧૩૦	૪	૨		
૧૩		૧	૦	૨	૭૭૮	૩,૦૦૦	૧૯૫	૬	૩		
૧૪		૧	૧	૨	૬૮૪	૪,૦૦૦	૨૬૦	૮	૪		
૧૫		૧	૨	૨	૫૯૦	૫,૦૦૦	૩૨૫	૧૦	૫		
રૂપીઆ ૧		૧	૩	૨	૫૦૦	૧૦,૦૦૦	૬૫૧	૦	૧૦		
૨		૨	૭	૧		૨૦,૦૦૦	૧,૩૦૨	૧	૮		
૩		૩	૧૦	૩	૫૦૦	૩૦,૦૦૦	૧,૯૫૩	૨	૬		
૪		૫	૨	૨		૪૦,૦૦૦	૨,૬૦૪	૩	૪		
૫		૬	૬	૦	૫૦૦	૫૦,૦૦૦	૩,૨૫૫	૪	૨		
૬		૭	૯	૩		૧,૦૦,૦૦૦	૬,૫૧૦	૮	૪		
૭		૯	૧	૧	૫૦૦	૨,૦૦,૦૦૦	૧૩.૦૨૦	૧૬	૮		

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી૧-૩-પેન્સ ૧૦ આના.					શા. ૧—૩ ૪/૬૪ પેન્સ (૧—આના)				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો.	પાઊંડ	રૂપીઆ	આ	પ.	દો
૧		૧	૦	૨૭૬	૪	૬૧	૬	૦	૬૯૫
૨		૨	૦	૫૫૧	૫	૭૬	૧૧	૬	૮૬૯
૩		૩	૦	૮૨૭	૬	૯૨	૧	૧	૦૪૩
૪		૪	૧	૧૦૩	૭	૧૦૭	૬	૭	૨૧૭
૫		૫	૧	૩૭૯	૮	૧૨૨	૧૨	૧	૩૯૧
૬		૬	૧	૬૫૪	૯	૧૩૮	૧	૭	૫૬૪
૭		૭	૧	૯૩૦	૧૦	૧૫૩	૭	૧	૭૩૮
૮		૮	૨	૨૦૬	૨૦	૩૦૬	૧૪	૩	૪૭૭
૯		૯	૨	૪૮૨	૩૦	૪૬૦	૫	૫	૨૧૫
૧૦		૧૦	૨	૭૫૭	૪૦	૬૧૩	૧૨	૬	૯૫૩
૧૧		૧૧	૩	૦૩૩	૫૦	૭૬૭	૩	૮	૬૯૧
શીલીંગ ૧		૧૨	૩	૩૦૯	૬૦	૯૨૦	૧૦	૧૦	૪૩૦
૨	૧	૮	૬	૬૧૭	૭૦	૧,૦૭૪	૨	૦	૧૬૮
૩	૨	૪	૯	૯૨૬	૮૦	૧,૨૨૭	૯	૧	૯૦૬
૪	૩	૧	૧	૨૩૫	૯૦	૧,૩૮૧	૦	૩	૬૪૪
૫	૩	૧૩	૪	૫૪૩	૧૦૦	૧,૫૩૪	૭	૫	૩૮૩
૬	૪	૯	૭	૮૫૨	૨૦૦	૩,૦૬૮	૧૪	૧૦	૭૬૫
૭	૫	૫	૧૧	૧૬૧	૩૦૦	૪,૬૦૩	૬	૪	૧૪૮
૮	૬	૨	૨	૪૭૦	૪૦૦	૬,૧૩૭	૧૩	૯	૫૩૧
૯	૬	૧૪	૫	૭૭૮	૫૦૦	૭,૬૭૨	૫	૨	૯૧૩
૧૦	૭	૧૦	૯	૦૮૭	૬૦૦	૯,૨૦૬	૧૨	૮	૨૯૬
૧૧	૮	૭	૦	૩૯૬	૭૦૦	૧૦,૭૪૧	૪	૧	૬૭૮
૧૨	૯	૩	૩	૭૦૪	૮૦૦	૧૨,૨૭૫	૧૧	૭	૦૬૧
૧૩	૯	૧૫	૭	૦૧૩	૯૦૦	૧૩,૮૧૦	૩	૦	૪૪૩
૧૪	૧૦	૧૧	૧૦	૩૨૨	૧,૦૦૦	૧૫,૩૪૪	૧૦	૫	૮૨૬
૧૫	૧૧	૮	૧	૬૩૦	૧,૫૦૦	૨૩,૦૧૬	૧૫	૮	૭૩૯
૧૬	૧૨	૪	૪	૯૩૯	૨,૦૦૦	૩૦,૬૮૯	૪	૧૧	૬૫૨
૧૭	૧૩	૦	૮	૨૪૮	૩,૦૦૦	૪૬,૦૩૩	૧૫	૫	૪૭૯
૧૮	૧૩	૧૨	૧૧	૫૫૬	૪,૦૦૦	૬૧,૩૭૮	૯	૧૧	૩૦૫
૧૯	૧૪	૯	૨	૮૬૫	૫,૦૦૦	૭૬,૭૨૩	૪	૫	૧૩૧
પોંડ ૧	૧૫	૫	૬	૧૭૪	૧૦,૦૦૦	૧,૫૩,૪૪૬	૮	૧[illegible]	૨૬૧
૨	૩૦	૧૧	૦	૩૪૮	૨૦,૦૦૦	૩,૦૬,૮૯૩	૧	૮	૫૨૩
૩	૪૬	૦	૬	૫૨૧	૪૦,૦૦૦	૬,૧૩,૭૮૬	૩	૫	૦૪૬

શી. ૧.-૩ પેન્સ ૧૦ આના.

પાઇ	પૌંડ	શી	પે.	ફાર	
૧				૦	૩૨૬
૨				૦	૬૫૨
૩				૦	૯૭૭
૪				૧	૩૦૩
૫				૧	૬૨૯
૬				૧	૯૫૪
૭				૨	૨૮૧
૮				૨	૬૦૭
૯				૨	૯૩૨
૧૦				૩	૨૫૮
૧૧				૩	૫૮૪
આના ૧				૩	૯૧૦
૨			૧	૩	૮૨૦
૩			૨	૩	૭૩૦
૪			૩	૩	૬૪૧
૫			૪	૩	૫૫૧
૬			૫	૩	૪૬૧
૭			૬	૩	૩૭૧
૮			૭	૩	૨૮૧
૯			૮	૩	૧૯૧
૧૦			૯	૩	૧૦૧
૧૧			૧૦	૩	૦૧૧
૧૨			૧૧	૨	૯૨૨
૧૩		૧	૦	૨	૮૩૨
૧૪		૧	૧	૨	૭૪૨
૧૫		૧	૨	૨	૬૫૨
રૂપીઆ ૧		૧	૩	૨	૫૬૩
૨		૨	૭	૧	૧૨૫
૩		૩	૧૦	૩	૬૬૮
૪		૫	૨	૨	૨૫૦
૫		૬	૬	૦	૮૧૩
૬		૭	૯	૩	૩૭૫
૭		૯	૧૧		૯૩૮

શો. ૧-૩।। ૪૧/૬૪ પે. (૧-૩।।=।)

રૂપીઆ	પૌંડ	શી	પે	ફાર	
૮		૧૦	૫	૦	૫૦૦
૯		૧૧	૮	૩	૦૬૩
૧૦		૧૩	૦	૧	૬૨૫
૨૦	૧	૬	૦	૩	૨૫૦
૩૦	૧	૧૯	૧	૦	૮૭૫
૪૦	૨	૧૨	૧	૨	૫૦૦
૫૦	૩	૫	૨	૦	૧૨૫
૬૦	૩	૧૮	૨	૧	૭૫૦
૭૦	૪	૧૧	૨	૩	૩૭૫
૮૦	૫	૪	૩	૧	
૯૦	૫	૧૭	૩	૨	૬૨૫
૧૦૦	૬	૧૦	૪	૦	૨૫૦
૨૦૦	૧૩	૦	૮	૦	૫૦૦
૩૦૦	૧૯	૧૧	૦	૦	૭૫૦
૪૦૦	૨૬	૧	૪	૧	
૫૦૦	૩૨	૧૧	૮	૧	૨૫૦
૬૦૦	૩૯	૨	૦	૧	૫૦૦
૭૦૦	૪૫	૧૨	૪	૧	૭૫૦
૮૦૦	૫૨	૨	૮	૨	
૯૦૦	૫૮	૧૩	૦	૨	૨૫૦
૧,૦૦૦	૬૫	૩	૪	૨	૫૦૦
૧,૫૦૦	૯૭	૧૫	૦	૩	૭૫૦
૨,૦૦૦	૧૩૦	૬	૯	૧	
૩,૦૦૦	૧૯૫	૧૦	૧	૩	૫૦૦
૪,૦૦૦	૨૬૦	૧૩	૬	૨	
૫,૦૦૦	૩૨૫	૧૬	૧૧	૦	૫૦૦
૧૦,૦૦૦	૬૫૧	૧૩	૧૦	૧	
૨૦,૦૦૦	૧,૩૦૩	૭	૮	૨	
૩૦,૦૦૦	૧.૯૫૫	૧	૬	૩	
૪૦,૦૦૦	૨,૬૦૬	૧૫	૫	૦	
૫૦,૦૦૦	૩,૨૫૮	૯	૩	૧	
૧,૦૦,૦૦૦	૬,૫૧૬	૧૮	૬	૨	
૨,૦૦,૦૦૦	૧૩૦૩૩	૧૭	૧	૦	

 (વીલાયતી હુંડી) પૌંડના રૂપીઆ

શી ૧-૩ પેન્સ ૧૦॥ આના					શી ૧-૩ ૨૩/૩૨ પેન્સ (૧-૪॥=॥)				
પેન્સ.	રૂપીઆ	આ	પા.	દો.	પૌંડ.	રૂપીઆ.	આ	પા	દો.
૧		૧	૦	૨૬૩	૪	૬૧	૫	૦	૯૩૬
૨		૨	૦	~~૫૨૬~~	૫	૭૬	૧૦	૪	૧૭૦
૩		૩	૦	૭૮૯	૬	૯૧	૧૪	૭	૪૦૪
૪		૪	૧	૦૫૨	૭	૧૦૭	૪	૧૦	૬૩૮
૫		૫	૧	૩૧૫	૮	૧૨૨	૧૦	૧	૮૭૨
૬		૬	૧	૫૮૧	૯	૧૩૭	૧૪	૫	૧૦૬
૭		૭	૧	૮૪૧	૧૦	૧૫૩	૪	૮	૩૩૫
૮		૮	૨	૧૦૪	૨૦	૩૦૬	૯	૪	૬૭૦
૯		૯	૨	૩૬૭	૩૦	૪૫૯	૧૪	૧	૦૦૫
૧૦		૧૦	૨	૬૩૦	૪૦	૬૧૩	૨	૯	૩૪૦
૧૧		૧૧	૨	૮૯૩	૫૦	૭૬૬	૭	૫	૬૭૬
૧		૧૨	૩	૧૬૨	૬૦	૯૧૯	૧૨	૨	૦૧૦
૨	૧	૮	૬	૩૨૪	૭૦	૧,૦૭૩	૦	૧૦	૩૪૫
૩	૨	૪	૯	૪૮૬	૮૦	૧.૨૨૬	૫	૬	૬૮૦
૪	૩	૧	૦	૬૪૮	૯૦	૧,૩૭૯	૧૦	૩	૦૧૫
૫	૩	૧૩	૩	૮૧૦	૧૦૦	૧,૫૩૨	૧૪	૧૧	૩૫૩
૬	૪	૯	૬	૯૭૨	૨૦૦	૩.૦૬૫	૧૩	૧૦	૭૦૬
૭	૫	૫	૧૦	૧૩૪	૩૦૦	૪,૫૯૮	૧૨	૧૦	૦૫૯
૮	૬	૨	૧	૨૯૬	૪૦૦	૬,૧૩૧	૧૧	૯	૪૧૨
૯	૬	૧૪	૪	૪૫૮	૫૦૦	૭,૬૬૪	૧૦	૮	૭૬૫
૧૦	૭	૧૦	૭	૬૨૦	૬૦૦	૯,૧૯૭	૯	૮	૧૧૮
૧૧	૮	૬	૧૦	૭૮૨	૭૦૦	૧૦,૭૩૦	૮	૭	૪૭૩
૧૨	૯	૩	૧	૯૪૪	૮૦૦	૧૨,૨૬૩	૭	૬	૮૨૬
૧૩	૯	૧૫	૫	૧૦૬	૯૦૦	૧૩,૭૯૬	૬	૬	૧૭૭
૧૪	૧૦	૧૧	૮	૨૬૮	૧.૦૦૦	૧૫,૩૨૯	૫	૫	૫૩૩
૧૫	૧૧	૭	૧૧	૪૩૦	૧,૫૦૦	૨૨.૯૯૪	૦	૨	૨૯૯
૧૬	૧૨	૪	૨	૫૯૨	૨,૦૦૦	૩૦,૬૫૮	૧૦	૧૧	૦૬૬
૧૭	૧૩	૦	૫	૭૫૪	૩,૦૦૦	૪૫,૯૮૮	૦	૪	૫૯૬
૧૮	૧૩	૧૨	૮	૯૧૬	૪ ૦૦૦	૬૧,૩૧૭	૫	૧૦	૧૨૮
૧૯	૧૪	૯	૦	૦૭૮	૫ ૦૦૦	૭૬,૬૪૬	૧૧	૩	૬૬૪
૧	૧૫	૫	૩	૨૩૪	૧૦,૦૦૦	૧,૫૩,૨૯૩	૬	૯	૩૨૯
૨	૩૦	૧૦	૬	૪૬૮	૨૦,૦૦૦	૩,૦૬,૫૮૬	૧૩	૨	૬૫૯
૩	૪૫	૧૫	૯	૭૦૨	૪૦,૦૦૦	૬.૧૩,૧૭૩	૧૦	૫	૩૧૯

શી. ૧-૩ પેન્સ ૧૦ાા આના						શી ૧-૩ ૩/૩ પેન્સ (૧-૩ાા=ાા)					
પાઇ.	પાઉંડ	શી	પે	ફાર.		રૂપીઆ	પાઉંડ	શી	પે	ફાર.	
૧				૦	૩૨૬	૮		૧૦	૫	૧	
૨				૦	૬૫૨	૯		૧૧	૮	૩	૬૨૫
૩				૦	૯૭૮	૧૦		૧૩	૦	૨	૨૫૦
૪				૧	૩૦૪	૨૦	૧	૬	૧	૦	૫૦૦
૫				૧	૬૩૦	૩૦	૧	૧૯	૧	૨	૭૫૦
૬				૧	૯૫૬	૪૦	૨	૧૨	૨	૧	
૭				૨	૨૮૨	૫૦	૩	૫	૨	૩	૨૫૦
૮				૨	૬૦૮	૬૦	૩	૧૮	૩	૧	૫૦૦
૯				૨	૯૩૪	૭૦	૪	૧૧	૩	૩	૭૫૦
૧૦				૩	૨૬૦	૮૦	૫	૪	૪	૨	
૧૧				૩	૫૮૬	૯૦	૫	૧૭	૫	૦	૨૫૦
આના ૧				૩	૯૧૪	૧૦૦	૬	૧૦	૫	૨	૫૦૦
૨			૧	૩	૮૨૮	૨૦૦	૧૩	૦	૧૧	૧	
૩			૨	૩	૭૪૨	૩૦૦	૧૯	૧૧	૪	૩	૫૦૦
૪			૩	૩	૬૫૬	૪૦૦	૨૬	૧	૧૦	૨	
૫			૪	૩	૫૭૦	૫૦૦	૩૨	૧૨	૪	૦	૫૦૦
૬			૫	૩	૪૮૪	૬૦૦	૩૯	૨	૯	૩	
૭			૬	૩	૩૯૮	૭૦૦	૪૫	૧૩	૩	૧	૫૦૦
૮			૭	૩	૩૧૨	૮૦૦	૫૨	૩	૯	૦	
૯			૮	૩	૨૨૬	૯૦૦	૫૮	૧૪	૨	૨	૫૦૦
૧૦			૯	૩	૧૪૦	૧,૦૦૦	૬૫	૪	૮	૧	
૧૧			૧૦	૩	૦૫૪	૧,૫૦૦	૯૭	૧૭	૦	૧	૫૦૦
૧૨			૧૧	૨	૯૬૮	૨.૦૦૦	૧૩૦	૯	૪	૨	
૧૩		૧	૦	૨	૮૮૨	૩ ૦૦૦	૧૯૫	૧૪	૦	૩	
૧૪		૧	૧	૨	૭૯૬	૪,૦૦૦	૨૬૦	૧૮	૯	૦	
૧૫		૧	૨	૨	૭૧૦	૫,૦૦૦	૩૨૬	૩	૫	૧	
રૂપીઆ ૧		૧	૩	૨	૬૨૫	૧૦,૦૦૦	૬૫૨	૬	૧૦	૨	
૨		૨	૭	૧	૨૫૦	૨૦.૦૦૦	૧૩૦૪	૧૩	૯	૦	
૩		૩	૧૦	૩	૮૭૫	૩૦,૦૦૦	૧૯૫૭	૦	૭	૨	
૪		૫	૨	૨	૫૦૦	૪૦,૦૦૦	૨૬૦૯	૭	૬	૦	
૫		૬	૬	[illegible]	૧૨૫	૫૦,૦૦૦	૩૨૬૧	૧૪	૪	૨	
૬		૭	૯	૩	૭૫૦	૧,૦૦,૦૦૦	૬૫૨૩	૮	૯		
૭		૯	૧	૨	૩૭૫	૨,૦૦,૦૦૦	૧૩૦૪૬	૧૭	૬		

 પાઉન્ડના રૂપીઆ

શી. ૧-૩ પેન્સ—૧૦ાા આના					શી ૧— ૩[illegible] પેન્સ(૧—૩ાા=ાા				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો	પૌંડ	રૂપીઆ	આ	પા	દો
૧		૧	૦	૨૫૧	૪	૬૧	૪	૧	૧૯૬
૨		૨	૦	૫૦૨	૫	૭૬	૯	૧	૪૯૬
૩		૩	૦	૭૫૪	૬	૯૧	૧૪	૧	૭૯૫
૪		૪	૧	૦૦૫	૭	૧૦૭	૩	૨	૦૯૪
૫		૫	૧	૨૫૬	૮	૧૨૨	૮	૨	૩૯૩
૬		૬	૧	૫૦૭	૯	૧૩૭	૧૩	૨	૬૯૨
૭		૭	૧	૭૫૯	૧૦	૧૫૩	૨	૨	૯૯૧
૮		૮	૨	૦૧૦	૨૦	૩૦૬	૪	૫	૯૮૨
૯		૯	૨	૨૬૧	૩૦	૪૫૯	૬	૮	૯૭૩
૧૦		૧૦	૨	૫૧૨	૪૦	૬૧૨	૮	૧૧	૯૬૪
૧૧		૧૧	૨	૭૬૩	૫૦	૭૬૫	૧૧	૨	૯૫૫
શીલીંગ ૧		૧૨	૩	૦૧૫	૬૦	૯૧૮	૧૩	૫	૯૪૬
૨	૧	૮	૬	૦૩૦	૭૦	૧,૦૭૧	૧૫	૮	૯૩૭
૩	૨	૪	૯	૦૪૫	૮૦	૧૨૨૫	૧	૧૧	૯૨૮
૪	૩	૧	૦	૦૬૦	૯૦	૧,૩૭૮	૪	૨	૯૧૯
૫	૩	૧૩	૩	૦૭૫	૧૦૦	૧,૫૩૧	૬	૫	૯૧૦
૬	૪	૯	૬	૦૯૦	૨૦૦	૩,૦૬૨	૧૨	૧૧	૮૨૧
૭	૫	૫	૯	૧૦૫	૩૦૦	૪,૫૯૪	૩	૫	૭૩૧
૮	૬	૨	૦	૧૨૦	૪૦૦	૬,૧૨૫	૯	૧૧	૬૪૧
૯	૬	૧૪	૩	૧૩૫	૫૦૦	૭,૬૫૭	૦	૫	૫૫૧
૧૦	૭	૧૦	૬	૧૫૦	૬૦૦	૯,૧૮૮	૬	૧૧	૪૬૨
૧૧	૮	૬	૯	૧૬૫	૭૦૦	૧૦,૭૧૯	૧૩	૫	૩૭૨
૧૨	૯	૩	૦	૧૭૯	૮૦૦	૧૨,૨૫૧	૩	૧૧	૨૮૨
૧૩	૯	૧૫	૩	૧૯૪	૯૦૦	૧૩,૭૮૨	૧૦	૫	૧૯૨
૧૪	૧૦	૧૧	૬	૨૦૯	૧૦૦૦	૧૫ ૩૧૪	૦	૧૧	૧૦૩
૧૫	૧૧	૭	૯	૨૨૪	૧,૫૦૦	૨૨,૯૭૧	૧	૪	૬૫૪
૧૬	૧૨	૪	૦	૨૩૯	૨,૦૦૦	૩૦,૬૨૮	૧	૧૦	૨૦૫
૧૭	૧૩	૦	૩	૨૫૪	૩,૦૦૦	૪૫,૯૪૨	૨	૯	૩૦૮
૧૮	૧૩	૧૨	૬	૨૬૯	૪,૦૦૦	૬૧,૨૫૬	૩	૮	૪૧૧
૧૯	૧૪	૮	૯	૨૮૪	૫૦૦૦	૭૬,૫૭૦	૪	૭	૫૧૩
પૌંડ ૧	૧૫	૫	૦	૨૯૯	૧૦,૦૦૦	[illegible]૫૩,૧૪૦	૯	૩	૦૨૭
૨	૩૦	૧૦	૦	૫૯૮	૨૦,૦૦૦	૩,૦૬,૨૮૧	૨	૬	૦૫૪
૩	[illegible]૫	૧[illegible]	૦	૮[illegible]	[illegible],૦૦૦	૬ ૧૨,૫૬૨	૫	૦	૧૦૮

શી ૧-૩ પેન્સ ૧૦॥ આના						શી. ૧-૩ ૬૩/૬૪ પેન્સ (૧-૩॥=॥।)					
પાઈ	પૌંડ	શી.	પે	ફાર		રૂપીઆ	પૌંડ.	શી.	પે	ફાર	
૧					૩૨૬	૮		૧૦	૫	૧	૫૦૦
૨					૬૫૩	૯		૧૧	૯	૦	૧૮૭
૩					૯૭૯	૧૦		૧૩	૦	૨	૮૭૫
૪				૧	૩૦૬	૨૦	૧	૬	૧	૧	૭૫૦
૫				૧	૬૩૨	૩૦	૧	૧૯	૨	૦	૬૨૫
૬				૧	૯૫૯	૪૦	૨	૧૨	૨	૩	૫૦૦
૭				૨	૨૮૫	૫૦	૩	૫	૩	૨	૩૭૫
૮				૨	૬૧૨	૬૦	૩	૧૮	૪	૧	૨૫૦
૯				૨	૯૩૮	૭૦	૪	૧૧	૫	૦	૧૨૫
૧૦				૩	૨૬૪	૮૦	૫	૪	૫	૩	
૧૧				૩	૫૯૧	૯૦	૫	૧૭	૬	૧	૮૭૫
આના ૧				૩	૯૧૮	૧૦૦	૬	૧૦	૭	૦	૭૫૦
૨			૧	૩	૮૩૬	૨૦૦	૧૩	૧	૨	૧	૫૦૦
૩			૨	૩	૭૫૪	૩૦૦	૧૯	૧૧	૯	૨	૨૫૦
૪			૩	૩	૬૭૨	૪૦૦	૨૬	૨	૪	૩	
૫			૪	૩	૫૯૦	૫૦૦	૩૨	૧૨	૧૧	૩	૭૫૦
૬			૫	૩	૫૦૮	૬૦૦	૩૯	૩	૭	૦	૫૦૦
૭			૬	૩	૪૨૬	૭૦૦	૪૫	૧૪	૨	૧	૨૫૦
૮			૭	૩	૩૪૪	૮૦૦	૫૨	૪	૯	૨	
૯			૮	૩	૨૬૨	૯૦૦	૫૮	૧૫	૪	૨	૭૫૦
૧૦			૯	૩	૧૮૦	૧૦૦૦	૬૫	૫	૧૧	૩	૫૦૦
૧૧			૧૦	૩	૦૯૮	૧,૫૦૦	૯૭	૧૮	૧૧	૩	૨૫૦
૧૨			૧૧	૩	૦૧૬	૨,૦૦૦	૧૩૦	૧૧	૧૧	૩	
૧૩		૧	૦	૨	૯૩૪	૩.૦૦૦	૧૯૫	૧૭	૧૧	૨	૫૦૦
૧૪		૧	૧	૨	૮૫૨	૪,૦૦૦	૨૬૧	૩	૧૧	૨	
૧૫		૧	૨	૨	૭૭૦	૫,૦૦૦	૩૨૬	૯	૧૧	૧	૫૦૦
રૂપીઆ ૧		૧	૩	૨	૬૮૭	૧૦,૦૦૦	૬૫૨	૧૯	૧૦	૩	
૨		૨	૭	૧	૩૭૫	૨૦,૦૦૦	૧,૩૦૫	૧૯	૯	૨	
૩		૩	૧૧	૦	૦૬૨	૩૦,૦૦૦	૧.૯૫૮	૧૯	૮	૧	
૪		૫	૨	૨	૭૫૦	૪૦,૦૦૦	૨ ૬૧૧	૧૯	૭	૦	
૫		૬	૬	૧	૪૩૭	૫૦ ૦૦૦	૩,૨૬૪	૧૯	૫	૩	
૬		૭	૧૦	૦	૧૨૫	૧,૦૦,૦૦૦	૬,૫૨૯	૧૮	૧૧	૨	
૭		૯	૧	૨	૮૧૨	૨,૦૦,૦૦૦	૧૩.૦૫૯	૧૭	૧૧	૦	

 (વીલાયતની હુંડી)

પૈંડના રૂપીઆ

શી ૧–૩ પેન્સ ૧૧ આના.					થા. ૧—૩ ૨૧/૧૬ પેન્સ (૧-૩॥≈)				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો	પૌંડ	રૂપીઆ	આ	પા	દો
૧		૧	૦	૨૩૯	૪	૬૧	૩	૧	૪૮૪
૨		૨	૦	૪૭૮	૫	૭૬	૭	૧૦	૮૫૫
૩		૩	૦	૭૧૭	૬	૯૧	૧૨	૮	૨૨૬
૪		૪	૦	૯૫૬	૭	૧૦૭	૧	૫	૫૯૬
૫		૫	૧	૧૯૫	૮	૧૨૨	૬	૨	૯૬૮
૬		૬	૧	૪૩૪	૯	૧૩૭	૧૧	૦	૩૩૯
૭		૭	૧	૬૭૩	૧૦	૧૫૨	૧૫	૯	૭૦૫
૮		૮	૧	૯૧૨	૨૦	૩૦૫	૧૫	૭	૪૧૦
૯		૯	૨	૧૫૧	૩૦	૪૫૮	૧૫	૫	૧૧૫
૧૦		૧૦	૨	૩૯૦	૪૦	૬૧૧	૧૫	૨	૮૨૦
૧૧		૧૧	૨	૬૨૯	૫૦	૭૬૪	૧૫	૦	૫૨૫
શાલીંગ ૧		૧૨	૨	૮૬૯	૬૦	૯૧૭	૧૪	૧૦	૨૩૦
૨	૧	૮	૫	૭૩૮	૭૦	૧,૦૭૦	૧૪	૭	૯૩૫
૩	૨	૪	૮	૬૦૭	૮૦	૧,૨૨૩	૧૪	૫	૬૪૦
૪	૩	૦	૧૧	૪૭૬	૯૦	૧,૩૭૬	૧૪	૩	૩૪[illegible]
૫	૩	૧૩	૨	૩૪૫	૧૦૦	૧,૫૨૯	૧૪	૧	૦૫[illegible]
૬	૪	૯	૫	૨૧૪	૨૦૦	૩,૦૫૯	૧૨	૨	૧૦[illegible]
૭	૫	૫	૮	૦૮૩	૩૦૦	૪,૫૮૯	૧૦	૩	૧૫૬
૮	૬	૧	૧૦	૯૫૨	૪૦૦	૬,૧૧૯	૮	૪	૨૦૮
૯	૬	૧૪	૧	૮૨૧	૫૦૦	૭,૬૪૯	૬	૫	૨૬૦
૧૦	૭	૧૦	૪	૬૯૦	૬૦૦	૯,૧૭૯	૪	૬	૩૧૨
૧૧	૮	૬	૭	૫૫૯	૭૦૦	૧૦,૭૦૯	૨	૭	૩૬૪
૧૨	૯	૨	૧૦	૪૨૮	૮૦૦	૧૨,૨૩૯	૦	૮	૪૧[illegible]
૧૩	૯	૧૫	૧	૨૯૭	૯૦૦	૧૩,૭૬૮	૧૪	૯	૪૬[illegible]
૧૪	૧૦	૧૧	૪	૧૬૬	૧૦૦૦	૧૫,૨૯૮	૧૨	૧૦	૫[illegible]
૧૫	૧૧	૭	૭	૦૩[illegible]	૧૫૦૦	૨૨,૯૪૮	૩	૩	૭[illegible]
૧૬	૧૨	૩	૯	૯૦૪	૨૦૦૦	૩૦,૫૯૭	૯	૯	૦[illegible]
૧૭	૧૩	૦	૦	૭૭૩	૩૦૦૦	૪૫,૮૯૬	૬	૭	૫[illegible]
૧૮	૧૩	૧૨	૩	૬૪૨	૪૦૦૦	૬૧,૧૯૫	૩	૬	૦[illegible]
૧૯	૧૪	૮	૬	૫૧૧	૫૦૦૦	૭૬,૪૯૪	૦	૪	૫૯
પૅાંડ ૧	૧૫	૪	૯	૩૭૧	૧૦,૦૦૦	૧,૫૨,૯૮૮	૦	૯	૧૮
૨	૩૦	૯	૬	૭૪૨	૨૦,૦૦૦	૩,૦૫,૯૭૬	૧	૬	૩૬
૩	૪૫	૧૪	૪	૧૧૩	૪૦,૦૦૦	૬,૧૧,૯૫૨	૩	૦	૭૨

શી ૧-૩ પેન્સ ૧૧ આના					શી ૧-૩ ૧/૨ ૧/૬ પેન્સ (૧-૩।।ᵴ)				
પાઇ	પાઉંડ	શી	પે.	ફર	રૂપીઆ.	પાઉંડ	શી	પે	ફાર
૧				૦ ૩૨૭	૮		૧૦	૫	૨
૨				૦ ૬૫૪	૯		૧૧	૯	૦ ૭૫૦
૩				૦ ૯૮૧	૧૦		૧૩	૦	૩ ૫૦૦
૪				૧ ૩૦૮	૨૦	૧	૬	૧	૩
૫				૧ ૬૩૫	૩૦	૧	૧૯	૨	૨ ૫૦૦
૬				૧ ૯૬૨	૪૦	૨	૧૨	૩	૨
૭				૨ ૨૮૯	૫૦	૩	૫	૪	૧ ૫૦૦
૮				૨ ૬૧૬	૬૦	૩	૧૮	૫	૧
૯				૨ ૯૪૩	૭૦	૪	૧૧	૬	૦ ૫૦૦
૧૦				૩ ૨૭૦	૮૦	૫	૪	૭	
૧૧				૩ ૫૯૭	૯૦	૫	૧૭	૭	૩ ૫૦૦
આના ૧				૩ ૯૨૨	૧૦૦	૬	૧૦	૮	૩
૨			૧	૩ ૮૪૪	૨૦૦	૧૩	૧	૫	૨
૩			૨	૩ ૭૬૬	૩૦૦	૧૯	૧૨	૨	૧
૪			૩	૩ ૬૮૮	૪૦૦	૨૬	૨	૧૧	
૫			૪	૩ ૬૧૦	૫૦૦	૩૨	૧૩	૭	૩
૬			૫	૩ ૫૩૨	૬૦૦	૩૯	૪	૪	૨
૭			૬	૩ ૪૫૪	૭૦૦	૪૫	૧૫	૧	૧
૮			૭	૩ ૩૭૬	૮૦૦	૫૨	૫	૧૦	
૯			૮	૩ ૨૯૮	૯૦૦	૫૮	૧૬	૬	૩
૧૦			૯	૩ ૨૨૦	૧,૦૦૦	૬૫	૭	૩	૨
૧૧			૧૦	૩ ૧૪૨	૧,૫૦૦	૯૮	૦	૧૧	૧
૧૨			૧૧	૩ ૦૬૪	૨,૦૦૦	૧૩૦	૧૪	૭	
૧૩		૧	૦	૨ ૯૮૬	૩,૦૦૦	૧૯૬	૧	૧૦	૨
૧૪		૧	૧	૨ ૯૦૮	૪,૦૦૦	૨૬૧	૯	૨	
૧૫		૧	૨	૨ ૮૩૦	૫,૦૦૦	૩૨૬	૧૬	૫	૨
પીઆ ૧		૧	૩	૨ ૭૫૦	૧૦,૦૦૦	૬૫૩	૧૨	૧૧	
૨		૨	૭	૧ ૫૦૦	૨૦,૦૦૦	૧ ૩૦૭	૫	૧૦	
૩		૩	૧૧	૦ ૨૫૦	૩૦,૦૦૦	૧,૯૬૦	૧૮	૯	
૪		૫	૨	૩	૪૦,૦૦૦	૨,૬૧૪	૧૧	૮	
૫		૬	૬	૧ ૭૫૦	૫૦.૦૦૦	૩,૨૬૮	૪	૭	
૬		૭	૧૦	૦ ૫૦૦	૧,૦૦,૦૦૦	૬,૫૩૬	૯	૨	
૭		૯	૧	૩ ૨૫૦	૨ ૦૦ ૦૦૦	૧૩,૦૭૨	૧૮	૪	

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૩ પેન્સ ૧૧। આના					શી ૧-૩ ૪૫/૬૪ પેન્સ (૧-૩॥)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો	પોંડ	રૂપીઆ	આ	પા	દો
૧		૧	૦	૨૨૭	૪	૬૧	૨	૧	૭૯૧
૨		૨	૦	૪૫૪	૫	૭૬	૬	૮	૨૩૯
૩		૩	૦	૬૮૧	૬	૯૧	૧૧	૨	૬૮૯
૪		૪	૦	૯૦૭	૭	૧૦૬	૧૫	૯	૧૩૪
૫		૫	૧	૧૩૪	૮	૧૨૨	૪	૩	૫૮૨
૬		૬	૧	૩૬૧	૯	૧૩૭	૮	૧૦	૦૩૨
૭		૭	૧	૫૮૮	૧૦	૧૫૨	૧૩	૪	૪૭૮
૮		૮	૧	૮૧૫	૨૦	૩૦૫	૧૦	૮	૯૫૫
૯		૯	૨	૦૪૨	૩૦	૪૫૮	૬	૧	૪૩૩
૧૦		૧૦	૨	૨૬૯	૪૦	૬૧૧	૫	૫	૯૧૦
૧૧		૧૧	૨	૪૯૬	૫૦	૭૬૪	૨	૧૦	૩૮૮
શીલીંગ ૧		૧૨	૨	૭૨૨	૬૦	૯૧૭	૦	૨	૮૬૬
૨	૧	૮	૫	૪૪૫	૭૦	૧,૦૬૯	૧૩	૭	૩૪૩
૩	૨	૪	૮	૧૬૭	૮૦	૧,૨૨૨	૧૦	૧૧	૮૨૧
૪	૩	૦	૧૦	૮૯૦	૯૦	૧,૩૭૫	૬	૪	૨૯૯
૫	૩	૧૩	૧	૬૧૨	૧૦૦	૧,૫૨૮	૫	૮	૭૭૬
૬	૪	૯	૪	૩૩૪	૨૦૦	૩,૦૫૬	૧૧	૫	૫૫૨
૭	૫	૫	૭	૦૫૭	૩૦૦	૪૫૮૫	૧	૨	૩૨૮
૮	૬	૧	૯	૭૭૯	૪૦૦	૬,૧૧૩	૬	૧૧	૧૦૪
૯	૬	૧૪	૦	૫૦૧	૫૦૦	૭.૬૪૧	૧૨	૭	૮૮૧
૧૦	૭	૧૦	૩	૨૨૪	૬૦૦	૯.૧૭૦	૨	૪	૬૫૭
૧૧	૮	૬	૫	૯૪૬	૭૦૦	૧૦,૬૯૮	૮	૧	૪૩૩
૧૨	૯	૨	૮	૬૬૮	૮૦૦	૧૨.૨૨૬	૧૩	૧૦	૨૦૯
૧૩	૯	૧૪	૧૧	૩૯૧	૯૦૦	૧૩ ૭૫૫	૩	૬	૯૮૫
૧૪	૧૦	૧૧	૨	૧૧૩	૧,૦૦૦	૧૫,૨૮૩	૯	૩	૭૬૧
૧૫	૧૧	૭	૪	૮૩૬	૧,૫૦૦	૨૨,૯૨૫	૫	૧૧	૬૪૨
૧૬	૧૨	૩	૭	૫૫૮	૨,૦૦૦	૩૦,૫૬૭	૨	૭	૫૨૨
૧૭	૧૨	૧૫	૧૦	૨૩૧	૩,૦૦૦	૪૫.૮૫૦	૧૧	૧૧	૨૮૪
૧૮	૧૩	૧૨	૧	૦૦૩	૪,૦૦૦	૬૧,૧૩૪	૫	૩	૦૪૫
૧૯	૧૪	૮	૩	૭૨૫	૫,૦૦૦	૭૬.૪૧૭	૧૪	૬	૮૦૬
પાઉંડ ૧	૧૫	૪	૬	૪૪૮	૧૦,૦૦૦	૧,૫૨ ૮૩૫	૧૩	૧	૬૧૨
૨	૩૦	૯	૦	૮૯૬	૨૦,૦૦૦	૩,૦૫.૬૭૧	૧૦	૩	૨૨૪
૩	૪૫	૧૩	૭	૩૪૩	૩૦,૦૦૦	૬,૧૧,૩૪૩	૪	૬	૪૪૮

(વીલાયતની હુંડી.) રૂપીઆના પૌંડ ૨૯

શી. ૧-૩ પેન્સ ૧૧ા આના.						શી. ૧-૩ $\frac{૧૫}{૧૬}$ પે. (૧-આક્કા)					
પાઇ	પાઉંડ	શી.	પે	ફાર		રૂપીઆ	પાઉંડ	શી.	પે	ફાર	
૧				૦	૩૨૭	૮		૧૦	૫	૨	૫૦૦
૨				૦	૬૫૪	૯		૧૧	૯	૧	૩૧૨
૩				૦	૯૮૧	૧૦		૧૩	૧	૦	૧૨૫
૪				૧	૩૦૮	૨૦	૧	૬	૨	૦	૨૫૦
૫				૧	૬૩૫	૩૦	૧	૧૯	૩	૦	૩૭૫
૬				૧	૯૬૩	૪૦	૨	૧૨	૪	૦	૫૦૦
૭				૨	૨૯૦	૫૦	૩	૫	૫	૦	૬૨૫
૮				૨	૬૧૭	૬૦	૩	૧૮	૬	૦	૭૫૦
૯				૨	૯૪૩	૭૦	૪	૧૧	૭	૦	૮૭૫
૧૦				૩	૨૭૦	૮૦	૫	૪	૮	૧	
૧૧				૩	૫૯૮	૯૦	૫	૧૭	૯	૧	૧૨૫
આના ૧				૩	૯૨૬	૧૦૦	૬	૧૦	૧૦	૧	૨૫૦
૨			૧	૩	૮૫૧	૨૦૦	૧૩	૧	૮	૨	૫૦૦
૩			૨	૩	૭૭૭	૩૦૦	૧૯	૧૨	૬	૩	૭૫૦
૪			૩	૩	૭૦૩	૪૦૦	૨૬	૩	૫	૧	
૫			૪	૩	૬૨૮	૫૦૦	૩૨	૧૪	૩	૨	૨૫૦
૬			૫	૩	૫૫૪	૬૦૦	૩૯	૫	૧	૩	૫૦૦
૭			૬	૩	૪૮૦	૭૦૦	૪૫	૧૬	૦	૦	૭૫૦
૮			૭	૩	૪૦૬	૮૦૦	૫૨	૬	૧૦	૨	
૯			૮	૩	૩૩૨	૯૦૦	૫૮	૧૭	૮	૩	૨૫૦
૧૦			૯	૩	૨૫૮	૧,૦૦૦	૬૫	૮	૭	૦	૫૦૦
૧૧			૧૦	૩	૧૮૨	૧ ૫૦૦	૯૮	૨	૧૦	૨	૭૫૦
૧૨			૧૧	૩	૧૦૮	૨,૦૦૦	૧૩૦	૧૭	૨	૧	
૧૩		૧	...	૩	૦૩૪	૩,૦૦૦	૧૯૬	૫	૯	૧	૫૦૦
૧૪		૧	૧	૨	૯૬૦	૪,૦૦૦	૨૬૧	૧૪	૪	૨	
૧૫		૧	૨	૨	૮૮૬	૫,૦૦૦	૩૨૭	૨	૧૧	૨	૫૦૦
રૂ. ૧		૧	૩	૨	૮૧૨	૧૦,૦૦૦	૬૫૪	૫	૧૧	૧	
૨		૨	૭	૧	૬૨૫	૨૦,૦૦૦	૧,૩૦૮	૧૧	૧૦	૨	
૩		૩	૧૧	૦	૪૩૭	૩૦,૦૦૦	૧,૯૬૨	૧૭	૯	૩	
૪		૪	૨	૩	૨૫૦	૪૦,૦૦૦	૨,૬૧૭	૩	૯	૦	
૫		૬	૬	૨	૦૬૨	૫૦,૦૦૦	૩,૨૭૧	૯	૮	૧	
૬		૭	૧૦	૦	૮૭૫	૧,૦૦,૦૦૦	૬,૫૪૨	૧૯	૪	૨	
૭		૯	૧	૩	૬૮૭	૨,૦૦.૦૦૦	૧૩,૦૮૫	૧૮	૯	૦	

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૩ પેન્સ ૧૧।। આના					શી. ૧-૩ ૨/૩ ૩/૬ પેન્સ (૧-૩।।=।।)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો	પૌંડ	રૂપીઆ.	આ	પા	દો
૧		૧	૦	૨૧૫	૪	૬૧	૧	૨	૧૨૪
૨		૨	૦	૪૩૦	૫	૭૬	૫	૫	૬૫૫
૩		૩	૦	૬૪૫	૬	૯૧	૯	૯	૧૮૬
૪		૪	૦	૮૬૦	૭	૧૦૬	૧૪	૦	૭૧૭
૫		૫	૧	૦૭૫	૮	૧૨૨	૨	૪	૨૪૮
૬		૬	૧	૨૯૦	૯	૧૩૭	૬	૭	૭૭૯
૭		૭	૧	૫૦૫	૧૦	૧૫૨	૧૦	૧૧	૩૦૮
૮		૮	૧	૭૨૦	૨૦	૩૦૫	૫	૧૦	૬૧૬
૯		૯	૧	૯૩૫	૩૦	૪૫૮	૦	૯	૯૨૪
૧૦		૧૦	૨	૧૫૦	૪૦	૬૧૦	૧૧	૯	૨૩૨
૧૧		૧૧	૨	૩૬૫	૫૦	૭૬૩	૬	૮	૫૪૦
શીલીંગ ૧		૧૨	૨	૫૭૭	૬૦	૯૧૬	૧	૭	૮૪૮
૨	૧	૮	૫	૧૫૪	૭૦	૧,૦૬૮	૧૨	૭	૧૫૬
૩	૨	૪	૭	૭૩૧	૮૦	૧,૨૨૧	૭	૬	૪૬૪
૪	૩	૦	૧૦	૩૦૮	૯૦	૧,૩૭૪	૨	૫	૭૭૨
૫	૩	૧૩	૦	૮૮૫	૧૦૦	૧,૫૨૬	૧૩	૫	૦૮૨
૬	૪	૯	૩	૪૬૨	૨૦૦	૩,૦૫૩	૧૦	૧૦	૧૬૪
૭	૫	૫	૬	૦૩૯	૩૦૦	૪,૫૮૦	૮	૩	૨૪૬
૮	૬	૧	૮	૬૧૬	૪૦૦	૬ ૧૦૭	૫	૮	૩૨૮
૯	૬	૧૩	૧૧	૧૯૩	૫૦૦	૭,૬૩૪	૩	૧	૪૧૦
૧૦	૭	૧૦	૧	૭૭૦	૬૦૦	૯,૧૬૧	૦	૬	૪૯૨
૧૧	૮	૬	૪	૩૪૭	૭૦૦	૧૦.૬૮૭	૧૩	૧૧	૫૭૪
૧૨	૯	૨	૬	૯૨૪	૮૦૦	૧૨ ૨૧૪	૧૧	૪	૬૫૬
૧૩	૯	૧૪	૯	૫૦૧	૯૦૦	૧૩,૭૪૧	૮	૯	૭૩૮
૧૪	૧૦	૧૧	૦	૦૭૮	૧,૦૦૦	૧૫૨૬૮	૬	૨	૮૧૫
૧૫	૧૧	૭	૨	૬૫૫	૧,૫૦૦	૨૨.૯૦૨	૯	૪	૨૩૦
૧૬	૧૨	૩	૫	૨૩૨	૨,૦૦૦	૩૦,૫૩૬	૧૨	૫	૬૩૦
૧૭	૧૨	૧૫	૭	૮૦૯	૩ ૦૦૦	૪૫૮૦૫	૨	૮	૪૫૦
૧૮	૧૩	૧૧	૧૦	૩૮૬	૪,૦૦૦	૬૧,૦૭૩	૮	૧૧	૨૭૦
૧૯	૧૪	૮	૦	૯૬૩	૫,૦૦૦	૭૬,૩૪૧	૧૫	૨	૦૭૫
પૌંડ ૧	૧૫	૪	૩	૫૩૧	૧૦,૦૦૦	૧,૫૨,૬૮૩	૧૪	૪	૧૫૦
૨	૩૦	૮	૭	૦૬૨	૨૦,૦૦૦	૩,૦૫,૩૬૭	૧૨	૮	૩૦૨
૩	૪૫	૧૨	૧૦	૫૯૩	૪૦,૦૦૦	૬,૧૦ ૭૩૫	૯	૪	૬૦૪

શી. ૧–૩ પેન્સ ૧૧।। આના						શી. ૧–૩ ૨૩/૩૨ પેન્સ (૧–૩।।[illegible]।।)					
પાઇ.	પાઉંડ	શી.	પે	ફાર		રૂપીઆ	પાઉંડ	શી	પે	ફાર.	
૧				૦	૩૨૭	૮	..	૧૦	૫	૩	
૨				૦	૬૫૪	૯	..	૧૧	૯	૧	૮૭૫
૩				૦	૯૮૧	૧૦	..	૧૩	૧	૦	૭૫૦
૪				૧	૩૦૮	૨૦	૧	૬	૨	૧	૫૦૦
૫				૧	૬૩૫	૩૦	૧	૧૯	૩	૨	૨૫૦
૬				૧	૯૬૨	૪૦	૨	૧૨	૪	૩	
૭				૨	૨૮૯	૫૦	૩	૫	૫	૩	૭૫૦
૮				૨	૬૧૬	૬૦	૩	૧૮	૭	૦	૫૦૦
૯				૨	૯૪૩	૭૦	૪	૧૧	૮	૧	૨૫૦
૧૦				૩	૨૭૦	૮૦	૫	૪	૯	૨	
૧૧				૩	૫૯૭	૯૦	૫	૧૭	૧૦	૨	૭૫૦
આના ૧				૩	૯૩૦	૧૦૦	૬	૧૦	૧૧	૩	૫૦૦
૨			૧	૩	૮૬૦	૨૦૦	૧૩	૧	૧૧	૩	
૩			૨	૩	૭૯૦	૩૦૦	૧૯	૧૨	૧૧	૨	૫૦૦
૪			૩	૩	૭૨૦	૪૦૦	૨૬	૩	૧૧	૨	
૫			૪	૩	૬૫૦	૫૦૦	૩૨	૧૪	૧૧	૧	૫૦૦
૬			૫	૩	૫૮૦	૬૦૦	૩૯	૫	૧૧	૧	
૭			૬	૩	૫૧૦	૭૦૦	૪૫	૧૬	૧૧	૦	૫૦૦
૮			૭	૩	૪૪૦	૮૦૦	૫૨	૭	૧૧		
૯			૮	૩	૩૭૦	૯૦૦	૫૮	૧૮	૧૦	૩	૫૦૦
૧૦			૯	૩	૩૦૦	૧,૦૦૦	૬૫	૯	૧૦	૩	
૧૧			૧૦	૩	૨૩૦	૧,૫૦૦	૯૮	૪	૧૦	૦	૫૦૦
૧૨			૧૧	૩	૧૬૦	૨,૦૦૦	૧૩૦	૧૯	૯	૨	
૧૩		૧	૦	૩	૦૯૦	૩,૦૦૦	૧૯૬	૯	૮	૧	
૧૪		૧	૧	૩	૦૨૦	૪,૦૦૦	૨૬૧	૧૯	૭		
૧૫		૧	૨	૨	૯૫૦	૫૦૦૦	૩૨૭	૯	૫	૩	
રૂપીઆ ૧		૧	૩	૨	૮૭૫	૧૦,૦૦૦	૬૫૪	૧૮	૧૧	૨	
૨		૨	૭	૧	૭૫૦	૨૦,૦૦૦	૧,૩૦૯	૧૭	૧૧		
૩		૩	૧૧	૦	૬૨૫	૩૦,૦૦૦	૧,૯૬૪	૧૬	૧૦	૨	
૪		૫	૨	૩	૫૦૦	૪૦,૦૦૦	૨ ૬૧૯	૧૫	૧૦		
૫		૬	૬	૨	૩૭૫	૫૦,૦૦૦	૩,૨૭૪	૧૪	૯	૨	
૬		૭	૧૦	૧	૨૫૦	૧,૦૦,૦૦૦	૬.૫૪૯	૯	૭		
૭		૯	૨	૦	૧૨૫	૨,૦૦,૦૦૦	૧૩,૦૯૮	૧૯	૨		

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૩ પેન્સ ૧૨।।। આના					શી. ૧-૩ ૭/૮ પેન્સ (૧-૩।' [illegible]।।)				
પેન્સ.	રૂપીઆ	આ	પા.	દો.	પાઉંડ	રૂપીઆ	આ	પા.	દો
૧		૧	૦	૨૦૩	૪	૬૧	૦	૨	૪૯૯
૨		૨	૦	૪૦૫	૫	૭૬	૪	૩	૦૯૯
૩		૩	૦	૬૦૮	૬	૯૧	૮	૩	૭૧૮
૪		૪	૦	૮૧૦	૭	૧૦૬	૧૨	૪	૩૩૮
૫		૫	૧	૦૧૩	૮	૧૨૨	૦	૪	૯૫૭
૬		૬	૧	૨૧૫	૯	૧૩૭	૪	૫	૫૭૭
૭		૭	૧	૪૧૮	૧૦	૧૫૨	૮	૬	૧૯૭
૮		૮	૧	૬૨૧	૨૦	૩૦૫	૧	૦	૩૯૩
૯		૯	૧	૮૨૩	૩૦	૪૫૭	૯	૬	૫૯૦
૧૦		૧૦	૨	૦૨૭	૪૦	૬૧૦	૨	૦	૭૮૬
૧૧		૧૧	૨	૨૨૮	૫૦	૭૬૨	૧૦	૬	૯૮૩
શીલીંગ ૧		૧૨	૨	૪૩૧	૬૦	૯૧૫	૩	૧	૧૮૦
૨	૧	૮	૪	૮૬૨	૭૦	૧,૦૬૭	૧૧	૭	૩૭૬
૩	૨	૪	૭	૨૯૩	૮૦	૧,૨૨૦	૪	૧	૫૭૩
૪	૩	૦	૯	૭૨૪	૯૦	૧,૩૭૨	૧૨	૭	૭૭૦
૫	૩	૧૩	૦	૧૫૫	૧૦૦	૧,૫૨૫	૫	૧	૯૬૬
૬	૪	૯	૨	૫૮૬	૨૦૦	૩.૦૫૦	૧૦	૩	૯૩૨
૭	૫	૫	૫	૦૧૭	૩૦૦	૪,૫૭૫	૧૫	૫	૮૯૯
૮	૬	૧	૭	૪૪૮	૪૦૦	૬,૧૦૧	૪	૭	૮૬૫
૯	૬	૧૩	૯	૮૭૯	૫૦૦	૭ ૬૨૬	૯	૯	૮૩૧
૧૦	૭	૧૦	૦	૩૧૦	૬૦૦	૯,૧૫૧	૧૪	૧૧	૭૯૭
૧૧	૮	૬	૨	૭૪૧	૭૦૦	૧૦,૬૭૭	૪	૧	૭૬૪
૧૨	૯	૨	૫	૧૭૨	૮૦૦	૧૨,૨૦૨	૯	૩	૭૩૦
૧૩	૯	૧૪	૭	૬૦૩	૯૦૦	૧૩,૭૨૭	૧૪	૫	૬૯૬
૧૪	૧૦	૧૧	૧૦	૦૩૪	૧,૦૦૦	૧૫,૨૫૩	૩	૭	૬૬૨
૧૫	૧૧	૭	૦	૪૬૫	૧.૫૦૦	૨૨.૮૭૯	૧૩	૫	૪૯૬
૧૬	૧૨	૩	૨	૮૯૬	૨,૦૦૦	૩૦,૫૦૬	૭	૩	૩૨૫
૧૭	૧૨	૧૫	૫	૩૨૭	૩,૦૦૦	૪૫,૭૫૯	૧૦	૧૦	૯૮૭
૧૮	૧૩	૧૧	૭	૭૫૮	૪,૦૦૦	૬૧,૦૧૨	૧૪	૬	૬૪૯
૧૯	૧૪	૭	૧૦	૧૮૯	૫,૦૦૦	૭૬.૨૬૬	૨	૨	૩૧૨
પાઊંડ ૧	૧૫	૪	૦	૬૨૦	૧૦,૦૦૦	૧,૫૨.૫૩૨	૪	૪	૬૨૩
૨	૩૦	૮	૧	૨૩૯	૨૦,૦૦૦	૩,૦૫,૦૬૪	૮	૯	૨૪૬
૩	૪૫	૧૨	૧	૮૫૯	૩૦,૦૦૦	૬,૧૦.૧૨૯	૧	૬	૪૯૨

શી. ૧-૩ પેન્સ ૧૨।।। આના.

પાઇ	પાઉંડ	શી	પે	ફારં	
૧				૦	૩૨૮
૨				૦	૬૫૫
૩				૦	૯૮૩
૪				૧	૩૧૧
૫				૧	૬૩૯
૬				૧	૯૬૭
૭				૨	૨૯૪
૮				૨	૬૨૨
૯				૨	૯૫૦
૧૦				૩	૨૭૮
૧૧				૩	૬૦૬
આના ૧				૩	૯૩૪
૨			૧	૩	૮૬૭
૩			૨	૩	૮૦૦
૪			૩	૩	૭૩૪
૫			૪	૩	૬૬૭
૬			૫	૩	૬૦૧
૭			૬	૩	૫૩૪
૮			૭	૩	૪૬૮
૯			૮	૩	૪૦૧
૧૦			૯	૩	૩૩૬
૧૧			૧૦	૩	૨૬૮
૧૨			૧૧	૩	૨૦૨
૧૩		૧	૦	૩	૧૩૫
૧૪		૧	૧	૩	૦૬૮
૧૫		૧	૨	૩	૦૦૨
રૂપીઆ ૧		૧	૩	૨	૯૩૭
૨		૨	૭	૧	૮૭૫
૩		૩	૧૧	૦	૮૧૨
૪		૫	૨	૩	૭૫૦
૫		૬	૬	૨	૬૮૭
૬		૭	૧૦	૧	૬૨૫
૭		૯	૨	૦	૫૬૨

શી. ૧-૩ ૬૭/૮ પેન્સ (૧-૩।।ફ।।।)

રૂપીઆ.	પાઉંડ	શી.	પે.	ફા રં	
૮		૧૦	૫	૩	૫૦૦
૯		૧૧	૯	૨	૪૩૭
૧૦		૧૩	૧	૧	૩૭૫
૨૦	૧	૬	૨	૨	૭૫૦
૩૦	૧	૧૯	૪	૦	૧૨૫
૪૦	૨	૧૨	૫	૧	૫૦૦
૫૦	૩	૫	૬	૨	૮૭૫
૬૦	૩	૧૮	૮	૦	૨૫૦
૭૦	૪	૧૧	૯	૧	૬૨૫
૮૦	૫	૪	૧૦	૩	
૯૦	૫	૧૮	૦	૦	૩૭૫
૧૦૦	૬	૧૧	૧	૧	૭૫૦
૨૦૦	૧૩	૨	૨	૩	૫૦૦
૩૦૦	૧૯	૧૩	૪	૧	૨૫૦
૪૦૦	૨૬	૪	૫	૩	
૫૦૦	૩૨	૧૫	૭	૦	૭૫
૬૦૦	૩૯	૬	૮	૨	૫૦૦
૭૦૦	૪૫	૧૭	૧૦	૦	૨૫૦
૮૦૦	૫૨	૮	૧૧	૨	
૯૦૦	૫૯	૦	૦	૩	૭૫૦
૧,૦૦૦	૬૫	૧૧	૨	૧	૫૦૦
૧,૫૦૦	૯૮	૬	૯	૨	૨૫૦
૨,૦૦૦	૧૩૧	૨	૪	૩	
૩,૦૦૦	૧૯૬	૧૩	૭	૦	૫૦૦
૪,૦૦૦	૨૬૨	૪	૯	૨	
૫,૦૦૦	૩૨૭	૧૫	૧૧	૩	૫૦૦
૧૦,૦૦૦	૬૫૫	૧૧	૧૧	૩	
૨૦,૦૦૦	૧,૩૧૧	૩	૧૧	૨	
૩૦,૦૦૦	૧,૯૬૬	૧૫	૧૧	૧	
૪૦,૦૦૦	૨,૬૨૨	૭	૧૧	૦	
૫૦,૦૦૦	૩,૨૭૭	૧૯	૧૦	૩	
૧,૦૦,૦૦૦	૬,૫૫૫	૧૯	૯	૨	
૨,૦૦,૦૦૦	૧૩,૧૧૧	૧૯	૭	૦	

(વીલાયતી હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૩ પેન્સ ૧૨ આના					શી. ૧-૩$\frac{3}{4}$ પેન્સ (૧-૩।।।)				
પેન્સ	રૂપીઆ.	આ	પા	દો.	પાઊંડ	રૂપીઆ	આ	પા	દો.
૧		૧	૦	૧૯૦	૪	૬૦	૧૫	૨	૮૫૮
૨		૨	૦	૩૮૧	૫	૭૬	૩	૦	૫૭૨
૩		૩	૦	૫૭૧	૬	૯૧	૬	૧૦	૨૮૭
૪		૪	૦	૭૬૨	૭	૧૦૬	૧૦	૮	૦૦૨
૫		૫	૦	૯૫૨	૮	૧૨૧	૧૪	૫	૭૧૬
૬		૬	૧	૧૪૩	૯	૧૩૭	૨	૩	૪૩૦
૭		૭	૧	૩૩૩	૧૦	૧૫૨	૬	૧	૧૪૪
૮		૮	૧	૫૨૪	૨૦	૩૦૪	૧૨	૨	૨૮૮
૯		૯	૧	૭૧૪	૩૦	૪૫૭	૨	૩	૪૩૦
૧૦		૧૦	૧	૯૦૫	૪૦	૬૦૯	૮	૪	૫૭૪
૧૧		૧૧	૨	૦૯૫	૫૦	૭૬૧	૧૪	૫	૭૧૭
શીલીંગ ૧		૧૨	૨	૨૮૬	૬૦	૯૧૪	૪	૬	૮૬૦
૨	૧	૮	૪	૫૭૨	૭૦	૧,૦૬૬	૧૦	૮	૦૦૪
૩	૨	૪	૬	૮૫૮	૮૦	૧,૨૧૯	૦	૯	૧૪૭
૪	૩	૦	૯	૧૪૫	૯૦	૧,૩૭૧	૬	૧૦	૨૯૦
૫	૩	૧૨	૧૧	૪૩૧	૧૦૦	૧,૫૨૩	૧૨	૧૧	૪૩૪
૬	૪	૯	૧	૭૧૭	૨૦૦	૩ ૦૪૭	૯	૧૦	૮૬૩
૭	૫	૫	૪	૦૦૩	૩૦૦	૪,૫૭૧	૬	૧૦	૨૯૨
૮	૬	૧	૬	૨૯૦	૪૦૦	૬ ૦૯૫	૩	૯	૭૨૧
૯	૬	૧૩	૮	૫૭૬	૫૦૦	૭.૬૧૯	૦	૯	૧૫૦
૧૦	૭	૯	૧૦	૮૬૨	૬૦૦	૯,૧૪૨	૧૩	૮	૫૭૯
૧૧	૮	૬	૧	૧૪૮	૭૦૦	૧૦.૬૬૬	૧૦	૮	૦૦૮
૧૨	૯	૨	૩	૪૩૫	૮૦૦	૧૨ ૧૯૦	૭	૭	૪૩૭
૧૩	૯	૧૪	૫	૭૨૧	૯૦૦	૧૩ ૭૧૪	૪	૬	૮૬૬
૧૪	૧૦	૧૦	૮	૦૦૭	૧,૦૦૦	૧૫,૨૩૮	૧	૬	૨૯૫
૧૫	૧૧	૬	૧૦	૨૯૩	૧,૫૦૦	૨૨,૮૫૭	૨	૩	૪૪૦
૧૬	૧૨	૩	૦	૫૭૦	૨,૦૦૦	૩૦,૪૭૬	૩	૦	૫૮૫
૧૭	૧૨	૧૫	૨	૮૬૫	૩,૦૦૦	૪૫,૭૧૪	૪	૬	૮૭૧
૧૮	૧૩	૧૧	૫	૧૪૩	૪,૦૦૦	૬૦,૯૫૨	૬	૧	૧૫૭
૧૯	૧૪	૭	૭	૪૩૦	૫,૦૦૦	૭૬,૧૯૦	૭	૭	૪૪૦
પાઊંડ ૧	૧૫	૩	૯	૭૧૬	૧૦,૦૦૦	૧.૫૨ ૩૮૦	૧૫	૨	૮૮૦
૨	૩૦	૭	૭	૪૩૦	૨૦,૦૦૦	૩.૦૪ ૭૬૧	૧૪	૫	૭૬૦
૩	૪૫	૧૧	૫	૧૪૪	૪૦,૦૦૦	૬.૦૯,૫૨૩	૧૨	૧૧	૫૨૦

શી. ૧-૩ પેન્સ ૧૨ આના						શી. ૧-૩¾ પેન્સ (૧-૩॥				
પાઈ	પાઊંડ	શી.	પે.	ફાર		રૂપીઆ.	પાઊંડ	શી	પે	ફાર
૧				૦	૩૨૮	૮	...	૧૦	૬	
૩				૦	૬૫૬	૯	...	૧૧	૯	૩
૩				૦	૯૮૪	૧૦	...	૧૩	૧	૨
૪				૧	૩૧૨	૨૦	૧	૬	૩	
૫				૧	૬૪૧	૩૦	૧	૧૯	૪	૨
૬				૧	૯૬૯	૪૦	૨	૧૨	૬	
૭				૨	૨૯૮	૫૦	૩	૫	૭	૨
૮				૨	૬૨૬	૬૦	૩	૧૮	૯	
૯				૨	૯૫૫	૭૦	૪	૧૧	૧૦	૨
૧૦				૩	૨૮૩	૮૦	૫	૫	૦	
૧૧				૩	૬૧૧	૯૦	૫	૧૮	૧	૨
આના ૧				૩	૯૩૯	૧૦૦	૬	૧૧	૩	
૨			૧	૩	૮૭૬	૨૦૦	૧૩	૨	૬	
૩			૨	૩	૮૧૩	૩૦૦	૧૯	૧૩	૯	
૪			૩	૩	૭૫૦	૪૦૦	૨૬	૫	૦	
૫			૪	૩	૬૮૭	૫૦૦	૩૨	૧૬	૩	
૧			૫	૩	૬૨૪	૬૦૦	૩૯	૭	૬	
૭			૬	૩	૫૬૧	૭૦૦	૪૫	૧૮	૯	
૮			૭	૩	૫૦૦	૮૦૦	૫૨	૧૦	૦	
૯			૮	૩	૪૩૭	૯૦૦	૫૯	૧	૩	
૧૦			૯	૩	૩૭૪	૧,૦૦૦	૬૫	૧૨	૬	
૧૧			૧૦	૩	૩૧૧	૧,૫૦૦	૯૮	૮	૯	
૧૨			૧૧	૩	૨૪૯	૨,૦૦૦	૧૩૧	૫	૦	
૧૩		૧	૦	૩	૧૮૬	૩,૦૦૦	૧૯૬	૧૭	૬	
૧૪		૧	૧	૩	૧૨૪	૪,૦૦૦	૨૬૨	૧૦	૦	
૧૫		૧	૨	૩	૦૬૧	૫,૦૦૦	૩૨૮	૨	૬	
રૂપીઆ ૧		૧	૩	૩		૧૦,૦૦૦	૬૫૬	૫	૦	
૨		૨	૭	૨		૨૦,૦૦૦	૧,૩૧૨	૧૦	૦	
૩		૩	૧૧	૧		૩૦,૦૦૦	૧,૯૬૮	૧૫	૦	
૪		૫	૩			૪૦,૦૦૦	૨,૬૨૫	૦	૦	
૫		૬	૬	૩		૫૦,૦૦૦	૩,૨૮૧	૫	૦	
૬		૭	૧૦	૨		૧,૦૦,૦૦૦	૬,૫૬૨	૧૦	૦	
૭		૯	૨	૧		૨,૦૦,૦૦૦	૧૩,૧૨૫	૦	૦	

પૌંડના રૂપીઆ

થી ૧-૩ પેન્સ ૧૨ા આના					શા ૧-૩ ૪૯/૬૪ પેન્સ (૧-૭ાા૦ા)				
પેન્સ.	રૂપીઆ.	આ	પા	દો.	પાઉંડ	રૂપીઆ	આ	પા.	દો.
૧		૧	૦	૧૭૮	૪	૬૦	૧૪	૩	૨૫૯
૨		૨	૦	૩૫૭	૫	૭૬	૧	૧૦	૦૭૩
૩		૩	૦	૫૩૫	૬	૯૧	૫	૪	૮૮૮
૪		૪	૦	૭૧૪	૭	૧૦૬	૮	૧૧	૭૦૩
૫		૫	૦	૮૯૨	૮	૧૨૧	૧૨	૬	૫૧૭
૬		૬	૧	૦૭૦	૯	૧૩૭	૦	૧	૩૩૨
૭		૭	૧	૨૪૯	૧૦	૧૫૨	૩	૮	૧૪૭
૮		૮	૧	૪૨૭	૨૦	૩૦૪	૭	૪	૨૯૩
૯		૯	૧	૬૦૬	૩૦	૪૫૬	૧૧	૦	૪૪૦
૧૦		૧૦	૧	૭૮૪	૪૦	૬૦૮	૧૪	૮	૫૮૭
૧૧		૧૧	૧	૯૬૨	૫૦	૭૬૧	૨	૪	૭૩૩
શીલીંગ ૧		૧૨	૨	૧૪૧	૬૦	૯૧૩	૬	૦	૮૩૦
૨	૧	૮	૪	૨૮૧	૭૦	૧,૦૬૫	૯	૯	૦૨૭
૩	૨	૪	૬	૪૨૨	૮૦	૧,૨૧૭	૧૩	૫	૧૭૩
૪	૩	૦	૮	૫૬૩	૯૦	૧,૩૭૦	૧	૧	૩૨૦
૫	૩	૧૨	૧૦	૭૦૪	૧૦૦	૧,૫૨૨	૪	૯	૪૬૭
૬	૪	૯	૦	૮૪૪	૨૦૦	૩,૦૪૪	૯	૬	૯૩૪
૭	૫	૫	૨	૯૮૫	૩૦૦	૪,૫૬૬	૧૪	૪	૪૦૦
૮	૬	૧	૫	૧૨૬	૪૦૦	૬,૦૮૯	૩	૧	૮૬૭
૯	૬	૧૩	૭	૨૬૭	૫૦૦	૭,૬૧૧	૭	૧૧	૩૩૪
૧૮	૭	૯	૯	૪૦૭	૬૦૦	૯,૧૩૩	૧૨	૮	૮૦૧
૧૧	૮	૫	૧૧	૫૧૮	૭૦૦	૧૦,૬૫૬	૧	૬	૨૬૮
૧૨	૯	૨	૧	૬૮૯	૮૦૦	૧૨,૧૭૮	૬	૩	૭૩૪
૧૩	૯	૧૪	૩	૮૩૫	૯૦૦	૧૩,૭૦૦	૧૧	૧	૨૦૧
૧૪	૧૦	૧૦	૫	૯૭૧	૧,૦૦૦	૧૫,૨૨૨	૧૫	૧૦	૬૬૮
૧૫	૧૧	૬	૮	૧૧૨	૧,૫૦૦	૨૨૮,૩૪	૭	૧૦	૦૦૨
૧૬	૧૨	૨	૧૦	૨૫૨	૨,૦૦૦	૩૦,૪૪૫	૧૫	૯	૩૩૬
૧૭	૧૨	૧૫	૦	૩૯૨	૩,૦૦૦	૪૫ ૬૬૮	૧૫	૮	૦૦૪
૧૮	૧૩	૧૧	૨	૫૩૫	૪,૦૦૦	૬૦,૮૯૧	૧૫	૬	૬૭૨
૧૯	૧૪	૭	૪	૬૭૪	૫,૦૦૦	૭૬,૧૧૪	૧૫	૫	૩૪૦
પાઉંડ ૧	૧૫	૩	૬	૮૧૫	૧૦,૦૦૦	૧,૫૨,૨૨૯	૧૪	૧૦	૬૭૯
૨	૩૦	૭	૧	૬૨૯	૨૦,૦૦૦	૩.૦૪,૪૫૯	૧૩	૯	૩૫૭
૩	૪૫	૧૦	૮	૪૪૪	૪૦,૦૦૦	૬,૦૮ ૯૧૯	૧૧	૬	૭૧૩

શી. ૧-૩ પેન્સ ૧૨। આના.					શી. ૧-૩ ૪૯/૬૪ પેન્સ (૧-૩।।।૦।)				
પાઇ	પૌંડ	શી.	પે.	ફાર	રૂપીઆ	પૌંડ	શી	પે	ફાર
૧				૦ ૩૨૮	૮		૧૦	૬	૦ ૫૦૦
૨				૦ ૬૫૭	૯		૧૧	૯	૩ ૫૬૨
૩				૦ ૯૮૫	૧૦		૧૩	૧	૨ ૬૨૫
૪				૧ ૩૧૪	૨૦	૧	૬	૩	૧ ૨૫૦
૫				૧ ૬૪૨	૩૦	૧	૧૯	૪	૩ ૮૭૫
૬				૧ ૯૭૦	૪૦	૨	૧૨	૬	૨ ૫૦૦
૭				૨ ૨૯૯	૫૦	૩	૫	૮	૧ ૧૨૫
૮				૨ ૬૪૭	૬૦	૩	૧૮	૯	૩ ૭૫૦
૯				૨ ૯૫૬	૭૦	૪	૧૧	૧૧	૨ ૩૭૫
૧૦				૩ ૨૮૪	૮૦	૫	૫	૧	૧
૧૧				૩ ૬૧૨	૯૦	૫	૧૮	૨	૩ ૬૨૫
આના ૧				૩ ૯૪૧	૧૦૦	૬	૧૧	૪	૨ ૨૫૦
૨			૧	૩ ૮૮૩	૨૦૦	૧૩	૨	૯	૦ ૫૦૦
૩			૨	૩ ૮૨૪	૩૦૦	૧૯	૧૪	૧	૨ ૭૫૦
૪			૩	૩ ૭૬૫	૪૦૦	૨૬	૫	૬	૧
૫			૪	૩ ૭૦૭	૫૦૦	૩૨	૧૬	૧૦	૩ ૨૫૦
૬			૫	૩ ૬૪૮	૬૦૦	૩૯	૮	૩	૧ ૫૦૦
૭			૬	૩ ૫૮૯	૭૦૦	૪૫	૧૯	૭	૩ ૭૫૦
૮			૭	૩ ૫૩૧	૮૦૦	૫૨	૧૧	૦	૨
૯			૮	૩ ૪૭૨	૯૦૦	૫૯	૨	૫	૦ ૨૫૦
૧૦			૯	૩ ૪૧૪	૧,૦૦૦	૬૫	૧૩	૯	૨ ૫૦૦
૧૧			૧૦	૩ ૩૫૫	૧,૫૦૦	૯૮	૧૦	૮	૧ ૭૫૦
૧૨			૧૧	૩ ૨૯૬	૨,૦૦૦	૧૩૧	૭	૭	૧
૧૩		૧	૦	૩ ૨૩૭	૩,૦૦૦	૧૯૭	૧	૪	૩ ૫૦૦
૧૪		૧	૧	૩ ૧૭૮	૪ ૦૦૦	૨૬૨	૧૫	૨	૨
૧૫		૧	૨	૩ ૧૨૧	૫,૦૦૦	૩૨૮	૯	૦	૦ ૫૦૦
પીઆ ૧		૧	૩	૩ ૦૬૨	૧૦,૦૦૦	૬૫૬	૧૮	૦	૧
૨		૨	૭	૨ ૧૨૫	૨૦,૦૦૦	૧,૩૧૩	૧૬	૦	૨
૩		૩	૧૧	૧ ૧૮૭	૩૦,૦૦૦	૧.૯૭૦	૧૪	૦	૩
૪		૫	૩	૦ ૨૫૦	૪૦,૦૦૦	૨,૬૨૭	૧૨	૧	૦
૫		૬	૬	૩ ૩૧૨	૫૦,૦૦૦	૩,૨૮૪	૧૦	૧	૧
૬		૭	૧૦	૨ ૩૭૫	૧,૦૦,૦૦૦	૬,૫૬૯	૦	૨	૨
૭		૯	૨	૧ ૪૩૭	૨,૦૦,૦૦૦	૧૩ ૧૩૮	૦	૫	૦

(વીલાયતની હુંડી) પૌંડના રૂપૈયા

શી. ૧-૩ પેન્સ ૧૨। આના					શી ૧-૩ ૨૫/૩૨ પેન્સ (૧-૩॥૦॥)				
પેન્સ	રૂપૈયા	આ	પા	દોકડ	પાઊંડ	રૂપૈયા	આ	પા	દો
૧		૧	૦	૧૬૬	૪	૬૦	૧૩	૩	૬૮૮
૨		૨	૦	૩૩૨	૫	૭૬	૦	૭	૬૦૫
૩		૩	૦	૪૯૮	૬	૯૧	૩	૧૧	૫૨૬
૪		૪	૦	૬૬૪	૭	૧૦૬	૭	૩	૪૪૭
૫		૫	૦	૮૩૦	૮	૧૨૧	૧૦	૭	૩૬૮
૬		૬	૦	૯૯૬	૯	૧૩૬	૧૩	૧૧	૨૮૯
૭		૭	૧	૧૬૨	૧૦	૧૫૨	૧	૩	૨૦૮
૮		૮	૧	૩૨૮	૨૦	૩૦૪	૨	૬	૪૧૬
૯		૯	૧	૪૯૪	૩૦	૪૫૬	૩	૯	૬૨૪
૧૦		૧૦	૧	૬૬૦	૪૦	૬૦૮	૫	૦	૮૩૨
૧૧		૧૧	૧	૮૨૬	૫૦	૭૬૦	૬	૪	૦૪૦
શાલીંગ ૧		૧૨	૧	૯૯૬	૬૦	૯૧૨	૭	૭	૨૪૮
૨	૧	૮	૩	૯૯૨	૭૦	૧,૦૬૪	૮	૧૦	૪૫૬
૩	૨	૪	૫	૯૮૮	૮૦	૧,૨૧૬	૧૦	૧	૬૬૪
૪	૩	૦	૭	૯૮૪	૯૦	૧,૩૬૮	૧૧	૪	૮૭૨
૫	૩	૧૨	૯	૯૮૦	૧૦૦	૧ ૫૨૦	૧૨	૮	૦૭૯
૬	૪	૮	૧૧	૯૭૬	૨૦૦	૩ ૦૪૧	૯	૪	૧૫૮
૭	૫	૫	૧	૯૭૨	૩૦૦	૪,૫૬૨	૬	૦	૨૩૭
૮	૬	૧	૩	૯૬૮	૪૦૦	૬,૦૮૩	૨	૮	૩૧૬
૯	૬	૧૩	૫	૯૬૪	૫૦૦	૭,૬૦૩	૧૫	૪	૩૯૫
૧૦	૭	૯	૭	૯૬૦	૬૦૦	૯,૧૨૪	૧૨	૦	૪૭૪
૧૧	૮	૫	૯	૯૫૬	૭૦૦	૧૦,૬૪૫	૮	૮	૫૫૩
૧૨	૯	૧	૧૧	૯૫૨	૮૦૦	૧૨,૧૬૬	૫	૪	૬૩૨
૧૩	૯	૧૪	૧	૯૪૮	૯૦૦	૧૩,૬૮૭	૨	૦	૭૧૧
૧૪	૧૦	૧૦	૩	૯૪૪	૧,૦૦૦	૧૫ ૨૦૭	૧૪	૮	૭૯૨
૧૫	૧૧	૬	૫	૯૪૦	૧,૫૦૦	૨૨,૮૧૧	૧૪	૧	૧૮૭
૧૬	૧૨	૨	૭	૯૩૬	૨,૦૦૦	૩૦,૪૧૫	૧૩	૫	૫૮૪
૧૭	૧૨	૧૪	૯	૯૩૨	૩,૦૦૦	૪૫,૬૨૩	૧૨	૨	૩૭૬
૧૮	૧૩	૧૦	૧૧	૯૨૮	૪,૦૦૦	૬૦,૮૩૧	૧૦	૧૧	૧૬૮
૧૯	૧૪	૭	૧	૯૨૪	૫,૦૦૦	૭૬,૦૩૯	૯	૭	૯૬૦
પાઉંડ ૧	૧૫	૩	૩	૯૨૧	૧૦,૦૦૦	૧,૫૨,૦૭૯	૩	૩	૯૨૧
૨	૩૦	૬	૭	૮૪૨	૨૦,૦૦૦	૩,૦૪,૧૫૮	૬	૭	૮૪૨
૩	૪૫	૯	૧૧	૭૬૩	૪૦,૦૦૦	૬,૦૮,૩૧૬	૧૩	૩	૬૮૪

શી ૧-૩ પેન્સ ૧૨॥ આના				
પાઇ.	પાઉંડ	શી	પે	ફાર.
૧				૦ ૩૨૯
૨				૦ ૬૫૮
૩				૦ ૯૮૭
૪				૧ ૩૧૬
૫				૧ ૬૪૫
૬				૧ ૯૭૪
૭				૨ ૩૦૩
૮				૨ ૬૩૨
૯				૨ ૯૬૧
૧૦				૩ ૨૯૦
૧૧				૩ ૬૧૯
આના ૧				૩ ૯૪૫
૨			૧	૩ ૮૯૦
૩			૨	૩ ૮૩૫
૪			૩	૩ ૭૮૦
૫			૪	૩ ૭૨૫
૬			૫	૩ ૬૭૦
૭			૬	૩ ૬૧૫
૮			૭	૩ ૫૬૦
૯			૮	૩ ૫૦૫
૧૦			૯	૩ ૪૫૦
૧૧			૧૦	૩ ૩૯૫
૧૨			૧૧	૩ ૩૪૦
૧૩		૧	૦	૩ ૨૮૫
૧૪		૧	૧	૩ ૨૩૦
૧૫		૧	૨	૩ ૧૭૫
રૂપીઆ ૧		૧	૩	૩ ૧૨૫
૨		૨	૭	૨ ૨૫૦
૩		૩	૧૧	૧ ૩૭૫
૪		૫	૩	૦ ૫૦૦
૫		૬	૬	૩ ૬૨૫
૬		૭	૧૦	૨ ૭૫૦
૭		૯	૨	૧ ૮૭૫

શી. ૧-૩ ૯/૧૬ પેન્સ (૧-૩॥।૦॥)				
રૂપીઆ	પાઉંડ	શીં	પે.	ફાર.
૮		૧૦	૬	૧
૯		૧૧	૧૦	૦૧૨૫
૧૦		૧૩	૧	૩૨૫૦
૨૦	૧	૬	૩	૨૫૦૦
૩૦	૧	૧૯	૫	૧૭૫૦
૪૦	૨	૧૨	૭	૧
૫૦	૩	૫	૯	૦૨૫૦
૬૦	૩	૧૮	૧૦	૩૫૦૦
૭૦	૪	૧૨	૦	૨૭૫૦
૮૦	૫	૫	૨	૨
૯૦	૫	૧૮	૪	૧૨૫૦
૧૦૦	૬	૧૧	૬	૦૫૦૦
૨૦૦	૧૩	૩	૦	૧
૩૦૦	૧૯	૧૪	૬	૧૫૦૦
૪૦૦	૨૬	૬	૦	૨
૫૦૦	૩૨	૧૭	૬	૨૫૦૦
૬૦૦	૩૯	૯	૦	૩
૭૦૦	૪૬	૦	૬	૩૫૦૦
૮૦૦	૫૨	૧૨	૧	૦
૯૦૦	૫૯	૩	૭	૦૫૦૦
૧,૦૦૦	૬૫	૧૫	૧	૧
૧,૫૦૦	૯૮	૧૨	૭	૩૫૦૦
૨,૦૦૦	૧૩૧	૧૦	૨	૨
૩ ૦૦૦	૧૯૭	૫	૩	૩
૪,૦૦૦	૨૬૩	૦	૫	૦
૫,૦૦૦	૩૨૮	૧૫	૬	૧
૧૦,૦૦૦	૬૫૭	૧૧	૦	૨
૨૦,૦૦૦	૧.૩૧૫	૨	૧	૦
૩૦,૦૦૦	૧ ૯૭૨	૧૩	૧	૨
૪૦,૦૦૦	૨,૬૩૦	૪	૨	૦
૫૦,૦૦૦	૩,૨૮૭	૧૫	૨	૨
૧,૦૦,૦૦૦	૬,૫૭૫	૧૦	૫	૦
૨,૦૦ ૦૦૦	૧૩.૧૫૧		૦	૧૦.૦

(વીલાયતી હુંડી) પૌંડના રૂપૈયા

શી. ૧–૩ પેન્સ ૧૨ાાા આના					શા ૧–૩ ૧૩/૧૬ પેન્સ (૧-આા૦ાા')				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો	પૌંડ	રૂપીઆ	આ	પા	દો
૧		૧	૦	૧૫૪	૪	૬૦	૧૨	૪	૧૩૦
૨		૨	૦	૩૦૯	૫	૭૫	૧૫	૫	૧૬૩
૩		૩	૦	૪૬૩	૬	૯૧	૨	૬	૧૯૬
૪		૪	૦	૬૧૭	૭	૧૦૬	૫	૭	૨૨૮
૫		૫	૦	૭૭૨	૮	૧૨૧	૮	૮	૨૬૧
૬		૬	૦	૯૨૬	૯	૧૩૬	૧૧	૯	૨૯૪
૭		૭	૧	૦૮૦	૧૦	૧૫૧	૧૪	૧૦	૩૨૬
૮		૮	૧	૨૩૪	૨૦	૩૦૩	૧૩	૮	૬૫૩
૯		૯	૧	૩૮૯	૩૦	૪૫૫	૧૨	૬	૯૭૯
૧૦		૧૦	૧	૫૪૩	૪૦	૬૦૭	૧૧	૫	૩૦૬
૧૧		૧૧	૧	૬૯૭	૫૦	૭૫૯	૧૦	૩	૬૩૨
શીલીંગ ૧		૧૨	૧	૮૫૨	૬૦	૯૧૧	૯	૧	૯૫૮
૨	૧	૮	૩	૭૦૩	૭૦	૧,૦૬૩	૮	૦	૨૮૫
૩	૨	૪	૫	૫૫૫	૮૦	૧ ૨૧૫	૬	૧૦	૬૧૧
૪	૩	૦	૭	૪૦૧૭	૯૦	૧.૩૬૭	૫	૮	૯૩૮
૫	૩	૧૨	૯	૨૫૮	૧૦૦	૧,૫૧૯	૪	૭	૨૬૪
૬	૪	૮	૧૧	૧૧૦	૨૦૦	૩,૦૩૮	૯	૨	૫૨૮
૭	૫	૫	૦	૯૬૧	૩૦૦	૪,૫૫૭	૧૩	૯	૭૯૩
૮	૬	૧	૨	૮૧૩	૪૦૦	૬ ૦૭૭	૨	૫	૦૫૬
૯	૬	૧૩	૪	૬૬૫	૫૦૦	૭.૫૯૬	૭	૦	૩૨૦
૧૦	૭	૯	૬	૫૧૬	૬૦૦	૯,૧૧૫	૧૧	૭	૫૮૫
૧૧	૮	૫	૮	૩૬૮	૭૦૦	૧૦,૬૩૫	૦	૨	૮૪૯
૧૨	૯	૧	૧૦	૨૨૦	૮૦૦	૧૨,૧૫૪	૪	૧૦	૧૧૩
૧૩	૯	૧૪	૦	૦૭૧	૯૦૦	૧૩,૬૭૩	૯	૫	૩૭૭
૧૪	૧૦	૧૦	૧	૯૨૩	૧,૦૦૦	૧૫.૧૯૨	૧૪	૦	૬૪૧
૧૫	૧૧	૬	૩	૭૭૪	૧,૫૦૦	૨૨,૭૮૯	૫	૦	૯૬૨
૧૬	૧૨	૨	૫	૬૨૬	૨,૦૦૦	૩૦,૩૮૫	૧૨	૧	૨૮૨
૧૭	૧૨	૧૪	૭	૪૭૮	૩,૦૦૦	૪૫,૫૭૮	૧૦	૧	૯૨૩
૧૮	૧૩	૧૦	૯	૩૨૯	૪,૦૦૦	૬૦,૭૭૧	૮	૨	૫૬૪
૧૯	૧૪	૬	૧૧	૧૮૧	૫,૦૦૦	૭૫,૯૬૪	૬	૩	૨૦૪
પૌંડ ૧	૧૫	૩	૧	૦૩૩	૧૦.૦૦૦	૧,૫૧,૯૨૮	૧૨	૬	૪૦[illegible]
૨	૩૦	૬	૨	૦૬૫	૨૦,૦૦૦	૩,૦૩,૮૫૭	૯	૦	[illegible]૧૩
૩	૪૫	૯	૩	૦૯૮	૪૦.૦૦૦	૬,૦૭,૭૧૫	૨	૧	૬૨[illegible]

શી. ૧-૦ પેન્સ ૧૨॥ આના						શી. ૧-૩ ૭/૮ પેન્સ (૧-૩॥)૦॥					
પાઈ	પૌંડ	શી	પે	ફાર		રૂપીઆ.	પૌંડ	શી.	પે	ફાર	
૧				૦	૩૨૯	૮		૧૦	૬	૧	૫૦૦
૨				૦	૬૫૮	૯		૧૧	૧૦	૦	૬૮૭
૩				૦	૯૮૭	૧૦		૧૩	૧	૩	૮૭૫
૪				૧	૩૧૬	૨૦	૧	૬	૩	૩	૭૫૦
૫				૧	૬૪૫	૩૦	૧	૧૯	૫	૩	૬૨૫
૬				૧	૯૭૪	૪૦	૨	૧૨	૭	૩	૫૦૦
૭				૨	૩૦૩	૫૦	૩	૫	૯	૩	૩૭૫
૮				૨	૬૩૩	૬૦	૩	૧૮	૧૧	૩	૨૫૦
૯				૨	૯૬૧	૭૦	૪	૧૨	૧	૩	૧૨૫
૧૦				૩	૨૯૦	૮૦	૫	૫	૩	૩	
૧૧				૩	૬૧૯	૯૦	૫	૧૮	૫	૨	૮૭૫
આના ૧				૩	૯૪૯	૧૦૦	૬	૧૧	૭	૨	૭૫૦
૨			૧	૩	૮૯૮	૨૦૦	૧૩	૩	૩	૧	૫૦૦
૩			૨	૩	૮૪૭	૩૦૦	૧૯	૧૪	૧૧	૦	૨૫૦
૪			૩	૩	૭૯૭	૪૦૦	૨૬	૬	૬	૩	
૫			૪	૩	૭૪૬	૫૦૦	૩૨	૧૮	૨	૧	૭૫૦
૬			૫	૩	૬૯૬	૬૦૦	૩૯	૯	૧૦	૦	૫૦૦
૭			૬	૩	૬૪૪	૭૦૦	૪૬	૧	૫	૩	૨૫૦
૮			૭	૩	૫૯૩	૮૦૦	૫૨	૧૩	૧	૨	
૯			૮	૩	૫૪૨	૯૦૦	૫૯	૪	૯	૦	૭૫૦
૧૦			૯	૩	૪૯૨	૧,૦૦૦	૬૫	૧૬	૪	૩	૫૦૦
૧૧			૧૦	૩	૪૪૧	૧,૫૦૦	૯૮	૧૪	૭	૧	૨૫૦
૧૨			૧૧	૩	૩૯૦	૨,૦૦૦	૧૩૧	૧૨	૯	૩	
૧૩		૧	૦	૩	૩૩૯	૩,૦૦૦	૧૯૭	૯	૨	૨	૫૦૦
૧૪		૧	૧	૩	૨૮૮	૪,૦૦૦	૨૬૩	૫	૭	૨	
૧૫		૧	૨	૩	૨૩૭	૫,૦૦૦	૩૨૯	૨	૦	૧	૫૦૦
રૂપીઆ ૧		૧	૩	૩	૧૮૭	૧૦,૦૦૦	૬૫૮	૪	૦	૩	
૨		૨	૭	૨	૩૭૫	૨૦,૦૦૦	૧,૩૧૬	૮	૧	૨	
૩		૩	૧૧	૧	૫૬૨	૩૦,૦૦૦	૧,૯૭૪	૧૨	૨	૧	
૪		૫	૩	૦	૭૫૦	૪૦,૦૦૦	૨,૬૩૨	૧૬	૩		
૫		૬	૬	૩	૯૩૭	૫૦,૦૦૦	૩,૨૯૧	૦	૩	૩	
૬		૭	૧૦	૩	૧૨૫	૧,૦૦,૦૦૦	૬,૫૮૨	૦	૭	૨	
૭		૯	૨	૨	૩૧૨	૨,૦૦,૦૦૦	૧૩,૧૬૪	૧	૩	૦	

પાઉના રૂપીઆ

શી. ૧–૩ પેન્સ ૧૩ આના					શી. ૧–૩ $\frac{13}{16}$ પેન્સ (૧–૩ાા–)				
પેન્સ.	રૂપીઆ	આ	પા.	દો.	પૌંડ.	રૂપીઆ.	આ	પ	દો.
૧		૧	૦	૧૪૨	૪	૬૦	૧૧	૪	૬૦૧
૨		૨	૦	૨૮૫	૫	૭૫	૧૪	૨	૭૫૧
૩		૩	૦	૪૨૭	૬	૯૧	૧	૦	૯૦૧
૪		૪	૦	૫૭૦	૭	૧૦૬	૩	૧૧	૦૫૨
૫		૫	૦	૭૧૨	૮	૧૨૧	૬	૯	૨૦૨
૬		૬	૦	૮૫૫	૯	૧૩૬	૯	૭	૩૫૨
૭		૭	૦	૯૯૭	૧૦	૧૫૧	૧૨	૫	૫૦૨
૮		૮	૧	૧૪૦	૨૦	૩૦૩	૮	૧૧	૦૦૪
૯		૯	૧	૨૮૨	૩૦	૪૫૫	૫	૪	૫૦૬
૧૦		૧૦	૧	૪૨૪	૪૦	૬૦૭	૧	૧૦	૦૦૮
૧૧		૧૧	૧	૫૬૬	૫૦	૭૫૮	૧૪	૩	૫૧૦
શીલીંગ ૧		૧૨	૧	૭૦૮	૬૦	૯૧૦	૧૦	૯	૦૧૨
૨	૧	૮	૩	૪૧૫	૭૦	૧,૦૬૨	૭	૨	૫૧૪
૩	૨	૪	૫	૧૨૨	૮૦	૧.૨૧૪	૩	૮	૦૧૬
૪	૩	૦	૬	૮૩૦	૯૦	૧,૩૬૬	૦	૧	૫૧૮
૫	૩	૧૨	૮	૫૩૮	૧૦૦	૧,૫૧૭	૧૨	૭	૦૨૦
૬	૪	૮	૧૦	૨૪૬	૨૦૦	૩.૦૩૫	૯	૨	૦૪૦
૭	૫	૪	૧૧	૯૫૩	૩૦૦	૪,૫૫૩	૫	૯	૦૬૦
૮	૬	૧	૧	૬૬૦	૪૦૦	૬,૦૭૧	૨	૪	૦૭૯
૯	૬	૧૩	૩	૩૬૮	૫૦૦	૭,૫૮૮	૧૪	૧૧	૦૯૯
૧૦	૭	૯	૫	૦૭૬	૬૦૦	૯,૧૦૬	૧૧	૬	૧૧૯
૧૧	૮	૫	૬	૭૮૩	૭૦૦	૧૦,૬૨૪	૮	૧	૧૩૯
૧૨	૯	૧	૮	૪૯૦	૮૦૦	૧૨,૧૪૨	૪	૮	૧૫૮
૧૩	૯	૧૩	૧૦	૧૯૮	૯૦૦	૧૩,૬૬૦	૧	૩	૧૭૮
૧૪	૧૦	૯	૧૧	૯૦૬	૧.૦૦૦	૧૫,૧૭૭	૧૩	૧૦	૧૯૮
૧૫	૧૧	૬	૧	૬૧૩	૧,૫૦૦	૨૨,૭૬૬	૧૨	૯	૨૯૬
૧૬	૧૨	૨	૩	૩૨૦	૨,૦૦૦	૩૦,૩૫૫	૧૧	૮	૩૯૫
૧૭	૧૨	૧૪	૫	૦૨૮	૩,૦૦૦	૪૫,૫૩૩	૯	૬	૫૯૩
૧૮	૧૩	૧૦	૬	૭૩૬	૪.૦૦૦	૬૦,૭૧૧	૭	૪	૭૯૨
૧૯	૧૪	૬	૮	૪૪૩	૫ ૦૦૦	૭૫,૮૮૯	૫	૨	૯૮૯
પાઉંડ ૧	૧૫	૨	૧૦	૧૫૦	૧૦,૦૦૦	૧,૫૧,૭૭૮	૧૦	૫	૯૭૯
૨	૩૦	૫	૮	૩૦૦	૨૦,૦૦૦	૩,૦૩,૫૫૭		૪ ૧૧	૯૫૪
૩	૪૫	૮	૬	૪૫૦	૪૦,૦૦૦	૬.૦૭,૧૧૪		૯ ૧૧	૯૦૮

શી. ૧-૩ પેન્સ ૧૩ આના.						શી. ૧-૩ ૧૩/૧૬ પે. (૧-૩।।।-)					
પાઇ.	પૌંડ	શી	પે.	ફાર		રૂપીઆ	પૌંડ	શી	પે	ફાર	
૧				૦	૩૨૯	૮		૧૦	૬	૨	
૨				૦	૬૫૯	૯		૧૧	૧૦	૧	૨૫૦
૩				૦	૯૮૮	૧૦		૧૩	૨	૦	૫૦૦
૪				૧	૩૧૭	૨૦	૧	૬	૪	૧	
૫				૧	૬૪૭	૩૦	૧	૧૯	૬	૧	૫૦૦
૬				૧	૯૭૬	૪૦	૨	૧૨	૮	૨	
૭				૨	૩૦૬	૫૦	૩	૫	૧૦	૨	૫૦૦
૮				૨	૬૩૫	૬૦	૩	૧૯	૦	૩	
૯				૨	૯૬૫	૭૦	૪	૧૨	૨	૩	૫૦૦
૧૦				૩	૨૯૪	૮૦	૫	૫	૫	૦	
૧૧				૩	૬૨૪	૯૦	૫	૧૮	૭	૦	૫૦૦
આના ૧				૩	૯૫૩	૧૦૦	૬	૧૧	૯	૧	
૨			૧	૩	૯૦૬	૨૦૦	૧૩	૩	૬	૨	
૩			૨	૩	૮૫૯	૩૦૦	૧૯	૧૫	૩	૩	
૪			૩	૩	૮૧૨	૪૦૦	૨૬	૭	૧	૦	
૫			૪	૩	૭૬૫	૫૦૦	૩૨	૧૮	૧૦	૧	
૬			૫	૩	૭૧૮	૬૦૦	૩૯	૧૦	૭	૨	
૭			૬	૩	૬૭૧	૭૦૦	૪૬	૨	૪	૩	
૮			૭	૩	૬૨૫	૮૦૦	૫૨	૧૪	૨	૦	
૯			૮	૩	૫૭૮	૯૦૦	૫૯	૫	૧૧	૧	
૧૦			૯	૩	૫૩૧	૧,૦૦૦	૬૫	૧૭	૮	૨	
૧૧			૧૦	૩	૪૮૪	૧,૫૦૦	૯૮	૧૬	૬	૩	
૧૨			૧૧	૩	૪૩૭	૨,૦૦૦	૧૩૧	૧૫	૫	૦	
૧૩		૧	૦	૩	૩૯૦	૩,૦૦૦	૧૯૭	૧૩	૧	૨	
૧૪		૧	૧	૩	૩૪૪	૪,૦૦૦	૨૬૩	૧૦	૧૦	૦	
૧૫		૧	૨	૩	૨૯૭	૫,૦૦૦	૩૨૯	૮	૬	૨	
રૂપીઆ ૧		૧	૩	૩	૨૫૦	૧૦,૦૦૦	૬૫૮	૧૭	૧	૦	
૨		૨	૭	૨	૫૦૦	૨૦,૦૦૦	૧,૩૧૭	૧૪	૨	૦	
૩		૩	૧૧	૧	૭૫૦	૩૦,૦૦૦	૧,૯૭૬	૧૧	૩	૦	
૪		૫	૩	૧		૪૦,૦૦૦	૨,૬૩૫	૮	૪	૦	
૫		૬	૭	૦	૨૫૦	૫૦,૦૦૦	૩,૨૯૪	૫	૫	૦	
૬		૭	૧૦	૩	૫૦૦	૧,૦૦,૦૦૦	૬,૫૮૮	૧૦	૧૦	૦	
૭		૯	૨	૨	૭૫૦	૨,૦૦,૦૦૦	૧૩,૧૭૭	૧	૮	૦	

પૌંડના રૂપીઆ

શી. ૧—૩ પેન્સ ૧૩। આના.					ચા. ૧—૩ ૫/૬ પેન્સ(૧-૩।।।ના)				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો.	પાઉંડ	રૂપીઆ	આ	પા	દો
૧		૧	૦	૧૩૦	૪	૬૦	૧૦	૫	૦૯૪
૨		૨	૦	૨૬૧	૫	૭૫	૧૩	૦	૩૬૭
૩		૩	૦	૩૯૧	૬	૯૦	૧૫	૭	૬૪૧
૪		૪	૦	૫૨૧	૭	૧૦૬	૨	૨	૯૧૪
૫		૫	૦	૬૫૨	૮	૧૨૧	૪	૧૦	૧૮૮
૬		૬	૦	૭૮૨	૯	૧૩૬	૭	૫	૪૬૧
૭		૭	૦	૯૧૨	૧૦	૧૫૧	૧૦	૦	૭૩૪
૮		૮	૧	૦૪૨	૨૦	૩૦૩	૪	૧	૪૬૯
૯		૯	૧	૧૭૩	૩૦	૪૫૪	૧૪	૨	૨૦૩
૧૦		૧૦	૧	૩૦૩	૪૦	૬૦૬	૮	૨	૯૩૮
૧૧		૧૧	૧	૪૩૩	૫૦	૭૫૮	૨	૩	૬૭૨
શીલીંગ ૧		૧૨	૧	૫૬૪	૬૦	૯૦૯	૧૨	૪	૪૦૭
૨	૧	૮	૩	૧૨૭	૭૦	૧,૦૬૧	૬	૫	૧૪૧
૩	૨	૪	૪	૬૯૧	૮૦	૧,૨૧૩	૦	૫	૮૭૮
૪	૩	૦	૬	૨૫૫	૯૦	૧,૩૬૪	૧૦	૬	૬૧૦
૫	૩	૧૨	૭	૮૧૮	૧૦૦	૧,૫૧૬	૪	૭	૩૪૫
૬	૪	૮	૯	૩૮૨	૨૦૦	૩,૦૩૨	૯	૨	૬૮૯
૭	૫	૪	૧૦	૯૪૬	૩૦૦	૪,૫૪૮	૧૩	૧૦	૦૩૪
૮	૬	૧	૦	૫૦૯	૪૦૦	૬,૦૬૫	૨	૫	૩૭૮
૯	૬	૧૩	૨	૦૭૩	૫૦૦	૭,૫૮૧	૭	૦	૭૨૩
૧૦	૭	૯	૩	૬૩૭	૬૦૦	૯,૦૯૭	૧૧	૮	૦૬૭
૧૧	૮	૫	૫	૨૦૦	૭૦૦	૧૦,૬૧૪	૦	૩	૪૧૨
૧૨	૯	૧	૬	૭૬૪	૮૦૦	૧૨,૧૩૦	૪	૧૦	૭૫૬
૧૩	૯	૧૩	૮	૩૨૮	૯૦૦	૧૩,૬૪૬	૯	૬	૧૦૧
૧૪	૧૦	૯	૯	૮૯૧	૧,૦૦૦	૧૫,૧૬૨	૧૪	૧	૪૪૫
૧૫	૧૧	૫	૧૧	૪૫૫	૧,૫૦૦	૨૨,૭૪૪	૫	૨	૧૬૮
૧૬	૧૨	૨	૧	૦૧૯	૨,૦૦૦	૩૦,૩૨૫	૧૨	૨	૮૯૦
૧૭	૧૨	૧૪	૨	૫૮૨	૩,૦૦૦	૪૫,૪૮૮	૧૦	૪	૩૩૬
૧૮	૧૩	૧૦	૪	૧૪૬	૪,૦૦૦	૬૦,૬૫૧	૮	૫	૭૮૧
૧૯	૧૪	૬	૫	૭૧૦	૫,૦૦૦	૭૫,૮૧૪	૬	૭	૨૨૬
પોંડ ૧	૧૫	૨	૭	૨૭૩	૧૦,૦૦૦	૧,૫૧,૬૨૮	૧૩	૨	૪૫૨
૨	૩૦	૫	૨	૫૪૭	૨૦,૦૦૦	૩,૦૩,૨૫૭	૧૦	૪	૯૦૩
૩	૪૫	૭	૯	૮૨૦	૪૦,૦૦૦	૬,૦૬,૫૧૫	૪	૯	૮૦૫

શી ૧-૩ પેન્સ ૧૩ આના						શી ૧-૩ ૧૩/૧૬ પેન્સ (૧-૩॥।-।)					
પાઇ	પાઉંડ	શી	પે	ફાર		રૂપીઆ	પાઉંડ.	શી.	પે.	ફાર	
૧					૩૩૦	૮		૧૦	૬	૨	૫૦૦
૨					૬૫૯	૯		૧૧	૧૦	૧	૮૧૨
૩					૯૬૯	૧૦		૧૩	૨	૧	૧૨૫
૪				૧	૩૧૯	૨૦	૧	૬	૪	૨	૨૫૦
૫				૧	૬૪૯	૩૦	૧	૧૯	૬	૩	૩૭૫
૬				૧	૯૭૮	૪૦	૨	૧૨	૯	૦	૫૦૦
૭				૨	૩૦૮	૫૦	૩	૫	૧૧	૧	૬૨૫
૮				૨	૬૩૮	૬૦	૩	૧૯	૧	૨	૭૫૦
૯				૨	૯૬૮	૭૦	૪	૧૨	૩	૩	૮૭૫
૧૦				૩	૨૯૮	૮૦	૫	૫	૬	૧	
૧૧				૩	૬૨૭	૯૦	૫	૧૮	૮	૨	૧૨૫
આના ૧				૩	૯૫૭	૧૦૦	૬	૧૧	૧૦	૩	૨૫૦
૨			૧	૩	૯૧૪	૨૦૦	૧૩	૩	૯	૨	૫૦૦
૩			૨	૩	૮૭૧	૩૦૦	૧૯	૧૫	૮	૧	૭૫૦
૪			૩	૩	૮૨૮	૪૦૦	૨૬	૭	૭	૧	
૫			૪	૩	૭૮૫	૫૦૦	૩૨	૧૯	૬	૦	૨૫૦
૬			૫	૩	૭૪૨	૬૦૦	૩૯	૧૧	૪	૩	૫૦૦
૭			૬	૩	૬૯૯	૭૦૦	૪૬	૩	૩	૨	૭૫૦
૮			૭	૩	૬૫૬	૮૦૦	૫૨	૧૫	૨	૨	
૯			૮	૩	૬૧૩	૯૦૦	૫૯	૭	૧	૧	૨૫૦
૧૦			૯	૩	૫૭૦	૧,૦૦૦	૬૫	૧૯	૦	૦	૫૦૦
૧૧			૧૦	૩	૫૨૭	૧,૫૦૦	૯૮	૧૮	૬	૦	૭૫૦
૧૨			૧૧	૩	૪૮૪	૨,૦૦૦	૧૩૧	૧૮	૦	૧	
૧૩		૧	૦	૩	૪૪૧	૩,૦૦૦	૧૯૭	૧૭	૦	૧	૫૦૦
૧૪		૧	૧	૩	૩૯૮	૪,૦૦૦	૨૬૩	૧૬	૦	૨	
૧૫		૧	૨	૩	૩૫૫	૫,૦૦૦	૩૨૯	૧૫	૦	૨	૫૦૦
રૂપીઆ ૧		૧	૩	૩	૩૧૨	૧૦,૦૦૦	૬૫૯	૧૦	૧	૧	
૨		૨	૭	૨	૬૨૫	૨૦,૦૦૦	૧.૩૧૯	૦	૨	૨	
૩		૩	૧૧	૧	૯૩૭	૩૦,૦૦૦	૧,૯૭૮	૧૦	૩	૩	
૪		૫	૩	૧	૨૫૦	૪૦,૦૦૦	૨,૬૩૮	૦	૫	૦	
૫		૬	૭	૦	૫૬૨	૫૦,૦૦૦	૩,૨૯૭	૧૦	૬	૧	
૬		૭	૧૦	૩	૮૭૫	૧,૦૦,૦૦૦	૬,૫૯૫	૧	૦	૨	
૭		૯	૨	૩	૧૮૭	૨.૦૦,૦૦૦	૧,૩૧૯૦	૨	૧	૦	

(વીલાયતી હુંડી) પૌંડના રૂપીઆ.

શી. ૧-૩ પેન્સ ૧૩॥ આના					શો. ૧-૩૩૪/૬૪ પેન્સ (૧-૩॥।~॥)				
પેન્સ	રૂપીઆ	આ	પ.	દોકડા	પૌંડ	રૂપીઆ	આ	પ.	દો.
૧		૧	૦	૧૧૮	૪	૬૦	૯	૫	૬૧૦
૨		૨	૦	૨૩૭	૫	૭૫	૧૧	૧૦	૦૧૨
૩		૩	૦	૩૫૫	૬	૯૦	૧૪	૨	૪૧૪
૪		૪	૦	૪૭૪	૭	૧૦૬	૦	૬	૮૧૬
૫		૫	૦	૫૯૨	૮	૧૨૧	૨	૧૧	૨૧૮
૬		૬	૦	૭૧૦	૯	૧૩૬	૫	૩	૬૨૦
૭		૭	૦	૮૨૮	૧૦	૧૫૧	૭	૮	૦૨૩
૮		૮	૦	૯૪૭	૨૦	૩૦૨	૧૫	૪	૦૪૬
૯		૯	૧	૦૬૫	૩૦	૪૫૪	૭	૦	૦૭૧
૧૦		૧૦	૧	૧૮૩	૪૦	૬૦૫	૧૪	૮	૦૯૬
૧૧		૧૧	૧	૩૦૧	૫૦	૭૫૭	૬	૪	૧૨૦
શીલીંગ ૧		૧૨	૧	૪૨૦	૬૦	૯૦૮	૧૪	૦	૧૪૫
૨	૧	૮	૨	૮૪૦	૭૦	૧,૦૬૦	૫	૮	૧૭૦
૩	૨	૪	૪	૨૬૧	૮૦	૧,૨૧૧	૧૩	૪	૧૯૫
૪	૩	૦	૫	૬૮૧	૯૦	૧,૩૬૩	૫	૦	૨૧૯
૫	૩	૧૨	૭	૧૦૧	૧૦૦	૧,૫૧૪	૧૨	૮	૨૪૧
૬	૪	૮	૮	૫૨૨	૨૦૦	૩,૦૨૯	૯	૪	૪૭૮
૭	૫	૪	૯	૯૪૩	૩૦૦	૪,૫૪૪	૬	૦	૭૧૪
૮	૬	૦	૧૧	૩૬૩	૪૦૦	૬,૦૫૯	૨	૮	૯૫૧
૯	૬	૧૩	૦	૭૮૩	૫૦૦	૭,૫૭૩	૧૫	૫	૧૮૭
૧૦	૭	૯	૨	૨૦૩	૬૦૦	૯,૦૮૮	૧૨	૧	૪૨૪
૧૧	૮	૫	૩	૬૨૩	૭૦૦	૧૦,૬૦૩	૮	૯	૬૬૧
૧૨	૯	૧	૫	૦૪૩	૮૦૦	૧૨,૧૧૮	૫	૫	૮૯૮
૧૩	૯	૧૩	૬	૪૬૩	૯૦૦	૧૩,૬૩૩	૨	૨	૧૩૪
૧૪	૧૦	૯	૭	૮૮૩	૧,૦૦૦	૧૫,૧૪૭	૧૪	૧૦	૩૭૦
૧૫	૧૧	૫	૯	૩૦૩	૧,૫૦૦	૨૨.૭૨૧	૧૪	૩	૫૫૪
૧૬	૧૨	૧	૧૦	૭૨૪	૨,૦૦૦	૩૦,૨૯૫	૧૩	૮	૭૩૫
૧૭	૧૨	૧૪	૦	૧૪૪	૩,૦૦૦	૪૫,૪૪૩	૧૨	૭	૧૦૦
૧૮	૧૩	૧૦	૧	૫૬૪	૪,૦૦૦	૬૦,૫૯૧	૧૧	૫	૪૬૬
૧૯	૧૪	૬	૨	૯૮૪	૫,૦૦૦	૭૫.૭૩૯	૧૦	૩	૮૩૩
પૌંડ ૧	૧૫	૨	૪	૪૦૪	૧૦,૦૦૦	૧,૫૧,૪૭૯	૪	૭	૬૬૭
૨	૩૦	૪	૮	૮૦૬	૨૦,૦૦૦	૩,૦૨,૯૫૮	૯	૩	૩૩૪
૩	૪૫	૭	૧	૨૦૮	૪૦,૦૦૦	૬,૦૫,૯૧૭	૨	૬	૬૬૮

શીં. ૧-૩ પેન્સ ૧૩॥ આના						શી. ૧-૩ ૨૭/૩૨ પેન્સ (૧-૩॥।-॥)					
પાઇ		પૌંડ	શી	પે	ફા.ર.	રૂપીઆ.	પૌંડ.	શી.	પે	ફા	ર.
	૧				૦૩૩૦	૮		૧૦	૬	૩	
	૨				૦૬૬૦	૯		૧૧	૧૦	૨	૩૭૫
	૩				૦૯૯૦	૧૦		૧૩	૨	૧	૭૫૦
	૪				૧૩૨૦	૨૦	૧	૬	૪	૩	૫૦૦
	૫				૧૬૫૦	૩૦	૧	૧૯	૭	૧	૨૫૦
	૬				૧૯૮૦	૪૦	૨	૧૨	૯	૩	
	૭				૨૩૧૧	૫૦	૩	૬	૦	૦	૭૫૦
	૮				૨૬૪૧	૬૦	૩	૧૯	૨	૨	૫૦૦
	૯				૨૯૭૧	૭૦	૪	૧૨	૫	૦	૨૫૦
	૧૦				૩૨૦૧	૮૦	૫	૫	૭	૨	
	૧૧				૩૬૩૧	૯૦	૫	૧૮	૯	૩	૭૫૦
આના	૧				૩૯૬૧	૧૦૦	૬	૧૨	૦	૧	૫૦૦
	૨			૧	૩૯૨૨	૨૦૦	૧૩	૪	૦	૩	
	૩			૨	૩૮૮૩	૩૦૦	૧૯	૧૬	૧	૦	૫૦૦
	૪			૩	૩૮૪૪	૪૦૦	૨૬	૮	૧	૨	
	૫			૪	૩૮૦૬	૫૦૦	૩૩	૦	૧	૩	૫૦૦
	૬			૫	૩૭૬૭	૬૦૦	૩૯	૧૨	૨	૧	
	૭			૬	૩૭૨૮	૭૦૦	૪૬	૪	૨	૨	૫૦૦
	૮			૭	૩૬૮૯	૮૦૦	૫૨	૧૬	૩	૦	
	૯			૮	૩૬૫૦	૯૦૦	૫૯	૮	૩	૧	૫૦૦
	૧૦			૯	૩૬૧૧	૧,૦૦૦	૬૬	૦	૩	૩	
	૧૧			૧૦	૩૫૭૨	૧,૫૦૦	૯૯	૦	૫	૨	૫૦૦
	૧૨			૧૧	૩૫૩૩	૨,૦૦૦	૧૩૨	૦	૭	૨	
	૧૩		૧	૦	૩૪૯૫	૩,૦૦૦	૧૯૮	૦	૧૧	૧	
	૧૪		૧	૧	૩૪૫૬	૪,૦૦૦	૨૬૪	૧	૩	૦	
	૧૫		૧	૨	૩૪૧૭	૫,૦૦૦	૩૩૦	૧	૬	૩	
રૂપીઆ	૧		૧	૩	૩૩૭૫	૧૦,૦૦૦	૬૬૦	૩	૧	૨	
	૨		૨	૭	૨૭૫૦	૨૦,૦૦૦	૧,૩૨૦	૬	૩	૦	
	૩		૩	૧૧	૨૧૨૫	૩૦,૦૦૦	૧,૯૮૦	૯	૪	૨	
	૪		૫	૩	૧૫૦૦	૪૦,૦૦૦	૨,૬૪૦	૧૨	૬	૦	
	૫		૬	૭	૦૮૭૫	૫૦,૦૦૦	૩,૩૦૦	૧૫	૭	૨	
	૬		૭	૧૧	૦૨૫૦	૧,૦૦,૦૦૦	૬,૬૦૧	૧૧	૩	૦	
	૭		૯	૨	૩૬૨૫	૨,૦૦,૦૦૦	૧૩૨૦૩	૨	૬	૦	

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૩ પેન્સ ૧૩।। આના

પેન્સ	રૂપીઆ	આ	પા.	દો.
૧		૧	૦	૧૦૬
૨		૨	૦	૨૧૩
૩		૩	૦	૩૧૯
૪		૪	૦	૪૨૬
૫		૫	૦	૫૩૨
૬		૬	૦	૬૩૮
૭		૭	૦	૭૪૬
૮		૮	૦	૮૫૧
૯		૯	૦	૯૫૮
૧૦		૧૦	૧	૦૬૪
૧૧		૧૧	૧	૧૭૦
શીલીંગ ૧		૧૨	૧	૨૭૭
૨	૧	૮	૨	૫૫૪
૩	૨	૪	૩	૮૩૧
૪	૩	૦	૫	૧૦૭
૫	૩	૧૨	૬	૩૮૪
૬	૪	૮	૭	૬૬૧
૭	૫	૪	૮	૯૩૮
૮	૬	૦	૧૦	૨૧૫
૯	૬	૧૨	૧૧	૪૯૨
૧૦	૭	૯	૦	૭૬૮
૧૧	૮	૫	૨	૦૪૫
૧૨	૯	૧	૩	૩૨૨
૧૩	૯	૧૩	૪	૫૯૯
૧૪	૧૦	૯	૫	૮૭૬
૧૫	૧૧	૫	૭	૧૫૩
૧૬	૧૨	૧	૮	૯૩૦
૧૭	૧૨	૧૩	૯	૭૬૬
૧૮	૧૩	૯	૧૦	૯૮૩
૧૯	૧૪	૬	૦	૨૬૦
પૌંડ ૧	૧૫	૨	૧	૫૩૭
૨	૩૦	૪	૩	૦૭૪
૩	૪૫	૬	૪	૬૧૧

શી. ૧-૩ ૫૫/૬૪ પેન્સ (૧-૩।।-।।।)

પૌંડ	રૂપીઆ	આ	પા.	દો.
૪	૬૦	૮	૬	૧૪૮
૫	૭૫	૧૦	૭	૬૮૫
૬	૯૦	૧૨	૯	૨૨૨
૭	૧૦૫	૧૪	૧૦	૭૫૯
૮	૧૨૧	૧	૦	૨૯૬
૯	૧૩૬	૩	૧	૮૩૩
૧૦	૧૫૧	૫	૩	૩૬૯
૨૦	૩૦૨	૧૦	૬	૭૩૯
૩૦	૪૫૩	૧૫	૧૦	૧૦૮
૪૦	૬૦૫	૫	૧	૪૭૮
૫૦	૭૫૬	૧૦	૪	૮૪૭
૬૦	૯૦૭	૧૫	૮	૨૧૭
૭૦	૧,૦૫૯	૪	૧૧	૫૮૬
૮૦	૧,૨૧૦	૧૦	૨	૯૫૬
૯૦	૧,૩૬૧	૧૫	૬	૩૨૫
૧૦૦	૧,૫૧૩	૪	૯	૬૯૫
૨૦૦	૩,૦૨૬	૯	૭	૩૮૯
૩૦૦	૪,૫૩૯	૧૪	૫	૦૮૪
૪૦૦	૬,૦૫૩	૩	૨	૭૭૮
૫૦૦	૭,૫૬૬	૮	૦	૪૭૩
૬૦૦	૯,૦૭૯	૧૨	૧૦	૧૬૭
૭૦૦	૧૦,૫૯૩	૧	૭	૮૬૨
૮૦૦	૧૨,૧૦૬	૬	૫	૫૫૭
૯૦૦	૧૩,૬૧૯	૧૧	૩	૨૫૧
૧,૦૦૦	૧૫,૧૩૩	૦	૦	૯૪૬
૧,૫૦૦	૨૨,૬૯૯	૮	૧	૪૧૯
૨,૦૦૦	૩૦,૨૬૬	૦	૧	૮૯૨
૩,૦૦૦	૪૫,૩૯૯	૦	૨	૮૩૭
૪,૦૦૦	૬૦,૫૩૨	૦	૩	૭૮૩
૫,૦૦૦	૭૫,૬૬૫	૦	૪	૭૨૯
૧૦,૦૦૦	૧,૫૧,૩૩૦	૦	૯	૪૫૮
૨૦,૦૦૦	૩,૦૨,૬૬૦	૧	૬	૯૧૬
૪૦,૦૦૦	૬,૦૫,૩૨૦	૩	૧	૮૩૨

શી. ૧-૩ પેન્સ ૧૩॥ આના.						શી. ૧-૩ ૫૫/૬૪ પે. (૧-૩॥-॥)					
પાઇ	પૌંડ	શી.	પે	ફાર		રૂપીઆ	પૌંડ.	શી	પે.	ફાર	
૧					૩૩૦	૮		૧૦	૬	૩	૫૦૦
૨					૬૬૧	૯		૧૧	૧૦	૨	૯૩૭
૩					૯૯૧	૧૦		૧૩	૨	૨	૩૭૫
૪				૧	૩૨૧	૨૦	૧	૬	૫	૦	૭૫૦
૫				૧	૬૫૨	૩૦	૧	૧૯	૭	૩	૧૨૫
૬				૧	૯૮૨	૪૦	૨	૧૨	૧૦	૧	૫૦૦
૭				૨	૩૧૨	૫૦	૩	૬	૦	૩	૮૭૫
૮				૨	૬૪૩	૬૦	૩	૧૯	૩	૨	૨૫૦
૯				૨	૯૭૩	૭૦	૪	૧૨	૬	૦	૬૨૫
૧૦				૩	૩૦૪	૮૦	૫	૫	૮	૩	
૧૧				૩	૬૩૪	૯૦	૫	૧૮	૧૧	૧	૩૭૫
આના ૧				૩	૯૬૫	૧૦૦	૬	૧૨	૧	૩	૭૫૦
૨			૧	૩	૯૨૯	૨૦૦	૧૩	૪	૩	૩	૫૦૦
૩			૨	૩	૮૯૪	૩૦૦	૧૯	૧૬	૫	૩	૨૫૦
૪			૩	૩	૮૫૯	૪૦૦	૨૬	૮	૭	૩	
૫			૪	૩	૮૨૪	૫૦૦	૩૩	૦	૯	૨	૭૫૦
૬			૫	૩	૭૮૯	૬૦૦	૩૯	૧૨	૧૧	૨	૫૦૦
૭			૬	૩	૭૫૩	૭૦૦	૪૬	૫	૧	૨	૨૫૦
૮			૭	૩	૭૧૮	૮૦૦	૫૨	૧૭	૩	૨	
૯			૮	૩	૬૮૩	૯૦૦	૫૯	૯	૫	૧	૭૫૦
૧૦			૯	૩	૬૪૮	૧૦૦૦	૬૬	૧	૭	૧	૫૦૦
૧૧			૧૦	૩	૬૧૩	૧,૫૦૦	૯૯	૨	૫	૦	૨૫૦
૧૨			૧૧	૩	૫૭૮	૨,૦૦૦	૧૩૨	૩	૨	૩	
૧૩		૧	૦	૩	૫૪૨	૩,૦૦૦	૧૯૮	૪	૧૦	૦	૫૦૦
૧૪		૧	૧	૩	૫૦૬	૪,૦૦૦	૨૬૪	૬	૫	૨	
૧૫		૧	૨	૩	૪૭૧	૫,૦૦૦	૩૩૦	૮	૦	૩	૫૦૦
પીઆ ૧		૧	૩	૩	૪૩૭	૧૦,૦૦૦	૬૬૦	૧૬	૧	૩	
૨		૨	૭	૨	૮૭૫	૨૦,૦૦૦	૧,૩૨૧	૧૨	૩	૨	
૩		૩	૧૧	૨	૩૧૨	૩૦,૦૦૦	૧,૯૮૨	૮	૫	૧	
૪		૫	૩	૧	૭૫૦	૪૦,૦૦૦	૨,૬૪૩	૪	૭	૦	
૫		૬	૭	૧	૧૮૭	૫૦ ૦૦૦	૩,૩૦૪	૦	૮	૩	
૬		૭	૧૧	૦	૬૨૫	૧,૦૦,૦૦૦	૬,૬૦૮	૧	૫	૨	
૭		૯	૩	૦	૦૬૨	૨,૦૦,૦૦૦	૧૩,૨૧૬	૨	૧૧	૦	

 (વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૩ પેન્સ ૧૪ આના					શી. ૧-૩ ૭/૮ પેન્સ (૧-૩॥=)				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો	પૌંડ	રૂપીઆ	આ	પા	દો
૧		૧	૦	૦૯૪	૪	૬૦	૭	૬	૭૦૯
૨		૨	૦	૧૮૮	૫	૭૫	૯	૫	૩૮૬
૩		૩	૦	૨૮૩	૬	૯૦	૧૧	૪	૦૬૪
૪		૪	૦	૩૭૮	૭	૧૦૫	૧૩	૨	૭૪૦
૫		૫	૦	૪૭૨	૮	૧૨૦	૧૫	૧	૪૧૭
૬		૬	૦	૫૬૭	૯	૧૩૬	૧	૦	૦૯૪
૭		૭	૦	૬૬૧	૧૦	૧૫૧	૨	૧૦	૭૭૨
૮		૮	૦	૭૫૬	૨૦	૩૦૨	૫	૯	૫૪૩
૯		૯	૦	૮૫૦	૩૦	૪૫૩	૮	૮	૩૧૫
૧૦		૧૦	૦	૯૪૫	૪૦	૬૦૪	૧૧	૭	૦૮૭
૧૧		૧૧	૧	૦૩૯	૫૦	૭૫૫	૧૪	૫	૮૫૯
શીલીંગ ૧		૧૨	૧	૧૩૪	૬૦	૯૦૭	૧	૪	૬૩૧
૨	૧	૮	૨	૨૬૮	૭૦	૧,૦૫૮	૪	૩	૪૦૩
૩	૨	૪	૩	૪૦૨	૮૦	૧,૨૦૯	૭	૨	૧૭૪
૪	૩	૦	૪	૫૩૬	૯૦	૧,૩૬૦	૧૦	૦	૯૪૬
૫	૩	૧૨	૫	૬૬૯	૧૦૦	૧,૫૧૧	૧૨	૧૧	૭૧૭
૬	૪	૮	૬	૮૦૩	૨૦૦	૩,૦૨૩	૯	૧૧	૪૩૩
૭	૫	૪	૭	૯૩૭	૩૦૦	૪,૫૩૫	૬	૧૧	૧૫૦
૮	૬	૦	૯	૦૭૧	૪૦૦	૬,૦૪૭	૩	૧૦	૮૬૭
૯	૬	૧૨	૧૦	૨૦૫	૫૦૦	૭,૫૫૯	૦	૧૦	૫૮૩
૧૦	૭	૮	૧૧	૩૩૯	૬૦૦	૯,૦૭૦	૧૩	૧૦	૩૦૦
૧૧	૮	૫	૦	૪૭૨	૭૦૦	૧૦,૫૮૨	૧૦	૧૦	૦૧૬
૧૨	૯	૧	૧	૬૦૬	૮૦૦	૧૨,૦૯૪	૭	૯	૭૩૩
૧૩	૯	૧૩	૨	૭૪૦	૯૦૦	૧૩,૬૦૬	૪	૯	૪૪૯
૧૪	૧૦	૯	૩	૮૭૪	૧,૦૦૦	૧૫,૧૧૮	૧	૯	૧૬૫
૧૫	૧૧	૫	૫	૦૦૮	૧,૫૦૦	૨૨,૬૭૭	૨	૭	૭૪૮
૧૬	૧૨	૧	૬	૧૪૨	૨,૦૦૦	૩૦,૨૩૬	૩	૬	૩૩૧
૧૭	૧૨	૧૩	૭	૨૭૬	૩,૦૦૦	૪૫,૩૫૪	૫	૩	૪૯૬
૧૮	૧૩	૯	૮	૪૧૦	૪,૦૦૦	૬૦,૪૭૨	૭	૦	૬૬૧
૧૯	૧૪	૫	૯	૫૪૪	૫,૦૦૦	૭૫૫૯૦	૮	૯	૮૨૭
પાઉંડ ૧	૧૫	૧	૧૦	૬૭૭	૧૦,૦૦૦	૧,૫૧,૧૮૧	૧	૭	૬૫૪
૨	૩૦	૩	૯	૩૫૪	૨૦,૦૦૦	૩,૦૨,૩૬૨	૩	૩	૩૦૮
૩	૪૫	૫	૮	૦૩૨	૩૦,૦૦૦	૬,૦૪,૭૨૪	૬	૬	૬૧૬

શી ૧-૩ પેન્સ ૧૪ આના						શો. ૧-૩ ૭/૮ પેન્સ (૧-૩॥=)					
પાઈ	પાઊંડ	શી	પે	ફ્રાર		રૂપીઆ.	પાઊંડ	શી.	પે.	ફ્રાર	
૧				૦	૩૩૧	૮		૧૦	૭	૦	
૨				૦	૬૬૧	૯		૧૧	૧૦	૩	૫૦
૩				૦	૯૯૨	૧૦		૧૩	૨	૩	
૪				૧	૩૨૩	૨૦	૧	૬	૫	૨	
૫				૧	૬૫૪	૩૦	૧	૧૯	૮	૧	
૬				૧	૯૮૫	૪૦	૨	૧૨	૧૧		
૭				૨	૩૧૬	૫૦	૩	૬	૧	૩	
૮				૨	૬૪૬	૬૦	૩	૧૯	૪	૨	
૯				૨	૯૭૭	૭૦	૪	૧૨	૭	૧	
૧૦				૩	૩૦૮	૮૦	૫	૫	૧૦		
૧૧				૩	૬૩૮	૯૦	૫	૧૯	૦	૩	
આના ૧				૩	૯૬૯	૧૦૦	૬	૧૨	૩	૨	
૨			૧	૩	૯૩૭	૨૦૦	૧૩	૪	૭		
૩			૨	૩	૯૦૬	૩૦૦	૧૯	૧૬	૧૦	૨	
૪			૩	૩	૮૭૫	૪૦૦	૨૬	૯	૨		
૫			૪	૩	૮૪૩	૫૦૦	૩૩	૧	૫	૨	
૬			૫	૩	૮૧૨	૬૦૦	૩૯	૧૩	૯		
૭			૬	૩	૭૮૧	૭૦૦	૪૬	૬	૦	૨	
૮			૭	૩	૭૫૦	૮૦૦	૫૨	૧૮	૪		
૯			૮	૩	૭૧૯	૯૦૦	૫૯	૧૦	૭	૨	
૧૦			૯	૩	૬૮૮	૧,૦૦૦	૬૬	૨	૧૧		
૧૧			૧૦	૩	૬૫૬	૧,૫૦૦	૯૯	૪	૪	૨	
૧૨			૧૧	૩	૬૨૫	૨,૦૦૦	૧૩૨	૫	૧૦		
૧૩		૧	૦	૩	૫૯૪	૩,૦૦૦	૧૯૮	૮	૯		
૧૪		૧	૧	૩	૫૬૨	૪,૦૦૦	૨૬૪	૧૧	૮		
૧૫		૧	૨	૩	૫૩૧	૫,૦૦૦	૩૩૦	૧૪	૭		
રૂપીઆ ૧		૧	૩	૩	૫૦૦	૧૦,૦૦૦	૬૬૧	૯	૨		
૨		૨	૭	૩		૨૦,૦૦૦	૧,૩૨૨	૧૮	૪		
૩		૩	૧૧	૨	૫૦૦	૩૦,૦૦૦	૧,૯૮૪	૭	૬		
૪		૫	૩	૨		૪૦,૦૦૦	૨,૬૪૫	૧૬	૮		
૫		૬	૭	૧	૫૦૦	૫૦,૦૦૦	૩,૩૦૭	૫	૧૦		
૬		૭	૧૧	૧		૧,૦૦,૦૦૦	૬,૬૧૪	૧૧	૮		
૭		૯	૩	૦	૫૦૦	૨,૦૦,૦૦૦	૧૩,૨૨૯	૩	૪		

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧–૩ પેન્સ ૧૪। આના					શી ૧–૩ ૫૭/૬૪ પેન્સ (૧–૩॥।=।)				
પેન્સ.	રૂપીઆ.	આ	પા	દો.	પાઉંડ	રૂપીઆ	આ	પા.	દો.
૧		૧	૦	૦૮૩	૪	૬૦	૬	૭	૨૯૨
૨		૨	૦	૧૬૫	૫	૭૫	૮	૩	૧૧૫
૩		૩	૦	૨૪૮	૬	૯૦	૯	૧૦	૯૩૮
૪		૪	૦	૩૩૦	૭	૧૦૫	૧૧	૬	૭૬૧
૫		૫	૦	૪૧૩	૮	૧૨૦	૧૩	૨	૫૮૪
૬		૬	૦	૪૯૬	૯	૧૩૫	૧૪	૧૦	૪૦૭
૭		૭	૦	૫૭૮	૧૦	૧૫૧	૦	૬	૨૩૦
૮		૮	૦	૬૬૧	૨૦	૩૦૨	૧	૦	૪૬૦
૯		૯	૦	૭૪૩	૩૦	૪૫૩	૧	૬	૬૯૦
૧૦		૧૦	૦	૮૨૬	૪૦	૬૦૪	૨	૦	૯૨૦
૧૧		૧૧	૦	૯૦૯	૫૦	૭૫૫	૨	૭	૧૫૦
શીલીંગ ૧		૧૨	૦	૯૯૧	૬૦	૯૦૬	૩	૧	૩૮૧
૨	૧	૮	૧	૯૮૨	૭૦	૧,૦૫૭	૩	૭	૬૧૧
૩	૨	૪	૨	૯૭૩	૮૦	૧,૨૦૮	૪	૧	૮૪૧
૪	૩	૦	૩	૯૬૫	૯૦	૧,૩૫૯	૪	૮	૦૭૧
૫	૩	૧૨	૪	૯૫૬	૧૦૦	૧,૫૧૦	૫	૨	૩૦૧
૬	૪	૮	૫	૯૪૭	૨૦૦	૩,૦૨૦	૧૦	૪	૬૦૨
૭	૫	૪	૬	૯૩૮	૩૦૦	૪,૫૩૦	૧૫	૬	૯૦૩
૮	૬	૦	૭	૯૨૯	૪૦૦	૬,૦૪૧	૪	૯	૨૦૪
૯	૬	૧૨	૮	૯૨૦	૫૦૦	૭,૫૫૧	૯	૧૧	૫૦૪
૧૦	૭	૮	૯	૯૧૨	૬૦૦	૯,૦૬૧	૧૫	૧	૮૦૫
૧૧	૮	૪	૧૦	૯૦૩	૭૦૦	૧૦,૫૭૨	૪	૪	૧૦૬
૧૨	૯	૦	૧૧	૮૯૪	૮૦૦	૧૨,૦૮૨	૯	૬	૪૦૭
૧૩	૯	૧૩	૦	૮૮૫	૯૦૦	૧૩,૫૯૨	૧૪	૮	૭૦૮
૧૪	૧૦	૯	૧	૮૭૬	૧,૦૦૦	૧૫,૧૦૩	૩	૧૧	૦૦૯
૧૫	૧૧	૫	૨	૮૬૭	૧,૫૦૦	૨૨૬,૫૪	૧૩	૧૦	૫૧૩
૧૬	૧૨	૧	૩	૮૫૮	૨,૦૦૦	૩૦,૨૦૬	૭	૧૦	૦૧૮
૧૭	૧૨	૧૩	૪	૮૫૦	૩,૦૦૦	૪૫.૩૦૯	૧૧	૯	૦૨૬
૧૮	૧૩	૯	૫	૮૪૧	૪,૦૦૦	૬૦,૪૧૨	૧૫	૮	૦૩૫
૧૯	૧૪	૫	૬	૮૩૨	૫,૦૦૦	૭૫,૫૧૬	૩	૭	૦૪૪
પાઊંડ ૧	૧૫	૧	૭	૮૨૩	૧૦,૦૦૦	૧,૫૧,૦૩૨	૭	૨	૦૮૮
૨	૩૦	૩	૩	૬૪૬	૨૦,૦૦૦	૩,૦૨,૦૬૪	૧૪	૪	૧૭૫
૩	૪૫	૪	૧૧	૪૬૯	૪૦,૦૦૦	૬,૦૪,૧૨૯	૧૨	૮	૩૫૦

શી. ૧-૩ પેન્સ ૧૪ા આના					શી. ૧-૩ ૫૭/૬૪ પેન્સ (૧-૩ાાત્ર)				
પાઈ.	પાઉંડ	શી.	પે	ફાર	રૂપીઆ	પાઉંડ	શી	પે	ફાર.
૧				૦ ૩૩૧	૮		૧૦	૭	૦ ૫૦૦
૨				૦ ૬૬૨	૯		૧૧	૧૧	૦ ૦૬૨
૩				૦ ૯૯૩	૧૦		૧૩	૨	૩ ૬૨૫
૪				૧ ૩૨૩	૨૦	૧	૬	૫	૩ ૨૫૦
૫				૧ ૬૫૫	૩૦	૧	૧૯	૮	૨ ૮૭૫
૬				૧ ૯૮૬	૪૦	૨	૧૨	૧૧	૨ ૫૦૦
૭				૨ ૩૧૬	૫૦	૩	૬	૨	૨ ૧૨૫
૮				૨ ૬૪૭	૬૦	૩	૧૯	૫	૧ ૭૫૦
૯				૨ ૯૭૮	૭૦	૪	૧૨	૮	૧ ૩૭૫
૧૦				૩ ૩૧૦	૮૦	૫	૫	૧૧	૧
૧૧				૩ ૬૪૧	૯૦	૫	૧૯	૨	૦ ૬૨૫
આના. ૧				૩ ૯૭૨	૧૦૦	૬	૧૨	૫	૦ ૨૫૦
૨			૧	૩ ૯૪૫	૨૦૦	૧૩	૪	૧૦	૦ ૫૦૦
૩			૨	૩ ૯૧૮	૩૦૦	૧૯	૧૭	૩	૦ ૭૫૦
૪			૩	૩ ૮૯૦	૪૦૦	૨૬	૯	૮	૧
૫			૪	૩ ૮૬૩	૫૦૦	૩૩	૨	૧	૧ ૨૫૦
૬			૫	૩ ૮૩૬	૬૦૦	૩૯	૧૪	૬	૧ ૫૦૦
૭			૬	૩ ૮૦૮	૭૦૦	૪૬	૬	૧૧	૧ ૭૫૦
૮			૭	૩ ૭૮૧	૮૦૦	૫૨	૧૯	૪	૨
૯			૮	૩ ૭૫૩	૯૦૦	૫૯	૧૧	૯	૨ ૫૦૦
૧૦			૯	૩ ૭૨૬	૧,૦૦૦	૬૬	૪	૨	૨ ૨૫૦
૧૧			૧૦	૩ ૬૯૯	૧,૫૦૦	૯૯	૬	૩	૩ ૭૫૦
૧૨			૧૧	૩ ૬૭૨	૨,૦૦૦	૧૩૨	૮	૫	૧
૧૩		૧	૦	૩ ૬૪૪	૩,૦૦૦	૧૯૮	૧૨	૭	૩ ૫૦૦
૧૪		૧	૧	૩ ૬૧૬	૪,૦૦૦	૨૬૪	૧૬	૧૦	૨
૧૫		૧	૨	૩ ૫૮૯	૫,૦૦૦	૩૩૧	૧	૧	૦ ૫૦૦
રૂપીઆ ૧		૧	૩	૩ ૫૬૨	૧૦,૦૦૦	૬૬૨	૨	૨	૧
૨		૨	૭	૩ ૧૨૫	૨૦,૦૦૦	૧,૩૨૪	૪	૪	૨
૩		૩	૧૧	૨ ૬૮૭	૩૦,૦૦૦	૧,૯૮૬	૬	૬	૩
૪		૫	૩	૨ ૨૫૦	૪૦,૦૦૦	૨,૬૪૮	૮	૯	૦
૫		૬	૭	૧ ૮૧૨	૫૦,૦૦૦	૩,૩૧૦	૧૦	૧૧	૧
૬		૭	૧૧	૧ ૩૭૫	૧,૦૦,૦૦૦	૬,૬૨૧	૧	૧૦	૨
૭		૯	૩	૦ ૯૩૭	૨,૦૦,૦૦૦	૧૩,૨૪૨	૩	૯	૦

(વીલાયતી હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૩ પેન્સ ૧૪ાા આના					શી. ૧-૩ [illegible] પેન્સ (૧-૩ાા=ાા)				
પેન્સ	રૂપીઆ.	આ	પા.	દો.	પાઊંડ	રૂપીઆ	આ	પા.	દો.
૧		૧	૦	૦૭૧	૪	૬૦	૫	૭	૮૯૫
૨		૨	૦	૧૪૨	૫	૭૫	૭	૦	૮૬૯
૩		૩	૦	૨૧૩	૬	૯૦	૮	૫	૮૪૪
૪		૪	૦	૨૮૪	૭	૧૦૫	૯	૧૦	૮૧૮
૫		૫	૦	૩૫૫	૮	૧૨૦	૧૧	૩	૭૯૩
૬		૬	૦	૪૨૬	૯	૧૩૫	૧૨	૮	૭૬૭
૭		૭	૦	૪૯૭	૧૦	૧૫૦	૧૪	૧	૭૪૫
૮		૮	૦	૫૬૮	૨૦	૩૦૧	૧૨	૩	૪૯૦
૯		૯	૦	૬૩૯	૩૦	૪૫૨	૧૦	૫	૨૩૬
૧૦		૧૦	૦	૭૧૦	૪૦	૬૦૩	૮	૬	૯૮૧
૧૧		૧૧	૦	૭૮૧	૫૦	૭૫૪	૬	૮	૭૨૩
શીલીંગ ૧		૧૨	૦	૮૫૦	૬૦	૯૦૫	૪	૧૦	૪૭૧
૨	૧	૮	૧	૭૦૦	૭૦	૧,૦૫૬	૩	૦	૨૧૬
૩	૨	૪	૨	૫૪૯	૮૦	૧,૨૦૭	૧	૧	૯૬૧
૪	૩	૦	૩	૩૯૯	૯૦	૧,૩૫૭	૧૫	૩	૭૦૬
૫	૩	૧૨	૪	૨૪૭	૧૦૦	૧,૫૦૮	૧૩	૫	૪૪૬
૬	૪	૮	૫	૦૯૬	૨૦૦	૩,૦૧૭	૧૦	૧૦	૮૯૨
૭	૫	૪	૫	૯૪૫	૩૦૦	૪,૫૨૬	૮	૪	૩૩૮
૮	૬	૦	૬	૭૯૪	૪૦૦	૬,૦૩૫	૫	૯	૭૮૪
૯	૬	૧૨	૭	૬૪૩	૫૦૦	૭,૫૪૪	૩	૩	૨૩૦
૧૦	૭	૮	૮	૪૯૩	૬૦૦	૯,૦૫૩	૦	૮	૬૭૬
૧૧	૮	૪	૯	૩૪૨	૭૦૦	૧૦,૫૬૧	૧૪	૨	૧૨૨
૧૨	૯	૦	૧૦	૧૯૧	૮૦૦	૧૨,૦૭૦	૧૧	૭	૫૬૮
૧૩	૯	૧૨	૧૧	૦૪•	૯૦૦	૧૩,૫૭૯	૯	૧	૦૧૪
૧૪	૧૦	૮	૧૧	૮૮૯	૧,૦૦૦	૧૫,૦૮૮	૬	૬	૪૬૦
૧૫	૧૧	૫	૦	૭૩૮	૧,૫૦૦	૨૨,૬૩૨	૯	૯	૬૯૦
૧૬	૧૨	૧	૧	૫૮૭	૨,૦૦૦	૩૦,૧૭૬	૧૩	૦	૯૨૦
૧૭	૧૨	૧૩	૨	૪૩૬	૩,૦૦૦	૪૫,૨૬૫	૩	૭	૩૮૦
૧૮	૧૩	૯	૩	૨૮૫	૪,૦૦૦	૬૦,૩૫૩	૧૦	૧	૮૪૦
૧૯	૧૪	૫	૪	૧૩૪	૫,૦૦૦	૭૫,૪૪૨	૦	૮	૩૦૦
પાઊંડ ૧	૧૫	૧	૪	૯૭૩	૧૦,૦૦૦	૧,૫૦,૮૮૪	૧	૪	૬૦૦
૨	૩૦	૨	૯	૯૪૭	૨૦,૦૦૦	૩,૦૧,૭૬૮	૨	૯	૨૦૦
૩	૪૫	૪	૨	૯૨૧	૪૦,૦૦૦	૬,૦૩,૫૩૬	૫	૬	૪૦૦

શી. ૧-૩ પેન્સ ૮ાા આના.					
પાઇ	પાઉંડ	શી.	પે.	ફાર	
૧				૦	૩૩૧
૨				૦	૬૬૩
૩				૦	૯૯૪
૪				૧	૩૨૫
૫				૧	૬૫૭
૬				૧	૯૮૮
૭				૨	૩૧૯
૮				૨	૬૫૧
૯				૨	૯૮૨
૧૦				૩	૩૧૪
૧૧				૩	૬૪૫
આના ૧				૩	૯૭૬
૨			૧	૩	૯૫૩
૩			૨	૩	૯૨૯
૪			૩	૩	૯૦૬
૫			૪	૩	૮૮૨
૬			૫	૩	૮૫૯
૭			૬	૩	૮૩૫
૮			૭	૩	૮૧૨
૯			૮	૩	૭૮૮
૧૦			૯	૩	૭૬૫
૧૧			૧૦	૩	૭૪૧
૧૨			૧૧	૩	૭૧૮
૧૩		૧	૦	૩	૬૯૪
૧૪		૧	૧	૩	૬૭૧
૧૫		૧	૨	૩	૬૪૭
રૂપીઆ ૧		૧	૩	૩	૬૨૫
૨		૨	૭	૩	૨૫૦
૩		૩	૧૧	૨	૮૭૫
૪		૫	૩	૨	૫૦૦
૫		૬	૭	૨	૧૨૫
૬		૭	૧૧	૧	૭૫૦
૭	.	૯	૩	૧	૩૭૫

શી. ૧-૩ ૩/૪ પેન્સ ૮-આના					
રૂપીઆ.	પાઉંડ	શી	પે	ફાર	
૮		૧૦	૭	૧	
૯		૧૧	૧૧	૦	૬૨૫
૧૦		૧૩	૩	૦	૨૫૦
૨૦	૧	૬	૬	૦	૫૦૦
૩૦	૧	૧૯	૯	૦	૭૫૦
૪૦	૨	૧૩	૦	૧	
૫૦	૩	૬	૩	૧	૨૫૦
૬૦	૩	૧૯	૬	૧	૫૦૦
૭૦	૪	૧૨	૯	૧	૭૫૦
૮૦	૫	૬	૦	૨	
૯૦	૫	૧૯	૩	૨	૨૫૦
૧૦૦	૬	૧૨	૬	૨	૫૦૦
૨૦૦	૧૩	૫	૧	૧	
૩૦૦	૧૯	૧૭	૭	૩	૫૦૦
૪૦૦	૨૬	૧૦	૨	૨	
૫૦૦	૩૩	૨	૯	૦	૫૦૦
૬૦૦	૩૯	૧૫	૩	૩	
૭૦૦	૪૬	૭	૧૦	૧	૫૦૦
૮૦૦	૫૩	૦	૫	૦	
૯૦૦	૫૯	૧૨	૧૧	૨	૫૦૦
૧,૦૦૦	૬૬	૫	૬	૧	
૧,૫૦૦	૯૯	૮	૩	૧	૫૦૦
૨,૦૦૦	૧૩૨	૧૧	૦	૨	
૩,૦૦૦	૧૯૮	૧૬	૬	૩	
૪,૦૦૦	૨૬૫	૨	૧	૦	
૫,૦૦૦	૩૩૧	૭	૭	૧	
૧૦,૦૦૦	૬૬૨	૧૫	૨	૨	
૨૦,૦૦૦	૧,૩૨૫	૧૦	૫	૦	
૩૦,૦૦૦	૧,૯૮૮	૫	૭	૨	
૪૦,૦૦૦	૨,૬૫૧	૦	૧૦	૦	
૫૦,૦૦૦	૩,૩૧૩	૧૬	૦	૨	
૧,૦૦,૦૦૦	૬,૬૨૭	૧૨	૧	૦	
૨,૦૦,૦૦૦	૧૩,૨૫૫	૪	૨	૦	

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી ૧-૩ પેન્સ ૧૪ાા આના.					શી. ૧—૩ ૫/૬૪ પેન્સ(૧-૩ાા=ાાા)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો	પૌંડ	રૂપીઆ.	આ	પા.	દો
૧		૧	૦	૦૫૯	૪	૬૦	૪	૮	૫૨૬
૨		૨	૦	૧૧૮	૫	૭૫	૫	૧૦	૬૫૮
૩		૩	૦	૧૭૭	૬	૯૦	૭	૦	૭૮૯
૪		૪	૦	૨૩૬	૭	૧૦૫	૮	૨	૯૨૧
૫		૫	૦	૨૯૪	૮	૧૨૦	૯	૫	૦૫૨
૬		૬	૦	૩૫૩	૯	૧૩૫	૧૦	૭	૧૮૪
૭		૭	૦	૪૧૨	૧૦	૧૫૦	૧૧	૯	૩૧૫
૮		૮	૦	૪૭૧	૨૦	૩૦૧	૭	૬	૬૩૦
૯		૯	૦	૫૩૦	૩૦	૪૫૨	૩	૩	૯૪૫
૧૦		૧૦	૦	૫૮૯	૪૦	૬૦૨	૧૫	૧	૨૬૦
૧૧		૧૧	૦	૬૪૮	૫૦	૭૫૩	૧૦	૧૦	૫૭૫
શીલીંગ ૧		૧૨	૦	૭૦૭	૬૦	૯૦૪	૬	૭	૮૯૦
૨	૧	૮	૧	૪૧૩	૭૦	૧,૦૫૫	૨	૫	૨૦૫
૩	૨	૪	૨	૧૨૦	૮૦	૧,૨૦૫	૧૪	૨	૫૨૦
૪	૩	૦	૨	૮૨૬	૯૦	૧,૩૫૬	૯	૧૧	૮૩૫
૫	૩	૧૨	૩	૫૩૩	૧૦૦	૧,૫૦૭	૫	૯	૧૫૦
૬	૪	૮	૪	૨૩૯	૨૦૦	૩,૦૧૪	૧૧	૬	૩૦૦
૭	૫	૪	૪	૯૪૬	૩૦૦	૪,૫૨૨	૧	૩	૪૫૦
૮	૬	૦	૫	૬૫૩	૪૦૦	૬ ૦૨૯	૭	૦	૬૦૧
૯	૬	૧૨	૬	૩૫૯	૫૦૦	૭,૫૩૬	૧૨	૯	૭૫૧
૧૦	૭	૮	૭	૦૬૬	૬૦૦	૯,૦૪૪	૨	૬	૯૦૧
૧૧	૮	૪	૭	૭૭૨	૭૦૦	૧૦,૫૫૧	૮	૪	૦૫૧
૧૨	૯	૦	૮	૪૭૯	૮૦૦	૧૨.૦૫૮	૧૪	૧	૨૦૧
૧૩	૯	૧૨	૯	૧૮૫	૯૦૦	૧૩,૫૬૬	૩	૧૦	૩૫૧
૧૪	૧૦	૮	૯	૮૯૨	૧,૦૦૦	૧૫.૦૭૩	૯	૭	૫૦૧
૧૫	૧૧	૪	૧૦	૫૯૯	૧,૫૦૦	૨૨,૬૧૦	૬	૫	૨૫૨
૧૬	૧૨	૦	૧૧	૩૦૫	૨,૦૦૦	૩૦,૧૪૭	૩	૩	૦૦૩
૧૭	૧૨	૧૩	૦	૦૧૨	૩,૦૦૦	૪૫,૨૨૦	૧૨	૧૦	૫૦૪
૧૮	૧૩	૯	૧૦	૭૧૮	૪,૦૦૦	૬૦,૨૯૪	૬	૬	૦૦૬
૧૯	૧૪	૫	૧૧	૪૨૫	૫,૦૦૦	૭૫,૩૬૮	૦	૧	૫૦૭
પૌંડ ૧	૧૫	૧	૨	૧૩૨	૧૦,૦૦૦	૧,૫૦,૭૩૬	૦	૩	૦૧૪
૨	૩૦	૨	૪	૨૬૩	૨૦,૦૦૦	૩,૦૧,૪૭૨	૦	૬	૦૨૮
૩	૪૫	૩	૬	૩૯૫	૪૦.૦૦૦	૬,૦૨ ૯૪૪	૧	૦	૦૫૬

શી. ૧-૩ પેન્સ ૧૪।।। આના						શી. ૧-૩ ૫⁄૬ ૧⁄૪ પેન્સ (૧-૩।।।=।।।)					
પાઈ	પાઉંડ	શી.	પે	ફાર		રૂપીઆ	પાઉંડ	શી.	પે	ફાર	
૧				૦	૩૩૨	૮		૧૦	૭	૧	૫૦૦
૨				૦	૬૬૩	૯		૧૧	૧૧	૧	૧૮૭
૩				૦	૯૯૫	૧૦		૧૩	૩	૦	૮૭૫
૪				૧	૩૨૭	૨૦	૧	૬	૬	૧	૭૫૦
૫				૧	૬૫૮	૩૦	૧	૧૯	૯	૨	૬૨૫
૬				૧	૯૯૦	૪૦	૨	૧૩	૦	૩	૫૦૦
૭				૨	૩૨૨	૫૦	૩	૬	૪	૦	૩૭૫
૮				૨	૬૫૩	૬૦	૩	૧૯	૭	૧	૨૫૦
૯				૨	૯૮૪	૭૦	૪	૧૨	૧૦	૨	૧૨૫
૧૦				૩	૩૧૫	૮૦	૫	૬	૧	૩	
૧૧				૩	૬૪૮	૯૦	૫	૧૯	૪	૩	૮૭૫
આના ૧				૩	૯૮૦	૧૦૦	૬	૧૨	૮	૦	૭૫૦
૨			૧	૩	૯૬૧	૨૦૦	૧૩	૫	૪	૧	૫૦૦
૩			૨	૩	૯૪૧	૩૦૦	૧૯	૧૮	૦	૨	૨૫૦
૪			૩	૩	૯૨૨	૪૦૦	૨૬	૧૦	૮	૩	
૫			૪	૩	૯૦૨	૫૦૦	૩૩	૩	૪	૩	૭૫૦
૬			૫	૩	૮૮૨	૬૦૦	૩૯	૧૬	૧	૦	૫૦૦
૭			૬	૩	૮૬૩	૭૦૦	૪૬	૮	૯	૧	૨૫૦
૮			૭	૩	૮૪૩	૮૦૦	૫૩	૧	૫	૨	
૯			૮	૩	૮૨૪	૯૦૦	૫૯	૧૪	૧	૨	૭૫૦
૧૦			૯	૩	૮૦૪	૧,૦૦૦	૬૬	૬	૯	૩	૫૦૦
૧૧			૧૦	૩	૭૮૫	૧,૫૦૦	૯૯	૧૦	૨	૩	૨૫૦
૧૨			૧૧	૩	૭૬૫	૨,૦૦૦	૧૩૨	૧૩	૭	૩	
૧૩		૧	૦	૩	૭૪૬	૩,૦૦૦	૧૯૯	૦	૫	૨	૫૦૦
૧૪		૧	૧	૩	૭૨૫	૪,૦૦૦	૨૬૫	૭	૩	૨	
૧૫		૧	૨	૩	૭૦૬	૫,૦૦૦	૩૩૧	૧૪	૧	૧	૫૦૦
રૂ. ૧		૧	૩	૩	૬૮૭	૧૦,૦૦૦	૬૬૩	૮	૨	૩	
૨		૨	૭	૩	૩૭૫	૨૦,૦૦૦	૧,૩૨૬	૧૬	૫	૨	
૩		૩	૧૧	૩	૦૬૨	૩૦,૦૦૦	૧,૯૯૦	૪	૮	૧	
૪		૫	૩	૨	૭૫૦	૪૦,૦૦૦	૨,૬૫૩	૧૨	૧૧	૦	
૫		૬	૭	૨	૪૩૭	૫૦,૦૦૦	૩,૩૧૭	૧	૧	૩	
૬		૭	૧૧	૨	૧૨૫	૧,૦૦,૦૦૦	૬,૬૩૪	૨	૩	૨	
૭		૯	૩	૧	૮૧૨	૨,૦૦,૦૦૦	૧૩,૨૬૮	૪	૭	૦	

(વીલાયતના હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧–૩ પેન્સ ૧૫ આના					શી. ૧–૩ ૧૫/૧૬ પેન્સ (૧–૩॥॥≢)				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો.	પૌંડ	રૂપીઆ	આ	પા	દો.
૧		૧	૦	૦૪૭	૪	૬૦	૩	૯	૧૭૬
૨		૨	૦	૦૯૪	૫	૭૫	૪	૮	૪૭૦
૩		૩	૦	૧૪૧	૬	૯૦	૫	૭	૭૬૪
૪		૪	૦	૧૮૮	૭	૧૦૫	૬	૭	૦૫૮
૫		૫	૦	૨૩૫	૮	૧૨૦	૭	૬	૩૫૨
૬		૬	૦	૨૮૨	૯	૧૩૫	૮	૫	૬૪૬
૭		૭	૦	૩૨૯	૧૦	૧૫૦	૯	૪	૯૪૧
૮		૮	૦	૩૭૬	૨૦	૩૦૧	૨	૯	૮૮૨
૯		૯	૦	૪૨૪	૩૦	૪૫૧	૧૨	૨	૮૨૩
૧૦		૧૦	૦	૪૭૧	૪૦	૬૦૨	૫	૭	૭૬૪
૧૧		૧૧	૦	૫૧૮	૫૦	૭૫૨	૧૫	૦	૭૦૫
શીલીંગ ૧		૧૨	૦	૫૬૫	૬૦	૯૦૩	૮	૫	૬૪૬
૨	૧	૮	૧	૧૩૦	૭૦	૧,૦૫૪	૧	૧૦	૫૮૮
૩	૨	૪	૧	૬૯૫	૮૦	૧,૨૦૪	૧૧	૩	૫૨૮
૪	૩	૦	૨	૨૬૦	૯૦	૧,૩૫૫	૪	૮	૪૬૯
૫	૩	૧૨	૨	૮૨૫	૧૦૦	૧,૫૦૫	૧૪	૧	૪૧૨
૬	૪	૮	૩	૩૮૯	૨૦૦	૩,૦૧૧	૧૨	૨	૮૨૪
૭	૫	૪	૩	૯૫૩	૩૦૦	૪,૫૧૭	૧૦	૪	૨૩૬
૮	૬	૦	૪	૫૧૮	૪૦૦	૬,૦૨૩	૮	૫	૬૪૮
૯	૬	૧૨	૫	૦૮૨	૫૦૦	૭,૫૨૯	૬	૭	૦૬૦
૧૦	૭	૮	૫	૬૪૭	૬૦૦	૯,૦૩૫	૪	૮	૪૭૨
૧૧	૮	૪	૬	૨૧૨	૭૦૦	૧૦,૫૪૧	૨	૯	૮૮૪
૧૨	૯	૦	૬	૭૭૬	૮૦૦	૧૨ ૦૪૭	૦	૧૧	૨૯૬
૧૩	૯	૧૨	૭	૩૪૧	૯૦૦	૧૩,૫૫૨	૧૫	૦	૭૦૮
૧૪	૧૦	૮	૭	૯૦૬	૧૦૦૦	૧૫,૦૫૮	૧૩	૨	૧૧૮
૧૫	૧૧	૪	૮	૪૭૧	૧૫૦૦	૨૨,૫૮૮	૩	૯	૧૭૮
૧૬	૧૨	૦	૯	૦૩૬	૨૦૦૦	૩૦,૧૧૭	૧૦	૪	૨૩૬
૧૭	૧૩	૧૨	૯	૬૦૦	૩૦૦૦	૪૫,૧૭૬	૭	૬	૩૫૬
૧૮	૧૩	૮	૧૦	૧૬૫	૪૦૦૦	૬૦,૨૩૫	૪	૮	૪૭૬
૧૯	૧૪	૪	૧૦	૭૩૦	૫૦૦૦	૭૫,૨૯૪	૧	૧૦	૫૯૬
પૌંડ ૧	૧૫	૦	૧૧	૨૯૪	૧૦,૦૦૦	૧,૫૦,૫૮૮	૩	૯	૧૭૬
૨	૩૦	૧	૧૦	૫૮૮	૨૦,૦૦૦	૩,૦૧,૧૭૬	૭	૬	૩૫૨
૩	૪૫	૨	૯	૮૮૨	૪૦,૦૦૦	૬,૦૨,૩૫૨	૧૫	૦	૭૦૪

શી ૧-૩ પેન્સ ૧૫ આના					શી ૧-૩ $\frac{૧}{૨}\frac{૫}{૬}$ પેન્સ (૧-૩॥≈)				
પાઇ.	પાઉંડ	શી.	પે.	ફાર	રૂપીઆ.	પાઉંડ	શી	પે.	ફાર
૧				૦ ૩૩૨	૮	૦	૧૦	૭	૨
૩				૦ ૬૬૪	૯	૦	૧૧	૧૧	૧ ૭૫૦
૩				૦ ૯૯૬	૧૦	૦	૧૩	૩	૧ ૫૦૦
૪				૧ ૩૨૮	૨૦	૧	૬	૬	૩
૫				૧ ૬૬૦	૩૦	૧	૧૯	૧૦	૦ ૫૦૦
૬				૧ ૯૯૨	૪૦	૨	૧૩	૧	૨
૭				૨ ૩૨૪	૫૦	૩	૬	૪	૩ ૫૦૦
૮				૨ ૬૫૬	૬૦	૩	૧૯	૮	૧
૯				૨ ૯૮૮	૭૦	૪	૧૨	૧૧	૨ ૫૦૦
૧૦				૩ ૩૨૦	૮૦	૫	૬	૩	
૧૧				૩ ૬૫૨	૯૦	૫	૧૯	૬	૧ ૫૦૦
આના ૧				૩ ૯૮૪	૧૦૦	૬	૧૨	૯	૩
૨			૧	૩ ૯૬૮	૨૦૦	૧૩	૫	૭	૨
૩			૨	૩ ૯૫૨	૩૦૦	૧૯	૧૮	૫	૧
૪			૩	૩ ૯૩૬	૪૦૦	૨૬	૧૧	૩	
૫			૪	૩ ૯૨૦	૫૦૦	૩૩	૪	૦	૩
૬			૫	૩ ૯૦૪	૬૦૦	૩૯	૧૬	૧૦	૨
૭			૬	૩ ૮૮૮	૭૦૦	૪૬	૯	૮	૧
૮			૭	૩ ૮૭૨	૮૦૦	૫૩	૨	૬	
૯			૮	૩ ૮૫૬	૯૦૦	૫૯	૧૫	૩	૩
૧૦			૯	૩ ૮૪૦	૧,૦૦૦	૬૬	૮	૧	૨
૧૧			૧૦	૩ ૮૨૪	૧,૫૦૦	૯૯	૧૨	૨	૧
૧૨			૧૧	૩ ૮૦૮	૨,૦૦૦	૧૩૨	૧૬	૩	
૧૩		૧	૦	૩ ૭૯૨	૩,૦૦૦	૧૯૯	૪	૪	૨
૧૪		૧	૧	૩ ૭૭૬	૪,૦૦૦	૨૬૫	૧૨	૬	
૧૫		૧	૨	૩ ૭૬૦	૫,૦૦૦	૩૩૨	૦	૭	૨
રૂપીઆ ૧		૧	૩	૩ ૭૫૦	૧૦,૦૦૦	૬૬૪	૧	૩	
૨		૨	૭	૩ ૫૦૦	૨૦,૦૦૦	૧,૩૨૮	૨	૬	
૩		૩	૧૧	૩ ૨૫૦	૩૦,૦૦૦	૧,૯૯૨	૩	૯	
૪		૫	૩	૩	૪૦,૦૦૦	૨,૬૫૬	૫	૦	
૫		૬	૭	૨ ૭૫૦	૫૦,૦૦૦	૩,૩૨૦	૬	૩	
૬		૭	૧૧	૨ ૫૦૦	૧,૦૦,૦૦૦	૬,૬૪૦	૧૨	૬	
૭		૯	[illegible]	૨ ૨૫૦	૨,૦૦,૦૦૦	૧૩,૨૮૧	૫	૦	

(વીઝાયતી હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૩ પેન્સ ૧પા આના					શી ૧-૩ ૧/૬ ૧/૪ પેન્સ (૧-૩॥૩॥)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો	પૌંડ	રૂપીઆ	આ	પા	દો
૧		૧	૦	૦૩૫	૪	૬૦	૨	૯	૮૪૯
૨		૨	૦	૦૭૧	૫	૭૫	૩	૬	૩૧૧
૩		૩	૦	૧૦૬	૬	૯૦	૪	૨	૭૭૪
૪		૪	૦	૧૪૧	૭	૧૦૫	૪	૧૧	૨૩૬
૫		૫	૦	૧૭૬	૮	૧૨૦	૫	૭	૬૯૮
૬		૬	૦	૨૧૨	૯	૧૩૫	૬	૪	૧૬૧
૭		૭	૦	૨૪૭	૧૦	૧૫૦	૭	૦	૬૨૩
૮		૮	૦	૨૮૨	૨૦	૩૦૦	૧૪	૧	૨૪૬
૯		૯	૦	૩૧૭	૩૦	૪૫૧	૫	૧	૮૬૯
૧૦		૧૦	૦	૩૫૩	૪૦	૬૦૧	૧૨	૨	૪૯૨
૧૧		૧૧	૦	૩૮૮	૫૦	૭૫૨	૩	૩	૧૧૫
શાલીંગ ૧		૧૨	૦	૪૨૩	૬૦	૯૦૨	૧૦	૩	૭૩૮
૨	૧	૮	૦	૮૪૬	૭૦	૧,૦૫૩	૧	૪	૩૬૦
૩	૨	૪	૧	૨૬૯	૮૦	૧,૨૦૩	૮	૪	૯૮૩
૪	૩	૦	૧	૬૯૨	૯૦	૧,૩૫૩	૧૫	૫	૬૦૬
૫	૩	૧૨	૨	૧૧૬	૧૦૦	૧,૫૦૪	૬	૬	૨૨૯
૬	૪	૮	૨	૫૩૯	૨૦૦	૩,૦૦૮	૧૩	૦	૪૫૮
૭	૫	૪	૨	૯૬૨	૩૦૦	૪,૫૧૩	૩	૬	૬૮૮
૮	૬	૦	૩	૩૮૫	૪૦૦	૬,૦૧૭	૧૦	૦	૯૧૭
૯	૬	૧૨	૩	૮૦૮	૫૦૦	૭,૫૨૨	૦	૭	૧૪૬
૧૦	૭	૮	૪	૨૩૧	૬૦૦	૯,૦૨૬	૭	૧	૩૭૫
૧૧	૮	૪	૪	૬૫૪	૭૦૦	૧૦,૫૩૦	૧૩	૭	૬૦૪
૧૨	૯	૦	૫	૦૭૭	૮૦૦	૧૨.૦૩૫	૪	૧	૮૮૩
૧૩	૯	૧૨	૫	૫૦૧	૯૦૦	૧૩,૫૩૯	૧૦	૮	૦૬૩
૧૪	૧૦	૮	૫	૯૨૩	૧,૦૦૦	૧૫,૦૪૪	૧	૨	૨૯૨
૧૫	૧૧	૪	૬	૩૪૩	૧,૫૦૦	૨૨.૫૬૬	૧	૯	૪૮૭
૧૬	૧૨	૦	૬	૭૭૦	૨,૦૦૦	૩૦,૦૮૮	૨	૪	૫૮૪
૧૭	૧૨	૧૨	૭	૧૯૩	૩,૦૦૦	૪૫,૧૩૨	૩	૬	૮૭૬
૧૮	૧૩	૮	૭	૬૧૬	૪,૦૦૦	૬૦.૧૭૬	૪	૯	૧૬૭
૧૯	૧૪	૪	૮	૦૩૯	૫,૦૦૦	૭૫,૨૨૦	૫	૧૧	૪૫૯
પૌંડ ૧	૧૫	૦	૮	૪૬૨	૧,૦૦૦૦	૧,૫૦,૪૪૦	૧૧	૧૦	૯૧૮
૨	૩૦	૧	૪	૯૨૫	૨,૦૦૦૦	૩,૦૦,૮૮૧	૭	૯	૮૩૬
૩	૪૫	૧	૧	૩૮૭	૪.૦૦૦૦	૬.૦૧ ૭૬૨	૧૫	૭	૬૭૨

શી. ૧-૩ પેન્સ ૧૫॥ આના

પાઇ	પાઊંડ	શી	પે	ફાર	
૧					૩૩૨
૨					૬૬૫
૩					૯૯૭
૪				૧	૩૨૯
૫				૧	૬૬૨
૬				૧	૯૯૪
૭				૨	૩૨૬
૮				૨	૬૫૯
૯				૨	૯૯૨
૧૦				૩	૩૨૫
૧૧				૩	૬૫૭
આના ૧				૩	૯૮૮
૨			૧	૩	૯૭૬
૩			૨	૩	૯૬૫
૪			૩	૩	૯૫૩
૫			૪	૩	૯૪૧
૬			૫	૩	૯૨૯
૭			૬	૩	૯૧૮
૮			૭	૩	૯૦૬
૯			૮	૩	૮૯૪
૧૦			૯	૩	૮૮૩
૧૧			૧૦	૩	૮૭૧
૧૨			૧૧	૩	૮૫૯
૧૩			૧૨	૩	૮૪૮
૧૪			૧૩	૩	૮૩૭
૧૫			૧૪	૩	૮૨૫
રૂપીઆ ૧		૧	૩	૩	૮૧૨
૨		૨	૭	૩	૬૨૫
૩		૩	૧૧	૩	૪૩૭
૪		૫	૩	૩	૨૫૦
૫		૬	૭	૩	૦૬૨
૬		૭	૧૧	૨	૮૭૫
૭		૯	૩	૨	૬૮૭

શી ૧-૩ ૬૧/૬૪ પેન્સ (૧-ફા॥ત્રા)

રૂપીઆ	પાઊંડ.	શી.	પે	ફાર	
૮		૧૦	૭	૨	૫૦૦
૯		૧૧	૧૧	૨	૩૧૨
૧૦		૧૩	૩	૨	૧૨૫
૨૦	૧	૬	૭	૦	૨૫૦
૩૦	૧	૧૯	૧૦	૨	૩૭૫
૪૦	૨	૧૩	૨	૦	૫૦૦
૫૦	૩	૬	૫	૨	૬૨૫
૬૦	૩	૧૯	૮	૦	૭૫૦
૭૦	૪	૧૩	૦	૨	૮૭૫
૮૦	૫	૬	૪	૧	
૯૦	૫	૧૯	૭	૩	૧૨૫
૧૦૦	૬	૧૨	૧૧	૧	૨૫૦
૨૦૦	૧૩	૫	૧૦	૨	૫૦૦
૩૦૦	૧૯	૧૮	૯	૩	૭૫૦
૪૦૦	૨૬	૧૧	૯	૧	
૫૦૦	૩૩	૪	૮	૨	૨૫૦
૬૦૦	૩૯	૧૭	૭	૩	૫૦૦
૭૦૦	૪૬	૧૦	૭	૦	૭૫૦
૮૦૦	૫૩	૩	૬	૨	
૯૦૦	૫૯	૧૬	૫	૩	૨૫૦
૧,૦૦૦	૬૬	૯	૫	૦	૫૦૦
૧,૫૦૦	૯૯	૧૪	૧	૨	૭૫૦
૨,૦૦૦	૧૩૨	૧૮	૧૦	૧	
૩,૦૦૦	૧૯૯	૮	૩	૧	૫૦૦
૪,૦૦૦	૨૬૫	૧૭	૮	૨	
૫,૦૦૦	૩૩૨	૭	૧	૨	૫૦૦
૧૦,૦૦૦	૬૬૪	૧૪	૩	૧	
૨૦,૦૦૦	૧,૩૨૯	૮	૬	૨	
૩૦,૦૦૦	૧,૯૯૪	૨	૯	૩	
૪૦,૦૦૦	૨,૬૫૮	૧૭	૧	૦	
૫૦,૦૦૦	૩,૩૨૩	૧૧	૪	૧	
૧,૦૦,૦૦૦	૬,૬૪૭	૨	૮	૨	
૨,૦૦,૦૦૦	૧૩,૨૯૪	૫	૫	૦	

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧–૩ પેન્સ ૧૫ાા આના					શી. ૧–૩ ⅞ ⅔ પેન્સ (૧–૩ાાાાા)				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો	પૌંડ	રૂપીઆ	આ	પા.	દો.
૧		૧	૦	૦૨૩	૪	૬૦	૧	૧૦	૫૪૪
૨		૨	૦	૦૪૭	૫	૭૫	૨	૪	૧૮૦
૩		૩	૦	૦૭૦	૬	૯૦	૨	૯	૮૧૬
૪		૪	૦	૦૯૪	૭	૧૦૫	૩	૩	૪૫૨
૫		૫	૦	૧૧૭	૮	૧૨૦	૩	૯	૦૮૮
૬		૬	૦	૧૪૧	૯	૧૩૫	૪	૨	૭૨૪
૭		૭	૦	૧૬૪	૧૦	૧૫૦	૪	૮	૩૬૦
૮		૮	૦	૧૮૮	૨૦	૩૦૦	૯	૪	૭૨૦
૯		૯	૦	૨૧૧	૩૦	૪૫૦	૧૪	૧	૦૮૦
૧૦		૧૦	૦	૨૩૫	૪૦	૬૦૧	૨	૯	૪૪૦
૧૧		૧૧	૦	૨૫૮	૫૦	૭૫૧	૭	૫	૮૦૦
શીલીંગ ૧		૧૨	૦	૨૮૨	૬૦	૯૦૧	૧૨	૨	૧૬૦
૨	૧	૮	૦	૫૬૪	૭૦	૧,૦૫૨	૦	૧૦	૫૨૧
૩	૨	૪	૦	૮૪૫	૮૦	૧,૨૦૨	૫	૬	૮૮૧
૪	૩	૦	૧	૧૨૮	૯૦	૧,૩૫૨	૧૦	૩	૨૪૧
૫	૩	૧૨	૧	૪૧૦	૧૦૦	૧,૫૦૨	૧૪	૧૧	૬૦૧
૬	૪	૮	૧	૬૯૨	૨૦૦	૩,૦૦૫	૧૩	૧૧	૨૦૨
૭	૫	૪	૧	૯૭૪	૩૦૦	૪,૫૦૮	૧૨	૧૦	૮૦૩
૮	૬	૦	૨	૨૫૪	૪૦૦	૬,૦૧૧	૧૧	૧૦	૪૦૩
૯	૬	૧૨	૨	૫૩૬	૫૦૦	૭,૫૧૪	૧૦	૧૦	૦૦૪
૧૦	૭	૮	૨	૮૧૮	૬૦૦	૯,૦૧૭	૯	૯	૬૦૬
૧૧	૮	૪	૩	૧૦૦	૭૦૦	૧૦,૫૨૦	૮	૯	૨૦૭
૧૨	૯	૦	૩	૩૮૨	૮૦૦	૧૨,૦૨૩	૭	૮	૮૦૬
૧૩	૯	૧૨	૩	૬૬૩	૯૦૦	૧૩,૫૨૬	૬	૮	૪૦૭
૧૪	૧૦	૮	૩	૯૪૫	૧,૦૦૦	૧૫,૦૨૯	૫	૮	૦૦૮
૧૫	૧૧	૪	૪	૨૨૭	૧,૫૦૦	૨૨,૫૪૪	૦	૬	૦૧૩
૧૬	૧૨	૦	૪	૫૦૯	૨,૦૦૦	૩૦,૦૫૮	૧૧	૪	૦૧૬
૧૭	૧૨	૧૨	૪	૭૯૧	૩,૦૦૦	૪૫,૦૮૮	૧	૦	૦૨૪
૧૮	૧૩	૮	૫	૦૭૨	૪,૦૦૦	૬૦,૧૧૭	૬	૮	૦૩૧
૧૯	૧૪	૪	૫	૩૫૪	૫,૦૦૦	૭૫,૧૪૬	૧૨	૪	૦૩૯
પૌંડ ૧	૧૫	૦	૫	૬૩૬	૧૦,૦૦૦	૧,૫૦,૨૯૩	૮	૮	૦૭૭
૨	૩૦	૦	૧૧	૨૭૨	૨૦,૦૦૦	૩,૦૦,૫૮૭	૧	૪	૧૫૪
૩	૪૫	૧	૪	૯૦૮	૪૦,૦૦૦	૬,૦૧,૧૧૪	૨	૮	૩૦૮

શી. ૧–૩ પેન્સ ૧૫ાા આના						શી. ૧–૩ ૩/૩૨ પેન્સ (૧–૩ાા≈ાાં)					
પાઇ	પૌંડ	શી	પે	ફાર		રૂપીઆ.	પૌંડ	શી.	પે	ફાર	
૧				૦	૩૩૩	૮		૧૦	૭	૩	
૨				૦	૬૬૫	૯		૧૧	૧૧	૨	૮૭૫
૩				૦	૯૯૮	૧૦		૧૩	૩	૨	૭૫૦
૪				૧	૩૩૧	૨૦	૧	૬	૭	૧	૫૦૦
૫				૧	૬૬૩	૩૦	૧	૧૯	૧૧	૦	૨૫૦
૬				૧	૯૯૭	૪૦	૨	૧૩	૨	૩	
૭				૨	૩૩૦	૫૦	૩	૬	૬	૧	૭૫૦
૮				૨	૬૬૧	૬૦	૩	૧૯	૧૦	૦	૫૦૦
૯				૨	૯૯૬	૭૦	૪	૧૩	૧	૩	૨૫૦
૧૦				૩	૩૩૦	૮૦	૫	૬	૫	૨	
૧૧				૩	૬૬૩	૯૦	૫	૧૯	૯	૦	૭૫૦
આના ૧				૩	૯૯૨	૧૦૦	૬	૧૩	૦	૩	૫૦૦
૨			૧	૩	૯૮૪	૨૦૦	૧૩	૬	૧	૩	
૩			૨	૩	૯૭૬	૩૦૦	૧૯	૧૯	૨	૨	૫૦૦
૪			૩	૩	૯૬૮	૪૦૦	૨૬	૧૨	૩	૨	
૫			૪	૩	૯૬૦	૫૦૦	૩૩	૫	૪	૧	૫૦૦
૬			૫	૩	૯૫૨	૬૦૦	૩૯	૧૮	૫	૧	
૭			૬	૩	૯૪૪	૭૦૦	૪૬	૧૧	૬	૦	૫૦૦
૮			૭	૩	૯૩૬	૮૦૦	૫૩	૪	૭		
૯			૮	૩	૯૨૮	૯૦૦	૫૯	૧૭	૭	૩	૫૦૦
૧૦			૯	૩	૯૨૨	૧,૦૦૦	૬૬	૧૦	૮	૩	
૧૧			૧૦	૩	૯૧૨	૧,૫૦૦	૯૯	૧૬	૧	૦	૫૦૦
૧૨			૧૧	૩	૯૦૪	૨,૦૦૦	૧૩૩	૧	૫	૨	
૧૩		૧	૦	૩	૮૯૬	૩,૦૦૦	૧૯૯	૧૨	૨	૧	
૧૪		૧	૧	૩	૮૮૮	૪,૦૦૦	૨૬૬	૨	૧૧		
૧૫		૧	૨	૩	૮૮૦	૫,૦૦૦	૩૩૨	૧૩	૭	૩	
રૂપીઆ ૧		૧	૩	૩	૮૭૫	૧૦,૦૦૦	૬૬૫	૭	૩	૨	
૨		૨	૭	૩	૭૫૦	૨૦,૦૦૦	૧,૩૩૦	૧૪	૭		
૩		૩	૧૧	૩	૬૨૫	૩૦,૦૦૦	૧,૯૯૬	૧	૧૦	૨	
૪		૫	૩	૩	૫૦૦	૪૦,૦૦૦	૨,૬૬૧	૯	૨		
૫		૬	૭	૩	૩૭૫	૫૦,૦૦૦	૩,૩૨૬	૧૬	૫	૨	
૬		૭	૧૧	૩	૨૫૦	૧,૦૦,૦૦૦	૬,૬૫૩	૧૨	૧૧		
૭		૯	૩	૩	૧૨૫	૨,૦૦,૦૦૦	૧૩,૩૦૭	૫	૧૦		

(વીલાયતી હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૩ પેન્સ ૧૫।।। આના					શી. ૧-૨$\frac{૬}{૬}\frac{૩}{૪}$ પેન્સ (૧-૩।।।=।।)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દોકડા.	પૌંડ	રૂપીઆ	આ	પ	દો
૧		૧	૦	૦૧૨	૪	૬૦	૦	૧૧	૨૬૧
૨		૨	૦	૦૨૪	૫	૭૫	૧	૨	૦૭૬
૩		૩	૦	૦૩૫	૬	૯૦	૧	૪	૮૯૧
૪		૪	૦	૦૪૭	૭	૧૦૫	૧	૭	૭૦૭
૫		૫	૦	૦૫૯	૮	૧૨૦	૧	૧૦	૫૨૨
૬		૬	૦	૦૭૦	૯	૧૩૫	૨	૧	૩૩૭
૭		૭	૦	૦૮૨	૧૦	૧૫૦	૨	૪	૧૫૨
૮		૮	૦	૦૯૪	૨૦	૩૦૦	૪	૮	૩૦૫
૯		૯	૦	૧૦૬	૩૦	૪૫૦	૭	૦	૪૫૭
૧૦		૧૦	૦	૧૧૭	૪૦	૬૦૦	૯	૪	૬૧૦
૧૧		૧૧	૦	૧૨૯	૫૦	૭૫૦	૧૧	૮	૭૬૨
શીલીંગ ૧		૧૨	૦	૧૪૧	૬૦	૯૦૦	૧૪	૦	૯૧૫
૨	૧	૮	૦	૨૮૨	૭૦	૧,૦૫૧	૦	૫	૦૬૭
૩	૨	૪	૦	૪૨૨	૮૦	૧,૨૦૧	૨	૯	૨૨૦
૪	૩	૦	૦	૫૬૩	૯૦	૧,૩૫૧	૫	૧	૩૭૨
૫	૩	૧૨	૦	૭૦૪	૧૦૦	૧,૫૦૧	૭	૫	૫૨૫
૬	૪	૮	૦	૮૪૫	૨૦૦	૩,૦૦૨	૧૪	૧૧	૦૫૦
૭	૫	૪	૦	૯૮૫	૩૦૦	૪,૫૦૪	૬	૪	૫૭૫
૮	૬	૦	૧	૧૨૬	૪૦૦	૬,૦૦૫	૧૩	૧૦	૧૦૦
૯	૬	૧૨	૧	૨૬૭	૫૦૦	૭.૫૦૭	૫	૩	૬૨૫
૧૦	૭	૮	૧	૪૦૮	૬૦૦	૯ ૦૦૮	૧૨	૯	૧૫૦
૧૧	૮	૪	૧	૫૪૮	૭૦૦	૧૦,૫૧૦	૪	૨	૬૭૪
૧૨	૯	૦	૧	૬૮૯	૮૦૦	૧૨,૦૧૧	૧૧	૮	૧૯૯
૧૩	૯	૧૨	૧	૮૩૦	૯૦૦	૧૩,૫૧૩	૩	૧	૭૨૪
૧૪	૧૦	૮	૧	૯૭૧	૧,૦૦૦	૧૫.૦૧૪	૧૦	૭	૨૪૯
૧૫	૧૧	૪	૨	૧૧૧	૧,૫૦૦	૨૨.૫૨૧	૧૫	૧૦	૮૭૪
૧૬	૧૨	૦	૨	૨૫૨	૨,૦૦૦	૩૦,૦૨૯	૫	૨	૪૯૯
૧૭	૧૨	૧૨	૨	૩૯૩	૩,૦૦૦	૪૫,૦૪૩	૧૫	૯	૭૪૮
૧૮	૧૩	૮	૨	૫૩૪	૪,૦૦૦	૬૦,૦૫૮	૧૦	૪	૯૯૭
૧૯	૧૪	૪	૨	૬૭૫	૫,૦૦૦	૭૫,૦૭૩	૫	૦	૨૪૬
પૌંડ ૧	૧૫	૦	૨	૮૧૫	૧૦,૦૦૦	૧,૫૦,૧૪૬	૧૦	૦	૪૯૨
૨	૩૦	૦	૫	૬૩૦	૨૦,૦૦૦	૩ ૦૦,૨૯૩	૪	૦	૯૮૪
૩	૪૫	૦	૮	૪૪૬	૪૦,૦૦૦	૪,૫૦,૪[illegible]૯	૧૪	૧	૪૭૬

પાઈ	પૌંડ	શી.	પે.	ફાર		રૂપીઆ	પૌંડ	શી	પે.	ફાર	
શી. ૧–૩ પેન્સ ૧૫॥ આના,						શી. ૧–૩ ૬૩/૬૪ પે. (૧–૩।।।≡।।)					
૧				૦	૩૩૩	૮		૧૦	૭	૩	૫૦૦
૨				૦	૬૬૬	૯		૧૧	૧૧	૩	૪૩૭
૩				૦	૯૯૯	૧૦		૧૩	૩	૩	૩૭૫
૪				૧	૩૩૨	૨૦	૧	૬	૭	૨	૭૫૦
૫				૧	૬૬૬	૩૦	૧	૧૯	૧૧	૨	૧૨૫
૬				૧	૯૯૮	૪૦	૨	૧૩	૩	૧	૫૦૦
૭				૨	૩૩૧	૫૦	૩	૬	૭	૦	૮૭૫
૮				૨	૬૬૪	૬૦	૩	૧૯	૧૧	૦	૨૫૦
૯				૨	૯૯૭	૭૦	૪	૧૩	૨	૩	૬૨૫
૧૦				૩	૩૩૦	૮૦	૫	૬	૬	૩	
૧૧				૩	૬૬૩	૯૦	૫	૧૯	૧૦	૨	૩૭૫
આના ૧				૩	૯૯૬	૧૦૦	૬	૧૩	૨	૧	૭૫૦
૨			૧	૩	૯૯૨	૨૦૦	૧૩	૬	૪	૩	૫૦૦
૩			૨	૩	૯૮૮	૩૦૦	૧૯	૧૯	૭	૧	૨૫૦
૪			૩	૩	૯૮૪	૪૦૦	૨૬	૧૨	૯	૩	
૫			૪	૩	૯૮૦	૫૦૦	૩૩	૬	૦	૦	૭૫૦
૬			૫	૩	૯૭૬	૬૦૦	૩૯	૧૯	૨	૨	૫૦૦
૭			૬	૩	૯૭૨	૭૦૦	૪૬	૧૨	૫	૦	૨૫૦
૮			૭	૩	૯૬૮	૮૦૦	૫૩	૫	૭	૨	
૯			૮	૩	૯૬૪	૯૦૦	૫૯	૧૮	૯	૩	૭૫૦
૧૦			૯	૩	૯૬૧	૧,૦૦૦	૬૬	૧૨	૦	૧	૫૦૦
૧૧			૧૦	૩	૯૫૭	૧,૫૦૦	૯૯	૧૮	૦	૨	૨૫૦
૧૨			૧૧	૩	૯૫૩	૨,૦૦૦	૧૩૩	૪	૦	૩	
૧૩			૧૨	૩	૯૪૯	૩,૦૦૦	૧૯૯	૧૬	૧	૦	૫૦૦
૧૪			૧૩	૩	૯૪૫	૪,૦૦૦	૨૬૬	૮	૧	૨	
૧૫			૧૪	૩	૯૪૧	૫,૦૦૦	૩૩૩	૦	૧	૩	૫૦૦
રૂપીઆ ૧		૧	૩	૩	૯૩૭	૧૦,૦૦૦	૬૬૬	૦	૩	૩	
૨		૨	૭	૩	૮૭૫	૨૦,૦૦૦	૧,૩૩૨	૦	૭	૨	
૩		૩	૧૧	૩	૮૧૨	૩૦,૦૦૦	૧,૯૯૮	૦	૧૧	૧	
૪		૫	૩	૩	૭૫૦	૪૦,૦૦૦	૨,૬૬૪	૧	૩	૦	
૫		૬	૭	૩	૬૮૭	૫૦,૦૦૦	૩,૩૩૦	૧	૬	૩	
૬		૭	૧૧	૩	૬૨૫	૧,૦૦,૦૦૦	૬,૬૬૦	૩	૧	૨	
૭		૯	૩	૩	૫૬૨	૨,૦૦,૦૦૦	૧૩ ૩૨૦	૬	૩	૦	

પૌંડના રૂપીઆ

શી. ૧-૪ પેન્સ					શી ૧-૪ પેન્સ				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો.	પાઊંડ	રૂપીઆ	આ	પા	દો
૧		૧			૪	૬૦			
૨		૨			૫	૭૫			
૩		૩			૬	૯૦			
૪		૪			૭	૧૦૫			
૫		૫			૮	૧૨૦			
૬		૬			૯	૧૩૫			
૭		૭			૧૦	૧૫૦			
૮		૮			૨૦	૩૦૦			
૯		૯			૩૦	૪૫૦			
૧૦		૧૦			૪૦	૬૦૦			
૧૧		૧૧			૫૦	૭૫૦			
શીલીંગ ૧		૧૨			૬૦	૯૦૦			
૨	૧	૮			૭૦	૧,૦૫૦			
૩	૨	૪			૮૦	૧,૨૦૦			
૪	૩	૦			૯૦	૧,૩૫૦			
૫	૩	૧૨			૧૦૦	૧,૫૦૦			
૬	૪	૮			૨૦૦	૩,૦૦૦			
૭	૫	૪			૩૦૦	૪,૫૦૦			
૮	૬	૦			૪૦૦	૬,૦૦૦			
૯	૬	૧૨			૫૦૦	૭,૫૦૦			
૧૦	૭	૮			૬૦૦	૯,૦૦૦			
૧૧	૮	૪			૭૦૦	૧૦,૫૦૦			
૧૨	૯	૦			૮૦૦	૧૨,૦૦૦			
૧૩	૯	૧૨			૯૦૦	૧૩,૫૦૦			
૧૪	૧૦	૮			૧,૦૦૦	૧૫,૦૦૦			
૧૫	૧૧	૪			૧,૫૦૦	૨૨,૫૦૦			
૧૬	૧૨	૦			૨,૦૦૦	૩૦,૦૦૦			
૧૭	૧૨	૧૨			૩,૦૦૦	૪૫,૦૦૦			
૧૮	૧૩	૮			૪,૦૦૦	૬૦,૦૦૦			
૧૯	૧૪	૪			૫,૦૦૦	૭૫,૦૦૦			
પૌંડ ૧	૧૫				૧૦,૦૦૦	૧,૫૦,૦૦૦			
૨	૩૦				૨૦,૦૦૦	૩,૦૦,૦૦૦			
૩	૪૫				૪૦,૦૦૦	૬,૦૦,૦૦૦			

શી. ૧-૪ પેન્સ

પાઇ.	પૌંડ	શી	પે	ફાર.
૧				૦ ૩૩૩
૨				૦ ૬૬૬
૩				૧
૪				૧ ૩૩૩
૫				૧ ૬૬૬
૬				૨
૭				૨ ૩૩૩
૮				૨ ૬૬૬
૯				૩
૧૦				૩ ૩૩૩
૧૧				૩ ૬૬૬
આના. ૧			૧	૦
૨			૨	૦
૩			૩	૦
૪			૪	૦
૫			૫	૦
૬			૬	૦
૭			૭	૦
૮			૮	૦
૯			૯	૦
૧૦			૧૦	૦
૧૧			૧૧	૦
૧૨		૧	૦	૦
૧૩		૧	૧	૦
૧૪		૧	૨	૦
૧૫		૧	૩	૦
રૂપીઆ ૧		૧	૪	૦
૨		૨	૮	૦
૩		૪	૦	૦
૪		૫	૪	૦
૫		૬	૮	૦
૬		૮	૦	૦
૭		૯	૪	૦

શી. ૧-૪ પેન્સ

રૂપીઆ.	પૌંડ.	શી.	પે	ફાર
૮		૧૦	૮	
૯		૧૨	૦	
૧૦		૧૩	૪	
૨૦	૧	૬	૮	
૩૦	૨	૦	૦	
૪૦	૨	૧૩	૪	
૫૦	૩	૬	૮	
૬૦	૪	૦	૦	
૭૦	૪	૧૩	૪	
૮૦	૫	૬	૮	
૯૦	૬	૦	૦	
૧૦૦	૬	૧૩	૪	
૨૦૦	૧૩	૬	૮	
૩૦૦	૨૦	૦	૦	
૪૦૦	૨૬	૧૩	૪	
૫૦૦	૩૩	૬	૮	
૬૦૦	૪૦	૦	૦	
૭૦૦	૪૬	૧૩	૪	
૮૦૦	૫૩	૬	૮	
૯૦૦	૬૦	૦	૦	
૧,૦૦૦	૬૬	૧૩	૪	
૧,૫૦૦	૧૦૦	૦	૦	
૨,૦૦૦	૧૩૩	૬	૮	
૩,૦૦૦	૨૦૦	૦	૦	
૪,૦૦૦	૨૬૬	૧૩	૪	
૫,૦૦૦	૩૩૩	૬	૮	
૧૦,૦૦૦	૬૬૬	૧૩	૪	
૨૦,૦૦૦	૧,૩૩૩	૬	૮	
૩૦,૦૦૦	૨,૦૦૦	૦	૦	
૪૦,૦૦૦	૨,૬૬૬	૧૩	૪	
૫૦,૦૦૦	૩,૩૩૩	૬	૮	
૧,૦૦,૦૦૦	૬,૬૬૬	૧૩	૪	
૨,૦૦,૦૦૦	૧૩,૩૩૩	૬	૮	

પૌંડના રૂપીઆ

શી ૧-૪ પેન્સ ૦૧ આનો.					શો. ૧—૪ $\frac{૧}{૬૪}$ પેન્સ(૧-૪)૦૧)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો.	પાઊંડ	રૂપીઆ.	આ	પા	દો.
૧			૧૧	૯૮૮	૪	૫૯	૧૫	૦	૭૬૧
૨		૧	૧૧	૯૭૭	૫	૭૪	૧૪	૯	૯૫૧
૩		૨	૧૧	૯૬૫	૬	૮૯	૧૪	૭	૧૪૧
૪		૩	૧૧	૯૫૩	૭	૧૦૪	૧૪	૪	૩૩૨
૫		૪	૧૧	૯૪૧	૮	૧૧૯	૧૪	૧	૫૨૨
૬		૫	૧૧	૯૩૦	૯	૧૩૪	૧૩	૧૦	૭૧૨
૭		૬	૧૧	૯૧૮	૧૦	૧૪૯	૧૩	૭	૯૦૨
૮		૭	૧૧	૯૦૬	૨૦	૨૯૯	૧૧	૩	૮૦૫
૯		૮	૧૧	૮૯૫	૩૦	૪૪૯	૮	૧૧	૭૦૭
૧૦		૯	૧૧	૮૮૩	૪૦	૫૯૯	૬	૭	૬૧૦
૧૧		૧૦	૧૧	૮૭૧	૫૦	૭૪૯	૪	૩	૫૧૨
શીલીંગ ૧		૧૧	૧૧	૮૫૯	૬૦	૮૯૯	૧	૧૧	૪૧૫
૨	૧	૭	૧૧	૭૧૯	૭૦	૧,૦૪૮	૧૫	૭	૩૧૭
૩	૨	૩	૧૧	૫૭૯	૮૦	૧,૧૯૮	૧૩	૩	૨૨૦
૪	૨	૧૫	૧૧	૪૩૮	૯૦	૧,૩૪૮	૧૦	૧૧	૧૨૨
૫	૩	૧૧	૧૧	૨૯૮	૧૦૦	૧.૪૯૮	૮	૭	૦૨૪
૬	૪	૭	૧૧	૧૫૭	૨૦૦	૨.૯૯૭	૧	૨	૦૪૯
૭	૫	૩	૧૧	૦૧૭	૩૦૦	૪,૪૯૫	૯	૯	૦૭૩
૮	૫	૧૫	૧૦	૮૭૬	૪૦૦	૫,૯૯૪	૨	૪	૦૯૮
૯	૬	૧૧	૧૦	૭૩૬	૫૦૦	૭,૪૯૨	૧૦	૧૧	૧૨૨
૧૦	૭	૭	૧૦	૫૯૫	૬૦૦	૮,૯૯૧	૩	૬	૧૪૬
૧૧	૮	૩	૦	૪૫૫	૭૦૦	૧૦,૪૮૯	૧૨	૧	૧૭૧
૧૨	૮	૧૫	૧૦	૩૧૪	૮૦૦	૧૧,૯૮૮	૪	૮	૧૯૫
૧૩	૯	૧૧	૧૦	૧૭૪	૯૦૦	૧૩,૪૮૬	૧૩	૩	૨૨૦
૧૪	૧૦	૭	૧૦	૦૩૩	૧,૦૦૦	૧૪ ૯૮૫	૫	૧૦	૨૪૪
૧૫	૧૧	૩	૯	૮૯૩	૧,૫૦૦	૨૨,૪૭૮	૦	૯	૩૬૬
૧૬	૧૧	૧૫	૯	૭૫૨	૨,૦૦૦	૨૯,૯૭૦	૧૧	૮	૪૮૮
૧૭	૧૨	૧૧	૯	૬૧૨	૩,૦૦૦	૪૪,૯૫૬	૧	૬	૭૩૨
૧૮	૧૩	૭	૯	૪૭૧	૪,૦૦૦	૫૯,૯૪૧	૭	૪	૯૭૬
૧૯	૧૪	૩	૯	૩૩૧	૫,૦૦૦	૭૪,૯૨૬	૧૩	૩	૨૨૦
પાઉંડ ૧	૧૪	૧૫	૯	૧૯૦	૧૦,૦૦૦	૧,૪૯.૮૫૩	૧૦	૬	૪૩૯
૨	૨૯	૧૫	૬	૩૮૦	૨૦,૦૦૦	૨,૯૯,૭૦૭	૫	૦	૮૭૭
૩	૪૪	૧૫	૩	૫૭૧	૪૦,૦૦૦	૫,૯૯.૪૧૪	૧૦	૧	૭૫૫

	શી. ૧–૪ પેન્સ નો આનો					શી ૧–૪ ૧/૪ પેન્સ (૧–૪॥૦।)				
	પાઇ.	પાઊંડ	શી.	પે	ફાર.	રૂપીઆ	પાઉંડ	શી	પે	ફાર.
	૧				૦ ૩૩૩	૮		૧૦	૮	૦ ૫૦૦
	૨				૦ ૬૬૭	૯		૧૨	૦	૦ ૫૬૨
	૩				૧ ૦૦૧	૧૦		૧૩	૪	૦ ૬૨૫
	૪				૧ ૩૩૪	૨૦	૧	૬	૮	૧ ૨૫૦
	૫				૧ ૬૬૮	૩૦	૨	૦	૦	૧ ૮૭૫
	૬				૨ ૦૦૨	૪૦	૨	૧૩	૪	૨ ૫૦૦
	૭				૨ ૩૩૫	૫૦	૩	૬	૮	૩ ૧૨૫
	૮				૨ ૬૬૯	૬૦	૪	૦	૦	૩ ૭૫૦
	૯				૩ ૦૦૩	૭૦	૪	૧૩	૫	૦ ૩૭૫
	૧૦				૩ ૩૩૬	૮૦	૫	૬	૯	૧
	૧૧				૩ ૬૭૦	૯૦	૬	૦	૧	૧ ૬૨૫
આના.	૧			૧	૦ ૦૦૪	૧૦૦	૬	૧૩	૫	૨ ૨૫૦
	૨			૨	૦ ૦૦૮	૨૦૦	૧૩	૬	૧૧	૦ ૫૦૦
	૩			૩	૦ ૦૧૨	૩૦૦	૨૦	૦	૪	૨ ૭૫૦
	૪			૪	૦ ૦૧૫	૪૦૦	૨૬	૧૩	૧૦	૧
	૫			૫	૦ ૦૧૯	૫૦૦	૩૩	૭	૩	૩ ૨૫૦
	૬			૬	૦ ૦૨૩	૬૦૦	૪૦	૦	૯	૧ ૫૦૦
	૭			૭	૦ ૦૨૭	૭૦૦	૪૬	૧૪	૨	૩ ૭૫૦
	૮			૮	૦ ૦૩૧	૮૦૦	૫૩	૭	૮	૨
	૯			૯	૦ ૦૩૫	૯૦૦	૬૦	૧	૨	૦ ૨૫૦
	૧૦			૧૦	૦ ૦૩૯	૧,૦૦૦	૬૬	૧૪	૭	૨ ૫૦૦
	૧૧			૧૧	૦ ૦૪૩	૧,૫૦૦	૧૦૦	૧	૧૧	૧ ૭૫૦
	૧૨		૧	૦	૦ ૦૪૭	૨,૦૦૦	૧૩૩	૯	૩	૧
	૧૩		૧	૧	૦ ૦૫૧	૩.૦૦૦	૨૦૦	૩	૧૦	૩ ૫૦૦
	૧૪		૧	૨	૦ ૦૫૪	૪,૦૦૦	૨૬૬	૧૮	૬	૨
	૧૫		૧	૩	૦ ૦૫૮	૫,૦૦૦	૩૩૩	૧૩	૨	૦ ૫૦૦
રૂપીઆ	૧		૧	૪	૦ ૦૬૨	૧૦,૦૦૦	૬૬૭	૬	૪	૧
	૨		૨	૮	૦ ૧૨૫	૨૦.૦૦૦	૧.૩૩૪	૧૨	૮	૨
	૩		૪	૦	૦ ૧૮૭	૩૦,૦૦૦	૨,૦૦૧	૧૯	૦	૩
	૪		૫	૪	૦ ૨૫૦	૪૦,૦૦૦	૨.૬૬૯	૫	૫	૦
	૫		૬	૮	૦ ૩૧૨	૫૦,૦૦૦	૩.૩૩૬	૧૧	૯	૧
	૬		૮	૦	૦ ૩૭૫	૧,૦૦,૦૦૦	૬,૬૭૩	૩	૬	૨
	૭		૯	૪	૦ ૪૩૭	૨,૦૦,૦૦૦	૧૩,૩૪૬	૭	૧	૦

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૪ પેન્સ ૦ાા આના				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો.
૧			૧૧	૯૭૭
૨		૧	૧૧	૯૫૩
૩		૨	૧૧	૯૩૦
૪		૩	૧૧	૯૦૭
૫		૪	૧૧	૮૮૪
૬		૫	૧૧	૮૬૧
૭		૬	૧૧	૮૩૬
૮		૭	૧૧	૮૧૩
૯		૮	૧૧	૭૯૦
૧૦		૯	૧૧	૭૬૭
૧૧		૧૦	૧૧	૭૪૩
શીલીંગ ૧		૧૧	૧૧	૭૧૯
૨	૧	૭	૧૧	૪૩૮
૩	૨	૩	૧૧	૧૫૭
૪	૨	૧૫	૧૦	૮૭૬
૫	૩	૧૧	૧૦	૫૯૬
૬	૪	૭	૧૦	૩૧૫
૭	૫	૩	૧૦	૦૩૫
૮	૫	૧૫	૯	૭૫૫
૯	૬	૧૧	૯	૪૭૪
૧૦	૭	૭	૯	૧૯૩
૧૧	૮	૩	૮	૯૧૧
૧૨	૮	૧૫	૮	૬૩૧
૧૩	૯	૧૧	૮	૩૫૦
૧૪	૧૦	૭	૮	૦૭
૧૫	૧૧	૩	૭	૭૮૯
૧૬	૧૧	૧૫	૭	૫૦૯
૧૭	૧૨	૧૧	૭	૨૨૮
૧૮	૧૩	૭	૬	૯૪૭
૧૯	૧૪	૩	૬	૬૬૭
પૌંડ ૧	૧૪	૧૫	૬	૩૮૬
૨	૨૯	૧૫	૦	૭૭૨
૩	૪૪	૧૪	૭	૧૫૮

શી. ૧-૪ $\frac{૧}{૩૨}$ પેન્સ (૧-૪)૦ાા)				
પૌંડ	રૂપીઆ	આ	પા.	દો.
૪	૫૯	૧૪	૧	૫૪૪
૫	૭૪	૧૩	૭	૯૩૦
૬	૮૯	૧૩	૨	૩૧૬
૭	૧૦૪	૧૨	૮	૭૦૨
૮	૧૧૯	૧૨	૩	૦૮૮
૯	૧૩૪	૧૧	૯	૪૭૪
૧૦	૧૪૯	૧૧	૩	૮૬૦
૨૦	૨૯૯	૬	૭	૭૨૦
૩૦	૪૪૯	૧	૧૧	૫૮૦
૪૦	૫૯૮	૧૩	૩	૪૪૦
૫૦	૭૪૮	૮	૭	૩૦૦
૬૦	૮૯૮	૩	૧૧	૧૬૦
૭૦	૧,૦૪૭	૧૫	૩	૦૨૦
૮૦	૧,૧૯૭	૧૦	૬	૮૮૦
૯૦	૧,૩૪૭	૫	૧૦	૭૪૦
૧૦૦	૧,૪૯૭	૧	૨	૫૯૬
૨૦૦	૨,૯૯૪	૨	૫	૧૯૨
૩૦૦	૪,૪૯૧	૩	૭	૭૯૦
૪૦૦	૫,૯૮૮	૪	૧૦	૩૮૬
૫૦૦	૭,૪૮૫	૬	૦	૯૮૩
૬૦૦	૮,૯૮૨	૭	૩	૫૭૯
૭૦૦	૧૦,૪૭૯	૮	૬	૧૭૬
૮૦૦	૧૧,૯૭૬	૯	૮	૭૭૨
૯૦૦	૧૩,૪૭૩	૧૦	૧૧	૩૬૯
૧,૦૦૦	૧૪.૯૭૦	૧૨	૧	૯૬૫
૧,૫૦૦	૨૨,૪૫૬	૨	૨	૯૪૮
૨,૦૦૦	૨૯,૯૪૧	૮	૩	૯૩૫
૩,૦૦૦	૪૪,૯૧૨	૪	૫	૮૯૫
૪,૦૦૦	૫૯,૮૮૩	૦	૭	૮૬૦
૫,૦૦૦	૭૪,૮૫૩	૧૨	૯	૮૨૫
૧૦,૦૦૦	૧,૪૯,૭૦૭	૯	૭	૬૪૯
૨૦,૦૦૦	૨,૯૯.૪૧૫	૩	૩	૨૯૮
૪૦,૦૦૦	૫,૯૮[illegible]૩૦	૬	૬	૫૯૬

શી. ૧-૪ પેન્સ ૦ા આના					શી. ૧-૪ રૂ ૧/૨ (૧-૪)૦ા				
પાઇ.	પાઊંડ	શી.	પે	ફાર	રૂપીઆ	પાઊંડ	શી	પે	ફાર.
૧				૦ ૩૩૪	૮		૧૦	૮	૧
૨				૦ ૬૬૮	૯		૧૨	૦	૧ ૧૨૫
૩				૧ ૦૦૨	૧૦		૧૩	૪	૧ ૨૫૦
૪				૧ ૩૩૬	૨૦	૧	૬	૮	૨ ૫૦૦
૫				૧ ૬૭૦	૩૦	૨	૦	૦	૩ ૭૫૦
૬				૨ ૦૦૪	૪૦	૨	૧૩	૫	૧
૭				૨ ૩૩૮	૫૦	૩	૬	૯	૨ ૨૫૦
૮				૨ ૬૭૨	૬૦	૪	૦	૧	૩ ૫૦૦
૯				૩ ૦૦૬	૭૦	૪	૧૩	૬	૦ ૭૫૦
૧૦				૩ ૩૪૦	૮૦	૫	૬	૧૦	૨
૧૧				૩ ૬૭૪	૯૦	૬	૦	૨	૩ ૨૫૦
આના. ૧			૧	૦ ૦૦૮	૧૦૦	૬	૧૩	૭	૦ ૫૦૦
૨			૨	૦ ૦૧૬	૨૦૦	૧૩	૭	૨	૧
૩			૩	૦ ૦૨૩	૩૦૦	૨૦	૦	૯	૧ ૫૦૦
૪			૪	૦ ૦૩૧	૪૦૦	૨૬	૧૪	૪	૨
૫			૫	૦ ૦૩૯	૫૦૦	૩૩	૭	૧૧	૨ ૫૦૦
૬			૬	૦ ૦૪૭	૬૦૦	૪૦	૧	૬	૩
૭			૭	૦ ૦૫૫	૭૦૦	૪૬	૧૫	૧	૩ ૫૦૦
૮			૮	૦ ૦૬૩	૮૦૦	૫૩	૮	૯	
૯			૯	૦ ૦૭૦	૯૦૦	૬૦	૨	૪	૫૦૦
૧૦			૧૦	૦ ૦૭૮	૧,૦૦૦	૬૬	૧૫	૧૧	૧
૧૧			૧૧	૦ ૦૮૬	૧,૫૦૦	૧૦૦	૩	૧૦	૩ ૫૦૦
૧૨		૧	૦	૦ ૦૯૪	૨,૦૦૦	૧૩૩	૧૧	૧૦	૨
૧૩		૧	૧	૦ ૧૦૨	૩,૦૦૦	૨૦૦	૭	૯	૩
૧૪		૧	૨	૦ ૧૦૯	૪,૦૦૦	૨૬૭	૩	૯	
૧૫		૧	૩	૦ ૧૧૭	૫,૦૦૦	૩૩૩	૧૯	૮	૧
રૂપીઆ ૧		૧	૪	૦ ૧૨૫	૧૦,૦૦૦	૬૬૭	૧૯	૪	૨
૨		૨	૮	૦ ૨૫૦	૨૦,૦૦૦	૧,૩૩૫	૧૮	૯	
૩		૪	૦	૦ ૩૭૫	૩૦,૦૦૦	૨,૦૦૩	૧૮	૧	૨
૪		૫	૪	૦ ૫૦૦	૪૦,૦૦૦	૨,૬૭૧	૧૭	૬	
૫		૬	૮	૦ ૬૨૫	૫૦,૦૦૦	૩,૩૩૯	૧૬	૧૦	૨
૬		૮	૦	૦ ૭૫૦	૧,૦૦,૦૦૦	૬,૬૭૯	૧૩	૯	
૭		૯	૪	૦ ૮૭૫	૨,૦૦,૦૦૦	૧૩,૩૫૯	૭	૬	

(વીલાયતની હુંડી.) પૌંડના રૂપીઆ.

શા ૧-૪ પેન્સ ૦ાાા આનો					શી. ૧-૪ $\frac{૩}{૬૪}$ પેન્સ (૧-૪)૦ાાા)				
પેન્સ.	રૂપીઆ	આ	પા.	દો.	પૌંડ.	રૂપીઆ.	આ	પા.	દો.
૧		૦	૧૧	૯૬૫	૪	૫૯	૧૩	૨	૩૪૯
૨		૧	૧૧	૯૩૦	૫	૭૪	૧૨	૫	૯૩૬
૩		૨	૧૧	૮૯૫	૬	૮૯	૧૧	૯	૫૨૩
૪		૩	૧૧	૮૬૦	૭	૧૦૪	૧૧	૧	૧૧૦
૫		૪	૧૧	૮૨૫	૮	૧૧૯	૧૦	૪	૬૯૭
૬		૫	૧૧	૭૯૦	૯	૧૩૪	૯	૮	૨૮૪
૭		૬	૧૧	૭૫૫	૧૦	૧૪૯	૮	૧૧	૮૭૧
૮		૭	૧૧	૭૨૦	૨૦	૨૯૯	૧	૧૧	૭૪૩
૯		૮	૧૧	૬૮૫	૩૦	૪૪૮	૧૦	૧૧	૬૧૪
૧૦		૯	૧૧	૬૪૯	૪૦	૫૯૮	૩	૧૧	૪૮૬
૧૧		૧૦	૧૧	૬૧૪	૫૦	૭૪૭	૧૨	૧૧	૩૫૭
શીલીંગ ૧		૧૧	૧૧	૫૭૯	૬૦	૮૯૭	૫	૧૧	૨૨૯
૨	૧	૭	૧૧	૧૫૯	૭૦	૧,૦૪૬	૧૪	૧૧	૧૦૦
૩	૨	૩	૧૦	૭૩૮	૮૦	૧.૧૯૬	૭	૧૦	૯૭૨
૪	૨	૧૫	૧૦	૩૧૮	૯૦	૧,૩૪૬	૦	૧૦	૮૪૩
૫	૩	૧૧	૯	૮૯૭	૧૦૦	૧,૪૯૫	૯	૧૦	૭૧૫
૬	૪	૭	૯	૪૭૬	૨૦૦	૨,૯૯૧	૩	૯	૪૨૯
૭	૫	૩	૯	૦૫૬	૩૦૦	૪,૪૮૬	૧૩	૮	૧૪૪
૮	૫	૧૫	૮	૬૩૫	૪૦૦	૫,૯૮૨	૭	૬	૮૫૯
૯	૬	૧૧	૮	૨૧૪	૫૦૦	૭,૪૭૮	૧	૫	૫૭૩
૧૦	૭	૭	૭	૭૯૪	૬૦૦	૮,૯૭૩	૧૧	૪	૨૮૮
૧૧	૮	૩	૭	૩૭૩	૭૦૦	૧૦,૪૬૯	૫	૩	૦૦૩
૧૨	૮	૧૫	૬	૯૫૨	૮૦૦	૧૧,૯૬૪	૧૫	૧	૭૧૮
૧૩	૯	૧૧	૬	૫૩૨	૯૦૦	૧૩,૪૬૦	૯	૦	૪૩૨
૧૪	૧૦	૭	૬	૧૧૧	૧,૦૦૦	૧૪,૯૫૬	૨	૧૧	૧૪૭
૧૫	૧૧	૩	૫	૬૯૧	૧,૫૦૦	૨૨,૪૩૪	૪	૪	૭૨૧
૧૬	૧૧	૧૫	૫	૨૭૦	૨,૦૦૦	૨૯,૯૧૨	૫	૧૦	૨૯૪
૧૭	૧૨	૧૧	૪	૮૪૯	૩,૦૦૦	૪૪,૮૬૮	૮	૯	૪૪૧
૧૮	૧૩	૭	૪	૪૨૮	૪,૦૦૦	૫૯,૮૨૪	૧૧	૮	૫૮૮
૧૯	૧૪	૩	૪	૦૦૮	૫,૦૦૦	૭૪,૭૮૦	૧૪	૭	૭૩૫
પ.ઉંડ ૧	૧૪	૧૫	૩	૫૮૭	૧૦,૦૦૦	૧,૪૯,૫૬૧	૧૩	૩	૪૭૦
૨	૨૯	૧૪	૭	૧૭૪	૨૦,૦૦૦	૨,૯૯,૧૨૩	૧૦	૬	૯૪૦
૩	૪૪	૧૩	૧૦	૭૬૨	૪૦,૦૦૦	૫૯૮,૨૪૭	૫	૧	૮૮૦

શી ૧-૪ પેન્સ ૦ાા આનો

	પાઇ.	પાઉંડ	શી.	પે	ફાર.	
	૧				૦	૩૩૪
	૨				૦	૬૬૮
	૩				૧	૦૦૩
	૪				૧	૩૩૭
	૫				૧	૬૭૧
	૬				૨	૦૦૬
	૭				૨	૩૪૦
	૮				૨	૬૭૫
	૯				૩	૦૦૯
	૧૦				૩	૩૪૩
	૧૧				૩	૬૭૭
આના	૧			૧	૦	૦૧૨
	૨			૨	૦	૦૨૩
	૩			૩	૦	૦૩૫
	૪			૪	૦	૦૪૭
	૫			૫	૦	૦૫૮
	૬			૬	૦	૦૭૦
	૭			૭	૦	૦૮૨
	૮			૮	૦	૦૯૩
	૯			૯	૦	૧૦૫
	૧૦			૧૦	૦	૧૧૭
	૧૧			૧૧	૦	૧૨૯
	૧૨		૧	૦	૦	૧૪૦
	૧૩		૧	૧	૦	૧૫૨
	૧૪		૧	૨	૦	૧૬૪
	૧૫		૧	૩	૦	૧૭૬
રૂપીઆ	૧		૧	૪	૦	૧૮૭
	૨		૨	૮	૦	૩૭૫
	૩		૪	૦	૦	૫૬૨
	૪		૫	૪	૦	૭૫૦
	૫		૬	૮	૦	૯૩૭
	૬		૮	૦	૧	૧૨૫
	૭		૯	૪	૧	૩૧૨

શી ૧-૪ $\frac{3}{64}$ પેન્સ (૧-૪) ૦ાાા

રૂપીઆ	પાઉંડ	શી	પે.	ફાર.	
૮		૧૦	૮	૧	૫૦૦
૯		૧૨	૦	૧	૬૮૭
૧૦		૧૩	૪	૧	૮૭૫
૨૦	૧	૬	૮	૩	૭૫૦
૩૦	૨	૦	૧	૧	૬૨૫
૪૦	૨	૧૩	૫	૩	૫૦૦
૫૦	૩	૬	૧૦	૧	૩૭૫
૬૦	૪	૦	૨	૩	૨૫૦
૭૦	૪	૧૩	૭	૧	૧૨૫
૮૦	૫	૬	૧૧	૩	
૯૦	૬	૦	૪	૦	૮૭૫
૧૦૦	૬	૧૩	૮	૨	૭૫૦
૨૦૦	૧૩	૭	૫	૧	૫૦૦
૩૦૦	૨૦	૧	૨	૦	૨૫૦
૪૦૦	૨૬	૧૪	૧૦	૩	
૫૦૦	૩૩	૮	૭	૧	૭૫૦
૬૦૦	૪૦	૨	૪	૦	૫૦૦
૭૦૦	૪૬	૧૬	૦	૩	૨૫૦
૮૦૦	૫૩	૯	૯	૨	
૯૦૦	૬૦	૩	૬	૦	૭૫૦
૧,૦૦૦	૬૬	૧૭	૨	૩	૫૦૦
૧,૫૦૦	૧૦૦	૫	૧૦	૧	૨૫૦
૨,૦૦૦	૧૩૩	૧૪	૫	૩	
૩ ૦૦૦	૨૦૦	૧૧	૮	૨	૫૦૦
૪,૦૦૦	૨૬૭	૮	૧૧	૨	
૫,૦૦૦	૩૩૪	૬	૨	૧	૫૦૦
૧૦,૦૦૦	૬૬૮	૧૨	૪	૩	
૨૦,૦૦૦	૧,૩૩૭	૪	૯	૨	
૩૦,૦૦૦	૨,૦૦૫	૧૭	૨	૧	
૪૦,૦૦૦	૨,૬૭૪	૯	૭	૦	
૫૦,૦૦૦	૩,૩૪૩	૧	૧૧	૩	
૧,૦૦,૦૦૦	૬,૬૮૬	૩	૧૧	૨	
૨,૦૦,૦૦૦	૧૩,૩૭૨	૭	૧૧	૦	

(વીલાયતી હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૪ પેન્સ ૧ આનો					શી. ૧-૪ ૧/૧૬ પેન્સ (૧-૪)-)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દોકડા.	પૌંડ	રૂપીઆ.	આ	પ.	દો
૧		૦	૧૧	૯૫૩	૪	૫૯	૧૨	૩	૧૭૬
૨		૧	૧૧	૯૦૭	૫	૭૪	૧૧	૩	૯૭૦
૩		૨	૧૧	૮૬૦	૬	૮૯	૧૦	૪	૭૬૪
૪		૩	૧૧	૮૧૩	૭	૧૦૪	૯	૫	૫૫૭
૫		૪	૧૧	૭૬૬	૮	૧૧૯	૮	૬	૩૫૧
૬		૫	૧૧	૭૧૯	૯	૧૩૪	૭	૭	૧૪૫
૭		૬	૧૧	૬૭૨	૧૦	૧૪૯	૬	૭	૯૩૮
૮		૭	૧૧	૬૨૫	૨૦	૨૯૮	૧૩	૩	૮૭૬
૯		૮	૧૧	૫૮૦	૩૦	૪૪૮	૩	૧૧	૮૧૪
૧૦		૯	૧૧	૫૩૩	૪૦	૫૯૭	૧૦	૭	૭૫૨
૧૧		૧૦	૧૧	૪૮૫	૫૦	૭૪૭	૧	૩	૬૯૦
શીલીંગ ૧		૧૧	૧૧	૪૪૦	૬૦	૮૯૬	૭	૧૧	૬૨૭
૨	૧	૭	૧૦	૮૭૯	૭૦	૧,૦૪૫	૧૪	૭	૫૬૫
૩	૨	૩	૧૦	૩૧૯	૮૦	૧,૧૯૫	૫	૩	૫૦૩
૪	૨	૧૫	૯	૭૫૯	૯૦	૧,૩૪૪	૧૧	૧૧	૪૪૦
૫	૩	૧૧	૯	૧૯૮	૧૦૦	૧,૪૯૪	૨	૭	૩૭૭
૬	૪	૭	૮	૬૩૮	૨૦૦	૨૯,૮૮	૫	૨	૭૫૫
૭	૫	૩	૮	૦૭૮	૩૦૦	૪,૪૮૨	૭	૧૦	૧૩૨
૮	૫	૧૫	૭	૫૧૮	૪૦૦	૫,૯૭૬	૧૦	૫	૫૦૯
૯	૬	૧૧	૬	૯૫૭	૫૦૦	૭,૪૭૦	૧૩	૦	૮૮૭
૧૦	૭	૭	૬	૩૯૭	૬૦૦	૮ ૯૬૪	૧૫	૮	૨૬૫
૧૧	૮	૩	૫	૮૩૬	૭૦૦	૧૦,૪૫૯	૨	૩	૬૩૨
૧૨	૮	૧૫	૫	૨૭૬	૮૦૦	૧૧,૯૫૩	૪	૧૧	૦૧૯
૧૩	૯	૧૧	૪	૭૧૬	૯૦૦	૧૩,૪૪૭	૭	૬	૩૯૭
૧૪	૧૦	૭	૪	૧૫૬	૧,૦૦૦	૧૪,૯૪૧	૧૦	૧	૭૭૪
૧૫	૧૧	૩	૩	૫૯૬	૧,૫૦૦	૨૨.૪૧૨	૭	૨	૬૬૧
૧૬	૧૧	૧૫	૩	૦૩૬	૨,૦૦૦	૨૯,૮૮૩	૪	૩	૫૪૯
૧૭	૧૨	૧૧	૨	૪૭૫	૩,૦૦૦	૪૪,૮૨૪	૧૪	૫	૩૨૩
૧૮	૧૩	૭	૧	૯૧૪	૪,૦૦૦	૫૯,૭૬૬	૮	૭	૦૯૭
૧૯	૧૪	૩	૧	૩૫૪	૫,૦૦૦	૭૪,૭૦૮	૨	૮	૮૭૧
પૌંડ ૧	૧૪	૧૫	૦	૭૯૪	૧૦,૦૦૦	૧,૪૯,૪૧૬	૫	૫	૭૪૨
૨	૨૯	૧૪	૧	૫૮૮	૨૦,૦૦૦	૨,૯૮,૮૩૨	૧૦	૧૧	૪૮૪
૩	૪૪	૧૩	૨	૩૮૨	૪૦,૦૦૦	૫,૯૭,૬૬૫	૫	૧૦	૯૬૮

શી. ૧-૪ પેન્સ ૧ આનો.					શી. ૧-૪ $\frac{1}{16}$ પે. (૧-૪)-)				
પાઈ	પૌંડ	શી.	પે.	ફાર	રૂપીઆ	પૌંડ	શી	પે.	ફાર
૧				૦ ૩૩૪	૮		૧૦	૮	૨
૨				૦ ૬૬૯	૯		૧૨	૦	૨ ૨૫૦
૩				૧ ૦૦૪	૧૦		૧૩	૪	૨ ૫૦૦
૪				૧ ૩૩૮	૨૦	૧	૬	૯	૧
૫				૧ ૬૭૩	૩૦	૨	૦	૧	૩ ૫૦૦
૬				૨ ૦૦૮	૪૦	૨	૧૩	૬	૨
૭				૨ ૩૪૨	૫૦	૩	૬	૧૧	૦ ૫૦૦
૮				૨ ૬૭૭	૬૦	૪	૦	૩	૩
૯				૩ ૦૧૨	૭૦	૪	૧૩	૮	૧ ૫૦૦
૧૦				૩ ૩૪૬	૮૦	૫	૭	૧	૦
૧૧				૩ ૬૮૧	૯૦	૬	૦	૫	૨ ૫૦૦
આના ૧			૧	૦ ૦૧૬	૧૦૦	૬	૧૩	૧૦	૧
૨			૨	૦ ૦૩૧	૨૦૦	૧૩	૭	૮	૨
૩			૩	૦ ૦૪૭	૩૦૦	૨૦	૧	૬	૩
૪			૪	૦ ૦૬૩	૪૦૦	૨૬	૧૫	૫	૦
૫			૫	૦ ૦૭૮	૫૦૦	૩૩	૯	૩	૧
૬			૬	૦ ૦૯૪	૬૦૦	૪૦	૩	૧	૨
૭			૭	૦ ૧૦૯	૭૦૦	૪૬	૧૬	૧૧	૩
૮			૮	૦ ૧૨૫	૮૦૦	૫૩	૧૦	૧૦	૦
૯			૯	૦ ૧૪૧	૯૦૦	૬૦	૪	૮	૧
૧૦			૧૦	૦ ૧૫૬	૧,૦૦૦	૬૬	૧૮	૬	૨
૧૧			૧૧	૦ ૧૭૨	૧,૫૦૦	૧૦૦	૭	૯	૩
૧૨		૧	૦	૦ ૧૮૮	૨,૦૦૦	૧૩૩	૧૭	૧	૦
૧૩		૧	૧	૦ ૨૦૩	૩,૦૦૦	૨૦૦	૧૫	૭	૨
૧૪		૧	૨	૦ ૨૧૯	૪,૦૦૦	૨૬૭	૧૪	૨	૦
૧૫		૧	૩	૦ ૨૩૪	૫,૦૦૦	૩૩૪	૧૨	૮	૨
રૂપીઆ ૧		૧	૪	૦ ૨૫૦	૧૦,૦૦૦	૬૬૯	૫	૫	૦
૨		૨	૮	૦ ૫૦૦	૨૦,૦૦૦	૧,૩૩૮	૧૦	૧૦	૦
૩		૪	૦	૦ ૭૫૦	૩૦,૦૦૦	૨.૦૦૭	૧૬	૩	૦
૪		૫	૪	૧	૪૦,૦૦૦	૨,૬૭૭	૧	૮	૦
૫		૬	૮	૧ ૨૫૦	૫૦,૦૦૦	૩,૩૪૬	૭	૧	૦
૬		૮	૦	૧ ૫૦૦	૧,૦૦,૦૦૦	૬,૬૯૨	૧૪	૨	૦
૭		૯	૪	૧ ૭૫૦	૨,૦૦,૦૦૦	૧૩.૩૮૫	૮	૪	૦

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી ૧-૪ પેન્સ ૧૧ આનો.					શા. ૧—૪$\frac{૫}{૬૪}$ પેન્સ(૧-૪j-૧)				
પેન્સ	રૂપીઆ	આ.	પા	દો	પાઊંડ	રૂપીઆ	આ.	પા	દો.
૧			૧૧	૯૪૨	૪	૫૯	૧૧	૪	૦૨૩
૨		૧	૧૧	૮૮૩	૫	૭૪	૧૦	૨	૦૨૯
૩		૨	૧૧	૮૨૫	૬	૮૯	૯	૦	૦૩૫
૪		૩	૧૧	૭૬૭	૭	૧૦૪	૭	૧૦	૦૪૧
૫		૪	૧૧	૭૦૯	૮	૧૧૯	૬	૮	૦૪૭
૬		૫	૧૧	૬૫૦	૯	૧૩૪	૫	૬	૦૫૨
૭		૬	૧૧	૫૯૨	૧૦	૧૪૯	૪	૪	૦૫૮
૮		૭	૧૧	૫૩૪	૨૦	૨૯૮	૮	૮	૧૧૭
૯		૮	૧૧	૪૭૫	૩૦	૪૪૭	૧૩	૦	૧૭૫
૧૦		૯	૧૧	૪૧૭	૪૦	૫૯૭	૧	૪	૨૩૩
૧૧		૧૦	૧૧	૩૫૯	૫૦	૭૪૬	૫	૮	૨૯૨
શીલીંગ ૧		૧૧	૧૧	૩૦૦	૬૦	૮૯૫	૧૦	૦	૩૫૦
૨	૧	૭	૧૦	૬૦૧	૭૦	૧,૦૪૪	૧૪	૪	૪૦૮
૩	૨	૩	૯	૯૦૧	૮૦	૧,૧૯૪	૨	૮	૪૬૬
૪	૨	૧૫	૯	૨૦૧	૯૦	૧,૩૪૩	૭	૦	૫૨૫
૫	૩	૧૧	૮	૫૦૧	૧૦૦	૧ ૪૯૨	૧૧	૪	૫૮૩
૬	૪	૭	૭	૮૦૨	૨૦૦	૨ ૯૮૫	૬	૯	૧૬૬
૭	૫	૩	૭	૧૦૨	૩૦૦	૪,૪૭૮	૨	૧	૭૪૯
૮	૫	૧૫	૬	૪૦૨	૪૦૦	૫,૯૭૦	૧૩	૬	૩૩૨
૯	૬	૧૧	૫	૭૦૩	૫૦૦	૭,૪૬૩	૮	૧૦	૯૧૫
૧૦	૭	૭	૫	૦૦૩	૬૦૦	૮.૯૫૬	૪	૩	૪૯૯
૧૧	૮	૩	૪	૩૦૩	૭૦૦	૧૦,૪૪૮	૧૫	૮	૦૮૨
૧૨	૮	૧૫	૩	૬૦૩	૮૦૦	૧૧,૯૪૧	૧૧	૦	૬૬૫
૧૩	૯	૧૧	૨	૯૦૪	૯૦૦	૧૩,૪૩૪	૬	૫	૨૪૮
૧૪	૧૦	૭	૨	૨૦૪	૧,૦૦૦	૧૪ ૯૨૭	૧	૯	૮૩૧
૧૫	૧૧	૩	૧	૫૦૪	૧,૫૦૦	૨૨,૩૯૦	૧૦	૮	૭૪૬
૧૬	૧૧	૧૫	૦	૮૦૫	૨,૦૦૦	૨૯,૮૫૪	૩	૭	૬૬૧
૧૭	૧૨	૧૧	૦	૧૦૫	૩,૦૦૦	૪૪,૭૮૧	૫	૫	૪૯૨
૧૮	૧૩	૬	૧૧	૪૦૫	૪,૦૦૦	૫૯,૭૦૮	૭	૩	૩૨૩
૧૯	૧૪	૨	૧૦	૭૦૬	૫,૦૦૦	૭૪,૬૩૫	૯	૧	૧૫૪
પાઊંડ ૧	[illegible]	૧૪	૧૦	૦૦૬	૧૦,૦૦૦	૧,૪૯,૨૭૧	૨	૨	૩૦૯
૨	૨૯	૧૩	૮	૦૧૨	૨૦,૦૦૦	૨,૯૮,૫૪૨	૪	૪	૬૧૮
૩	૪૪	૧૧	૬	૦૧૭	૪૦,૦૦૦	૫,૯૭,૦૮૪	૮	૯	૨૩૬

શી. ૧-૪ પેન્સ ૧૧ આનો					શી. ૧-૪ ૫/૬૪ પેન્સ (૧-૪)-૧)				
પાઈ.	પાઊંડ	શી.	પે	ફાર	રૂપીઆ	પાઊંડ	શી	પે	ફાર.
૧				૦૩૩૫	૮		૧૦	૮	૨ ૫૦૦
૨				૦૬૭૦	૯		૧૨	૦	૨ ૮૧૨
૩				૧૦૦૫	૧૦		૧૩	૪	૩ ૧૨૫
૪				૧૩૪૦	૨૦	૧	૬	૯	૨ ૨૫૦
૫				૧૬૭૫	૩૦	૨	૦	૨	૧ ૩૭૫
૬				૨૦૧૦	૪૦	૨	૧૩	૭	૦ ૫૦૦
૭				૨૩૪૫	૫૦	૩	૬	૧૧	૩ ૬૨૫
૮				૨૬૮૦	૬૦	૪	૦	૪	૨ ૭૫૦
૯				૩૦૧૫	૭૦	૪	૧૩	૯	૧ ૮૭૫
૧૦				૩૩૫૦	૮૦	૫	૭	૨	૧
૧૧				૩૬૮૫	૯૦	૬	૦	૭	૦ ૧૨૫
આના ૧			૧	૦૧૯	૧૦૦	૬	૧૩	૧૧	૩ ૨૫૦
૨			૨	૦૩૯	૨૦૦	૧૩	૭	૧૧	૨ ૫૦૦
૩			૩	૦૫૮	૩૦૦	૨૦	૧	૧૧	૧ ૭૫૦
૪			૪	૦૭૮	૪૦૦	૨૬	૧૫	૧૧	૧
૫			૫	૦૯૭	૫૦૦	૩૩	૯	૧૧	૦ ૨૫૦
૬			૬	૦૧૧૭	૬૦૦	૪૦	૩	૧૦	૩ ૫૦૦
૭			૭	૦૧૩૬	૭૦૦	૪૬	૧૭	૧૦	૨ ૭૫૦
૮			૮	૦૧૫૬	૮૦૦	૫૩	૧૧	૧૦	૨
૯			૯	૦૧૭૫	૯૦૦	૬૦	૫	૧૦	૧ ૨૫૦
૧૦			૧૦	૦૧૯૫	૧,૦૦૦	૬૬	૧૯	૧૦	૦ ૫૦૦
૧૧			૧૧	૦૨૧૪	૧,૫૦૦	૧૦૦	૯	૯	૦ ૭૫૦
૧૨			૧૨	૦૨૩૪	૨,૦૦૦	૧૩૩	૧૯	૮	૧
૧૩			૧૩	૦૨૫૩	૩,૦૦૦	૨૦૦	૧૯	૬	૧ ૫૦૦
૧૪			૧૪	૦૨૭૨	૪,૦૦૦	૨૬૭	૧૯	૪	૨
૧૫			૧૫	૦૨૯૨	૫,૦૦૦	૩૩૪	૧૯	૨	૨ ૫૦૦
રૂપીઆ ૧		૧	૪	૦૩૧૨	૧૦,૦૦૦	૬૬૯	૧૮	૫	૧
૨		૨	૮	૦૬૨૫	૨૦,૦૦૦	૧,૩૩૯	૧૬	૧૦	૨
૩		૪	૦	૯૩૭	૩૦,૦૦૦	૨,૦૦૯	૧૫	૩	૩
૪		૫	૪	૧૨૫૦	૪૦,૦૦૦	૨,૬૭૯	૧૩	૯	
૫		૬	૮	૧૫૬૨	૫૦,૦૦૦	૩,૩૪૯	૧૨	૨	૧
૬		૮	૦	૧૮૭૫	૧,૦૦,૦૦૦	૬,૬૯૯	૪	૪	૨
૭		૯	૪	૨૧૮૭	૨,૦૦,૦૦૦	૧૩,૩૯૮	૮	૯	

(વીલાયતની હુંડી.) પૌંડના રૂપીઆ

થી ૧-૪ પેન્સ ૧।। આનો					શી. ૧-૪ $\frac{૩}{૩૨}$ પેન્સ (૧-૪) –।।)				
પેન્સ.	રૂપીઆ	આ	પા.	દો.	પૌંડ.	રૂપીઆ.	આ	પા.	દો.
૧		૦	૧૧	૯૩૦	૪	૫૯	૧૦	૪	૮૯૩
૨		૧	૧૧	૮૬૦	૫	૭૪	૯	૦	૧૧૭
૩		૨	૧૧	૭૯૦	૬	૮૯	૭	૭	૩૪૦
૪		૩	૧૧	૭૨૦	૭	૧૦૪	૬	૨	૫૬૩
૫		૪	૧૧	૬૫૦	૮	૧૧૯	૪	૯	૭૮૬
૬		૫	૧૧	૫૮૧	૯	૧૩૪	૩	૫	૦૧૦
૭		૬	૧૧	૫૧૧	૧૦	૧૪૯	૨	૦	૨૩૩
૮		૭	૧૧	૪૪૧	૨૦	૨૯૮	૪	૦	૪૬૬
૯		૮	૧૧	૩૭૧	૩૦	૪૪૭	૬	૦	૬૯૯
૧૦		૯	૧૧	૩૦૧	૪૦	૫૯૬	૮	૦	૯૩૨
૧૧		૧૦	૧૧	૨૩૧	૫૦	૭૪૫	૧૦	૧	૧૬૫
શીલીંગ ૧		૧૧	૧૧	૧૬૧	૬૦	૮૯૪	૧૨	૧	૩૯૮
૨	૧	૭	૧૦	૩૨૨	૭૦	૧,૦૪૩	૧૪	૧	૬૩૧
૩	૨	૩	૯	૪૮૩	૮૦	૧.૧૯૩	૦	૧	૮૬૪
૪	૨	૧૫	૮	૬૪૫	૯૦	૧,૩૪૨	૨	૨	૦૯૭
૫	૩	૧૧	૭	૮૦૬	૧૦૦	૧,૪૯૧	૪	૨	૩૩૦
૬	૪	૭	૬	૯૬૭	૨૦૦	૨.૯૮૨	૮	૪	૬૬૦
૭	૫	૩	૬	૧૨૮	૩૦૦	૪,૪૭૩	૧૨	૬	૯૯૦
૮	૫	૧૫	૫	૨૮૯	૪૦૦	૫,૯૬૫	૦	૯	૩૨૦
૯	૬	૧૧	૪	૪૫૦	૫૦૦	૭,૪૫૬	૪	૧૧	૬૫૦
૧૦	૭	૭	૩	૬૧૨	૬૦૦	૮,૯૪૭	૯	૧	૯૮૧
૧૧	૮	૩	૨	૭૭૩	૭૦૦	૧૦,૪૩૮	૧૩	૪	૩૧૧
૧૨	૮	૧૫	૧	૯૩૪	૮૦૦	૧૧,૯૩૦	૧	૬	૬૪૧
૧૩	૯	૧૧	૧	૦૯૫	૯૦૦	૧૩,૪૨૧	૫	૮	૯૭૧
૧૪	૧૦	૭	૦	૨૫૬	૧,૦૦૦	૧૪,૯૧૨	૯	૧૧	૩૦૧
૧૫	૧૧	૨	૧૧	૪૧૭	૧,૫૦૦	૨૨,૩૬૮	૧૪	૧૦	૯૫૨
૧૬	૧૧	૧૪	૧૦	૫૭૯	૨,૦૦૦	૨૯,૮૨૫	૩	૧૦	૬૦૨
૧૭	૧૨	૧૦	૯	૭૪૦	૩,૦૦૦	૪૪,૭૩૭	૧૩	૯	૯૦૩
૧૮	૧૩	૬	૮	૯૦૧	૪,૦૦૦	૫૯,૬૫૦	૭	૯	૨૦૪
૧૯	૧૪	૨	૮	૦૬૨	૫,૦૦૦	૭૪,૫૬૩	૧	૮	૫૦૫
પૌંડ ૧	૧૪	૧૪	૭	૨૨૩	૧૦,૦૦૦	૧,૪૯,૧૨૬	૩	૫	૦૧૦
૨	૨૯	૧૩	૨	૪૪૭	૨૦,૦૦૦	૨,૯૮,૨૫૨	૬	૧૦	૦૧૯
૩	૪૪	૧૧	૯	૬૭૦	૪૦,૦૦૦	૫,૯૬,૫૦૪	૧૩	૮	૦૩૮

શી. ૧-૪ પેન્સ ૧॥ આનો						શી. ૧-૪ ૩/૩૨ પેન્સ (૧-૪]-॥)					
પાઇ	પાઊંડ	શી	પે	ફાર		રૂપીઆ	પાઊંડ.	શી.	પે.	ફાર.	
૧				૦	૩૩૫	૮		૧૦	૮	૩	
૨				૦	૬૭૦	૯		૧૨	૦	૩	૩૭૫
૩				૧	૦૦૬	૧૦		૧૩	૪	૩	૭૫૦
૪				૧	૩૪૧	૨૦	૧	૬	૯	૩	૫૦૦
૫				૧	૬૭૬	૩૦	૨	૦	૨	૩	૨૫૦
૬				૨	૦૧૨	૪૦	૨	૧૩	૭	૩	
૭				૨	૩૪૭	૫૦	૩	૭	૦	૨	૭૫૦
૮				૨	૬૮૨	૬૦	૪	૦	૫	૨	૫૦૦
૯				૩	૦૧૮	૭૦	૪	૧૩	૧૦	૨	૨૫૦
૧૦				૩	૩૫૩	૮૦	૫	૭	૩	૨	
૧૧				૩	૬૮૮	૯૦	૬	૦	૮	૧	૭૫૦
આના ૧			૧	૦	૦૨૩	૧૦૦	૬	૧૪	૧	૧	૫૦૦
૨			૨	૦	૦૪૭	૨૦૦	૧૩	૮	૨	૩	
૩			૩	૦	·૭૦	૩૦૦	૨૦	૨	૪	૦	૫૦૦
૪			૪	૦	૦૯૪	૪૦૦	૨૬	૧૬	૫	૨	
૫			૫	૦	૧૧૭	૫૦૦	૩૩	૧૦	૬	૩	૫૦૦
૬			૬	૦	૧૪૧	૬૦૦	૪૦	૪	૮	૧	
૭			૭	૦	૧૬૪	૭૦૦	૪૬	૧૮	૯	૨	૫૦૦
૮			૮	૦	૧૮૭	૮૦૦	૫૩	૧૨	૧૧		
૯			૯	૦	૨૧૧	૯૦૦	૬૦	૭	૦	૧	૫૦૦
૧૦			૧૦	૦	૨૩૪	૧,૦૦૦	૬૭	૧	૧	૩	
૧૧			૧૧	૦	૨૫૮	૧,૫૦૦	૧૦૦	૧૧	૮	૨	
૧૨		૧	૦	૦	૨૮૧	૨,૦૦૦	૧૩૪	૨	૩	૨	
૧૩		૧	૧	૦	૩૦૫	૩,૦૦૦	૨૦૧	૩	૫	૧	
૧૪		૧	૨	૦	૩૨૮	૪,૦૦૦	૨૬૮	૪	૭		
૧૫		૧	૩	૦	૩૫૨	૫,૦૦૦	૩૩૫	૫	૮	૩	
રૂપીઆ ૧		૧	૪	૦	૩૭૫	૧૦,૦૦૦	૬૭૦	૧૧	૫	૨	
૨		૨	૮	૦	૭૫૦	૨૦,૦૦૦	૧.૩૪૧	૨	૧૧		
૩		૪	૦	૧	૧૨૫	૩૦,૦૦૦	૨,૦૧૧	૧૪	૪	૨	
૪		૫	૪	૧	૫૦૦	૪૦,૦૦૦	૨,૬૮૨	૫	૧૦		
૫		૬	૮	૧	૮૭૫	૫૦,૦૦૦	૩,૩૫૨	૧૭	૩	૨	
૬		૮	૦	૨	૨૫૦	૧,૦૦,૦૦૦	૬,૭૦૫	૧૪	૭		
૭		૯	૪	૨	૬૨૫	૨,૦૦,૦૦૦	૧૩,૪૧૧	૯	૨		

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૪ પેન્સ ૧।।। આના					શી. ૧-૪ $\frac{૭}{૧૬}$ પેન્સ (૧-૪-।।।)				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો	પૌંડ	રૂપીઆ	આ	પા.	દો.
૧		૦	૧૧	૯૧૯	૪	૫૯	૯	૫	૭૮૫
૨		૧	૧૧	૮૩૭	૫	૭૪	૭	૧૦	૨૩૧
૩		૨	૧૧	૭૫૬	૬	૮૯	૬	૨	૬૭૭
૪		૩	૧૧	૬૭૪	૭	૧૦૪	૪	૭	૧૨૩
૫		૪	૧૧	૫૯૩	૮	૧૧૯	૨	૧૧	૫૬૯
૬		૫	૧૧	૫૧૧	૯	૧૩૪	૧	૪	૦૧૬
૭		૬	૧૧	૪૩૦	૧૦	૧૪૮	૧૫	૮	૪૬૨
૮		૭	૧૧	૩૪૮	૨૦	૨૯૭	૧૫	૪	૯૨૩
૯		૮	૧૧	૨૬૭	૩૦	૪૪૬	૧૫	૧	૩૮૫
૧૦		૯	૧૧	૧૮૫	૪૦	૫૯૫	૧૪	૯	૮૪૭
૧૧		૧૦	૧૧	૧૦૪	૫૦	૭૪૪	૧૪	૬	૩૦૮
શીલીંગ ૧		૧૧	૧૧	૦૨૨	૬૦	૮૯૩	૧૪	૨	૭૭૦
૨	૧	૭	૧૦	૦૪૫	૭૦	૧,૦૪૨	૧૩	૧૧	૨૩૨
૩	૨	૩	૯	૦૬૭	૮૦	૧,૧૯૧	૧૩	૭	૬૯૪
૪	૨	૧૫	૮	૦૮૯	૯૦	૧,૩૪૦	૧૩	૪	૧૫૫
૫	૩	૧૧	૭	૧૧૨	૧૦૦	૧,૪૮૯	૧૩	૦	૬૧૭
૬	૪	૭	૬	૧૩૪	૨૦૦	૨,૯૭૯	૧૦	૧	૨૩૪
૭	૫	૩	૫	૧૫૬	૩૦૦	૪,૪૬૯	૭	૧	૮૫૧
૮	૫	૧૫	૪	૧૭૮	૪૦૦	૫,૯૫૯	૪	૨	૪૬૮
૯	૬	૧૧	૩	૨૦૧	૫૦૦	૭,૪૪૯	૧	૩	૦૮૪
૧૦	૭	૭	૨	૨૨૩	૬૦૦	૮,૯૩૮	૧૪	૩	૭૦૧
૧૧	૮	૩	૧	૨૪૫	૭૦૦	૧૦,૪૨૮	૧૧	૪	૩૧૮
૧૨	૮	૧૫	૦	૨૬૮	૮૦૦	૧૧,૯૧૮	૮	૪	૯૩૫
૧૩	૯	૧૦	૧૧	૨૯૦	૯૦૦	૧૩,૪૦૮	૫	૫	૫૫૨
૧૪	૧૦	૬	૧૦	૩૧૨	૧,૦૦૦	૧૪,૮૯૮	૧	૬	૧૬૯
૧૫	૧૧	૨	૯	૩૩૫	૧,૫૦૦	૨૨,૩૪૭	૭	૯	૨૫૩
૧૬	૧૧	૧૪	૮	૩૫૭	૨,૦૦૦	૨૯,૭૯૬	૫	૦	૩૩૮
૧૭	૧૨	૧૦	૭	૩૭૯	૩,૦૦૦	૪૪,૬૯૪	૭	૬	૫૦૬
૧૮	૧૩	૬	૬	૪૦૧	૪,૦૦૦	૫૯,૫૯૨	૧૦	૦	૬૭૫
૧૯	૧૪	૨	૫	૪૨૪	૫,૦૦૦	૭૪,૪૯૦	૧૨	૬	૮૪૪
પૌંડ ૧	૧૪	૧૪	૪	૪૪૬	૧૦,૦૦૦	૧,૪૮,૯૮૧	૯	૧	૬૮૮
૨	૨૯	૧૨	૮	૮૯૨	૨૦,૦૦૦	૨,૯૭,૯૬૩	૨	૩	૩૭૬
૩	૪૪	૧૧	૧	૩૩૯	૪૦,૦૦૦	૫,૯૫,૯૨૬	૪	૬	૭૫૨

શી. ૧-૪ પેન્સ ૧॥। આના						શી. ૧-૪ $\frac{૭}{૬૪}$ પેન્સ (૧-૪)-॥।					
પાઇ	પૌંડ	શી	પે	ફાર		રૂપીઆ.	પૌંડ	શી.	પે	ફાર	
૧				૦	૩૩૫	૮		૧૦	૮	૩	૫૦૦
૨				૦	૬૭૧	૯		૧૨	૦	૩	૯૩૭
૩				૧	૦૦૭	૧૦		૧૩	૫	૦	૩૭૫
૪				૧	૩૪૨	૨૦	૧	૬	૧૦	૦	૭૫૦
૫				૧	૬૭૮	૩૦	૨	૦	૩	૧	૧૨૫
૬				૨	૦૧૪	૪૦	૨	૧૩	૮	૧	૫૦૦
૭				૨	૩૪૯	૫૦	૩	૭	૧	૧	૮૭૫
૮				૨	૬૮૫	૬૦	૪	૦	૬	૨	૨૫૦
૯				૩	૦૨૦	૭૦	૪	૧૩	૧૧	૨	૬૨૫
૧૦				૩	૩૫૬	૮૦	૫	૭	૪	૩	
૧૧				૩	૬૯૨	૯૦	૬	૦	૯	૩	૩૭૫
આના ૧			૧	૦	૦૨૭	૧૦૦	૬	૧૪	૨	૩	૭૫૦
૨			૨	૦	૦૫૪	૨૦૦	૧૩	૮	૫	૩	૫૦૦
૩			૩	૦	૦૮૧	૩૦૦	૨૦	૨	૮	૩	૨૫૦
૪			૪	૦	૧૦૯	૪૦૦	૨૬	૧૬	૧૧	૩	
૫			૫	૦	૧૩૬	૫૦૦	૩૩	૧૧	૨	૨	૭૫૦
૬			૬	૦	૧૬૪	૬૦૦	૪૦	૫	૫	૨	૫૦૦
૭			૭	૦	૧૯૧	૭૦૦	૪૬	૧૯	૮	૨	૨૫૦
૮			૮	૦	૨૧૮	૮૦૦	૫૩	૧૩	૧૧	૨	
૯			૯	૦	૨૪૬	૯૦૦	૬૦	૮	૨	૧	૭૫૦
૧૦			૧૦	૦	૨૭૩	૧,૦૦૦	૬૭	૨	૫	૧	૫૦૦
૧૧			૧૧	૦	૩૦૦	૧,૫૦૦	૧૦૦	૧૩	૮	૦	૨૫૦
૧૨		૧	૦	૦	૩૨૮	૨,૦૦૦	૧૩૪	૪	૧૦	૩	૨૫૦
૧૩		૧	૧	૦	૩૫૫	૩,૦૦૦	૨૦૧	૭	૪	૦	૫૦૦
૧૪		૧	૨	૦	૩૮૨	૪,૦૦૦	૨૬૮	૯	૯	૨	
૧૫		૧	૩	૦	૪૦૯	૫,૦૦૦	૩૩૫	૧૨	૨	૩	૫૦૦
રૂપીઆ ૧		૧	૪	૦	૪૩૭	૧૦,૦૦૦	૬૭૧	૪	૫	૩	
૨		૨	૮	૦	૮૭૫	૨૦,૦૦૦	૧,૩૪૨	૮	૧૧	૨	
૩		૪	૦	૧	૩૧૨	૩૦,૦૦૦	૨,૦૧૩	૧૩	૫	૧	
૪		૫	૪	૧	૭૫૦	૪૦.૦૦૦	૨,૬૮૪	૧૭	૧૧	૦	
૫		૬	૮	૨	૧૮૭	૫૦,૦૦૦	૩,૩૫૬	૨	૪	૩	
૬		૮	૦	૨	૬૨૫	૧,૦૦,૦૦૦	૬,૭૧૨	૪	૯	૨	
૭		૯	૪	૩	૦૬૨	૨,૦૦,૦૦૦	૧૩,૪૨૪	૯	૭		

(વીલાયતી હુંડી) પૌંડના રૂપીઆ

શી ૧-૪ પેન્સ ૨ આના

પેન્સ	રૂપીઆ	આ	પા.	દો.
૧			૧૧	૯૦૭
૨		૧	૧૧	૮૧૪
૩		૨	૧૧	૭૨૧
૪		૩	૧૧	૬૨૮
૫		૪	૧૧	૫૩૫
૬		૫	૧૧	૪૪૨
૭		૬	૧૧	૩૪૯
૮		૭	૧૧	૨૫૬
૯		૮	૧૧	૧૬૩
૧૦		૯	૧૧	૦૭૦
૧૧		૧૦	૧૦	૯૭૭
શીલીંગ ૧		૧૧	૧૦	૮૮૪
૨	૧	૭	૯	૭૬૭
૩	૨	૩	૮	૬૫૧
૪	૨	૧૫	૭	૫૩૫
૫	૩	૧૧	૬	૪૧૯
૬	૪	૭	૫	૩૦૨
૭	૫	૩	૪	૧૮૬
૮	૫	૧૫	૩	૦૭૦
૯	૬	૧૧	૧	૯૫૪
૧૦	૭	૭	૦	૮૩૭
૧૧	૮	૨	૧૧	૭૨૧
૧૨	૮	૧૪	૧૦	૬૦૫
૧૩	૯	૧૦	૯	૪૮૮
૧૪	૧૦	૬	૮	૩૭૨
૧૫	૧૧	૨	૭	૨૫૬
૧૬	૧૧	૧૪	૬	૧૪૦
૧૭	૧૨	૧૦	૫	૦૨૩
૧૮	૧૩	૬	૩	૯૦૭
૧૯	૧૪	૨	૨	૭૯૧
પૌંડ ૧	૧૪	૧૪	૧	૬૭૪
૨	૨૯	૧૨	૩	૩૪૯
૩	૪૪	૧૦	૫	૦૨૩

શી ૧-૪ ½ પેન્સ(૧-૪)ર)

પાઊંડ	રૂપીઆ	આ	પા	દો.
૪	૫૯	૮	૬	૬૯૮
૫	૭૪	૬	૮	૩૭૨
૬	૮૯	૪	૧૦	૦૪૭
૭	૧૦૪	૨	૧૧	૭૨૧
૮	૧૧૯	૧	૧	૩૯૫
૯	૧૩૩	૧૫	૩	૦૭૦
૧૦	૧૪૮	૧૩	૪	૭૪૪
૨૦	૨૯૭	૧૦	૯	૪૮૮
૩૦	૪૪૬	૮	૨	૨૩૩
૪૦	૫૯૫	૫	૬	૯૭૭
૫૦	૭૪૪	૨	૧૧	૭૨૧
૬૦	૮૯૩	૦	૪	૪૬૫
૭૦	૧,૦૪૧	૧૩	૯	૨૦૯
૮૦	૧,૧૯૦	૧૧	૧	૯૫૩
૯૦	૧,૩૩૯	૮	૬	૬૯૮
૧૦૦	૧,૪૮૮	૫	૧૧	૪૪૨
૨૦૦	૨,૯૭૬	૧૧	૧૦	૮૮૪
૩૦૦	૪,૪૬૫	૧	૧૦	૩૨૬
૪૦૦	૫,૯૫૩	૭	૯	૭૬૭
૫૦૦	૭,૪૪૧	૧૩	૯	૨૦૯
૬૦૦	૮,૯૩૦	૩	૮	૬૫૧
૭૦૦	૧૦,૪૧૮	૯	૮	૦૯૩
૮૦૦	૧૧,૯૦૬	૧૫	૭	૫૩૫
૯૦૦	૧૩,૩૯૫	૫	૬	૯૭૭
૧,૦૦૦	૧૪,૮૮૩	૧૧	૬	૪૧૯
૧,૫૦૦	૨૨,૩૨૫	૯	૩	૬૨૮
૨ ૦૦૦	૨,૯૭૬૭	૭	૦	૮૩૭
૩,૦૦૦	૪૪,૬૫૧	૨	૭	૨૫૬
૪,૦૦૦	૫૯,૫૩૪	૧૪	૧	૬૭૪
૫,૦૦૦	૭૪,૪૧૮	૯	૮	૦૯૩
૧૦,૦૦૦	૧,૪૮,૮૩૭	૩	૪	૧૮૬
૨૦,૦૦૦	૨,૯૭,૬૭૪	૬	૮	૩૭૨
૪૦,૦૦૦	૫,૯૫,૩૪૮	૧૩	૪	૭૪૪

રૂપીઆના પૌંડ

શી. ૧–૪ પેન્સ ૨ આના

પાઈ.	પૌંડ	શી	પે	ફાર.	
૧				૦	૩૩૬
૨				૦	૬૭૨
૩				૧	૦૦૮
૪				૧	૩૪૪
૫				૧	૬૮૦
૬				૨	૦૧૬
૭				૨	૩૫૨
૮				૨	૬૮૮
૯				૩	૦૨૩
૧૦				૩	૩૫૯
૧૧				૩	૬૯૫
આના. ૧			૧	૦	૦૩૧
૨			૨	૦	૦૬૩
૩			૩	૦	૦૯૪
૪			૪	૦	૧૨૫
૫			૫	૦	૧૫૬
૬			૬	૦	૧૮૮
૭			૭	૦	૨૧૯
૮			૮	૦	૨૫૦
૯			૯	૦	૨૮૧
૧૦			૧૦	૦	૩૧૩
૧૧			૧૧	૦	૩૪૪
૧૨		૧	૦	૦	૩૭૫
૧૩		૧	૧	૦	૪૦૬
૧૪		૧	૨	૦	૪૩૮
૧૫		૧	૩	૦	૪૬૯
રૂપીઆ ૧		૧	૪	૦	૫૦૦
૨		૨	૮	૧	
૩		૪	૦	૧	૫૦૦
૪		૫	૪	૨	
૫		૬	૮	૨	૫૦૦
૬		૮	૦	૩	
૭		૯	૪	૩	૫૦૦

શી. ૧–૪ ૧/૮ પેન્સ (૧–૪)૨)

રૂપીઆ.	પૌંડ.	શી.	પે	ફાર.	
૮		૧૦	૯	૦	
૯		૧૨	૧	૦	૫૦૦
૧૦		૧૩	૫	૧	
૨૦	૧	૬	૧૦	૨	
૩૦	૨	૦	૩	૩	
૪૦	૨	૧૩	૯	૦	
૫૦	૩	૭	૨	૧	
૬૦	૪	૦	૭	૨	
૭૦	૪	૧૪	૦	૩	
૮૦	૫	૭	૬	૦	
૯૦	૬	૦	૧૧	૧	
૧૦૦	૬	૧૪	૪	૨	
૨૦૦	૧૩	૮	૯	૦	
૩૦૦	૨૦	૩	૧	૨	
૪૦૦	૨૬	૧૭	૬	૦	
૫૦૦	૩૩	૧૧	૧૦	૨	
૬૦૦	૪૦	૬	૩	૦	
૭૦૦	૪૭	૦	૭	૨	
૮૦૦	૫૩	૧૫	૦	૦	
૯૦૦	૬૦	૯	૪	૨	
૧,૦૦૦	૬૭	૩	૯	૦	
૧,૫૦૦	૧૦૦	૧૫	૭	૨	
૨,૦૦૦	૧૩૪	૭	૬	૦	
૩,૦૦૦	૨૦૧	૧૧	૩	૦	
૪,૦૦૦	૨૬૮	૧૫	૦	૦	
૫,૦૦૦	૩૩૫	૧૮	૯	૦	
૧૦,૦૦૦	૬૭૧	૧૭	૬	૦	
૨૦,૦૦૦	૧,૩૪૩	૧૫	૦	૦	
૩૦,૦૦૦	૨,૦૧૫	૧૨	૬	૦	
૪૦,૦૦૦	૨,૬૮૭	૧૦	૦	૦	
૫૦,૦૦૦	૩,૩૫૯	૭	૬	૦	
૧,૦૦,૦૦૦	૬,૭૧૮	૧૫	૦	૦	
૨,૦૦,૦૦૦	૧૩,૪૩૭	૧૦	૦	૦	

પૌંડના રૂપીઆ

શી. ૧-૪ પેન્સ ૨૧ આના					શી. ૧-૪ ૧૫/૧૬ પેન્સ (૧-૪) આ)				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો.	પૌંડ	રૂપીઆ	આ	પા.	દો.
૧			૧૧	૮૯૫	૪	૫૯	૭	૭	૬૩૨
૨		૧	૧૧	૭૯૧	૫	૭૪	૫	૬	૫૪૦
૩		૨	૧૧	૬૮૬	૬	૮૯	૩	૫	૪૪૮
૪		૩	૧૧	૫૮૨	૭	૧૦૪	૧	૪	૩૫૬
૫		૪	૧૧	૪૭૭	૮	૧૧૮	૧૫	૩	૨૬૪
૬		૫	૧૧	૩૭૩	૯	૧૩૩	૧૩	૨	૧૭૨
૭		૬	૧૧	૨૬૮	૧૦	૧૪૮	૧૧	૧	૦૮૦
૮		૭	૧૧	૧૬૪	૨૦	૨૯૭	૬	૨	૧૬૧
૯		૮	૧૧	૦૫૯	૩૦	૪૪૬	૧	૩	૨૪૧
૧૦		૯	૧૦	૯૫૫	૪૦	૫૯૪	૧૨	૪	૩૨૧
૧૧		૧૦	૧૦	૮૫૦	૫૦	૭૪૩	૭	૫	૪૦૨
શીલીંગ ૧		૧૧	૧૦	૭૪૬	૬૦	૮૯૨	૨	૬	૪૮૨
૨	૧	૭	૯	૪૯૧	૭૦	૧,૦૪૦	૧૩	૭	૫૬૨
૩	૨	૩	૮	૨૩૬	૮૦	૧,૧૮૯	૮	૮	૬૪૩
૪	૨	૧૫	૬	૯૮૨	૯૦	૧,૩૩૮	૩	૯	૭૨૩
૫	૩	૧૧	૫	૭૨૭	૧૦૦	૧,૪૮૬	૧૪	૧૦	૮૦૩
૬	૪	૭	૪	૪૭૩	૨૦૦	૨,૯૭૩	૧૩	૯	૬૦૭
૭	૫	૩	૩	૨૧૮	૩૦૦	૪,૪૬૦	૧૨	૮	૪૧૦
૮	૫	૧૫	૧	૯૬૩	૪૦૦	૫,૯૪૭	૧૧	૭	૨૧૪
૯	૬	૧૧	૦	૭૦૯	૫૦૦	૭,૪૩૪	૧૦	૬	૦૧૭
૧૦	૭	૬	૧૧	૪૫૪	૬૦૦	૮,૯૨૧	૯	૪	૮૨૧
૧૧	૮	૨	૧૦	૧૯૯	૭૦૦	૧૦,૪૦૮	૮	૩	૬૨૪
૧૨	૮	૧૪	૮	૯૪૫	૮૦૦	૧૧ ૮૯૫	૭	૨	૪૨૮
૧૩	૯	૧૦	૭	૬૯૦	૯૦૦	૧૩,૩૮૨	૬	૧	૨૩૧
૧૪	૧૦	૬	૬	૪૩૬	૧,૦૦૦	૧૪,૮૬૯	૫	૦	૦૩૫
૧૫	૧૧	૨	૫	૧૮૧	૧,૫૦૦	૨૨,૩૦૩	૧૫	૬	૦૫૨
૧૬	૧૧	૧૪	૩	૯૨૬	૨,૦૦૦	૨૯,૭૩૮	૧૦	૦	૦૭૦
૧૭	૧૨	૧૦	૨	૬૭૨	૩,૦૦૦	૪૪,૬૦૭	૧૫	૦	૧૦૫
૧૮	૧૩	૬	૧	૪૧૭	૪,૦૦૦	૫૯,૪૭૭	૪	૦	૧૩૯
૧૯	૧૪	૨	૦	૧૬૩	૫,૦૦૦	૭૪,૩૪૬	૯	૦	૧૭૪
પૌંડ ૧	૧૪	૧૩	૧૦	૯૦૮	૧૦,૦૦૦	૧,૪૮,૬૯૩	૨	૦	૩૪૮
૨	૨૯	૧૧	૯	૮૧૬	૨૦,૦૦૦	૨,૯૭,૩૮૬	૪	૦	૬૯૬
૩	૪૪	૯	૮	૭૨૪	૪૦,૦૦૦	૫,૯૪,૭૭૨	૮	૧	૩૯૨

રૂપીઆના પૌંડ

શી ૧-૪ પેન્સ ૨૧ આના

પાઈ	પાઉંડ	શી	પે.	ફ ૨
૧				૦ ૩૩૬
૨				૦ ૬૭૩
૩				૧ ૦૦૯
૪				૧ ૩૪૫
૫				૧ ૬૮૧
૬				૨ ૦૧૮
૭				૨ ૩૫૪
૮				૨ ૬૯૦
૯				૩ ૦૨૬
૧૦				૩ ૩૬૩
૧૧				૩ ૬૯૯
આના ૧			૧	૦ ૦૩૫
૨			૨	૦ ૦૭૦
૩			૩	૦ ૧૦૫
૪			૪	૦ ૧૪૧
૫			૫	૦ ૧૭૬
૬			૬	૦ ૨૧૧
૭			૭	૦ ૨૪૬
૮			૮	૦ ૨૮૧
૯			૯	૦ ૩૧૫
૧૦			૧૦	૦ ૩૫૨
૧૧			૧૧	૦ ૩૮૭
૧૨		૧	૦	૦ ૪૨૨
૧૩		૧	૧	૦ ૪૫૭
૧૪		૧	૨	૦ ૪૯૨
૧૫		૧	૩	૦ ૫૨૭
રૂપીઆ ૧		૧	૪	૦ ૫૬૨
૨		૨	૮	૧ ૧૨૫
૩		૪	૦	૧ ૬૮૭
૪		૫	૪	૨ ૨૫૦
૫		૬	૮	૨ ૮૧૨
૬		૮	૦	૩ ૩૭૫
૭		૯	૪	૩ ૯૩૭

શી ૧-૪ [illegible] પેન્સ (૧-૪J=૧)

રૂપીઆ.	પાઉંડ	શી	પે	ફાર
૮		૧૦	૯ ૦	૫૦૦
૯		૧૨	૧ ૧	૦૬૨
૧૦		૧૩	૫ ૧	૬૨૫
૨૦	૧	૬	૧૦ ૩	૨૫૦
૩૦	૨	૦	૪ ૦	૮૭૫
૪૦	૨	૧૩	૯ ૨	૫૦૦
૫૦	૩	૭	૩ ૦	૧૨૫
૬૦	૪	૦	૮ ૧	૭૫૦
૭૦	૪	૧૪	૧ ૩	૩૭૫
૮૦	૫	૭	૭ ૧	
૯૦	૬	૧	૦ ૨	૬૨૫
૧૦૦	૬	૧૪	૬ ૦	૨૫૦
૨૦૦	૧૩	૯	૦ ૦	૫૦૦
૩૦૦	૨૦	૩	૬ ૦	૭૫૦
૪૦૦	૨૬	૧૮	૦ ૧	
૫૦૦	૩૩	૧૨	૬ ૧	૨૫૦
૬૦૦	૪૦	૭	૦ ૧	૫૦૦
૭૦૦	૪૭	૧	૬ ૧	૭૫૦
૮૦૦	૫૩	૧૬	૦ ૨	
૯૦૦	૬૦	૧૦	૬ ૨	૨૫૦
૧,૦૦૦	૬૭	૫	૦ ૨	૫૦૦
૧.૫૦૦	૧૦૦	૧૭	૬ ૩	૭૫૦
૨,૦૦૦	૧૩૪	૧૦	૧ ૧	
૩,૦૦૦	૨૦૧	૧૫	૧ ૩	૫૦૦
૪,૦૦૦	૨૬૯	૦	૨ ૨	
૫,૦૦૦	૩૩૬	૫	૩ ૦	૫૦૦
૧૦,૦૦૦	૬૭૨	૧૦	૬ ૧	
૨૦,૦૦૦	૧ ૩૪૫	૧	૦ ૨	
૩૦,૦૦૦	૨,૦૧૭	૧૧	૬ ૩	
૪૦,૦૦૦	૨,૬૯૦	૨	૧ ૦	
૫૦,૦૦૦	૩,૩૬૨	૧૨	૭ ૧	
૧,૦૦,૦૦૦	૬,૭૨૫	૫	૨ ૨	
૨ ૦૦ ૦૦૦	૧૩,૪૫૦	૧૦	૫ ૦	.

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૪ પેન્સ ૨ાા આના					શી. ૧-૪ ૫/૩૨ પેન્સ (૧-૪) =ાા				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો	પૌંડ	રૂપીઆ	આ	પા	દો
૧		૦	૧૧	૮૮૪	૪	૫૯	૬	૮	૫૮૮
૨		૧	૧૧	૭૬૮	૫	૭૪	૪	૪	૭૩૫
૩		૨	૧૧	૬૫૨	૬	૮૯	૨	૦	૮૮૨
૪		૩	૧૧	૫૩૬	૭	૧૦૩	૧૫	૯	૦૨૯
૫		૪	૧૧	૪૨૦	૮	૧૧૮	૧૩	૫	૧૭૬
૬		૫	૧૧	૩૦૪	૯	૧૩૩	૧૧	૧	૩૨૩
૭		૬	૧૧	૧૮૮	૧૦	૧૪૮	૮	૯	૪૭૦
૮		૭	૧૧	૦૭૨	૨૦	૨૯૭	૧	૬	૯૪૦
૯		૮	૧૦	૯૫૬	૩૦	૪૪૫	૧૦	૪	૪૧૦
૧૦		૯	૧૦	૮૪૦	૪૦	૫૯૪	૩	૧	૮૮૦
૧૧		૧૦	૧૦	૭૨૪	૫૦	૭૪૨	૧૧	૧૧	૩૫૦
શીલીંગ ૧		૧૧	૧૦	૬૦૭	૬૦	૮૯૧	૪	૮	૮૨૦
૨	૧	૭	૯	૨૧૪	૭૦	૧,૦૩૯	૧૩	૬	૨૯૦
૩	૨	૩	૭	૮૨૧	૮૦	૧,૧૮૮	૬	૩	૭૬૦
૪	૨	૧૫	૬	૪૨૮	૯૦	૧,૩૩૬	૧૫	૧	૨૩૦
૫	૩	૧૧	૫	૦૩૬	૧૦૦	૧,૪૮૫	૭	૧૦	૭૦૦
૬	૪	૭	૩	૬૪૪	૨૦૦	૨,૯૭૦	૧૫	૯	૪૦૦
૭	૫	૩	૨	૨૫૧	૩૦૦	૪,૪૫૬	૭	૮	૧૦૧
૮	૫	૧૫	૦	૮૫૯	૪૦૦	૫ ૯૪૧	૧૫	૬	૮૦૧
૯	૬	૧૦	૧૧	૪૬૬	૫૦૦	૭ ૪૨૭	૭	૫	૫૦૧
૧૦	૭	૬	૧૦	૦૭૩	૬૦૦	૮,૯૧૨	૧૫	૪	૨૦૧
૧૧	૮	૨	૮	૬૮૧	૭૦૦	૧૦,૩૯૮	૭	૨	૯૦૧
૧૨	૮	૧૪	૭	૨૮૮	૮૦૦	૧૧,૮૮૩	૧૫	૧	૬૦૨
૧૩	૯	૧૦	૫	૮૯૬	૯૦૦	૧૩,૩૬૯	૭	૦	૩૦૨
૧૪	૧૦	૬	૪	૫૦૩	૧,૦૦૦	૧૪,૮૫૪	૧૪	૧૧	૦૦૨
૧૫	૧૧	૨	૩	૧૧૦	૧,૫૦૦	૨૨,૨૮૨	૬	૪	૫૦૩
૧૬	૧૧	૧૪	૧	૭૧૮	૨,૦૦૦	૨૯,૭૦૯	૧૩	૧૦	૦૦૪
૧૭	૧૨	૧૦	૦	૩૨૫	૩,૦૦૦	૪૪,૫૬૪	૧૨	૯	૦૦૬
૧૮	૧૩	૫	૧૦	૯૩૨	૪,૦૦૦	૫૯,૪૧૯	૧૧	૮	૦૦૮
૧૯	૧૪	૧	૯	૫૪૦	૫,૦૦૦	૭૪,૨૭૪	૧૦	૭	૦૧૦
પૌંડ ૧	૧૪	૧૩	૮	૧૪૭	૧૦,૦૦૦	૧,૪૮,૫૪૯	૫	૨	૦૧૯
૨	૨૯	૧૧	૪	૨૯૪	૨૦,૦૦૦	૨,૯૭,[illegible]	[illegible]	૪	૦૩૮
૩	૪૪	૯	૦	૪૪૧	[illegible]૦,૦૦૦	૫,૯૪,[illegible]	[illegible]	૮	૦૭૬

શા. ૧-૪ પેન્સ ૨ાા આના					
પાઈ.	પોંડ.	શાં	પે.	ફાર	
૧				૦	૩૩૬
૨				૦	૬૭૩
૩				૧	૦૧૦
૪				૧	૩૪૬
૫				૧	૬૮૩
૬				૨	૦૨૦
૭				૨	૩૫૬
૮				૨	૬૯૩
૯				૩	૦૨૯
૧૦				૩	૩૬૬
૧૧				૩	૭૦૨
આના ૧			૧	૦	૦૩૯
૨			૨	૦	૦૭૮
૩			૩	૦	૧૧૭
૪			૪	૦	૧૫૬
૫			૫	૦	૧૯૫
૬			૬	૦	૨૩૪
૭			૭	૦	૨૭૩
૮			૮	૦	૩૧૩
૯			૯	૦	૩૫૨
૧૦			૧૦	૦	૩૯૧
૧૧			૧૧	૦	૪૩૦
૧૨		૧	૦	૦	૪૬૯
૧૩		૧	૧	૦	૫૦૮
૧૪		૧	૨	૦	૫૪૭
૧૫		૧	૩	૦	૫૮૬
રૂપીઆ ૧		૧	૪	૦	૬૨૫
૨		૨	૮	૧	૨૫૦
૩		૪	૦	૧	૮૭૫
૪		૫	૪	૨	૫૦૦
૫		૬	૮	૩	૧૨૫
૬		૮	૦	૩	૭૫૦
૭		૯	૫	૦	૩૭૫

શી. ૧-૪ ફુટે પેન્સ (૧-૪)=ાા					
રૂપીયા	પોંડ	શા	પે.	ફાર	
૮		૧૦	૯	૧	૦૦
૯		૧૨	૧	૧	૬૨૫
૧૦		૧૩	૫	૨	૨૫૦
૨૦	૧	૬	૧૧	૦	૫૦૦
૩૦	૨	૦	૪	૨	૭૫૦
૪૦	૨	૧૩	૧૦	૧	
૫૦	૩	૭	૩	૩	૨૫૦
૬૦	૪	૦	૯	૧	૫૦૦
૭૦	૪	૧૪	૨	૩	૭૫૦
૮૦	૫	૭	૮	૨	
૯૦	૬	૧	૨	૦	૨૫૦
૧૦૦	૬	૧૪	૭	૨	૫૦૦
૨૦૦	૧૩	૯	૩	૧	
૩૦૦	૨૦	૩	૧૦	૩	૫૦૦
૪૦૦	૨૬	૧૮	૬	૨	
૫૦૦	૩૩	૧૩	૨	૦	૫૦૦
૬૦૦	૪૦	૭	૯	૩	
૭૦૦	૪૭	૨	૫	૧	૫૦૦
૮૦૦	૫૩	૧૭	૧	૦	
૯૦૦	૬૦	૧૧	૮	૨	૫૦૦
૧,૦૦૦	૬૭	૬	૪	૧	
૧,૫૦૦	૧૦૦	૧૯	૬	૧	૫૦૦
૨,૦૦૦	૧૩૪	૧૨	૮	૨	
૩,૦૦૦	૨૦૧	૧૯	૦	૩	
૪,૦૦૦	૨૬૯	૫	૫	૦	
૫,૦૦૦	૩૩૬	૧૧	૯	૧	
૧૦,૦૦૦	૬૭૩	૩	૬	૨	
૨૦,૦૦૦	૧,૩૪૬	૭	૧	૦	
૩૦,૦૦૦	૨,૦૧૯	૧૦	૭	૨	
૪૦,૦૦૦	૨,૬૯૨	૧૪	૨	૦	
૫૦,૦૦૦	૩,૩૬૫	૧૭	૮	૨	
૧,૦૦,૦૦૦	૬,૭૩૧	૧૫	૫	૦	
૨,૦૦ ૦૦૦	૧૩.૪૬૩	૧૦	૧૦	૦	

પૌંડના રૂપીયા

થી. ૧-૪ પેન્સ ૨॥। આના					શી. ૧-૪$\frac{1}{6}\frac{1}{4}$ પેન્સ (૧-૪)આ॥।)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો	પૌંડ	રૂપીઆ.	આ	પા.	દો
૧			૧૧	૮૭૨	૪	૫૯	૫	૯	૫૬૫
૨		૧	૧૧	૭૪૫	૫	૭૪	૩	૨	૯૫૭
૩		૨	૧૧	૬૧૭	૬	૮૯	૦	૮	૩૪૮
૪		૩	૧૧	૪૯૦	૭	૧૦૩	૧૪	૧	૭૩૯
૫		૪	૧૧	૩૬૨	૮	૧૧૮	૧૧	૭	૧૩૦
૬		૫	૧૧	૨૩૫	૯	૧૩૩	૯	૦	૫૨૨
૭		૬	૧૧	૧૦૭	૧૦	૧૪૮	૬	૫	૯૧૩
૮		૭	૧૦	૯૮૦	૨૦	૨૯૬	૧૨	૧૧	૮૨૬
૯		૮	૧૦	૮૫૨	૩૦	૪૪૫	૩	૫	૭૩૯
૧૦		૯	૧૦	૭૨૫	૪૦	૫૯૩	૯	૧૧	૬૫૨
૧૧		૧૦	૧૦	૫૯૭	૫૦	૭૪૨	૦	૫	૫૬૫
શીલીંગ ૧		૧૧	૧૦	૪૭૦	૬૦	૮૯૦	૬	૧૧	૪૭૮
૨	૧	૭	૮	૯૩૯	૭૦	૧,૦૩૮	૧૩	૫	૩૯૧
૩	૨	૩	૭	૪૦૯	૮૦	૧,૧૮૭	૩	૧૧	૩૦૪
૪	૨	૧૫	૫	૮૭૮	૯૦	૧,૩૩૫	૧૦	૫	૨૧૭
૫	૩	૧૧	૪	૩૪૮	૧૦૦	૧,૪૮૮	૦	૧૧	૧૩૦
૬	૪	૭	૨	૮૧૭	૨૦૦	૨,૯૬૮	૧	૧૦	૨૬૧
૭	૫	૩	૧	૨૮૭	૩૦૦	૪,૪૫૨	૨	૯	૩૯૧
૮	૫	૧૪	૧૧	૭૫૭	૪૦૦	૫૯૩૬	૩	૮	૫૨૨
૯	૬	૧૦	૧૦	૨૨૬	૫૦૦	૭,૪૨૦	૪	૭	૬૫૨
૧૦	૭	૬	૮	૬૯૬	૬૦૦	૮,૯૦૪	૫	૬	૭૮૩
૧૧	૮	૨	૭	૧૬૫	૭૦૦	૧૦,૩૮૮	૬	૫	૯૧૩
૧૨	૮	૧૪	૫	૬૩૫	૮૦૦	૧૧,૮૭૨	૭	૫	૦૪૩
૧૩	૯	૧૦	૪	૧૦૪	૯૦૦	૧૩ ૩૫૬	૮	૪	૧૭૪
૧૪	૧૦	૬	૨	૫૭૪	૧,૦૦૦	૧૪,૮૪૦	૯	૩	૩૦૪
૧૫	૧૧	૨	૧	૦૪૩	૧,૫૦૦	૨૨,૨૬૦	૧૩	૧૦	૯૫૬
૧૬	૧૧	૧૩	૧૧	૫૧૩	૨,૦૦૦	૨૯,૬૮૧	૨	૬	૬૦૯
૧૭	૧૨	૯	૯	૯૮૨	૩,૦૦૦	૪૪,૫૨૧	૧૧	૯	૯૧૩
૧૮	૧૩	૫	૮	૪૫૨	૪,૦૦૦	૫૯,૩૬૨	૫	૧	૨૧૭
૧૯	૧૪	૧	૬	૯૨૨	૫,૦૦૦	૭૪,૨૦૨	૧૪	૪	૫૨૨
પૌંડ ૧	૧૪	૧૩	૫	૩૯૧	૧૦,૦૦૦	૧,૪૮,૪૦૫	૧૨	૯	૦૪૩
૨	૨૯	૧૦	૧૦	૭૮૩	૨૦,૦૦૦	૨,૯૬,૮૧૧	૯	૬	૦૮૬
૩	૪૪	૮	૪	૧૭૪	૪૦,૦૦૦	૫,૯૩ ૬૨૩	૭	૦	૧૭૨

(વોલાતયની હુંડી) રૂપીઆના પૌંડ

શી. ૧-૪ પેન્સ ૨॥ આના					શી. ૧-૪ ૧૧/૧૬ પેન્સ (૧-૪) ૨॥।)				
પાઇ	પાઉંડ	શી.	પે	ફાર	રૂપીઆ	પાઉંડ	શી.	પે	ફાર
૧			૦	૩૩૭	૮		૧૦	૯	૧ ૫૦૦
૨			૦	૬૭૪	૯		૧૨	૧	૨ ૧૮૭
૩			૧	૦૧૧	૧૦		૧૩	૫	૨ ૮૭૫
૪			૧	૩૪૮	૨૦	૧	૬	૧૧	૧ ૭૫૦
૫			૧	૬૮૫	૩૦	૨	૦	૫	૦ ૬૨૫
૬			૨	૦૨૨	૪૦	૨	૧૩	૧૦	૩ ૫૦૦
૭			૨	૩૫૮	૫૦	૩	૭	૪	૨ ૩૭૫
૮			૨	૬૯૫	૬૦	૪	૦	૧૦	૧ ૨૫૦
૯			૩	૦૩૨	૭૦	૪	૧૪	૪	૦ ૧૨૫
૧૦			૩	૩૬૯	૮૦	૫	૭	૯	૩
૧૧			૩	૭૦૬	૯૦	૬	૧	૩	૧ ૮૭૫
આના ૧			૧	૦ ૦૪૩	૧૦૦	૬	૧૪	૯	૦ ૭૫૦
૨			૨	૦ ૦૮૬	૨૦૦	૧૩	૯	૬	૧ ૫૦૦
૩			૩	૦ ૧૨૯	૩૦૦	૨૦	૪	૩	૨ ૨૫૦
૪			૪	૦ ૧૭૨	૪૦૦	૨૬	૧૯	૦	૩
૫			૫	૦ ૨૧૫	૫૦૦	૩૩	૧૩	૯	૩ ૭૫૦
૬			૬	૦ ૨૫૮	૬૦૦	૪૦	૮	૭	૦ ૫૦૦
૭			૭	૦ ૩૦૧	૭૦૦	૪૭	૩	૬	૧ ૨૫૦
૮			૮	૦ ૩૪૪	૮૦૦	૫૩	૧૮	૧	૨
૯			૯	૦ ૩૮૭	૯૦૦	૬૦	૧૨	૧૦	૨ ૭૫૦
૧૦			૧૦	૦ ૪૩૦	૧,૦૦૦	૬૭	૭	૭	૩ ૫૦૦
૧૧			૧૧	૦ ૪૭૩	૧,૫૦૦	૧૦૧	૧	૫	૩ ૨૫૦
૧૨		૧	૦	૦ ૫૧૬	૨,૦૦૦	૧૩૪	૧૫	૩	૩
૧૩		૧	૧	૦ ૫૫૯	૩,૦૦૦	૨૦૨	૨	૧૧	૨ ૫૦૦
૧૪		૧	૨	૦ ૬૦૨	૪,૦૦૦	૨૬૯	૧૦	૭	૨
૧૫		૧	૩	૦ ૬૪૫	૫,૦૦૦	૩૩૬	૧૮	૩	૧ ૫૦૦
રૂ. ૧		૧	૪	૦ ૬૮૭	૧૦,૦૦૦	૬૭૩	૧૬	૬	૩
૨		૨	૮	૧ ૩૭૫	૨૦,૦૦૦	૧,૩૪૭	૧૩	૧	૨
૩		૪	૦	૨ ૦૬૨	૩૦,૦૦૦	૨,૦૨૧	૯	૮	૧
૪		૫	૪	૨ ૭૫૦	૪૦,૦૦૦	૨,૬૯૫	૬	૩	૦
૫		૬	૮	૩ ૪૩૭	૫૦,૦૦૦	૩,૩૬૯	૨	૯	૩
૬		૮	૧	૦ ૧૨૫	૧,૦૦,૦૦૦	૬,૭૩૮	૫	૭	૨
૭		૯	૫	૦ ૮૧૨	૨,૦૦,૦૦૦	૧૩,૪૭૬	૧૧	૩	૦

(વીલાયતી હુંડી) પૌંડના રૂપીઆ

શી ૧-૪ પેન્સ ૩ આના					શી ૧-૪ $\frac{3}{16}$ પેન્સ (૧-૪)				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો	પૌંડ	રૂપીઆ	આ	પા	દો.
૧		૦	૧૧	૮૬૫	૪	૫૯	૪	૧૦	૫૬૪
૨		૧	૧૧	૭૨૨	૫	૭૪	૨	૧	૨૦૫
૩		૨	૧૧	૫૮૩	૬	૮૮	૧૫	૩	૮૪૬
૪		૩	૧૧	૪૪૪	૭	૧૦૩	૧૨	૬	૪૮૬
૫		૪	૧૧	૩૦૫	૮	૧૧૮	૯	૯	૧૨૭
૬		૫	૧૧	૧૬૬	૯	૧૩૩	૬	૧૧	૭૬૮
૭		૬	૧૧	૦૨૭	૧૦	૧૪૮	૪	૨	૪૦૯
૮		૭	૧૦	૮૮૮	૨૦	૨૯૬	૮	૪	૮૧૯
૯		૮	૧૦	૭૪૯	૩૦	૪૪૪	૧૨	૭	૨૨૮
૧૦		૯	૧૦	૬૧૦	૪૦	૫૯૩	૦	૯	૬૩૭
૧૧		૧૦	૧૦	૪૭૧	૫૦	૭૪૧	૫	૦	૦૪૬
શીલીંગ ૧		૧૧	૧૦	૩૩૨	૬૦	૮૮૯	૯	૨	૪૫૬
૨	૧	૭	૮	૬૬૪	૭૦	૧,૦૩૭	૧૩	૪	૮૬૫
૩	૨	૩	૬	૯૯૬	૮૦	૧,૧૮૬	૧	૭	૨૭૪
૪	૨	૧૫	૫	૩૨૮	૯૦	૧,૩૩૪	૫	૯	૬૮૩
૫	૩	૧૧	૩	૬૬૦	૧૦૦	૧,૪૮૨	૧૦	૦	૦૯૩
૬	૪	૭	૧	૯૯૨	૨૦૦	૨,૯૬૫	૪	૦	૧૮૫
૭	૫	૩	૦	૩૨૪	૩૦૦	૪.૪૪૭	૧૪	૦	૨૭૮
૮	૫	૧૪	૧૦	૬૫૬	૪૦૦	૫,૯૩૦	૮	૦	૩૭૧
૯	૬	૧૦	૮	૯૮૮	૫૦૦	૭,૪૧૩	૨	૦	૪૬૩
૧૦	૭	૬	૭	૩૨૦	૬૦૦	૮,૮૯૫	૧૨	૦	૫૫૬
૧૧	૮	૨	૫	૬૫૩	૭૦૦	૧૦,૩૭૮	૬	૦	૬૪૯
૧૨	૮	૧૪	૩	૯૮૫	૮૦૦	૧૧ ૮૬૧	૦	૦	૭૪૧
૧૩	૯	૧૦	૨	૩૧૭	૯૦૦	૧૩,૩૪૩	૧૦	૦	૮૩૪
૧૪	૧૦	૬	૦	૬૪૯	૧,૦૦૦	૧૪,૮૨૬	૪	૦	૯૨૭
૧૫	૧૧	૧	૧૦	૯૮૧	૧,૫૦૦	૨૨,૨૩૯	૬	૧	૩૯૦
૧૬	૧૧	૧૩	૯	૩૧૩	૨,૦૦૦	૨૯,૬૫૨	૮	૧	૮૫૩
૧૭	૧૨	૯	૭	૬૪૫	૩,૦૦૦	૪૪,૪૭૮	૧૨	૨	૭૭૯
૧૮	૧૩	૫	૫	૯૭૭	૪,૦૦૦	૫૯,૩૦૫	૦	૩	૭૦૬
૧૯	૧૪	૧	૪	૩૦૯	૫,૦૦૦	૭૪,૧૩૧	૪	૪	૬૩૩
પાઉંડ ૧	૧૪	૧૩	૨	૬૪૧	૧૦,૦૦૦	૧,૪૮,૨૬૨	૮	૯	૨૬૬
૨	૨૯	૧૦	૫	૨૮૨	૨૦,૦૦૦	૨,૯૬,૫૨૫	૧	૬	૫૩૩
૩	૪૪	૭	૭	૯૨૩	૪૦,૦૦૦	૫,૯૩,૦૫૦	૩	૧	૦૬૬

શી. ૧-૪ પેન્સ ૩ આના.						શી. ૧-૪$\frac{3}{16}$ પે. (૧-૪)ᴙ)					
પાઈ.	પાઊંડ	શી.	પે.		દાર	રૂપીઆ.	પાઊંડ	શી	પે.		દાર
૧				૦	૩૩૭	૮		૧૦	૯	૨	
૨				૦	૬૭૪	૯		૧૨	૧	૨	૭૫૦
૩				૧	૦૧૨	૧૦		૧૩	૫	૩	૫૦૦
૪				૧	૩૪૯	૨૦	૧	૬	૧૧	૩	
૫				૧	૬૮૭	૩૦	૨	૦	૫	૨	૫૦૦
૬				૨	૦૨૩	૪૦	૨	૧૩	૧૧	૨	
૭				૨	૩૬૦	૫૦	૩	૭	૫	૧	૫૦૦
૮				૨	૬૯૮	૬૦	૪	૦	૧૧	૧	
૯				૩	૦૩૫	૭૦	૪	૧૪	૫	૦	૫૦૦
૧૦				૩	૩૭૨	૮૦	૫	૭	૧૧	૦	
૧૧				૩	૭૧૦	૯૦	૬	૧	૪	૩	૫૦૦
આના ૧			૧	૦	૦૪૭	૧૦૦	૬	૧૪	૧૦	૩	
૨			૨	૦	૦૯૪	૨૦૦	૧૩	૯	૯	૨	
૩			૩	૦	૧૪૧	૩૦૦	૨૦	૪	૮	૧	
૪			૪	૦	૧૮૮	૪૦૦	૨૬	૧૯	૭	૦	
૫			૫	૦	૨૩૪	૫૦૦	૩૩	૧૪	૫	૩	
૬			૬	૦	૨૮૧	૬૦૦	૪૦	૯	૪	૨	
૭			૭	૦	૩૨૮	૭૦૦	૪૭	૪	૩	૧	
૮			૮	૦	૩૭૫	૮૦૦	૫૩	૧૯	૨	૦	
૯			૯	૦	૪૨૨	૯૦૦	૬૦	૧૪	૦	૩	
૧૦			૧૦	૦	૪૬૯	૧,૦૦૦	૬૭	૮	૧૧	૨	
૧૧			૧૧	૦	૫૧૬	૧,૫૦૦	૧૦૧	૩	૫	૧	
૧૨		૧	૦	૦	૫૬૩	૨,૦૦૦	૧૩૪	૧૭	૧૧	૦	
૧૩		૧	૧	૦	૬૦૯	૩,૦૦૦	૨૦૨	૬	૧૦	૨	
૧૪		૧	૨	૦	૬૫૬	૪,૦૦૦	૨૬૯	૧૫	૧૦	૦	
૧૫		૧	૩	૦	૭૦૩	૫,૦૦૦	૩૩૭	૪	૯	૨	
રૂપીઆ ૧		૧	૪	૦	૭૫૦	૧૦,૦૦૦	૬૭૪	૯	૭		
૨		૨	૮	૧	૫૦૦	૨૦,૦૦૦	૧,૩૪૮	૧૯	૨		
૩		૪	૦	૨	૨૫૦	૩૦,૦૦૦	૨,૦૨૩	૮	૯		
૪		૫	૪	૩		૪૦,૦૦૦	૨,૬૯૭	૧૮	૪		
૫		૬	૮	૩	૭૫૦	૫૦,૦૦૦	૩,૩૭૨	૭	૧૧		
૬		૮	૧	૦	૫૦૦	૧,૦૦,૦૦૦	૬ ૭૪૪	૧૫	૧૦		
૭		૯	૫	૧	૨૫૦	૨ ૦૦,૦૦૦	૧૩,૪૮૯	૧૧	૮		

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી ૧-૪ પેન્સ ૩। આના				
પેન્સ.	રૂપીઆ.	આ	પા	દો.
૧		૦	૧૧	૮૫૦
૨		૧	૧૧	૬૯૯
૩		૨	૧૧	૫૪૯
૪		૩	૧૧	૩૯૮
૫		૪	૧૧	૨૪૮
૬		૫	૧૧	૦૯૭
૭		૬	૧૦	૯૪૭
૮		૭	૧૦	૭૯૭
૯		૮	૧૦	૬૪૬
૧૦		૯	૧૦	૪૯૬
૧૧		૧૦	૧૦	૩૪૫
શીલીંગ ૧		૧૧	૧૦	૧૯૫
૨	૧	૭	૮	૩૯૦
૩	૨	૩	૬	૫૮૪
૪	૨	૧૫	૪	૭૭૯
૫	૩	૧૧	૨	૯૭૪
૬	૪	૭	૧	૧૬૯
૭	૫	૨	૧૧	૩૬૪
૮	૫	૧૪	૯	૫૫૮
૯	૬	૧૦	૭	૭૫૩
૧૦	૭	૬	૫	૯૪૮
૧૧	૮	૨	૪	૧૪૩
૧૨	૮	૧૪	૨	૩૩૮
૧૩	૯	૧૦	૦	૫૩૨
૧૪	૧૦	૫	૧૦	૭૨૭
૧૫	૧૧	૧	૮	૯૨૨
૧૬	૧૧	૧૩	૭	૧૧૭
૧૭	૧૨	૯	૫	૩૧૧
૧૮	૧૩	૫	૩	૫૦૬
૧૯	૧૪	૧	૧	૭૦૧
પાઉંડ ૧	૧૪	૧૨	૧૧	૮૯૬
૨	૨૯	૯	૧૧	૭૯૨
૩	૪૪	૬	૧૧	૬૮૮

શી. ૧-૪ ૧૩/૬૪ પેન્સ (૧-૪) ≡।)				
પાઉંડ	રૂપીઆ	આ	પા.	દો.
૪	૫૯	૩	૧૧	૫૮૩
૫	૭૪	૦	૧૧	૪૭૯
૬	૮૮	૧૩	૧૧	૩૭૫
૭	૧૦૩	૧૦	૧૧	૨૭૧
૮	૧૧૮	૭	૧૧	૧૬૭
૯	૧૩૩	૪	૧૧	૦૬૩
૧૦	૧૪૮	૧	૧૦	૯૫૯
૨૦	૨૯૬	૩	૯	૯૧૭
૩૦	૪૪૪	૫	૮	૮૭૬
૪૦	૫૯૨	૭	૭	૮૩૪
૫૦	૭૪૦	૯	૬	૭૯૩
૬૦	૮૮૮	૧૧	૫	૭૫૧
૭૦	૧,૦૩૬	૧૩	૪	૭૧૦
૮૦	૧,૧૮૪	૧૫	૩	૬૬૮
૯૦	૧,૩૩૩	૧	૨	૬૨૭
૧૦૦	૧,૪૮૧	૩	૧	૫૮૫
૨૦૦	૨,૯૬૨	૬	૩	૧૭૧
૩૦૦	૪,૪૪૩	૯	૪	૭૫૬
૪૦૦	૫,૯૨૪	૧૨	૬	૩૪૧
૫૦૦	૭,૪૦૫	૧૫	૭	૯૨૭
૬૦૦	૮,૮૮૭	૨	૯	૫૧૨
૭૦૦	૧૦,૩૬૮	૫	૧૧	૦૯૭
૮૦૦	૧૧,૮૪૯	૯	૦	૬૮૩
૯૦૦	૧૩,૩૩૦	૧૨	૨	૨૬૮
૧,૦૦૦	૧૪,૮૧૧	૧૫	૩	૮૫૩
૧,૫૦૦	૨૨,૨૧૭	૧૪	૧૧	૭૮૦
૨,૦૦૦	૨૯,૬૨૩	૧૪	૭	૭૦૭
૩,૦૦૦	૪૪,૪૩૫	૧૩	૧૧	૫૬૦
૪,૦૦૦	૫૯,૨૪૭	૧૩	૩	૪૧૪
૫,૦૦૦	૭૪,૦૫૯	૧૨	૭	૨૬૭
૧,૦,૦૦૦	૧,૪૮,૧૧૯	૯	૨	૫૩૪
૨,૦,૦૦૦	૨,૯૬,૨૩૯	૨	૫	૦૬૮
૪,૦,૦૦૦	૫,૯૨,૪૭૮	૪	૧૦	૧૩૬

શી. ૧-૪ પેન્સ ૩ા આના				
પાઇ	પાઊંડ	શી	પે	ફાર
૧				૦ ૩૩૭
૨				૦ ૬૭૫
૩				૧ ૦૧૩
૪				૧ ૩૫૦
૫				૧ ૬૮૮
૬				૨ ૦૨૫
૭				૨ ૩૬૩
૮				૨ ૭૦૧
૯				૩ ૦૩૮
૧૦				૩ ૩૭૬
૧૧				૩ ૭૧૩
આના ૧			૧	૦ ૦૫૧
૨			૨	૦ ૧૦૨
૩			૩	૦ ૧૫૨
૪			૪	૦ ૨૦૩
૫			૫	૦ ૨૫૪
૬			૬	૦ ૩૦૫
૭			૭	૦ ૩૫૫
૮			૮	૦ ૪૦૬
૯			૯	૦ ૪૫૭
૧૦			૧૦	૦ ૫૦૮
૧૧			૧૧	૦ ૫૫૯
૧૨		૧	૦	૦ ૬૦૯
૧૩		૧	૧	૦ ૬૬૦
૧૪		૧	૨	૦ ૭૧૧
૧૫		૧	૩	૦ ૭૬૨
રૂપીઆ ૧		૧	૪	૦ ૮૧૨
૨		૨	૮	૧ ૬૨૫
૩		૪	૦	૨ ૪૩૭
૪		૫	૪	૩ ૨૫૦
૫		૬	૯	૦ ૦૬૨
૬		૮	૧	૦ ૮૭૫
૭		૯	૫	૧ ૬૮૭

શી. ૧-૪ $\frac{33}{64}$ પેન્સ (૧-૪)=ા)				
રૂપીઆ.	પાઊંડ	શી.	પે.	ફાર
૮		૧૦	૯	૨ ૫૦૦
૯		૧૨	૧	૩ ૩૧૨
૧૦		૧૩	૬	૦ ૧૨૫
૨૦	૧	૭	૦	૦ ૨૫૦
૩૦	૨	૦	૬	૦ ૩૭૫
૪૦	૨	૧૪	૦	૦ ૫૦૦
૫૦	૩	૭	૬	૦ ૬૨૫
૬૦	૪	૧	૦	૦ ૭૫૦
૭૦	૪	૧૪	૬	૦ ૮૭૫
૮૦	૫	૮	૦	૧
૯૦	૬	૧	૬	૧ ૧૨૫
૧૦૦	૬	૧૫	૦	૧ ૨૫૦
૨૦૦	૧૩	૧૦	૦	૨ ૫૦૦
૩૦૦	૨૦	૫	૦	૩ ૭૫૦
૪૦૦	૨૭	૦	૧	૧
૫૦૦	૩૩	૧૫	૧	૨ ૨૫૦
૬૦૦	૪૦	૧૦	૧	૩ ૫૦૦
૭૦૦	૪૭	૫	૨	૦ ૭૫૦
૮૦૦	૫૪	૦	૨	૨
૯૦૦	૬૦	૧૫	૨	૩ ૨૫૦
૧,૦૦૦	૬૭	૧૦	૩	૦ ૫૦૦
૧,૫૦૦	૧૦૧	૫	૪	૨ ૭૫૦
૨,૦૦૦	૧૩૫	૦	૬	૧
૩,૦૦૦	૨૦૨	૧૦	૯	૧ ૫૦૦
૪,૦૦૦	૨૭૦	૧	૦	૨
૫,૦૦૦	૩૩૭	૧૧	૩	૨ ૫૦૦
૧૦,૦૦૦	૬૭૫	૨	૭	૧
૨૦,૦૦૦	૧,૩૫૦	૫	૨	૨
૩૦,૦૦૦	૨,૦૨૫	૭	૯	૩
૪૦,૦૦૦	૨,૭૦૦	૧૦	૫	૦
૫૦,૦૦૦	૩,૩૭૫	૧૩	૦	૧
૧,૦૦,૦૦૦	૬,૭૫૧	૬	૦	૨
૨,૦૦,૦૦૦	૧૩,૫૦૨	૧૨	૧	૦

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

થી ૧-૪ પેન્સ ૩॥ આના.						થા. ૧—૪ ૭/૩૨ પેન્સ(૧-૪)આ)				
પેન્સ		રૂપીઆ	આ	પા	દો	પોંડ	રૂપીઆ	આ	પા	દો
	૧		૦	૧૧	૮૩૮	૪	૫૯	૩	૦	૬૨૪
	૨		૧	૧૧	૬૭૬	૫	૭૩	૧૫	૯	૭૮૦
	૩		૨	૧૧	૫૧૪	૬	૮૮	૧૨	૬	૯૩૬
	૪		૩	૧૧	૩૫૩	૭	૧૦૩	૯	૪	૦૯૨
	૫		૪	૧૧	૧૯૧	૮	૧૧૮	૬	૧	૨૪૯
	૬		૫	૧૧	૦૨૯	૯	૧૩૩	૨	૧૦	૪૦૫
	૭		૬	૧૦	૮૬૭	૧૦	૧૪૭	૧૫	૭	૫૬૧
	૮		૭	૧૦	૭૦૫	૨૦	૨૯૫	૧૫	૩	૧૨૨
	૯		૮	૧૦	૫૪૩	૩૦	૪૪૩	૧૪	૧૦	૬૮૨
	૧૦		૯	૧૦	૩૮૨	૪૦	૫૯૧	૧૪	૬	૨૪૩
	૧૧		૧૦	૧૦	૨૨૦	૫૦	૭૩૯	૧૪	૧	૮૦૩
શીલીંગ	૧		૧૧	૧૦	૦૫૮	૬૦	૮૮૭	૧૩	૯	૩૬૪
	૨	૧	૭	૮	૧૧૬	૭૦	૧,૦૩૫	૧૩	૪	૯૨૫
	૩	૨	૩	૬	૧૭૩	૮૦	૧,૧૮૩	૧૩	૦	૪૮૬
	૪	૨	૧૫	૪	૨૩૧	૯૦	૧,૩૩૧	૧૨	૮	૦૪૬
	૫	૩	૧૧	૨	૨૮૯	૧૦૦	૧,૪૭૯	૧૨	૩	૬૦૭
	૬	૪	૭	૦	૩૪૭	૨૦૦	૨,૯૫૯	૮	૭	૨૧૪
	૭	૫	૨	૧૦	૪૦૫	૩૦૦	૪,૪૩૯	૪	૧૦	૮૨૧
	૮	૫	૧૪	૮	૪૬૨	૪૦૦	૫,૯૧૯	૧	૨	૪૨૮
	૯	૬	૧૦	૬	૫૨૦	૫૦૦	૭,૩૯૮	૧૩	૬	૦૩૫
	૧૦	૭	૬	૪	૫૭૮	૬૦૦	૮,૮૭૮	૯	૯	૬૪૨
	૧૧	૮	૨	૨	૬૩૬	૭૦૦	૧૦,૩૫૮	૬	૧	૨૪૯
	૧૨	૮	૧૪	૦	૬૯૪	૮૦૦	૧૧,૮૩૮	૨	૪	૮૫૫
	૧૩	૯	૯	૧૦	૭૫૧	૯૦૦	૧૩,૩૧૭	૧૪	૮	૪૬૨
	૧૪	૧૦	૫	૮	૮૦૯	૧,૦૦૦	૧,૪૭૯૭	૧૧	૦	૦૬૯
	૧૫	૧૧	૧	૬	૮૬૭	૧,૫૦૦	૨૨,૧૯૬	૮	૬	૧૦૪
	૧૬	૧૧	૧૩	૪	૯૨૫	૨,૦૦૦	૨૯,૫૯૫	૬	૦	૧૩૯
	૧૭	૧૨	૯	૨	૯૮૩	૩,૦૦૦	૪૪,૩૯૩	૧	૦	૨૦૯
	૧૮	૧૩	૫	૧	૦૪૦	૪,૦૦૦	૫૯૧૯૦	૧૨	૦	૨૭૮
	૧૯	૧૪	૦	૧૧	૦૯૮	૫,૦૦૦	૭૩.૯૮૮	૭	૦	૩૪૮
પોંડ	૧	૧૪	૧૨	૯	૧૫૬	૧૦,૦૦૦	૧,૪૭,૯૭૬	૧૪	૦	૬૯૬
	૨	૨૯	૯	૬	૩૧૨	૨૦,૦૦૦	૨,૯૫,૯૫૩	૧૨	૧	૩૯૨
	૩	૪૪	૬	૩	૪૬૮	૪૦,૦૦૦	૫૯૧ ૯૦૭	૮	૨	૭૮૪

શી. ૧-૪ પેન્સ ૩॥ આના						શી. ૧-૪ ૭/૧૬ પેન્સ (૧-૪]=॥)					
પાઇ	પૌંડ	શી.	પે	ફાર		રૂપીઆ	પૌંડ.	શી	પે.	ફાર	
૧				૦	૩૩૮	૮		૧૦	૯	૩	
૨				૦	૬૭૬	૯		૧૨	૧	૩	૮૧૭૫
૩				૧	૦૧૪	૧૦		૧૩	૬	૦	૭૫૦
૪				૧	૩૫૧	૨૦	૧	૭	૦	૧	૫૦૦
૫				૧	૬૮૯	૩૦	૨	૦	૬	૨	૨૫૦
૬				૨	૦૨૭	૪૦	૨	૧૪	૦	૩	
૭				૨	૩૬૪	૫૦	૩	૭	૬	૩	૭૫૦
૮				૨	૭૦૨	૬૦	૪	૧	૧	૦	૫૦૦
૯				૩	૦૪૦	૭૦	૪	૧૪	૭	૧	૨૫૦
૧૦				૩	૩૭૮	૮૦	૫	૮	૧	૨	
૧૧				૩	૭૧૬	૯૦	૬	૧	૭	૨	૭૫૦
આના ૧			૧	૦	૦૫૫	૧૦૦	૬	૧૫	૧	૩	૫૦૦
૨			૨	૦	૧૦૯	૨૦૦	૧૩	૧૦	૩	૩	
૩			૩	૦	૧૬૪	૩૦૦	૨૦	૫	૫	૨	૫૦૦
૪			૪	૦	૨૧૯	૪૦૦	૨૭	૦	૭	૨	
૫			૫	૦	૨૭૩	૫૦૦	૩૩	૧૫	૯	૧	૫૦૦
૬			૬	૦	૩૨૬	૬૦૦	૪૦	૧૦	૧૧	૧	
૭			૭	૦	૩૮૩	૭૦૦	૪૭	૬	૧	૦	૫૦૦
૮			૮	૦	૪૩૮	૮૦૦	૫૪	૧	૩	૦	
૯			૯	૦	૪૯૨	૯૦૦	૬૦	૧૬	૪	૩	૫૦૦
૧૦			૧૦	૦	૫૪૭	૧.૦૦૦	૬૭	૧૧	૬	૩	
૧૧			૧૧	૦	૬૦૨	૧,૫૦૦	૧૦૧	૭	૪	૦	૫૦૦
૧૨		૧	૦	૦	૬૫૬	૨,૦૦૦	૧૩૫	૩	૧	૨	
૧૩		૧	૧	૦	૭૧૧	૩,૦૦૦	૨૦૨	૧૪	૮	૧	
૧૪		૧	૨	૦	૭૬૬	૪,૦૦૦	૨૭૦	૬	૩	૦	
૧૫		૧	૩	૦	૮૨૦	૫,૦૦૦	૩૩૭	૧૭	૯	૩	
રૂપીઆ ૧		૧	૪	૦	૮૭૫	૧૦,૦૦૦	૬૭૫	૧૫	૭	૨	
૨		૨	૮	૧	૭૫૦	૨૦,૦૦૦	૧,૩૫૧	૧૧	૩	૦	
૩		૪	૦	૨	૬૨૫	૩૦,૦૦૦	૨,૦૨૭	૬	૧૦	૨	
૪		૫	૪	૩	૫૦૦	૪૦,૦૦૦	૨,૭૦૩	૨	૬	૦	
૫		૬	૯	૦	૩૭૫	૫૦ ૦૦૦	૩,૩૭૮	૧૮	૧	૨	
૬		૮	૧	૧	૨૫૦	૧,૦૦,૦૦૦	૬,૭૫૭	૧૬	૩	૦	
૭		૯	૫	૨	૧૨૫	૨,૦૦,૦૦૦	૧૩,૫૧૫	૧૨	૬	૦	

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

થી. ૧-૪ પેન્સ ૩।। આના					શી. ૧-૪ ૧૫/૬૪ પેન્સ (૧-૪)=।।)				
પેન્સ	રૂપીઆ.	આ	પા	દો	પાઊંડ	રૂપીઆ	આ	પા.	દો.
૧		૦	૧૧	૮૨૭	૪	૫૯	૨	૧	૬૮૬
૨		૧	૧૧	૬૫૪	૫	૭૩	૧૪	૮	૧૦૮
૩		૨	૧૧	૪૮૦	૬	૮૮	૧૧	૨	૫૨૯
૪		૩	૧૧	૩૦૭	૭	૧૦૩	૭	૮	૯૫૧
૫		૪	૧૧	૧૩૪	૮	૧૧૮	૪	૩	૩૭૨
૬		૫	૧૦	૯૬૧	૯	૧૩૩	૦	૯	૭૯૪
૭		૬	૧૦	૭૮૭	૧૦	૧૪૭	૧૩	૪	૨૧૫
૮		૭	૧૦	૬૧૪	૨૦	૨૯૫	૧૦	૮	૪૩૧
૯		૮	૧૦	૪૪૧	૩૦	૪૪૩	૮	૦	૬૪૬
૧૦		૯	૧૦	૨૬૮	૪૦	૫૯૧	૫	૪	૮૬૨
૧૧		૧૦	૧૦	૦૯૪	૫૦	૭૩૯	૨	૯	૦૭૭
શીલાંગ ૧		૧૧	૯	૯૨૧	૬૦	૮૮૭	૦	૧	૨૯૩
૨	૧	૭	૭	૮૪૨	૭૦	૧.૦૩૪	૧૩	૫	૫૦૯
૩	૨	૩	૫	૭૬૩	૮૦	૧,૧૮૨	૧૦	૯	૭૨૪
૪	૨	૧૫	૩	૬૮૪	૯૦	૧,૩૩૦	૮	૧	૯૪૦
૫	૩	૧૧	૧	૬૦૫	૧૦૦	૧,૪૭૮	૫	૬	૧૫૫
૬	૪	૬	૧૧	૫૨૬	૨૦૦	૨ ૯૫૬	૧૧	૦	૩૧૨
૭	૫	૨	૯	૪૪૮	૩૦૦	૪,૪૩૫	૦	૬	૪૬૭
૮	૫	૧૪	૭	૩૬૯	૪૦૦	૫૯૧૩	૬	૦	૬૨૩
૯	૬	૧૦	૫	૨૯૦	૫૦૦	૭,૩૯૧	૧૧	૬	૭૭૯
૧૦	૭	૬	૩	૨૧૧	૬૦૦	૮,૮૭૦	૧	૦	૯૩૫
૧૧	૮	૨	૧	૧૩૨	૭૦૦	૧૦,૩૪૮	૬	૭	૦૯૧
૧૨	૮	૧૩	૧૧	૦૫૩	૮૦૦	૧૧.૮૨૬	૧૨	૧	૨૪૭
૧૩	૯	૯	૮	૯૭૪	૯૦૦	૧૩,૩૦૫	૧	૭	૪૦૩
૧૪	૧૦	૫	૬	૮૯૫	૧,૦૦૦	૧૪,૭૮૩	૭	૧	૫૫૯
૧૫	૧૧	૧	૪	૮૧૬	૧,૫૦૦	૨૨,૧૭૫	૨	૮	૩૩૮
૧૬	૧૧	૧૩	૨	૭૩૭	૨,૦૦૦	૨૯,૫૬૬	૧૪	૩	૧૧૮
૧૭	૧૨	૯	૦	૬૫૮	૩,૦૦૦	૪૪,૩૫૦	૫	૪	૬૭૭
૧૮	૧૩	૪	૧૦	૫૭૯	૪,૦૦૦	૫૯,૧૩૩	૧૨	૬	૨૩૬
૧૯	૧૪	૦	૮	૫૦૧	૫,૦૦૦	૭૩,૯૧૭	૩	૭	૭૯૫
પાઊંડ ૧	૧૪	૧૨	૬	૪૨૨	૧૦,૦૦૦	૧,૪૭,૮૩૪	૭	૩	૫૯૧
૨	૨૯	૯	૦	૮૪૩	૨૦,૦૦૦	૨,૯૫,૬૬૮	૧૪	૭	૧૮૨
૩	૪૪	૫	૭	૨૬૫	૪૦,૦૦૦	૫,૯૧,૩૩૭	૧૩	૨	૩૬૪

શી. ૧-૪ પેન્સ ૩॥ આના.						શી. ૧-૪ ૧૫/૬૪ પે. (૧-૪)≡॥।					
પાઇ	પાઊંડ	શી	પે.	ફાર		રૂપીઆ	પાઊંડ.	શી.	પે.	ફાર.	
૧				૦	૩૩૮	૮		૧૦	૯	૩	૫૦૦
૨				૦	૬૭૬	૯		૧૨	૨	૦	૪૩૭
૩				૧	૦૧૫	૧૦		૧૩	૬	૧	૩૭૫
૪				૧	૩૫૩	૨૦	૧	૭	૦	૨	૭૫૦
૫				૧	૬૯૧	૩૦	૨	૦	૭	૦	૧૨૫
૬				૨	૦૨૯	૪૦	૨	૧૪	૧	૧	૫૦૦
૭				૨	૩૬૮	૫૦	૩	૭	૭	૨	૮૭૫
૮				૨	૭૦૬	૬૦	૪	૧	૨	૦	૨૫૦
૯				૩	૦૪૪	૭૦	૪	૧૪	૮	૧	૬૨૫
૧૦				૩	૩૮૨	૮૦	૫	૮	૨	૩	
૧૧				૩	૭૨૦	૯૦	૬	૧	૯	૦	૩૭૫
આના ૧			૧	૦	૦૫૯	૧૦૦	૬	૧૫	૩	૧	૭૫૦
૨			૨	૦	૧૧૭	૨૦૦	૧૩	૧૦	૬	૩	૫૦૦
૩			૩	૦	૧૭૬	૩૦૦	૨૦	૫	૧૦	૧	૨૫૦
૪			૪	૦	૨૩૪	૪૦૦	૨૭	૧	૧	૩	
૫			૫	૦	૨૯૩	૫૦૦	૩૩	૧૬	૫	૦	૭૫૦
૬			૬	૦	૩૫૨	૬૦૦	૪૦	૧૧	૮	૨	૫૦૦
૭			૭	૦	૪૧૦	૭૦૦	૪૭	૭	૦	૦	૨૫૦
૮			૮	૦	૪૬૯	૮૦૦	૫૪	૨	૩	૨	
૯			૯	૦	૫૨૭	૯૦૦	૬૦	૧૭	૬	૩	૭૫૦
૧૦			૧૦	૦	૫૮૬	૧,૦૦૦	૬૭	૧૨	૧૦	૧	૫૦૦
૧૧			૧૧	૦	૬૪૫	૧,૫૦૦	૧૦૧	૯	૩	૨	૨૫૦
૧૨		૧	૦	૦	૭૦૩	૨,૦૦૦	૧૩૫	૫	૮	૩	
૧૩		૧	૧	૦	૭૬૨	૩,૦૦૦	૨૦૨	૧૮	૭	૦	૫૦૦
૧૪		૧	૨	૦	૮૨૦	૪,૦૦૦	૨૭૦	૧૧	૫	૨	
૧૫		૧	૩	૦	૮૭૯	૫,૦૦૦	૩૩૮	૪	૩	૩	૫૦૦
રૂપીઆ ૧		૧	૪	૦	૯૩૭	૧૦,૦૦૦	૬૭૬	૮	૭	૩	
૨		૨	૮	૧	૮૭૫	૨૦,૦૦૦	૧,૩૫૨	૧૭	૩	૨	
૩		૪	૦	૨	૮૧૨	૩૦,૦૦૦	૨,૦૨૯	૫	૧૧	૧	
૪		૫	૪	૩	૭૫૦	૪૦,૦૦૦	૨,૭૦૫	૧૪	૭	૦	
૫		૬	૯	૦	૬૮૭	૫૦,૦૦૦	૩,૩૮૨	૩	૨	૩	
૬		૮	૧	૧	૬૨૫	૧,૦૦,૦૦૦	૬,૭૬૪	૬	૫	૨	
૭		૯	૫	૨	૫૬૨	૨,૦૦,૦૦૦	૧૩,૫૨૮	૧૨	૧૧	૦	.

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૪ પેન્સ ૪ આના					શી. ૧-૪ ¼ પેન્સ (૧-૪।)				
પેન્સ.	રૂપીઆ	આ	પા.	દો.	પૌંડ.	રૂપીઆ.	આ	પા.	દો.
૧		૦	૧૧	૮૧૫	૪	૫૯	૧	૨	૭૬૯
૨		૧	૧૧	૬૩૧	૫	૭૩	૧૩	૬	૪૬૨
૩		૨	૧૧	૪૪૬	૬	૮૮	૯	૧૦	૧૫૪
૪		૩	૧૧	૨૬૨	૭	૧૦૩	૬	૧	૮૪૬
૫		૪	૧૧	૦૭૭	૮	૧૧૮	૨	૫	૫૩૮
૬		૫	૧૦	૮૯૨	૯	૧૩૨	૧૪	૯	૨૩૧
૭		૬	૧૦	૭૦૮	૧૦	૧૪૭	૧૧	૦	૯૨૩
૮		૭	૧૦	૫૨૩	૨૦	૨૯૫	૬	૧	૮૪૬
૯		૮	૧૦	૩૩૮	૩૦	૪૪૩	૧	૨	૭૬૯
૧૦		૯	૧૦	૧૫૪	૪૦	૫૯૦	૧૨	૩	૬૯૨
૧૧		૧૦	૯	૯૬૯	૫૦	૭૩૮	૭	૪	૬૧૫
શીલીંગ ૧		૧૧	૯	૭૮૫	૬૦	૮૮૬	૨	૫	૫૩૮
૨	૧	૭	૭	૫૬૯	૭૦	૧,૦૩૩	૧૩	૬	૪૬૨
૩	૨	૩	૫	૩૫૪	૮૦	૧,૧૮૧	૮	૭	૩૮૫
૪	૨	૧૫	૩	૧૩૮	૯૦	૧,૩૨૯	૩	૮	૩૦૮
૫	૩	૧૧	૦	૯૨૩	૧૦૦	૧,૪૭૬	૧૪	૯	૨૩૧
૬	૪	૬	૧૦	૭૦૮	૨૦૦	૨,૯૫૩	૧૩	૬	૪૬૨
૭	૫	૨	૮	૪૯૨	૩૦૦	૪,૪૩૦	૧૨	૩	૬૯૨
૮	૫	૧૪	૬	૨૭૭	૪૦૦	૫,૯૦૭	૧૧	૦	૯૨૩
૯	૬	૧૦	૪	૦૬૨	૫૦૦	૭,૩૮૪	૯	૧૦	૧૫૪
૧૦	૭	૬	૧	૮૪૬	૬૦૦	૮,૮૬૧	૮	૭	૩૮૫
૧૧	૮	૧	૧૧	૬૩૧	૭૦૦	૧૦,૩૩૮	૭	૪	૬૧૫
૧૨	૮	૧૩	૯	૪૧૫	૮૦૦	૧૧,૮૧૫	૬	૧	૮૪૬
૧૩	૯	૯	૭	૨૦૦	૯૦૦	૧૩,૨૯૨	૪	૧૧	૦૭૭
૧૪	૧૦	૫	૪	૯૮૫	૧,૦૦૦	૧૪,૭૬૯	૩	૮	૩૦૮
૧૫	૧૧	૧	૨	૭૬૯	૧,૫૦૦	૨૨,૧૫૩	૧૩	૬	૪૬૨
૧૬	૧૧	૧૩	૦	૫૫૪	૨,૦૦૦	૨૯,૫૩૮	૭	૪	૬૧૬
૧૭	૧૨	૮	૧૦	૪૩૮	૩,૦૦૦	૪૪,૩૦૭	૧૧	૦	૯૨૩
૧૮	૧૩	૪	૮	૧૨૩	૪,૦૦૦	૫૯,૦૭૬	૧૪	૯	૨૩૧
૧૯	૧૪	૦	૫	૯૦૮	૫,૦૦૦	૭૩,૮૪૬	૨	૫	૫૩૮
પાઉંડ ૧	૧૪	૧૨	૩	૬૯૨	૧૦,૦૦૦	૧,૪૭,૬૯૨	૪	૧૧	૦૭૬
૨	૨૯	૮	૭	૩૮૫	૨૦,૦૦૦	૨,૯૫,૩૮૪	૯	૧૦	૧૫૨
૩	૪૪	૪	૧૧	૦૭૭	૪૦,૦૦૦	૫,૯૦,૭૬૯	૩	૮	૩૦૪

રૂપીઆનાપૌંડ

શી. ૧-૪ પેન્સ ૪ આના

પાઇ	પાઊંડ	શી	પે	ફાર
૧				૦ ૩૩૯
૨				૦ ૬૭૭
૩				૧ ૦૧૬
૪				૧ ૩૫૪
૫				૧ ૬૯૩
૬				૨ ૦૩૧
૭				૨ ૩૭૦
૮				૨ ૭૦૮
૯				૩ ૦૪૭
૧૦				૩ ૩૮૫
૧૧				૩ ૭૨૪
આના ૧			૧	૦ ૦૬૨
૨			૨	૦ ૧૨૫
૩			૩	૦ ૧૮૭
૪			૪	૦ ૨૫૦
૫			૫	૦ ૩૧૨
૬			૬	૦ ૩૭૫
૭			૭	૦ ૪૩૭
૮			૮	૦ ૫૦૦
૯			૯	૦ ૫૬૨
૧૦			૧૦	૦ ૬૨૫
૧૧			૧૧	૦ ૬૮૮
૧૨		૧	૦	૦ ૭૫૦
૧૩		૧	૧	૦ ૮૧૨
૧૪		૧	૨	૦ ૮૭૫
૧૫		૧	૩	૦ ૯૩૭
રૂપીઆ ૧		૧	૪	૧
૨		૨	૮	૨
૩		૪	●	૩
૪		૫	૫	૦
૫		૬	૯	૧
૬		૮	૧	૨
૭		૯	૫	૩

શી. ૧-૪ $\frac{૧}{૪}$ પેન્સ (૧-આ)

રૂપાઆ.	પાઊંડ	શી.	પે.	ફાર
૮		૧૦	૧૦	૦
૯		૧૨	૨	૧
૧૦		૧૩	૬	૨
૨૦	૧	૭	૧	૦
૩૦	૨	૦	૭	૨
૪૦	૨	૧૪	૨	૦
૫૦	૩	૭	૮	૨
૬૦	૪	૧	૩	૦
૭૦	૪	૧૪	૯	૨
૮૦	૫	૮	૪	૦
૯૦	૬	૧	૧૦	૨
૧૦૦	૬	૧૫	૫	
૨૦૦	૧૩	૧૦	૧૦	
૩૦૦	૨૦	૬	૩	
૪૦૦	૨૭	૧	૮	
૫૦૦	૩૩	૧૭	૧	
૬૦૦	૪૦	૧૨	૬	
૭૦૦	૪૭	૭	૧૧	
૮૦૦	૫૪	૩	૪	
૯૦૦	૬૦	૧૮	૯	
૧,૦૦૦	૬૭	૧૪	૨	
૧,૫૦૦	૧૦૧	૧૧	૩	
૨,૦૦૦	૧૩૫	૮	૪	
૩,૦૦૦	૨૦૩	૨	૬	
૪,૦૦૦	૨૭૦	૧૬	૮	
૫,૦૦૦	૩૩૮	૧૦	૧૦	
૧૦,૦૦૦	૬૭૭	૧	૮	
૨૦,૦૦૦	૧,૩૫૪	૩	૪	
૩૦,૦૦૦	૨,૦૩૧	૫	૦	
૪૦,૦૦૦	૨,૭૦૮	૬	૮	
૫૦,૦૦૦	૩,૩૮૫	૮	૪	
૧,૦૦,૦૦૦	૬,૭૭૦	૧૬	૮	
૨,૦૦,૦૦૦	૧૩,૫૪૧	૧૩	૪	

(વીલાયતી હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૪ પેન્સ ૪૧ આના					શી. ૧-૪$\frac{17}{64}$ પેન્સ (૧-૪૧૦)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો	પૌંડ	રૂપીઆ.	આ	પા.	દો.
૧			૧૧	૮૦૪	૪	૫૯	૦	૩	૮૭૩
૨		૧	૧૧	૬૦૮	૫	૭૩	૧૨	૪	૮૪૧
૩		૨	૧૧	૪૧૨	૬	૮૮	૮	૫	૮૧૦
૪		૩	૧૧	૨૧૬	૭	૧૦૩	૪	૬	૭૭૮
૫		૪	૧૧	૦૨૦	૮	૧૧૮	૦	૭	૭૪૬
૬		૫	૧૦	૮૨૪	૯	૧૩૨	૧૨	૮	૭૧૫
૭		૬	૧૦	૬૨૮	૧૦	૧૪૭	૮	૯	૬૮૩
૮		૭	૧૦	૪૩૨	૨૦	૨૯૫	૧	૭	૩૬૬
૯		૮	૧૦	૨૩૬	૩૦	૪૪૨	૧૦	૫	૦૪૯
૧૦		૯	૧૦	૦૪૦	૪૦	૫૯૦	૩	૨	૭૩૨
૧૧		૧૦	૯	૮૪૪	૫૦	૭૩૭	૧૨	૦	૪૧૫
શીલીંગ ૧		૧૧	૯	૬૪૮	૬૦	૮૮૫	૪	૧૦	૦૯૮
૨	૧	૭	૭	૨૯૭	૭૦	૧,૦૩૨	૧૩	૭	૭૮૧
૩	૨	૩	૪	૯૪૫	૮૦	૧,૧૮૦	૬	૫	૪૬૪
૪	૨	૧૫	૨	૫૯૪	૯૦	૧,૩૨૭	૧૫	૩	૧૪૭
૫	૩	૧૧	૦	૨૪૨	૧૦૦	૧,૪૭૫	૮	૦	૮૩૦
૬	૪	૬	૯	૮૯૦	૨૦૦	૨,૯૫૧	૦	૧	૬૬૦
૭	૫	૨	૭	૫૩૯	૩૦૦	૪,૪૨૬	૮	૨	૪૯૦
૮	૫	૧૪	૫	૧૮૭	૪૦૦	૫,૯૦૨	૦	૩	૩૨૦
૯	૬	૧૦	૨	૮૩૬	૫૦૦	૭,૩૭૭	૮	૪	૧૫૦
૧૦	૭	૬	૦	૪૮૪	૬૦૦	૮,૮૫૩	૦	૪	૯૮૦
૧૧	૮	૧	૧૦	૧૩૩	૭૦૦	૧૦,૩૨૮	૮	૫	૮૧૦
૧૨	૮	૧૩	૭	૭૮૧	૮૦૦	૧૧,૮૦૪	૦	૬	૬૪૦
૧૩	૯	૯	૫	૪૨૯	૯૦૦	૧૩,૨૭૯	૮	૭	૪૭૦
૧૪	૧૦	૫	૩	૦૭૮	૧,૦૦૦	૧૪,૭૫૫	૦	૮	૩૦૦
૧૫	૧૧	૧	૦	૭૨૬	૧,૫૦૦	૨૨,૧૩૨	૯	૦	૪૫૦
૧૬	૧૧	૧૨	૧૦	૩૭૫	૨,૦૦૦	૨૯,૫૧૦	૧	૪	૬૦૦
૧૭	૧૨	૮	૮	૦૨૩	૩,૦૦૦	૪૪,૨૬૫	૨	૦	૯૦૦
૧૮	૧૩	૪	૫	૬૭૧	૪,૦૦૦	૫૯,૦૨૦	૨	૯	૨૦૦
૧૯	૧૪	૦	૩	૩૨૦	૫,૦૦૦	૭૩,૭૭૫	૩	૫	૫૦૦
પૌંડ ૧	૧૪	૧૨	૦	૯૬૮	૧૦,૦૦૦	૧,૪૭,૫૫૦	૬	૧૧	
૨	૨૯	૮	૧	૯૩૭	૨૦,૦૦૦	૨,૯૫,૧૦૦	૧૩	૧૦	
૩	૪૪	૪	૨	૯૦૫	૪૦,૦૦૦	૫,૯૦,૨૦૧	૧૧	૮	

શી ૧-૪ પેન્સ ૪। આના						શી ૧-૪ $\frac{17}{64}$ પેન્સ (૧-૪। ૦।)					
પાઈ	પાઉંડ	શી.	પે.	ફાર		રૂપીઆ.	પાઉંડ	શી	પે.	ફાર	
૧				૦	૩૩૯	૮		૧૦	૧૦	૦	૫૦૦
૨				૦	૬૭૮	૯		૧૨	૨	૧	૫૬૨
૩				૧	૦૧૭	૧૦		૧૩	૬	૨	૬૨૫
૪				૧	૩૫૫	૨૦	૧	૭	૧	૧	૨૫૦
૫				૧	૬૯૪	૩૦	૨	૦	૭	૩	૮૭૫
૬				૨	૦૩૩	૪૦	૨	૧૪	૨	૨	૫૦૦
૭				૨	૩૭૨	૫૦	૩	૭	૯	૧	૧૨૫
૮				૨	૭૧૧	૬૦	૪	૧	૩	૩	૭૫૦
૯				૩	૦૫૦	૭૦	૪	૧૪	૧૦	૨	૩૭૫
૧૦				૩	૩૮૯	૮૦	૫	૮	૫	૧	
૧૧				૩	૭૨૮	૯૦	૬	૧	૧૧	૩	૬૨૫
આના ૧			૧	૦	૦૬૬	૧૦૦	૬	૧૫	૬	૨	૨૫૦
૨			૨	૦	૧૩૩	૨૦૦	૧૩	૧૧	૧	૦	૫૦૦
૩			૩	૦	૧૯૯	૩૦૦	૨૦	૬	૭	૨	૭૫૦
૪			૪	૦	૨૬૬	૪૦૦	૨૭	૨	૨	૧	
૫			૫	૦	૩૩૨	૫૦૦	૩૩	૧૭	૮	૩	૨૫૦
૬			૬	૦	૩૯૮	૬૦૦	૪૦	૧૩	૩	૧	૫૦૦
૭			૭	૦	૪૬૫	૭૦૦	૪૭	૮	૯	૩	૭૫૦
૮			૮	૦	૫૩૧	૮૦૦	૫૪	૪	૪	૨	
૯			૯	૦	૫૯૮	૯૦૦	૬૦	૧૯	૧૧	૦	૨૫૦
૧૦			૧૦	૦	૬૬૪	૧,૦૦૦	૬૭	૧૫	૫	૨	૫૦૦
૧૧			૧૧	૦	૭૩૦	૧,૫૦૦	૧૦૧	૧૨	૧૪	૧	૭૫૦
૧૨		૧	૦	૦	૭૯૭	૨,૦૦૦	૧૩૫	૧૦	૧૧	૧	
૧૩		૧	૧	૦	૮૬૩	૩,૦૦૦	૨૦૩	૬	૪	૩	૫૦૦
૧૪		૧	૨	૦	૯૩૦	૪,૦૦૦	૨૭૧	૧	૧૦	૨	
૧૫		૧	૩	૦	૯૯૬	૫,૦૦૦	૩૩૮	૧૭	૪	૦	૫૦૦
રૂપીઆ ૧		૧	૪	૧	૦૬૨	૧૦,૦૦૦	૬૭૭	૧૪	૮	૧	
૨		૨	૮	૨	૧૨૫	૨૦,૦૦૦	૧,૩૫૫	૯	૪	૨	
૩		૪	૦	૩	૧૮૭	૩૦,૦૦૦	૨,૦૩૩	૪	૦	૩	
૪		૫	૫	૦	૨૫૦	૪૦,૦૦૦	૨,૭૧૦	૧૮	૯	૦	
૫		૬	૯	૧	૩૧૨	૫૦,૦૦૦	૩,૩૮૮	૧૩	૫	૧	
૬		૮	૧	૨	૩૭૫	૧,૦૦,૦૦૦	૬,૭૭૭	૬	૧૦	૨	
૭		૯	૫	૩	૪૩૭	૨ ૦૦.૦૦૦	૧૩,૫૫૪	૧૩	૯	૦	

પૌંડના રૂપીઆ

શી ૧—૪ પેન્સ ૪॥ આના					શા ૧-૪ $\frac{૩૧}{૩૨}$ પેન્સ (૧-૪૧૦॥)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો	પૌંડ	રૂપીઆ	આ	પા	દો
૧		૦	૧૧	૭૯૩	૪	૫૮	૧૫	૪	૯૯૮
૨		૧	૧૧	૫૮૫	૫	૭૩	૧૧	૩	૨૪૮
૩		૨	૧૧	૩૭૮	૬	૮૮	૭	૧	૪૯૭
૪		૩	૧૧	૧૭૧	૭	૧૦૩	૨	૧૧	૭૪૭
૫		૪	૧૦	૯૬૪	૮	૧૧૭	૧૪	૯	૯૯૬
૬		૫	૧૦	૭૫૬	૯	૧૩૨	૧૦	૮	૨૪૬
૭		૬	૧૦	૫૪૯	૧૦	૧૪૭	૬	૬	૪૯૫
૮		૭	૧૦	૩૪૨	૨૦	૨૯૪	૧૩	૦	૯૯૦
૯		૮	૧૦	૧૩૪	૩૦	૪૪૨	૩	૭	૪૮૬
૧૦		૯	૯	૯૨૭	૪૦	૫૮૯	૧૦	૧	૯૮૧
૧૧		૧૦	૯	૭૨૦	૫૦	૭૩૭	૦	૮	૪૭૬
શીલીંગ ૧		૧૧	૯	૫૧૨	૬૦	૮૮૪	૭	૨	૯૭૧
૨	૧	૭	૭	૦૨૫	૭૦	૧,૦૩૧	૧૩	૯	૪૬૬
૩	૨	૩	૪	૫૩૭	૮૦	૧,૧૭૯	૪	૩	૯૬૨
૪	૨	૧૫	૨	૦૫૦	૯૦	૧,૩૨૬	૧૦	૧૦	૪૫૭
૫	૩	૧૦	૧૧	૫૬૨	૧૦૦	૧,૪૭૪	૧	૪	૯૫૨
૬	૪	૬	૯	૦૭૫	૨૦૦	૨,૯૪૮	૨	૯	૯૦૪
૭	૫	૨	૬	૫૮૭	૩૦૦	૪,૪૨૨	૪	૨	૮૫૬
૮	૫	૧૪	૪	૧૦૦	૪૦૦	૫,૮૯૦	૫	૭	૮૦૮
૯	૬	૧૦	૧	૬૧૨	૫૦૦	૭,૩૭૦	૭	૦	૭૬૦
૧૦	૭	૫	૧૧	૧૨૫	૬૦૦	૮,૮૪૪	૮	૫	૭૧૨
૧૧	૮	૧	૮	૬૩૭	૭૦૦	૧૦,૩૧૮	૯	૧૦	૬૬૪
૧૨	૮	૧૩	૬	૧૫૦	૮૦૦	૧૧,૭૯૨	૧૧	૩	૬૧૬
૧૩	૯	૯	૩	૬૬૨	૯૦૦	૧૩,૨૬૬	૧૨	૮	૫૬૮
૧૪	૧૦	૫	૧	૧૭૫	૧,૦૦૦	૧૪,૭૪૦	૧૪	૧	૫૨૦
૧૫	૧૧	૦	૧૦	૬૮૭	૧,૫૦૦	૨૨,૧૧૧	૫	૨	૨૮૦
૧૬	૧૧	૧૨	૮	૨૦૦	૨,૦૦૦	૨૯,૪૮૧	૧૨	૩	૦૪૦
૧૭	૧૨	૮	૫	૭૧૨	૩,૦૦૦	૪૪,૨૨૨	૧૦	૪	૫૬૦
૧૮	૧૩	૪	૩	૨૨૫	૪,૦૦૦	૫,૮૯૬૩	૮	૬	૦૮૦
૧૯	૧૪	૦	૦	૭૩૭	૫,૦૦૦	૭૩,૭૦૪	૬	૭	૬૦૦
પૌંડ ૧	૧૪	૧૧	૧૦	૨૫૦	૧૦,૦૦૦	૧,૪૭,૪૦૮	૧૩	૩	૨૦૨
૨	૨૯	૭	૮	૪૯૯	૨૦,૦૦૦	૨,૯૪,૮૧૭	૧૦	૬	૪૦૪
૩	૪૪	૩	૬	૭૪૯	૪૦,૦૦૦	૫,૮૯,૬૩૫	૫	૦	૮૦૮

શી. ૧-૪ પેન્સ ૪ાા આના				
પાઇ	પાઉંડ	શી.	પે	ફાર
૧				૦ ૩૩૯
૨				૦ ૬૭૮
૩				૧ ૦૧૮
૪				૧ ૩૫૭
૫				૧ ૬૯૬
૬				૨ ૦૩૫
૭				૨ ૩૭૪
૮				૨ ૭૧૪
૯				૩ ૦૫૩
૧૦				૩ ૩૯૨
૧૧				૩ ૭૩૧
આના ૧			૧	૦ ૦૭૦
૨			૨	૦ ૧૪૧
૩			૩	૦ ૨૧૧
૪			૪	૦ ૨૮૧
૫			૫	૦ ૩૫૨
૬			૬	૦ ૪૨૨
૭			૭	૦ ૪૯૨
૮			૮	૦ ૫૬૨
૯			૯	૦ ૬૩૩
૧૦			૧૦	૦ ૭૦૩
૧૧			૧૧	૦ ૭૭૩
૧૨		૧	૦	૦ ૮૪૪
૧૩		૧	૧	૦ ૯૧૪
૧૪		૧	૨	૦ ૯૮૪
૧૫		૧	૩	૧ ૦૫૫
રૂ. ૧		૧	૪	૧ ૧૨૫
૨		૨	૮	૨ ૨૫૦
૩		૪	૦	૩ ૩૭૫
૪		૫	૫	૦ ૫૦૦
૫		૬	૯	૧ ૬૨૫
૬		૮	૧	૨ ૭૫૦
૭		૯	૫	૩ ૮૭૫

શી. ૧-૪ ૩/૧૬ પેન્સ (૧-૪ા૦ાા)				
રૂપીઆ	પાઉંડ	શી.	પે.	ફાર
૮		૧૦	૧૦	૧
૯		૧૨	૨	૨ ૧૨૫
૧૦		૧૩	૬	૩ ૨૫૦
૨૦	૧	૭	૧	૨ ૫૦૦
૩૦	૨	૦	૮	૧ ૭૫૦
૪૦	૨	૧૪	૩	૧
૫૦	૩	૭	૧૦	૦ ૨૫૦
૬૦	૪	૧	૪	૩ ૫૦૦
૭૦	૪	૧૪	૧૧	૨ ૭૫૦
૮૦	૫	૮	૬	૨
૯૦	૬	૨	૧	૧ ૨૫૦
૧૦૦	૬	૧૫	૮	૦ ૫૦૦
૨૦૦	૧૩	૧૧	૪	૧
૩૦૦	૨૦	૭	૦	૧ ૫૦૦
૪૦૦	૨૭	૨	૮	૨
૫૦૦	૩૩	૧૮	૪	૨ ૫૦૦
૬૦૦	૪૦	૧૪	૦	૩
૭૦૦	૪૭	૯	૮	૩ ૫૦૦
૮૦૦	૫૪	૫	૫	૦
૯૦૦	૬૧	૧	૧	૦ ૫૦૦
૧,૦૦૦	૬૭	૧૬	૯	૧
૧,૫૦૦	૧૦૧	૧૫	૧	૩ ૫૦૦
૨,૦૦૦	૧૩૫	૧૩	૬	૨
૩,૦૦૦	૨૦૩	૧૦	૩	૩
૪,૦૦૦	૨૭૧	૭	૧	૦
૫,૦૦૦	૩૩૯	૩	૧૦	૧
૧૦,૦૦૦	૬૭૮	૭	૮	૨
૨૦,૦૦૦	૧,૩૫૬	૧૫	૫	૦
૩૦,૦૦૦	૨,૦૩૫	૩	૧	૨
૪૦,૦૦૦	૨,૭૧૩	૧૦	૧૦	૦
૫૦,૦૦૦	૩,૩૯૧	૧૮	૬	૨
૧,૦૦,૦૦૦	૬,૭૮૩	૧૭	૧	૦
૨,૦૦,૦૦૦	૧૩,૫૬૭	૧૪	૨	૦

 પૌંડના રૂપીઆ

શી ૧-૪ પેન્સ ૪ાાા આના					શી. ૧-૪ ૬૩/૬૪ પેન્સ (૧-૪ા ૦ાાા)				
પેન્સ.	રૂપીઆ.	આ	પા	દો.	પાઊંડ	રૂપીઆ	આ	પા.	દો.
૧		૦	૧૧	૭૮૧	૪	૫૮	૧૪	૬	૧૪૪
૨		૧	૧૧	૫૬૩	૫	૭૩	૧૦	૧	૬૮૦
૩		૨	૧૧	૩૪૪	૬	૮૮	૫	૯	૨૧૬
૪		૩	૧૧	૧૨૬	૭	૧૦૩	૧	૪	૭૫૨
૫		૪	૧૦	૯૦૭	૮	૧૧૭	૧૩	૦	૨૮૮
૬		૫	૧૦	૬૮૮	૯	૧૩૨	૮	૭	૮૨૪
૭		૬	૧૦	૪૭૦	૧૦	૧૪૭	૪	૩	૩૬૦
૮		૭	૧૦	૨૫૧	૨૦	૨૯૪	૮	૬	૭૧૯
૯		૮	૧૦	૦૩૩	૩૦	૪૪૧	૧૨	૧૦	૦૭૯
૧૦		૯	૯	૮૧૪	૪૦	૫૮૯	૧	૧	૪૩૮
૧૧		૧૦	૯	૫૯૫	૫૦	૭૩૬	૫	૪	૭૯૮
શીલીંગ ૧		૧૧	૯	૩૭૭	૬૦	૮૮૩	૯	૮	૧૫૭
૨	૧	૭	૬	૭૫૪	૭૦	૧,૦૩૦	૧૩	૧૧	૫૧૭
૩	૨	૩	૪	૧૩૦	૮૦	૧,૧૭૮	૨	૨	૮૭૬
૪	૨	૧૫	૧	૫૦૭	૯૦	૧,૩૨૫	૬	૬	૨૩૬
૫	૩	૧૦	૧૦	૮૮૪	૧૦૦	૧,૪૭૨	૧૦	૯	૫૯૫
૬	૪	૬	૮	૨૬૧	૨૦૦	૨,૯૪૫	૫	૭	૧૯૧
૭	૫	૨	૫	૬૩૮	૩૦૦	૪,૪૧૮	૦	૪	૫૮૬
૮	૫	૧૪	૩	૦૧૪	૪૦૦	૫,૮૯૦	૧૧	૨	૩૮૨
૯	૬	૧૦	૦	૩૯૧	૫૦૦	૭,૩૬૩	૫	૧૧	૯૭૭
૧૦	૭	૫	૯	૭૬૮	૬૦૦	૮,૮૩૬	૦	૯	૫૭૨
૧૧	૮	૧	૭	૧૪૫	૭૦૦	૧૦,૩૦૮	૧૧	૭	૧૬૮
૧૨	૮	૧૩	૪	૫૨૨	૮૦૦	૧૧,૭૮૧	૬	૪	૭૬૩
૧૩	૯	૯	૧	૮૯૮	૯૦૦	૧૩,૨૫૪	૧	૨	૩૧૯
૧૪	૧૦	૪	૧૧	૨૭૫	૧,૦૦૦	૧૪,૭૨૬	૧૧	૧૧	૯૫૪
૧૫	૧૧	૦	૮	૬૫૨	૧,૫૦૦	૨૨,૦૯૦	૧	૧૧	૯૩૧
૧૬	૧૧	૧૨	૬	૦૨૯	૨,૦૦૦	૨૯,૪૫૩	૭	૧૧	૯૦૮
૧૭	૧૨	૮	૩	૪૦૬	૩,૦૦૦	૪૪,૧૮૦	૩	૧૧	૮૬૨
૧૮	૧૩	૪	૦	૭૮૨	૪,૦૦૦	૫૮,૯૦૬	૧૫	૧૧	૮૧૬
૧૯	૧૩	૧૫	૧૦	૧૫૯	૫,૦૦૦	૭૩,૬૩૩	૧૧	૧૧	૭૭૦
પાઊંડ ૧	૧૪	૧૧	૭	૫૩૬	૧,૦,૦૦૦	૧,૪૭,૨૬૭	૭	૧૧	૫૪૦
૨	૨૯	૭	૩	૦૭૨	૨,૦,૦૦૦	૨,૯૪,૫૩૪	૧૫	૧૧	૦૮૦
૩	૪૪	૨	૧૦	૬૦૮	૪,૦,૦૦૦	૫,૮૯,૦૬૯	૧૫	૧૦	૧૫૯

શી. ૧-૪ા પેન્સ ૪ાા આના						શી. ૧-૪ ૧૯/૬૪ પેન્સ (૧-૪ા૦ાાા)					
પાઈ.	પૌંડ.	શી	પે.	ફાર		રૂપીઆ	પૌંડ	શી	પે	ફાર	
૧				૦	૩૪૦	૮		૧૦	૧૦	૧	૫૦૦
૨				૦	૬૭૯	૯		૧૨	૨	૨	૬૮૭
૩				૧	૦૧૯	૧૦		૧૩	૬	૩	૮૭૫
૪				૧	૩૫૮	૨૦	૧	૭	૧	૩	૭૫૦
૫				૧	૬૯૮	૩૦	૨	૦	૮	૩	૬૨૫
૬				૨	૦૩૭	૪૦	૨	૧૪	૩	૩	૫૦૦
૭				૨	૩૭૭	૫૦	૩	૭	૧૦	૩	૩૭૫
૮				૨	૭૧૬	૬૦	૪	૧	૫	૩	૨૫૦
૯				૩	૦૫૬	૭૦	૪	૧૫	૦	૩	૧૨૫
૧૦				૩	૩૯૫	૮૦	૫	૮	૭	૩	
૧૧				૩	૭૩૫	૯૦	૬	૨	૨	૨	૮૭૫
આના ૧			૧	૦	૦૭૪	૧૦૦	૬	૧૫	૯	૨	૭૫૦
૨			૨	૦	૧૪૮	૨૦૦	૧૩	૧૧	૭	૧	૫૦૦
૩			૩	૦	૨૨૩	૩૦૦	૨૦	૭	૫	૦	૨૫૦
૪			૪	૦	૨૯૭	૪૦૦	૨૭	૩	૨	૩	
૫			૫	૦	૩૭૧	૫૦૦	૩૩	૧૯	૦	૧	૭૫૦
૬			૬	૦	૪૪૫	૬૦૦	૪૦	૧૪	૧૦	૦	૫૦૦
૭			૭	૦	૫૨૦	૭૦૦	૪૭	૧૦	૭	૩	૨૫૦
૮			૮	૦	૫૯૪	૮૦૦	૫૪	૬	૫	૨	
૯			૯	૦	૬૬૮	૯૦૦	૬૧	૨	૩	૦	૭૫૦
૧૦			૧૦	૦	૭૪૨	૧,૦૦૦	૬૭	૧૮	૦	૩	૫૦૦
૧૧			૧૧	૦	૮૧૬	૧,૫૦૦	૧૦૧	૧૭	૧	૧	૨૫૦
૧૨		૧	૦	૦	૮૯૧	૨,૦૦૦	૧૩૫	૧૬	૧	૩	
૧૩		૧	૧	૦	૯૬૫	૩,૦૦૦	૨૦૩	૧૪	૨	૨	૫૦૦
૧૪		૧	૨	૧	૦૩૯	૪,૦૦૦	૨૭૧	૧૨	૩	૨	
૧૫		૧	૩	૧	૧૧૩	૫,૦૦૦	૩૩૯	૧૦	૪	૧	૫૦૦
રૂપીઆ ૧		૧	૪	૧	૧૮૭	૧૦,૦૦૦	૬૭૯	૦	૮	૩	
૨		૨	૮	૨	૩૭૫	૨૦,૦૦૦	૧,૩૫૮	૧	૫	૨	
૩		૪	૦	૩	૫૬૨	૩૦,૦૦૦	૨,૦૩૭	૨	૨	૧	
૪		૫	૫	૦	૭૫૦	૪૦,૦૦૦	૨,૭૧૬	૨	૧૧	૦	
૫		૬	૯	૧	૯૩૭	૫૦,૦૦૦	૩,૩૯૫	૩	૭	૩	
૬		૮	૧	૩	૧૨૫	૧,૦૦,૦૦૦	૬,૭૯૦	૭	૩	૨	
૭		૯	૬	૦	૩૧૨	૨,૦૦.૦૦૦	૧૩.૫૮૦	૧૪	૭	૦	.

પૌંડના રૂપીઆ

શી. ૧-૪ પેન્સ ૫ આના					શી ૧-૪ ૨૫/૬૪ પેન્સ (૧-૪૧-				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો.	પાંડ	રૂપીઆ	આ	પા	દો.
૧		૦	૧૧	૭૭૦	૪	૫૮	૧૩	૭	૩૧૦
૨		૧	૧૧	૫૪૦	૫	૭૩	૯	૦	૧૩૮
૩		૨	૧૧	૩૧૦	૬	૮૮	૪	૪	૯૬૬
૪		૩	૧૧	૦૮૦	૭	૧૦૨	૧૫	૯	૭૯૩
૫		૪	૧૦	૮૫૧	૮	૧૧૭	૧૧	૨	૬૨૧
૬		૫	૧૦	૬૨૧	૯	૧૩૨	૬	૭	૪૪૮
૭		૬	૧૦	૩૯૧	૧૦	૧૪૭	૨	૦	૨૭૬
૮		૭	૧૦	૧૬૧	૨૦	૨૯૪	૪	૦	૫૫૨
૯		૮	૯	૯૩૧	૩૦	૪૪૧	૬	૦	૮૨૮
૧૦		૯	૯	૭૦૧	૪૦	૫૮૮	૮	૧	૧૦૩
૧૧		૧૦	૯	૪૭૧	૫૦	૭૩૫	૧૦	૧	૩૭૯
શીલીંગ ૧		૧૧	૯	૨૪૧	૬૦	૮૮૨	૧૨	૧	૬૫૫
૨	૧	૭	૬	૪૮૩	૭૦	૧,૦૨૯	૧૪	૧	૯૩૧
૩	૨	૩	૩	૭૨૪	૮૦	૧,૧૭૭	૦	૨	૨૦૭
૪	૨	૧૫	૦	૯૬૬	૯૦	૧,૩૨૪	૨	૨	૪૮૩
૫	૩	૧૦	૧૦	૨૦૭	૧૦૦	૧,૪૭૧	૪	૨	૭૫૯
૬	૪	૬	૭	૪૪૮	૨૦૦	૨,૯૪૨	૮	૫	૫૧૭
૭	૫	૨	૪	૬૯૦	૩૦૦	૪.૪૧૩	૧૨	૮	૨૭૬
૮	૫	૧૪	૧	૯૩૧	૪૦૦	૫,૮૮૫	૦	૧૧	૦૩૪
૯	૬	૯	૧૧	૧૭૨	૫૦૦	૭,૩૫૬	૫	૧	૭૯૩
૧૦	૭	૫	૮	૪૧૪	૬૦૦	૮,૮૨૭	૯	૪	૫૫૨
૧૧	૮	૧	૫	૬૫૫	૭૦૦	૧૦,૨૯૮	૧૩	૭	૩૧૦
૧૨	૮	૧૩	૨	૮૯૭	૮૦૦	૧૧ ૭૭૦	૧	૧૦	૦૬૯
૧૩	૯	૯	૦	૧૩૮	૯૦૦	૧૩,૨૪૧	૬	૦	૮૨૮
૧૪	૧૦	૪	૯	૩૭૯	૧,૦૦૦	૧૪,૭૧૨	૧૦	૩	૫૮૬
૧૫	૧૧	૦	૬	૬૨૧	૧,૫૦૦	૨૨,૦૬૮	૧૫	૫	૩૭૯
૧૬	૧૧	૧૨	૩	૮૬૨	૨,૦૦૦	૨૯,૪૨૫	૪	૭	૧૭૨
૧૭	૧૨	૮	૧	૧૦૩	૩,૦૦૦	૪૪,૧૩૭	૧૪	૧૦	૭૫૮
૧૮	૧૩	૩	૧૦	૩૪૫	૪,૦૦૦	૫૮,૮૫૦	૯	૨	૩૪૪
૧૯	૧૩	૧૫	૭	૫૮૬	૫,૦૦૦	૭૩,૫૬૩	૩	૫	૯૩૦
પાઉંડ ૧	૧૪	૧૧	૪	૮૨૮	૧૦,૦૦૦	૧,૪૭,૧૨૬	૬	૧૧	૮૬૧
૨	૨૯	૬	૯	૬૫૫	૨૦,૦૦૦	૨,૯૪,૨૫૨	૧૩	૧૧	૭૨૨
૩	૪૪	૨	૨	૪૮૩	૪૦,૦૦૦	૫,૮૮,૫૦૫	૧૧	૧૧	૪૪૪

શી. ૧-૪ પેન્સ ૫ આના

પાઇ	પૌંડ	શી.	પે	ફાર	
૧				૦	૩૪૦
૨				૦	૬૮૦
૩				૧	૦૨૦
૪				૧	૩૫૯
૫				૧	૬૯૯
૬				૨	૦૩૯
૭				૨	૩૭૯
૮				૨	૭૧૯
૯				૩	૦૫૯
૧૦				૩	૩૯૮
૧૧				૩	૭૩૮
આના ૧			૧	૦	૦૭૮
૨			૨	૦	૧૫૬
૩			૩	૦	૨૩૪
૪			૪	૦	૩૧૩
૫			૫	૦	૩૯૧
૬			૬	૦	૪૬૯
૭			૭	૦	૫૪૭
૮			૮	૦	૬૨૫
૯			૯	૦	૭૦૩
૧૦			૧૦	૦	૭૮૧
૧૧			૧૧	૦	૮૫૯
૧૨		૧	૦	૦	૯૩૮
૧૩		૧	૧	૧	૦૧૬
૧૪		૧	૨	૧	૦૯૪
૧૫		૧	૩	૧	૧૭૨
રૂપીઆ ૧		૧	૪	૧	૨૫૦
૨		૨	૮	૨	૫૦૦
૩		૪	૦	૩	૭૫૦
૪		૫	૫	૧	
૫		૬	૯	૨	૨૫૦
૬		૮	૧	૩	૫૦૦
૭		૯	૬	૦	૫૦૭

શી. ૧-૪ ૫/૧૬ પેન્સ (૧-૪।-)

રૂપીઆ	પૌંડ.	શી	પે.	ફાર	
૮		૧૦	૧૦	૨	
૯		૧૨	૨	૩	૨૫૦
૧૦		૧૩	૭	૦	૫૦૦
૨૦	૧	૭	૨	૧	
૩૦	૨	૦	૯	૧	૫૦૦
૪૦	૨	૧૪	૪	૨	
૫૦	૩	૭	૧૧	૨	૫૦૦
૬૦	૪	૧	૬	૩	
૭૦	૪	૧૫	૧	૩	૫૦૦
૮૦	૫	૮	૯	૦	
૯૦	૬	૨	૪	૦	૫૦૦
૧૦૦	૬	૧૫	૧૧	૧	
૨૦૦	૧૩	૧૧	૧૦	૨	
૩૦૦	૨૦	૭	૯	૩	
૪૦૦	૨૭	૩	૯	૦	
૫૦૦	૩૩	૧૯	૮	૧	
૬૦૦	૪૦	૧૫	૭	૨	
૭૦૦	૪૭	૧૧	૬	૩	
૮૦૦	૫૪	૭	૬	૦	
૯૦૦	૬૧	૩	૫	૧	
૧.૦૦૦	૬૭	૧૯	૪	૨	
૧,૫૦૦	૧૦૧	૧૯	૦	૩	
૨,૦૦૦	૧૩૫	૧૮	૯	૦	
૩,૦૦૦	૨૦૩	૧૮	૧	૨	
૪,૦૦૦	૨૭૧	૧૭	૬	૦	
૫,૦૦૦	૩૩૯	૧૬	૧૦	૨	
૧૦,૦૦૦	૬૭૯	૧૩	૯	૦	
૨૦,૦૦૦	૧,૩૫૯	૭	૬	૦	
૩૦,૦૦૦	૨,૦૩૯	૧	૩	૦	
૪૦,૦૦૦	૨,૭૧૮	૧૫	૦	૦	
૫૦ ૦૦૦	૩,૩૯૮	૮	૯	૦	
૧,૦૦,૦૦૦	૬,૭૯૬	૧૭	૬	૦	
૨,૦૦,૦૦૦	૧૩,૫૯૩	૧૫	૦	૦	

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧–૪ પેન્સ પા આના				
પેન્સ	રૂપીઆ.	આ	પા.	દો
૧		૦	૧૧	૭૨૯
૨		૧	૧૧	૫૧૮
૩		૨	૧૧	૨૭૭
૪		૩	૧૧	૦૩૫
૫		૪	૧૦	૭૯૪
૬		૫	૧૦	૫૫૩
૭		૬	૧૦	૩૧૨
૮		૭	૧૦	૦૭૧
૯		૮	૯	૮૩૦
૧૦		૯	૯	૫૮૯
૧૧		૧૦	૯	૩૪૭
શીલીંગ ૧		૧૧	૯	૧૦૬
૨	૧	૭	૬	૨૧૨
૩	૨	૩	૩	૩૧૯
૪	૨	૧૫	૦	૪૨૫
૫	૩	૧૦	૯	૫૩૧
૬	૪	૬	૬	૬૩૭
૭	૫	૨	૩	૭૪૪
૮	૫	૧૪	૦	૮૫૦
૯	૬	૯	૯	૯૫૬
૧૦	૭	૫	૭	૦૬૨
૧૧	૮	૧	૪	૧૬૮
૧૨	૮	૧૩	૧	૨૭૫
૧૩	૯	૮	૧૦	૩૮૧
૧૪	૧૦	૪	૭	૪૮૭
૧૫	૧૧	૦	૪	૫૯૩
૧૬	૧૧	૧૨	૧	૭૦૦
૧૭	૧૨	૭	૧૦	૮૦૬
૧૮	૧૩	૩	૭	૯૧૨
૧૯	૧૩	૧૫	૫	૦૧૮
પાઊંડ ૧	૧૪	૧૧	૨	૧૨૪
૨	૨૯	૬	૪	૨૪૯
૩	૪૪	૧	૬	૩૭૩

શી. ૧–૪૩/૮ પેન્સ (૧–૪ના)				
પાઊંડ	રૂપીઆ	આ	પા	દો.
૪	૫૮	૧૨	૮	૪૯૮
૫	૭૩	૭	૧૦	૬૨૨
૬	૮૮	૩	૦	૭૪૬
૭	૧૦૨	૧૪	૨	૮૭૧
૮	૧૧૭	૯	૪	૯૯૫
૯	૧૩૨	૪	૭	૧૨૦
૧૦	૧૪૬	૧૫	૯	૨૪૪
૨૦	૨૯૩	૧૫	૬	૪૮૮
૩૦	૪૪૦	૧૫	૩	૭૩૨
૪૦	૫૮૭	૧૫	૦	૯૭૬
૫૦	૭૩૪	૧૪	૧૦	૨૨૦
૬૦	૮૮૧	૧૪	૭	૪૬૪
૭૦	૧,૦૨૮	૧૪	૪	૭૦૮
૮૦	૧,૧૭૫	૧૪	૧	૯૫૨
૯૦	૧,૩૨૨	૧૩	૧૧	૧૯૬
૧૦૦	૧,૪૬૯	૧૩	૮	૪૪૦
૨૦૦	૨,૯૩૯	૧૧	૪	૮૮૦
૩૦૦	૪,૪૦૯	૯	૧	૩૨૧
૪૦૦	૫,૮૭૯	૬	૯	૭૬૧
૫૦૦	૭,૩૪૯	૪	૬	૨૦૧
૬૦૦	૮,૮૧૯	૨	૨	૬૪૧
૭૦૦	૧૦,૨૮૮	૧૫	૧૧	૦૮૧
૮૦૦	૧૧,૭૫૮	૧૩	૭	૫૨૨
૯૦૦	૧૩,૨૨૮	૧૧	૩	૯૬૨
૧,૦૦૦	૧૪,૬૯૮	૯	૦	૪૦૨
૧,૫૦૦	૨૨,૦૪૭	૧૩	૬	૬૦૩
૨,૦૦૦	૨૯,૩૯૭	૨	૦	૮૦૪
૩,૦૦૦	૪૪,૦૯૫	૧૧	૧	૨૦૬
૪,૦૦૦	૫૮,૭૯૪	૪	૧	૬૦૮
૫,૦૦૦	૭૩,૪૯૨	૧૩	૨	૦૧૦
૧૦,૦૦૦	૧,૪૬,૯૮૫	૧૦	૪	૦૧૯
૨૦,૦૦૦	૨,૯૩,૯૭૧	૪	૮	૦૩૮
૪૦,૦૦૦	૫,૮૭,૯૪૨	૯	૪	૦૭૭

શી. ૧-૪ પેન્સ પા આના					શી. ૧-૪ ૨૩/૬૪ પેન્સ (૧-૪ાના)				
પાઇ	પૌંડ	શી	પે	ફાર	રૂપીઆ.	પૌંડ	શી.	પે	ફાર
૧				૦ ૩૪૦	૮		૧૦	૧૦	૨ ૫૦૦
૨				૦ ૬૮૦	૯		૧૨	૨	૩ ૮૧૨
૩				૧ ૦૨૧	૧૦		૧૩	૭	૧ ૧૨૫
૪				૧ ૩૬૧	૨૦	૧	૭	૨	૨ ૨૫૦
૫				૧ ૭૦૧	૩૦	૨	૦	૯	૩ ૩૭૫
૬				૨ ૦૪૧	૪૦	૨	૧૪	૫	૦ ૫૦૦
૭				૨ ૩૮૧	૫૦	૩	૮	૦	૧ ૬૨૫
૮				૨ ૭૨૨	૬૦	૪	૧	૭	૨ ૭૫૦
૯				૩ ૦૬૨	૭૦	૪	૧૫	૨	૩ ૮૭૫
૧૦				૩ ૪૦૨	૮૦	૫	૮	૧૦	૧
૧૧				૩ ૭૪૨	૯૦	૬	૨	૫	૨ ૧૨૫
આના ૧			૧	૦ ૦૮૨	૧૦૦	૬	૧૬	૦	૩ ૨૫૦
૨			૨	૦ ૧૬૪	૨૦૦	૧૩	૧૨	૧	૨ ૫૦૦
૩			૩	૦ ૨૪૬	૩૦૦	૨૦	૮	૨	૧ ૭૫૦
૪			૪	૦ ૩૨૮	૪૦૦	૨૭	૪	૩	૧
૫			૫	૦ ૪૧૦	૫૦૦	૩૪	૦	૪	૦ ૨૫૦
૬			૬	૦ ૪૯૨	૬૦૦	૪૦	૧૬	૪	૩ ૫૦૦
૭			૭	૦ ૫૭૪	૭૦૦	૪૭	૧૨	૫	૨ ૭૫૦
૮			૮	૬૫૬	૮૦૦	૫૪	૮	૬	૨
૯			૯	૦ ૭૩૮	૯૦૦	૬૧	૪	૭	૧ ૨૫૦
૧૦			૧૦	૦ ૮૨૦	૧,૦૦૦	૬૮	૦	૮	૦ ૫૦૦
૧૧			૧૧	૦ ૯૦૨	૧,૫૦૦	૧૦૨	૧	૦	૦ ૭૫૦
૧૨		૧	૦	૦ ૯૮૪	૨,૦૦૦	૧૩૬	૧	૪	૧
૧૩		૧	૧	૧ ૦૬૬	૩,૦૦૦	૨૦૪	૨	૦	૧ ૫૦૦
૧૪		૧	૨	૧ ૧૪૮	૪,૦૦૦	૨૭૨	૨	૮	૨
૧૫		૧	૩	૧ ૨૩૦	૫,૦૦૦	૩૪૦	૩	૪	૨ ૫૦૦
રૂપીઆ ૧		૧	૪	૧ ૩૧૨	૧૦,૦૦૦	૬૮૦	૬	૯	૧
૨		૨	૮	૨ ૬૨૫	૨૦,૦૦૦	૧,૩૬૦	૧૩	૬	૨
૩		૪	૦	૩ ૯૩૭	૩૦,૦૦૦	૨,૦૪૧	૦	૩	૩
૪		૫	૫	૧ ૨૫૦	૪૦,૦૦૦	૨,૭૨૧	૭	૧	
૫		૬	૯	૨ ૫૬૨	૫૦,૦૦૦	૩,૪૦૧	૧૩	૧૦	૧
૬		૮	૧	૩ ૮૭૫	૧,૦૦,૦૦૦	૬,૮૦૩	૭	૮	૨
૭		૯	૬	૧ ૧૮૭	૨,૦૦,૦૦૦	૧૩,૬૦૬	૧૫	૧	

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૪ પેન્સ પા આના					શી. ૧-૪ ૧/૩ ૧/૨ પેન્સ (૧-૪ાન્ના)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો	પૌંડ	રૂપીઆ	આ	પા	દો
૧		૦	૧૧	૭૪૮	૪	૫૮	૧૧	૯	૭૦૬
૨		૧	૧૧	૪૯૫	૫	૭૩	૬	૯	૧૩૨
૩		૨	૧૧	૨૪૩	૬	૮૮	૧	૮	૫૫૮
૪		૩	૧૦	૯૯૦	૭	૧૦૨	૧૨	૭	૯૮૫
૫		૪	૧૦	૭૩૮	૮	૧૧૭	૭	૭	૪૧૧
૬		૫	૧૦	૪૮૬	૯	૧૩૨	૨	૬	૮૩૭
૭		૬	૧૦	૨૩૩	૧૦	૧૪૬	૧૩	૬	૨૬૪
૮		૭	૯	૯૮૧	૨૦	૨૯૩	૧૧	૦	૫૨૮
૯		૮	૯	૭૨૮	૩૦	૪૪૦	૮	૬	૭૯૨
૧૦		૯	૯	૪૭૬	૪૦	૫૮૭	૬	૧	૦૫૫
૧૧		૧૦	૯	૨૨૪	૫૦	૭૩૪	૩	૭	૩૧૯
શાલીગ ૧		૧૧	૮	૯૭૧	૬૦	૮૮૧	૧	૧	૫૮૩
૨	૧	૭	૫	૯૪૩	૭૦	૧,૦૨૭	૧૪	૭	૮૪૮
૩	૨	૩	૨	૯૧૪	૮૦	૧,૧૭૪	૧૨	૨	૧૧૧
૪	૨	૧૪	૧૧	૮૮૫	૯૦	૧,૩૨૧	૯	૮	૩૭૫
૫	૩	૧૦	૮	૮૫૭	૧૦૦	૧,૪૬૮	૭	૨	૬૩૯
૬	૪	૬	૫	૮૨૮	૨૦૦	૨,૯૩૬	૧૪	૫	૨૭૭
૭	૫	૨	૨	૭૯૯	૩૦૦	૪,૪૦૫	૫	૭	૯૧૬
૮	૫	૧૩	૧૧	૭૭૧	૪૦૦	૫,૮૭૩	૧૨	૧૦	૫૫૪
૯	૬	૯	૮	૭૪૨	૫૦૦	૭,૩૪૨	૪	૧	૧૯૨
૧૦	૭	૫	૫	૭૧૩	૬૦૦	૮,૮૧૦	૧૧	૩	૮૩૨
૧૧	૮	૧	૨	૬૮૫	.૭૦૦	૧૦,૨૭૯	૨	૬	૪૭૦
૧૨	૮	૧૨	૧૧	૬૫૬	૮૦૦	૧૧,૭૪૭	૯	૯	૧૦૯
૧૩	૯	૮	૮	૬૨૭	૯૦૦	૧૩,૨૧૬	૦	૧૧	૭૪૭
૧૪	૧૦	૪	૫	૫૯૮	૧,૦૦૦	૧૪,૬૮૪	૮	૨	૩૮૬
૧૫	૧૧	૦	૨	૫૭૦	૧,૫૦૦	૨૨,૦૨૬	૧૨	૩	૫૭૯
૧૬	૧૧	૧૧	૧૧	૫૪૧	૨,૦૦૦	૨૯,૩૬૯	૦	૪	૭૭૨
૧૭	૧૨	૭	૮	૫૧૨	૩,૦૦૦	૪૪,૦૫૩	૮	૭	૧૫૮
૧૮	૧૩	૩	૫	૪૮૪	૪,૦૦૦	૫૮,૭૩૮	૦	૯	૫૪૪
૧૯	૧૩	૧૫	૨	૪૫૫	૫,૦૦૦	૭૩,૪૨૨	૮	૧૧	૯૩૦
પૌંડ ૧	૧૪	૧૦	૧૧	૪૨૬	૧૦,૦૦૦	૧,૪૬,૮૪૫	૧	૧૧	૮૬૨
૨	૨૯	૫	૧૦	૮૫૩	૨૦,૦૦૦	૨,૯૩,૬૯૦	૩	૧૧	૭૨૫
,, ૩	૪૪	૦	૧૦	૨૭૯	૪૦,૦૦૦	૫,૮૭,૩૮૦	૭	૧૧	૪૪૯

શી. ૧–૪ પેન્સ પા। આના

પાઇ.	પાઉંડ	શી.	પે	ફાર.	
૧				૦	૩૪૧
૨				૦	૬૮૧
૩				૧	૦૨૨
૪				૧	૩૬૨
૫				૧	૭૦૩
૬				૨	૦૪૩
૭				૨	૩૮૪
૮				૨	૭૨૪
૯				૩	૦૬૫
૧૦				૩	૪૦૫
૧૧				૩	૭૪૬
આના. ૧			૧	૦	૦૮૬
૨			૨	૦	૧૭૨
૩			૩	૦	૨૫૮
૪			૪	૦	૩૪૪
૫			૫	૦	૪૩૦
૬			૬	૦	૫૧૬
૭			૭	૦	૬૦૨
૮			૮	૦	૬૮૮
૯			૯	૦	૭૭૩
૧૦			૧૦	૦	૮૫૯
૧૧			૧૧	૦	૯૪૬
૧૨		૧	૦	૧	૦૩૧
૧૩		૧	૧	૧	૧૧૭
૧૪		૧	૨	૧	૨૦૩
૧૫		૧	૩	૧	૨૮૯
રૂપીઆ ૧		૧	૪	૧	૩૭૫
૨		૨	૮	૨	૭૫૦
૩		૪	૧	૦	૧૨૫
૪		૫	૫	૧	૫૦૦
૫		૬	૯	૨	૮૭૫
૬		૮	૨	૦	૨૫૦
૭		૯	૬	૧	૬૨૫

શી. ૧–૪ $\frac{૧૧}{૩૨}$ પેન્સ (૧–૪।–॥)

રૂપીઆ	પાઉંડ	શી.	પે.	ફાર.	
૮		૧૦	૧૦	૩	
૯		૧૨	૩	૦	૩૭૫
૧૦		૧૩	૭	૧	૭૫૦
૨૦	૧	૭	૨	૩	૫૦૦
૩૦	૨	૦	૧૦	૧	૨૫૦
૪૦	૨	૧૪	૫	૩	
૫૦	૩	૮	૧	૦	૭૫૦
૬૦	૪	૧	૮	૨	૫૦૦
૭૦	૪	૧૫	૪	૦	૨૫૦
૮૦	૫	૮	૧૧	૨	
૯૦	૬	૨	૬	૩	૭૫૦
૧૦૦	૬	૧૬	૨	૧	૫૦૦
૨૦૦	૧૩	૧૨	૪	૩	
૩૦૦	૨૦	૮	૭	૦	૫૦૦
૪૦૦	૨૭	૪	૯	૨	
૫૦૦	૩૪	૦	૧૧	૩	૫૦૦
૬૦૦	૪૦	૧૭	૨	૧	
૭૦૦	૪૭	૧૩	૪	૨	૫૦૦
૮૦૦	૫૪	૯	૭	૦	
૯૦૦	૬૧	૫	૯	૧	૫૦૦
૧,૦૦૦	૬૮	૧	૧૧	૩	
૧,૫૦૦	૧૦૨	૨	૧૧	૨	૫૦૦
૨,૦૦૦	૧૩૬	૩	૧૧	૨	
૩ ૦૦૦	૨૦૪	૫	૧૧	૧	
૪,૦૦૦	૨૭૨	૭	૧૧	૦	
૫,૦૦૦	૩૪૦	૯	૧૦	૩	
૧૦,૦૦૦	૬૮૦	૧૯	૯	૨	
૨૦.૦૦૦	૧,૩૬૧	૧૯	૭	૦	
૩૦,૦૦૦	૨,૦૪૨	૧૯	૪	૨	
૪૦,૦૦૦	૨,૭૨૩	૧૯	૨	૦	
૫૦,૦૦૦	૩,૪૦૪	૧૮	૧૧	૨	
૧,૦૦,૦૦૦	૬,૮૦૯	૧૭	૧૧		
૨,૦૦ ૦૦૦	૧૩,૬૧૯	૧૫	૧૦		

પૌંડના રૂપીઆ

શી ૧—૪ પેન્સ પાાા આના					શા ૧-૪ $\frac{3}{6}\frac{3}{8}$ પેન્સ (૧-૪ા~ાાા)				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો.	પૌંડ	રૂપીઆ	આ	પા.	દો.
૧			૧૧	૭૩૬	૪	૫૮	૧૦	૧૦	૯૩૪
૨		૧	૧૧	૪૭૩	૫	૭૩	૫	૭	૬૬૮
૩		૨	૧૧	૨૦૯	૬	૮૮	૦	૪	૪૦૧
૪		૩	૧૦	૯૪૬	૭	૧૦૨	૧૧	૧	૧૩૫
૫		૪	૧૦	૬૮૨	૮	૧૧૭	૫	૯	૮૬૮
૬		૫	૧૦	૪૧૮	૯	૧૩૨	૦	૬	૬૦૨
૭		૬	૧૦	૧૫૫	૧૦	૧૪૬	૧૧	૩	૩૩૫
૮		૭	૯	૮૯૧	૨૦	૨૯૩	૬	૬	૬૭૦
૯		૮	૯	૬૨૮	૩૦	૪૪૦	૧	૧૦	૦૦૬
૧૦		૯	૯	૩૬૪	૪૦	૫૮૬	૧૩	૧	૩૪૧
૧૧		૧૦	૯	૧૦૦	૫૦	૭૩૩	૮	૪	૬૭૬
શીલીંગ ૧		૧૧	૮	૮૩૭	૬૦	૮૮૦	૩	૮	૦૧૧
૨	૧	૭	૫	૬૭૩	૭૦	૧,૦૨૬	૧૪	૧૧	૩૪૭
૩	૨	૩	૨	૫૧૦	૮૦	૧,૧૭૩	૧૦	૨	૬૮૨
૪	૨	૧૪	૧૧	૩૪૭	૯૦	૧,૩૨૦	૫	૬	૦૧૭
૫	૩	૧૦	૮	૧૮૩	૧૦૦	૧,૪૬૭	૦	૯	૩૫૨
૬	૪	૬	૫	૦૨૦	૨૦૦	૨,૯૩૪	૧	૬	૭૦૫
૭	૫	૨	૧	૮૫૭	૩૦૦	૪,૪૦૧	૨	૪	૦૫૭
૮	૫	૧૩	૧૦	૬૯૩	૪૦૦	૫,૮૬૮	૩	૧	૪૧૦
૯	૬	૯	૭	૫૩૦	૫૦૦	૭,૩૩૫	૩	૧૦	૭૬૨
૧૦	૭	૫	૪	૩૬૭	૬૦૦	૮,૮૦૨	૪	૮	૧૧૫
૧૧	૮	૧	૧	૨૦૩	૭૦૦	૧૦,૨૬૯	૫	૫	૪૬૭
૧૨	૮	૧૨	૧૦	૦૪૦	૮૦૦	૧૧,૭૩૬	૬	૨	૮૧૯
૧૩	૯	૮	૬	૮૭૭	૯૦૦	૧૩,૨૦૩	૭	૦	૧૭૨
૧૪	૧૦	૪	૩	૭૧૪	૧,૦૦૦	૧૪,૬૭૦	૭	૯	૫૨૪
૧૫	૧૧	૦	૦	૫૫૦	૧,૫૦૦	૨૨,૦૦૫	૧૧	૮	૨૮૬
૧૬	૧૧	૧૧	૯	૩૮૬	૨,૦૦૦	૨૯,૩૪૦	૧૫	૭	૦૪૯
૧૭	૧૨	૭	૬	૨૨૩	૩,૦૦૦	૪૪,૦૧૧	૭	૪	૫૭૩
૧૮	૧૩	૩	૩	૦૬૦	૪,૦૦૦	૫૮,૬૮૧	૧૫	૨	૦૯૭
૧૯	૧૩	૧૪	૧૧	૮૯૭	૫,૦૦૦	૭૩,૩૫૨	૬	૧૧	૬૨૨
પૌંડ ૧	૧૪	૧૦	૮	૭૩૪	૧૦,૦૦૦	૧,૪૬,૭૦૪	૧૩	૧૧	૨૪૪
૨	૨૯	૫	૫	૪૬૭	૨૦,૦૦૦	૨,૯૩,૪૦૯	૧૧	૧૦	૪૮૭
૩	૪૪	૦	૨	૨૦૧	૪૦,૦૦૦	૫,૮૬,૮૧૯	૭	૮	૯૭૫

શી. ૧-૪ પેન્સ પાાા આના					શી ૧-૪ ૨૩/૬૪ પેન્સ (૧-૪ાા-ાાા)				
પાઇ.	પાઊંડ	શી.	પે	ફાર.	રૂપીઆ	પાઊંડ	શી	પે	ફાર.
૧				૦ ૩૪૧	૮		૧૦	૧૦	૩ ૫૦૦
૨				૦ ૬૮૨	૯		૧૨	૩	૦ ૯૩૭
૩				૧ ૦૨૨	૧૦		૧૩	૭	૨ ૩૭૫
૪				૧ ૩૬૩	૨૦	૧	૭	૩	૦ ૭૫૦
૫				૧ ૭૦૪	૩૦	૨	૦	૧૦	૩ ૧૨૫
૬				૨ ૦૪૫	૪૦	૨	૧૪	૬	૧ ૫૦૦
૭				૨ ૩૮૬	૫૦	૩	૮	૧	૩ ૮૭૫
૮				૨ ૭૨૬	૬૦	૪	૧	૯	૨ ૨૫૦
૯				૩ ૦૬૭	૭૦	૪	૧૫	૫	૦ ૬૨૫
૧૦				૩ ૪૦૮	૮૦	૫	૯	૦	૩
૧૧				૩ ૭૪૯	૯૦	૬	૨	૮	૧ ૩૭૫
આના. ૧			૧	૦ ૦૯૦	૧૦૦	૬	૧૬	૩	૩ ૭૫૦
૨			૨	૦ ૧૮૦	૨૦૦	૧૩	૧૨	૭	૩ ૫૦૦
૩			૩	૦ ૨૭૦	૩૦૦	૨૦	૮	૧૧	૩ ૨૫૦
૪			૪	૦ ૩૫૯	૪૦૦	૨૭	૫	૩	૩
૫			૫	૦ ૪૪૯	૫૦૦	૩૪	૧	૭	૨ ૭૫૦
૬			૬	૦ ૫૩૯	૬૦૦	૪૦	૧૭	૧૧	૨ ૫૦૦
૭			૭	૦ ૬૨૯	૭૦૦	૪૭	૧૪	૩	૨ ૨૫૦
૮			૮	૦ ૭૧૯	૮૦૦	૫૪	૧૦	૭	૨
૯			૯	૦ ૮૦૯	૯૦૦	૬૧	૬	૧૧	૧ ૭૫૦
૧૦			૧૦	૦ ૮૯૮	૧,૦૦૦	૬૮	૩	૩	૧ ૫૦૦
૧૧			૧૧	૦ ૯૮૮	૧,૫૦૦	૧૦૨	૪	૧૧	૦ ૨૫૦
૧૨		૧	૦	૧ ૦૭૮	૨,૦૦૦	૧૩૬	૬	૬	૩
૧૩		૧	૧	૧ ૧૬૮	૩,૦૦૦	૨૦૪	૯	૧૦	૦ ૫૦૦
૧૪		૧	૨	૧ ૨૫૮	૪,૦૦૦	૨૭૨	૧૩	૧	૨
૧૫		૧	૩	૧ ૩૪૮	૫,૦૦૦	૩૪૦	૧૬	૪	૩ ૫૦૦
રૂપીઆ ૧		૧	૪	૧ ૪૩૭	૧૦,૦૦૦	૬૮૧	૧૨	૯	૩
૨		૨	૮	૨ ૮૭૫	૨૦,૦૦૦	૧,૩૬૩	૫	૭	૨
૩		૪	૧	૦ ૩૧૨	૩૦,૦૦૦	૨,૦૪૪	૧૮	૫	૧
૪		૫	૫	૧ ૭૫૦	૪૦,૦૦૦	૨,૭૨૬	૧૧	૩	
૫		૬	૯	૩ ૧૮૭	૫૦,૦૦૦	૩,૪૦૮	૪	૦	૩
૬		૮	૨	૦ ૬૨૫	૧,૦૦,૦૦૦	૬,૮૧૬	૮	૧	૨
૭		૯	૬	૨ ૦૬૨	૨,૦૦,૦૦૦	૧૩,૬૩૨	૧૬	૨	૦

પૌંડના રૂપીઆ

શી ૧-૪ પેન્સ ૬ આના					શી ૧-૪ $\frac{3}{8}$ પેન્સ (૧-૪ા=)				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો.	પાઊંડ	રૂપીઆ	આ	પા	દો.
૧			૧૧	૭૨૫	૪	૫૮	૧૦	૦	૧૮૩
૨		૧	૧૧	૪૫૦	૫	૭૩	૪	૬	૨૨૯
૩		૨	૧૧	૧૭૬	૬	૮૭	૧૫	૦	૨૭૫
૪		૩	૧૦	૯૦૧	૭	૧૦૨	૯	૬	૩૨૧
૫		૪	૧૦	૬૨૬	૮	૧૧૭	૪	૦	૩૬૬
૬		૫	૧૦	૩૫૧	૯	૧૩૧	૧૪	૬	૪૧૨
૭		૬	૧૦	૦૭૬	૧૦	૧૪૬	૯	૦	૪૫૮
૮		૭	૯	૮૦૨	૨૦	૨૯૩	૨	૦	૯૧૬
૯		૮	૯	૫૨૭	૩૦	૪૩૯	૧૧	૧	૩૭૪
૧૦		૯	૯	૨૫૨	૪૦	૫૮૬	૪	૧	૮૩૨
૧૧		૧૦	૮	૯૭૭	૫૦	૭૩૨	૧૩	૨	૨૯૦
શીલીંગ ૧		૧૧	૮	૭૦૨	૬૦	૮૭૯	૬	૨	૭૪૮
૨	૧	૭	૫	૪૦૫	૭૦	૧,૦૨૫	૧૫	૩	૨૦૬
૩	૨	૩	૨	૧૦૭	૮૦	૧,૧૭૨	૮	૩	૬૬૪
૪	૨	૧૪	૧૦	૮૦૯	૯૦	૧,૩૧૯	૧	૪	૧૨૨
૫	૩	૧૦	૭	૫૧૧	૧૦૦	૧,૪૬૫	૧૦	૪	૫૮૦
૬	૪	૬	૪	૨૧૪	૨૦૦	૨,૯૩૧	૪	૯	૧૬૦
૭	૫	૨	૦	૯૧૬	૩૦૦	૪,૩૯૬	૧૫	૧	૭૪૦
૮	૫	૧૩	૯	૬૧૮	૪૦૦	૫,૮૬૨	૯	૬	૩૨૧
૯	૬	૯	૬	૩૨૧	૫૦૦	૭,૩૨૮	૩	૧૦	૯૦૧
૧૦	૭	૫	૩	૦૨૩	૬૦૦	૮,૭૯૩	૧૪	૩	૪૮૧
૧૧	૮	૦	૧૧	૭૨૫	૭૦૦	૧૦,૨૫૯	૮	૮	૦૬૧
૧૨	૮	૧૨	૮	૪૨૭	૮૦૦	૧૧,૭૨૫	૩	૦	૬૪૧
૧૩	૯	૮	૫	૧૩૦	૯૦૦	૧૩,૧૯૦	૧૩	૫	૨૨૧
૧૪	૧૦	૪	૧	૮૩૨	૧,૦૦૦	૧૪,૬૫૬	૭	૯	૮૦૨
૧૫	૧૦	૧૫	૧૦	૫૩૪	૧,૫૦૦	૨૧,૯૮૪	૧૧	૮	૭૦૨
૧૬	૧૧	૧૧	૭	૨૩૭	૨,૦૦૦	૨,૯૩૧૨	૧૫	૭	૬૦૩
૧૭	૧૨	૭	૩	૯૩૯	૩,૦૦૦	૪૩,૯૬૯	૭	૫	૪૦૫
૧૮	૧૩	૩	૦	૬૪૧	૪,૦૦૦	૫૮,૬૨૫	[illegible]	૩	૨૦૬
૧૯	૧૩	૧૪	૯	૩૪૪	૫,૦૦૦	૭૩,૨૮૨	૭	૧	૧૦૮
પૌંડ ૧	૧૪	૧૦	૬	૦૪૬	૧૦,૦૦૦	૧,૪૬,૫૬૪	૧૪	૨	૦૧૫
૨	૨૯	૫	૦	૦૯૨	૨૦,૦૦૦	૨,૯૩,૧૨૯	૧૨	૪	૦૩૧
૩	૪૩	૧૫	૬	૧૩૭	૪૦,૦૦૦	૫,૮૬,૨૫૯	૮	૮	૦૬૩

શી ૧-૪ પેન્સ ૬ આના					શી ૧-૪ $\frac{3}{8}$ પેન્સ (૧-૪।≈)				
પાઇ.	પૌંડ	શા	પે	ફાર.	રૂપીઆ.	પૌંડ.	શા.	પે.	ફાર.
૧				૦ ૩૪૧	૮		૧૦	૧૧	૦
૨				૦ ૬૮૨	૯		૧૨	૩	૧ ૫૦૦
૩				૧ ૦૨૩	૧૦		૧૩	૭	૩
૪				૧ ૩૬૫	૨૦	૧	૭	૩	૨
૫				૧ ૭૦૬	૩૦	૨	૦	૧૧	૧
૬				૨ ૦૪૭	૪૦	૨	૧૪	૭	૦
૭				૨ ૩૮૮	૫૦	૩	૮	૨	૩
૮				૨ ૭૨૯	૬૦	૪	૧	૧૦	૨
૯				૩ ૦૭૦	૭૦	૪	૧૫	૬	૧
૧૦				૩ ૪૧૨	૮૦	૫	૯	૨	૦
૧૧				૩ ૭૫૩	૯૦	૬	૨	૯	૩
આના. ૧			૧	૦ ૦૯૪	૧૦૦	૬	૧૬	૫	૨
૨			૨	૦ ૧૮૮	૨૦૦	૧૩	૧૨	૧૧	૦
૩			૩	૦ ૨૮૧	૩૦૦	૨૦	૯	૪	૨
૪			૪	૦ ૩૭૫	૪૦૦	૨૭	૫	૧૦	૦
૫			૫	૦ ૪૬૯	૫૦૦	૩૪	૨	૩	૨
૬			૬	૦ ૫૬૩	૬૦૦	૪૦	૧૮	૯	૦
૭			૭	૦ ૬૫૬	૭૦૦	૪૭	૧૫	૨	૨
૮			૮	૦ ૭૫૦	૮૦૦	૫૪	૧૧	૮	૦
૯			૯	૦ ૮૪૪	૯૦૦	૬૧	૮	૧	૨
૧૦			૧૦	૦ ૯૩૮	૧,૦૦૦	૬૮	૪	૭	૦
૧૧			૧૧	૧ ૦૩૧	૧,૫૦૦	૧૦૨	૬	૧૦	૨
૧૨		૧	૦	૧ ૧૨.૫	૨,૦૦૦	૧૩૬	૯	૨	૦
૧૩		૧	૧	૧ ૧૨૨	૩,૦૦૦	૨૦૪	૧૩	૯	૦
૧૪		૧	૨	૧ ૩૧૩	૪,૦૦૦	૨૭૨	૧૮	૪	૦
૧૫		૧	૩	૧ ૪૦૬	૫,૦૦૦	૩૪૧	૨	૧૧	૦
રૂપીઆ ૧		૧	૪	૧ ૫૦૦	૧૦,૦૦૦	૬૮૨	૫	૧૦	૦
૨		૨	૮	૩	૨૦,૦૦૦	૧,૩૬૪	૧૧	૮	૦
૩		૪	૧	૦ ૫૦૦	૩૦,૦૦૦	૨,૦૪૬	૧૭	૬	૦
૪		૫	૫	૨	૪૦,૦૦૦	૨,૭૨૯	૩	૪	૦
૫		૬	૯	૩ ૫૦૦	૫૦,૦૦૦	૩,૪૧૧	૯	૨	૦
૬		૮	૨	૧	૧,૦૦,૦૦૦	૬,૮૨૨	૧૮	૪	૦
૭		૯	૬	૨ ૫૦૦	૨,૦૦,૦૦૦	૧૩,૬૪૫	૧૬	૮	૦

શી ૧-૪ પેન્સ ૬ા આના					શી. ૧-૪ ૨⁄૬ ૫⁄૪ પેન્સ (૧-૪૧=૧)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો.	પૌંડ	રૂપીઆ	આ	પ..	દો
૧		૦	૧૧	૭૧૪	૪	૫૮	૯	૧	૪૫૩
૨		૧	૧૧	૪૨૮	૫	૭૩	૩	૪	૮૧૬
૩		૨	૧૧	૧૪૨	૬	૮૭	૧૩	૮	૧૭૯
૪		૩	૧૦	૮૫૬	૭	૧૦૨	૭	૧૧	૫૪૨
૫		૪	૧૦	૫૭૦	૮	૧૧૭	૨	૨	૯૦૬
૬		૫	૧૦	૨૮૪	૯	૧૩૧	૧૨	૬	૨૬૯
૭		૬	૯	૯૯૮	૧૦	૧૪૬	૬	૯	૬૩૨
૮		૭	૯	૭૧૨	૨૦	૨૯૨	૧૩	૭	૨૬૪
૯		૮	૯	૪૨૬	૩૦	૪૩૯	૪	૪	૮૯૬
૧૦		૯	૯	૧૪૦	૪૦	૫૮૫	૧૧	૨	૫૨૮
૧૧		૧૦	૮	૮૫૪	૫૦	૭૩૨	૨	૦	૧૬૦
શીલીંગ ૧		૧૧	૮	૫૬૮	૬૦	૮૭૮	૮	૯	૭૯૩
૨	૧	૭	૫	૧૩૬	૭૦	૧,૦૨૪	૧૫	૭	૪૨૪
૩	૨	૩	૧	૭૦૪	૮૦	૧,૧૭૧	૬	૫	૦૫૬
૪	૨	૧૪	૧૦	૨૭૩	૯૦	૧,૩૧૭	૧૩	૨	૬૮૮
૫	૩	૧૦	૬	૮૪૧	૧૦૦	૧,૪૬૪	૪	૦	૩૨૦
૬	૪	૬	૩	૪૦૯	૨૦૦	૨૯,૨૮	૮	૦	૬૪૧
૭	૫	૧	૧૧	૯૭૭	૩૦૦	૪,૩૯૨	૧૨	૦	૯૬૧
૮	૫	૧૩	૮	૫૪૫	૪૦૦	૫,૮૫૭	૦	૧	૨૮૧
૯	૬	૯	૫	૧૧૩	૫૦૦	૭,૩૨૧	૪	૧	૬૦૨
૧૦	૭	૫	૧	૬૮૨	૬૦૦	૮૭૮૫	૮	૧	૯૨૨
૧૧	૮	૦	૧૦	૨૫૦	૭૦૦	૧૦,૨૪૯	૧૨	૨	૨૪૨
૧૨	૮	૧૨	૬	૮૧૮	૮૦૦	૧૧,૭૧૪	૦	૨	૫૬૨
૧૩	૯	૭	૩	૩૮૬	૯૦૦	૧૩,૧૭૮	૪	૨	૮૮૩
૧૪	૧૦	૩	૧૧	૯૫૪	૧,૦૦૦	૧૪,૬૪૨	૮	૩	૨૦૩
૧૫	૧૦	૧૫	૮	૫૨૨	૧,૫૦૦	૨૧.૯૬૩	૧૨	૪	૮૦૪
૧૬	૧૧	૧૧	૫	૦૯૦	૨,૦૦૦	૨૯,૨૮૫	૦	૬	૪૦૬
૧૭	૧૨	૭	૧	૬૫૮	૩,૦૦૦	૪૩,૯૨૭	૮	૯	૬૦૯
૧૮	૧૩	૨	૧૦	૨૨૬	૪,૦૦૦	૫૮,૫૭૦	૧	૦	૮૧૨
૧૯	૧૩	૧૪	૬	૭૯૫	૫,૦૦૦	૭૩,૨૧૨	૯	૪	૦૧૫
પૌંડ ૧	૧૪	૧૦	૩	૩૬૩	૧૦,૦૦૦	૧,૪૬,૪૨૫	૨	૮	૦૩૧
૨	૨૯	૪	૬	૭૨૬	૨૦,૦૦૦	૨,૯૨,૮૫૦	૫	૪	૦૬૧
૩	૪૩	૧૪	૧૦	૦૯૦	૪૦,૦૦૦	૫,૮૫,૭૧૦	૧૦	૮	૧૨૧

શો. ૧-૪ પેન્સ ૬। આના							શી. ૧-૪ $\frac{૨૫}{૬૪}$ પેન્સ (૧-૪।)=૧)					
	પાઈ.	પાઊંડ	શી.	પે.	ફાર		રૂપીઆ.	પાઊંડ	શીં	પે.	ફાર	
	૧				૦	૩૪૧	૮		૧૦	૧૧	૦	૫૦૦
	૨				૦	૬૮૩	૯		૧૨	૩	૨	૦૬૨
	૩				૧	૦૨૪	૧૦		૧૩	૭	૩	૬૨૫
	૪				૧	૩૬૬	૨૦	૧	૭	૩	૩	૨૫૦
	૫				૧	૭૦૭	૩૦	૨	૦	૧૧	૨	૮૭૫
	૬				૨	૦૪૯	૪૦	૨	૧૪	૭	૨	૫૦૦
	૭				૨	૩૯૦	૫૦	૩	૮	૩	૨	૧૨૫
	૮				૨	૭૩૨	૬૦	૪	૧	૧૧	૧	૭૫૦
	૯				૩	૦૭૩	૭૦	૪	૧૫	૭	૧	૩૭૫
	૧૦				૩	૪૧૫	૮૦	૫	૯	૩	૧	
	૧૧				૩	૭૫૬	૯૦	૬	૨	૧૧	૦	૬૨૫
આના	૧			૧	૦	૦૯૮	૧૦૦	૬	૧૬	૭	૦	૨૫૦
	૨			૨	૦	૧૯૫	૨૦૦	૧૩	૧૩	૨	૦	૫૦૦
	૩			૩	૦	૨૯૩	૩૦૦	૨૦	૯	૯	૦	૭૫૦
	૪			૪	૦	૩૯૧	૪૦૦	૨૭	૬	૪	૧	
	૫			૫	૦	૪૮૮	૫૦૦	૩૪	૨	૧૧	૧	૨૫૦
	૬			૬	૦	૫૮૬	૬૦૦	૪૦	૧૯	૬	૧	૫૦૦
	૭			૭	૦	૬૮૪	૭૦૦	૪૭	૧૬	૧	૧	૭૫૦
	૮			૮	૦	૭૮૧	૮૦૦	૫૪	૧૨	૮	૨	
	૯			૯	૦	૮૭૯	૯૦૦	૬૧	૯	૩	૨	૨૫૦
	૧૦			૧૦	૦	૯૭૭	૧,૦૦૦	૬૮	૫	૧૦	૨	૫૦૦
	૧૧			૧૧	૧	૦૭૪	૧,૫૦૦	૧૦૨	૮	૯	૩	૭૫૦
	૧૨		૧	૦	૧	૧૭૨	૨,૦૦૦	૧૩૬	૧૧	૯	૧	
	૧૩		૧	૧	૧	૨૭૦	૩,૦૦૦	૨૦૪	૧૭	૭	૩	૫૦૦
	૧૪		૧	૨	૧	૩૬૭	૪,૦૦૦	૨૭૩	૩	૬	૨	
	૧૫		૧	૩	૧	૪૬૫	૫,૦૦૦	૩૪૧	૯	૫	૦	૫૦૦
રૂપીઆ	૧		૧	૪	૧	૫૬૨	૧૦,૦૦૦	૬૮૨	૧૮	૧૦	૧	
	૨		૨	૮	૩	૧૨૫	૨૦,૦૦૦	૧,૩૬૫	૧૭	૮	૨	
	૩		૪	૧	૦	૬૮૭	૩૦,૦૦૦	૨,૦૪૮	૧૬	૬	૩	
	૪		૫	૫	૨	૨૫૦	૪૦,૦૦૦	૨,૭૩૧	૧૫	૫	૦	
	૫		૬	૯	૩	૮૧૨	૫૦,૦૦૦	૩,૪૧૪	૧૪	૩	૧	
	૬		૮	૨	૧	૩૭૫	૧,૦૦,૦૦૦	૬,૮૨૯	૮	૬	૨	
	૭		૯	૬	૨	૯૩૭	૨,૦૦,૦૦૦	૧૩,૬૫૮	૧૭	૧	૦	

(વીલાયતી હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧-૪ પેન્સ ૬।। આના					શી. ૧-૪ ૧૩/૩૨ પેન્સ (૧-૪ા=ાા)				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો.	પાઊંડ	રૂપીઆ.	આ	પા	દો.
૧			૧૧	૭૦૩	૪	૫૮	૮	૨	૭૪૩
૨		૧	૧૧	૪૦૫	૫	૭૩	૨	૩	૪૨૯
૩		૨	૧૧	૧૦૯	૬	૮૭	૧૨	૪	૧૧૪
૪		૩	૧૦	૮૧૧	૭	૧૦૨	૬	૪	૮૦૦
૫		૪	૧૦	૫૧૪	૮	૧૧૭	૦	૫	૪૮૬
૬		૫	૧૦	૨૧૭	૯	૧૩૧	૧૦	૬	૧૭૧
૭		૬	૯	૯૨૦	૧૦	૧૪૬	૪	૬	૮૫૭
૮		૭	૯	૬૨૩	૨૦	૨૯૨	૯	૧	૭૧૪
૯		૮	૯	૩૨૬	૩૦	૪૩૮	૧૩	૮	૫૭૧
૧૦		૯	૯	૦૨૯	૪૦	૫૮૫	૨	૩	૪૨૯
૧૧		૧૦	૮	૭૩૧	૫૦	૭૩૧	૬	૧૦	૨૮૬
શીલીંગ ૧		૧૧	૮	૪૩૪	૬૦	૮૭૭	૧૧	૫	૧૪૩
૨	૧	૭	૪	૮૬૯	૭૦	૧,૦૨૪	૦	૦	
૩	૨	૩	૧	૩૦૩	૮૦	૧,૧૭૦	૪	૬	૮૫૭
૪	૨	૧૪	૯	૭૩૭	૯૦	૧,૩૧૬	૯	૧	૭૧૪
૫	૩	૧૦	૬	૧૭૧	૧૦૦	૧.૪૬૨	૧૩	૮	૫૭૧
૬	૪	૬	૨	૬૦૬	૨૦૦	૨,૯૨૫	૧૧	૫	૧૪૩
૭	૫	૧	૧૧	૦૪૦	૩૦૦	૪,૩૮૮	૯	૧	૭૧૪
૮	૫	૧૩	૭	૪૭૪	૪૦૦	૫,૮૫૧	૬	૧૦	૨૮૬
૯	૬	૯	૩	૯૦૯	૫૦૦	૭,૩૧૪	૪	૬	૮૫૭
૧૦	૭	૫	૦	૩૪૩	૬૦૦	૮,૭૭૭	૨	૩	૪૨૯
૧૧	૮	૦	૮	૭૭૭	૭૦૦	૧૦,૨૪૦	૦	૦	
૧૨	૮	૧૨	૫	૨૧૧	૮૦૦	૧૧,૭૦૨	૧૩	૮	૫૭૧
૧૩	૯	૮	૧	૬૪૬	૯૦૦	૧૩,૧૬૫	૧૧	૫	૧૪૩
૧૪	૧૦	૩	૧૦	૦૮૦	૧,૦૦૦	૧૪ ૬૨૮	૯	૧	૭૧૪
૧૫	૧૦	૧૫	૬	૫૧૪	૧,૫૦૦	૨૧.૯૪૨	૧૩	૮	૫૭૧
૧૬	૧૧	૧૧	૨	૯૪૯	૨,૦૦૦	૨૯,૨૫૭	૨	૩	૪૨૯
૧૭	૧૨	૬	૧૧	૩૮૩	૩,૦૦૦	૪૩,૮૮૫	૧૧	૫	૧૪૩
૧૮	૧૩	૨	૭	૮૧૭	૪,૦૦૦	૫૮ ૫૧૪	૪	૬	૮૫૭
૧૯	૧૩	૧૪	૪	૨૫૧	૫,૦૦૦	૭૩.૧૪૨	૧૩	૮	૫૭૧
પાઉંડ ૧	૧૪	૧૦	૦	૬૮૬	૧૦,૦૦૦	૧,૪૬,૨૮૫	૧૧	૫	૧૪૩
૨	૨૯	૪	૧	૩૭૧	૨૦,૦૦૦	૨,૯૨,૫૭૧	૬	૧૦	૨૮૬
૩	૪૩	૧૪	૨	૦૫૭	૪૦,૦૦૦	૫,૮૫,૧૪૨	૧૩	૮	૫૭૨

શી. ૧-૪ પેન્સ ૬॥ આના.				
પાઈ	પૌંડ	શી	પે.	ફાર
૧				૦ ૩૪૨
૨				૦ ૬૮૪
૩				૧ ૦૨૫
૪				૧ ૩૬૭
૫				૧ ૭૦૯
૬				૨ ૦૫૧
૭				૨ ૩૯૩
૮				૨ ૭૩૪
૯				૩ ૦૭૬
૧૦				૩ ૪૧૮
૧૧				૩ ૭૬૦
આના ૧			૧	૦ ૧૦૨
૨			૨	૦ ૨૦૩
૩			૩	૦ ૩૦૫
૪			૪	૦ ૪૦૬
૫			૫	૦ ૫૦૮
૬			૬	૦ ૬૦૯
૭			૭	૦ ૭૧૧
૮			૮	૦ ૮૧૩
૯			૯	૦ ૯૧૪
૧૦			૧૦	૧ ૦૧૬
૧૧			૧૧	૧ ૧૧૭
૧૨		૧	૦	૧ ૨૧૯
૧૩		૧	૧	૧ ૩૨૦
૧૪		૧	૨	૧ ૪૨૨
૧૫		૧	૩	૧ ૫૨૩
રૂપીઆ ૧		૧	૪	૧ ૬૨૫
૨		૨	૮	૩ ૨૫૦
૩		૪	૧	૦ ૮૭૫
૪		૫	૫	૨ ૫૦૦
૫		૬	૧૦	૦ ૧૨૫
૬		૮	૨	૧ ૭૫૦
૭		૯	૬	૩ ૩૭૫

શી. ૧-૪ ૧૩/૩૨ પે. (૧-૪।=॥)				
રૂપીઆ	પૌંડ	શી	પે.	ફાર
૮		૧૦	૧૧	૧
૯		૧૨	૩	૨ ૬૨૫
૧૦		૧૩	૮	૦ ૨૫૦
૨૦	૧	૭	૪	૦ ૫૦૦
૩૦	૨	૧	૦	૦ ૭૫૦
૪૦	૨	૧૪	૮	૧
૫૦	૩	૮	૪	૧ ૨૫૦
૬૦	૪	૨	૦	૧ ૫૦૦
૭૦	૪	૧૫	૮	૧ ૭૫૦
૮૦	૫	૯	૪	૨
૯૦	૬	૩	૦	૨ ૨૫૦
૧૦૦	૬	૧૬	૮	૨ ૫૦૦
૨૦૦	૧૩	૧૩	૫	૧
૩૦૦	૨૦	૧૦	૧	૩ ૫૦૦
૪૦૦	૨૭	૬	૧૦	૨
૫૦૦	૩૪	૩	૭	૦ ૫૦૦
૬૦૦	૪૧	૦	૩	૩
૭૦૦	૪૭	૧૭	૦	૧ ૫૦૦
૮૦૦	૫૪	૧૩	૯	૦
૯૦૦	૬૧	૧૦	૫	૨ ૫૦૦
૧,૦૦૦	૬૮	૭	૨	૧
૧,૫૦૦	૧૦૨	૧૦	૯	૧ ૫૦૦
૨,૦૦૦	૧૩૬	૧૪	૪	૨
૩,૦૦૦	૨૦૫	૧	૬	૩
૪૦૦૦	૨૭૩	૮	૯	૦
૫,૦૦૦	૩૪૧	૧૫	૧૧	૧
૧૦,૦૦૦	૬૮૩	૧૧	૧૦	૨
૨૦,૦૦૦	૧,૩૬૭	૩	૯	૦
૩૦,૦૦૦	૨,૦૫૦	૧૫	૭	૨
૪૦,૦૦૦	૨,૭૩૪	૭	૬	૦
૫૦,૦૦૦	૩,૪૧૭	૧૯	૪	૨
૧,૦૦,૦૦૦	૬,૮૩૫	૧૮	૯	૦
૨,૦૦,૦૦૦	૧૩,૬૭૧	૧૭	૬	૦

(વીલાયતની હુંડી) પૌંડના રૂપીઆ

શી. ૧–૪ પેન્સ ૬।।। આના

પેન્સ	રૂપીઆ	આ	પા.	દો.
૧		૦	૧૧	૬૯૨
૨		૧	૧૧	૩૮૩
૩		૨	૧૧	૦૭૫
૪		૩	૧૦	૭૬૭
૫		૪	૧૦	૪૫૯
૬		૫	૧૦	૧૫૦
૭		૬	૯	૮૪૨
૮		૭	૯	૫૩૪
૯		૮	૯	૨૨૫
૧૦		૯	૮	૯૧૭
૧૧		૧૦	૮	૬૦૯
શીલીંગ ૧		૧૧	૮	૩૦૧
૨	૧	૭	૪	૬૦૧
૩	૨	૩	૦	૯૦૨
૪	૨	૧૪	૯	૨૦૩
૫	૩	૧૦	૫	૫૦૩
૬	૪	૬	૧	૮૦૪
૭	૫	૧	૧૦	૧૦૫
૮	૫	૧૩	૬	૪૦૫
૯	૬	૯	૨	૭૦૬
૧૦	૭	૪	૧૧	૦૦૭
૧૧	૮	૦	૭	૩૦૭
૧૨	૮	૧૨	૨	૬૦૮
૧૩	૯	૭	૧૧	૯૦૯
૧૪	૧૦	૩	૮	૨૧૦
૧૫	૧૦	૧૫	૪	૫૧૦
૧૬	૧૧	૧૧	૦	૮૧૦
૧૭	૧૨	૬	૯	૧૧૧
૧૮	૧૩	૨	૪	૪૧૨
૧૯	૧૩	૧૪	૧	૭૧૩
પૌંડ ૧	૧૪	૯	૧૦	૦૧૩
૨	૨૯	૩	૮	૦૨૭
૩	૪૩	૧૩	૬	૦૪૦

શી. ૧–૪ ૨૭/૬૪ પેન્સ (૧–૪=।।)

પૌંડ	રૂપીઆ	આ	પા.	દો.
૪	૫૮	૭	૪	૦૫૩
૫	૭૩	૧	૨	૦૬૭
૬	૮૭	૧૧	૦	૦૮૦
૭	૧૦૨	૪	૧૦	૦૯૩
૮	૧૧૬	૧૪	૮	૧૦૭
૯	૧૩૧	૮	૬	૧૨૦
૧૦	૧૪૬	૨	૪	૧૩૩
૨૦	૨૯૨	૪	૮	૨૬૬
૩૦	૪૩૮	૭	૦	૪૦૦
૪૦	૫૮૪	૯	૪	૫૩૩
૫૦	૭૩૦	૧૧	૮	૬૬૬
૬૦	૮૭૬	૧૪	૦	૭૯૯
૭૦	૧,૦૨૩	૦	૪	૯૩૨
૮૦	૧,૧૬૯	૨	૯	૦૬૬
૯૦	૧,૩૧૫	૫	૧	૧૯૯
૧૦૦	૧,૪૬૧	૭	૫	૩૩૨
૨૦૦	૨,૯૨૨	૧૪	૧૦	૬૬૪
૩૦૦	૪,૩૮૪	૬	૩	૯૯૬
૪૦૦	૫,૮૪૫	૧૩	૯	૩૨૮
૫૦૦	૭,૩૦૭	૫	૨	૬૬૦
૬૦૦	૮,૭૬૮	૧૨	૭	૯૯૨
૭૦૦	૧૦,૨૩૦	૪	૧	૩૨૪
૮૦૦	૧૧,૬૯૧	૧૧	૬	૬૫૭
૯૦૦	૧૩,૧૫૩	૨	૧૧	૯૮૯
૧,૦૦૦	૧૪,૬૧૪	૧૦	૫	૩૨૧
૧,૫૦૦	૨૧,૯૨૧	૧૫	૭	૯૮૧
૨,૦૦૦	૨૯,૨૨૯	૪	૧૦	૬૪૧
૩,૦૦૦	૪૩,૮૪૩	૧૫	૩	૯૬૨
૪,૦૦૦	૫૮,૪૫૮	૯	૯	૨૮૩
૫,૦૦૦	૭૩,૦૭૩	૪	૨	૬૦૩
૧૦,૦૦૦	૧,૪૬,૧૪૬	૮	૫	૨૦૬
૨૦,૦૦૦	૨,૯૨,૨૯૩	૦	૧૦	૪૧૩
૪૦,૦૦૦	૫,૮૪,૫૮૬	૧	૮	૮૨૬

શી. ૧-૪ પેન્સ ૬॥। આના					શી. ૧-૪ ૨૭/૬૪ પેન્સ (૧-૪।ર॥।)				
પાઈ.	પ.ઔંડ	શી.	પે	ફાર.	રૂપીઆ	પાઉંડ	શી.	પે.	ફાર.
૧				૦.૩૪૨	૮		૧૦	૧૧	૧.૫૦૦
૨				૦.૬૮૪	૯		૧૨	૩	૩.૧૮૮
૩				૧.૦૨૬	૧૦		૧૩	૮	૦.૮૭૫
૪				૧.૩૬૮	૨૦	૧	૭	૪	૧.૭૫૦
૫				૧.૭૧૧	૩૦	૨	૧	૦	૨.૬૨૫
૬				૨.૦૫૩	૪૦	૨	૧૪	૮	૩.૫૦૦
૭				૨.૩૯૫	૫૦	૩	૮	૫	૦.૩૭૫
૮				૨.૭૩૭	૬૦	૪	૨	૧	૧.૨૫૦
૯				૩.૦૭૯	૭૦	૪	૧૫	૯	૨.૧૨૫
૧૦				૩.૪૨૧	૮૦	૫	૯	૫	૩
૧૧				૩.૭૬૩	૯૦	૬	૩	૧	૩.૮૭૫
આના. ૧			૧	૦.૧૦૫	૧૦૦	૬	૧૬	૧૦	૦.૭૫૦
૨			૨	૦.૨૧૧	૨૦૦	૧૩	૧૩	૮	૧.૫૦૦
૩			૩	૦.૩૧૬	૩૦૦	૨૦	૧૦	૬	૨.૨૫૦
૪			૪	૦.૪૨૨	૪૦૦	૨૭	૭	૪	૩
૫			૫	૦.૫૨૭	૫૦૦	૩૪	૪	૨	૩.૭૫૦
૬			૬	૦.૬૩૩	૬૦૦	૪૧	૧	૧	૦.૫૦૦
૭			૭	૦.૭૩૮	૭૦૦	૪૭	૧૭	૧૧	૧.૨૫૦
૮			૮	૦.૮૪૪	૮૦૦	૫૪	૧૪	૯	૨
૯			૯	૦.૯૪૯	૯૦૦	૬૧	૧૧	૭	૨.૭૫૦
૧૦			૧૦	૧.૦૫૫	૧,૦૦૦	૬૮	૮	૫	૩.૫૦૦
૧૧			૧૧	૧.૧૬૦	૧,૫૦૦	૧૦૨	૧૨	૮	૩.૨૫૦
૧૨		૧	૦	૧.૨૬૫	૨,૦૦૦	૧૩૬	૧૬	૧૧	૩
૧૩		૧	૧	૧.૩૭૧	૩૦૦૦	૨૦૫	૫	૫	૨.૫૦૦
૧૪		૧	૨	૧.૪૭૬	૪,૦૦૦	૨૭૩	૧૩	૧૧	૨
૧૫		૧	૩	૧.૫૮૨	૫,૦૦૦	૩૪૨	૨	૫	૧.૫૦૦
રૂપીઆ ૧		૧	૪	૧.૬૮૮	૧૦,૦૦૦	૬૮૪	૪	૧૦	૩
૨		૨	૮	૩.૩૭૫	૨૦.૦૦૦	૧.૩૬૮	૯	૯	૨
૩		૪	૧	૧.૦૬૨	૩૦,૦૦૦	૨,૦૫૨	૧૪	૮	૧
૪		૫	૫	૨.૭૫૦	૪૦,૦૦૦	૨,૭૩૬	૧૯	૭	૦
૫		૬	૧૦	૦.૪૩૭	૫૦,૦૦૦	૩,૪૨૧	૪	૫	૩
૬		૮	૩	૨.૧૨૫	૧,૦૦,૦૦૦	૬,૮૪૨	૮	૧૧	૨
૭		૯	૬	૩.૮૧૩	૨,૦૦ ૦૦૦	૧૩.૬૮૪	૧૭	૧૧	

([illegible]) પૌંડના રૂપીયા

શી. ૧-૪ પેન્સ ૭ આના					શી. ૧-૪[illegible] પેન્સ (૧-૪[illegible])				
પેન્સ	રૂપીઆ	આ	પા	દા	પાઊંડ	રૂપીઆ	આ	પા	દા.
૧			૧૧	૬૮૧	૪	૫૮	૬	૫	૩૮૪
૨		૧	૧૧	૩૬૧	૫	૭૩	૦	૦	૭૩૦
૩		૨	૧૧	૦૪૨	૬	૮૭	૯	૮	૦૭૬
૪		૩	૧૦	૭૨૨	૭	૧૦૨	૩	૩	૪૨૨
૫		૪	૧૦	૪૦૩	૮	૧૧૬	૧૨	૧૦	૭૬૮
૬		૫	૧૦	૦૮૪	૯	૧૩૧	૬	૬	૧૧૪
૭		૬	૯	૭૬૪	૧૦	૧૪૬	૦	૧	૪૬૦
૮		૭	૯	૪૪૫	૨૦	૨૯૨	૦	૨	૯૨૦
૯		૮	૯	૧૨૫	૩૦	૪૩૮	૦	૪	૩૮૦
૧૦		૯	૮	૮૦૬	૪૦	૫૮૪	૦	૫	૮૪૦
૧૧		૧૦	૮	૪૮૭	૫૦	૭૩૦	૦	૭	૩૦૦
શાલીંગ ૧		૧૧	૮	૧૬૭	૬૦	૮૭૬	૦	૮	૭૬૦
૨	૧	૭	૪	૩૩૫	૭૦	૧,૦૨૨	૦	૧૦	૨૨૧
૩	૨	૩	૦	૫૦૨	૮૦	૧,૧૬૮	૦	૧૧	૬૮૧
૪	૨	૧૪	૮	૬૬૯	૯૦	૧,૩૧૪	૧	૧	૧૪૧
૫	૩	૧૦	૪	૮૩૭	૧૦૦	૧૪૬૦	૧	૨	૬૦૧
૬	૪	૬	૧	૦૦૪	૨૦૦	૨૯૨૦	૨	૫	૨૦૨
૭	૫	૧	૯	૧૭૧	૩૦૦	૪,૩૮૦	૩	૭	૮૦૨
૮	૫	૧૩	૫	૩૩૮	૪૦૦	૫,૮૪૦	૪	૧૦	૪૦૩
૯	૬	૯	૧	૫૦૬	૫૦૦	૭,૩૦૦	૬	૧	૦૦૪
૧૦	૭	૪	૯	૬૭૩	૬૦૦	૮,૭૬૦	૭	૩	૬૦૫
૧૧	૮	૦	૫	૮૪૦	૭૦૦	૧૦,૨૨૦	૮	૬	૨૦૫
૧૨	૮	૧૨	૨	૦૦૮	૮૦૦	૧૧,૬૮૦	૯	૮	૮૦૬
૧૩	૯	૭	૧૦	૧૭૫	૯૦૦	૧૩,૧૪૦	૧૦	૧૧	૪૦૭
૧૪	૧૦	૩	૬	૩૪૨	૧,૦૦૦	૧૪ ૬૦૦	૧૨	૨	૦૦૮
૧૫	૧૦	૧૫	૨	૫૧૦	૧,૫૦૦	૨૧,૯૦૧	૨	૩	૦૧૧
૧૬	૧૧	૧૦	૧૦	૬૭૭	૨,૦૦૦	૨૯,૨૦૧	૮	૪	૦૧૫
૧૭	૧૨	૬	૬	૮૪૪	૩,૦૦૦	૪૩,૮૦૨	૪	૬	૦૨૩
૧૮	૧૩	૨	૩	૦૧૧	૪,૦૦૦	૫૮,૪૦૩	૦	૮	૦૩૦
૧૯	૧૩	૧૩	૧૧	૧૭૯	૫,૦૦૦	૭૩,૦૦૩	૧૨	૧૦	૦૩૮
પાઉંડ ૧	૧૪	૯	૭	૩૪૬	૧૦,૦૦૦	૧,૪૬,૦૦૭	૯	૮	૦૭૬
૨	૨૯	૩	૨	૬૯૨	૨૦,૦૦૦	૨,૯૨,૦૧૫	૩	૪	૧૫૨
૩	૪૩	૧૨	૧૦	૦૩૮	૪૦,૦૦૦	૫,૮૪,૦૩૦	૬	૮	૩૦૫

શી. ૧-૪ પેન્સ ૭ આના					શી. ૧-૪ ૭/૧૬ પે. (૧-૪૧૬)				
પાઇ	પૌંડ	શી	પે.	ફાર	રૂપીઆ	પૌંડ	શી	પે	ફાર
૧				૦ ૩૪૨	૮		૧૦	૧૧	૨
૨				૦ ૬૮૫	૯		૧૨	૩	૩ ૭૫૦
૩				૧ ૦૨૭	૧૦		૧૩	૮	૧ ૫૦૦
૪				૧ ૩૭૦	.૨૦	૧	૭	૪	૩
૫				૧ ૭૧૨	૩૦	૨	૧	૧	૦ ૫૦૦
૬				૨ ૦૫૫	૪૦	૨	૧૪	૯	૨
૭				૨ ૩૯૭	૫૦	૩	૮	૫	૩ ૫૦૦
૮				૨ ૭૪૦	૬૦	૪	૨	૨	૧
૯				૩ ૦૮૨	૭૦	૪	૧૫	૧૦	૨ ૫૦૦
૧૦				૩ ૪૨૪	૮૦	૫	૯	૭	૦
૧૧				૩ ૭૬૭	૯૦	૬	૩	૩	૧ ૫૦૦
આના ૧			૧	૦ ૧૦૯	૧૦૦	૬	૧૬	૧૧	૩
૨			૨	૦ ૨૧૯	૨૦૦	૧૩	૧૩	૧૧	૨
૩			૩	૦ ૩૨૮	૩૦૦	૨૦	૧૦	૧૧	૧
૪			૪	૦ ૪૩૮	૪૦૦	૨૭	૭	૧૧	૦
૫			૫	૦ ૫૪૭	૫૦૦	૩૪	૪	૧૦	૩
૬			૬	૦ ૬૫૬	૬૦૦	૪૧	૧	૧૦	૨
૭			૭	૦ ૭૬૬	૭૦૦	૪૭	૧૮	૧૦	૧
૮			૮	૦ ૮૭૫	૮૦૦	૫૪	૧૫	૧૦	૦
૯			૯	૦ ૯૮૪	૯૦૦	૬૧	૧૨	૯	૩
૧૦			૧૦	૧ ૦૯૪	૧,૦૦૦	૬૮	૯	૯	૨
૧૧			૧૧	૧ ૨૦૩	૧,૫૦૦	૧૦૨	૧૪	૮	૧
૧૨		૧	૦	૧ ૩૧૩	૨,૦૦૦	૧૩૬	૧૯	૭	૦
૧૩		૧	૧	૧ ૪૨૨	૩,૦૦૦	૨૦૫	૯	૪	૨
૧૪		૧	૨	૧ ૫૩૧	૪ ૦૦૦	૨૭૩	૧૯	૨	૦
૧૫		૧	૩	૧ ૬૪૧	૫,૦૦૦	૩૪૨	૮	૧૧	૨
રૂપીઆ ૧		૧	૪	૧ ૭૫૦	૧૦,૦૦૦	૬૮૪	૧૭	૧૧	૦
૨		૨	૮	૩ ૫૦૦	૨૦,૦૦૦	૧,૩૬૯	૧૫	૧૦	૦
૩		૪	૧	૧ ૨૫૦	૩૦,૦૦૦	૨.૦૫૪	૧૩	૯	૦
૪		૫	૫	૩	૪૦,૦૦૦	૨ ૭૩૯	૧૧	૮	૦
૫		૬	૧૦	૦ ૭૫૦	૫૦,૦૦૦	૩,૪૨૪	૯	૭	૦
૬		૮	૨	૨ ૫૦૦	૧,૦૦,૦૦૦	૬,૮૪૮	૧૯	૨	૦
૭		૯	૭	૦ ૨૫૦	૨,૦૦,૦૦૦	૧૩ ૬૯૭	૧૮	૪	૦

 પૌંડના રૂપીઆ

થી. ૧-૪ પેન્સ ૭ આના					થી ૧-૪ ૬૬ પેન્સ (૧-[illegible])				
પેન્સ	રૂપીઆ	આ	પા.	દો.	પાઊંડ	રૂપીઆ	આ	પા	દો
૧			૧૧	૬૭૦	૪	૫૮	૫	૬	૭૩૫
૨		૧	૧૧	૩૩૯	૫	૭૨	૧૪	૧૧	૪૧૯
૩		૨	૧૧	૦૦૯	૬	૮૭	૮	૪	૧૦૩
૪		૩	૧૦	૬૭૮	૭	૧૦૨	૧	૮	૭૮૬
૫		૪	૧૦	૩૪૮	૮	૧૧૬	૧૧	૧	૪૭૦
૬		૫	૧૦	૦૧૭	૯	૧૩૧	૪	૬	૧૫૪
૭		૬	૯	૬૮૭	૧૦	૧૪૫	૧૩	૧૦	૮૩૮
૮		૭	૯	૩૫૬	૨૦	૨૯૧	૧૧	૯	૬૭૫
૯		૮	૯	૦૨૬	૩૦	૪૩૭	૯	૮	૫૧૩
૧૦		૯	૮	૬૯૫	૪૦	૫૮૩	૭	૭	૩૫૦
૧૧		૧૦	૮	૩૬૫	૫૦	૭૨૯	૫	૬	૧૮૮
શીલીંગ ૧		૧૧	૮	૦૩૪	૬૦	૮૭૫	૩	૫	૦૨૬
૨	૧	૭	૪	૦૬૮	૭૦	૧,૦૨૧	૧	૩	૮૬૪
૩	૨	૩	૦	૧૦૩	૮૦	૧,૧૬૬	૧૫	૨	૭૦૧
૪	૨	૧૪	૮	૧૩૭	૯૦	૧,૩૧૨	૧૩	૧	૫૩૮
૫	૩	૧૦	૪	૧૭૧	૧૦૦	૧,૪૫૮	૧૧	૦	૩૭૬
૬	૪	૬	૦	૨૦૫	૨૦૦	૨,૯૧૭	૬	૦	૭૫૨
૭	૫	૧	૮	૨૩૯	૩૦૦	૪,૩૭૬	૧	૧	૧૨૮
૮	૫	૧૩	૪	૨૭૪	૪૦૦	૫ ૮૩૪	૧૨	૧	૫૦૪
૯	૬	૯	૦	૩૦૮	૫૦૦	૭ ૨૯૩	૭	૧	૮૮૦
૧૦	૭	૪	૮	૩૪૨	૬૦૦	૮,૭૫૨	૨	૨	૨૫૬
૧૧	૮	૦	૪	૩૭૬	૭૦૦	૧૦,૨૧૦	૧૩	૨	૬૩૨
૧૨	૮	૧૨	૦	૪૧૦	૮૦૦	૧૧,૬૬૯	૮	૩	૦૦૯
૧૩	૯	૭	૮	૪૪૪	૯૦૦	૧૩.૧૨૮	૩	૩	૩૮૫
૧૪	૧૦	૩	૪	૪૭૮	૧,૦૦૦	૧૪,૫૮૬	૧૪	૩	૭૬૧
૧૫	૧૦	૧૪	૦	૫૧૩	૧.૫૦૦	૨૧,૮૮૦	૫	૫	૬૪૧
૧૬	૧૧	૧૦	૮	૫૪૮	૨,૦૦૦	૨,૯૧૭૩	૧૨	૭	૫૨૧
૧૭	૧૨	૬	૪	૫૮૨	૩,૦૦૦	૪૩,૭૬૦	૧૦	૧૧	૨૮૨
૧૮	૧૩	૨	૦	૭૧૬	૪,૦૦૦	૫૮,૩૪૭	૯	૩	૦૪૩
૧૯	૧૩	૧૩	૮	૬૫૦	૫,૦૦૦	૭૨.૯૩૪	૭	૬	૮૦૩
પૌંડ ૧	૧૪	૯	૪	૬૮૪	૧૦,૦૦૦	૧,૪૫,૮૬૮	૧૫	૧	૬૦૧
૨	૨૯	૨	૯	૩૬૮	૨૦,૦૦૦	૨,૯૧ ૭૩૭	૧૪	૩	૨૧૪
૩	૪૩	૧૨	૧૨	૦૫૧	૪૦,૦૦૦	૫,૮૩,૪૭૫	૧૨	૬	૪૨૮

શી. ૧-૪ ⅞ પેન્સ (૧-૪⅞ના)											
પાઇ	પૌંડ	શી	પે	ફાર		રૂપીઆ.	પૌંડ	શીં.	પે	ફાર	
૧				૦	૩૪૩	૮		૧૦	૧૧	૨	૫૦૦
૨				૦	૬૮૬	૯		૧૨	૪	૦	૩૧૩
૩				૧	૦૨૮	૧૦		૧૩	૮	૨	૧૨૫
૪				૧	૩૭૧	૨૦	૧	૭	૫	૦	૨૫૦
૫				૧	૭૧૪	૩૦	૨	૧	૧	૨	૩૭૫
૬				૨	૦૫૭	૪૦	૨	૧૪	૧૦	૦	૫૦૦
૭				૨	૩૯૯	૫૦	૩	૮	૬	૨	૬૨૫
૮				૨	૭૪૨	૬૦	૪	૨	૩	૦	૭૫૦
૯				૩	૦૮૫	૭૦	૪	૧૫	૧૧	૨	૮૭૫
૧૦				૩	૪૨૮	૮૦	૫	૯	૮	૧	
૧૧				૩	૭૭૧	૯૦	૬	૩	૪	૩	૧૨૫
આના ૧			૧	૦	૧૧૩	૧૦૦	૬	૧૭	૧	૧	૨૫૦
૨			૨	૦	૨૨૭	૨૦૦	૧૩	૧૪	૨	૨	૫૦૦
૩			૩	૦	૩૪૦	૩૦૦	૨૦	૧૧	૩	૩	૭૫૦
૪			૪	૦	૪૫૩	૪૦૦	૨૭	૮	૫	૧	
૫			૫	૦	૫૬૬	૫૦૦	૩૪	૫	૬	૨	૨૫૦
૬			૬	૦	૬૮૦	૬૦૦	૪૧	૨	૭	૩	૫૦૦
૭			૭	૦	૭૯૩	૭૦૦	૪૭	૧૯	૯	૦	૭૫૦
૮			૮	૦	૯૦૬	૮૦૦	૫૪	૧૬	૧૦	૨	
૯			૯	૧	૦૨૦	૯૦૦	૬૧	૧૩	૧૧	૩	૨૫૦
૧૦			૧૦	૧	૧૩૩	૧,૦૦૦	૬૮	૧૧	૧	૦	૫૦૦
૧૧			૧૧	૧	૨૪૬	૧,૫૦૦	૧૦૨	૧૬	૭	૨	૭૫૦
૧૨		૧	૦	૧	૩૫૯	૨,૦૦૦	૧૩૭	૨	૨	૧	
૧૩		૧	૧	૧	૪૭૩	૩,૦૦૦	૨૦૫	૧૩	૩	૧	૫૦૦
૧૪		૧	૨	૧	૫૮૬	૪,૦૦૦	૨૭૪	૪	૪	૨	
૧૫		૧	૩	૧	૬૯૯	૫૦૦૦	૩૪૨	૧૫	૫	૨	૫૦૦
રૂપીઆ ૧		૧	૪	૧	૮૧૩	૧૦,૦૦૦	૬૮૫	૧૦	૧૧	૧	
૨		૨	૮	૩	૬૨૫	૨૦,૦૦૦	૧,૩૭૧	૧	૧૦	૨	
૩		૪	૧	૧	૪૩૭	૩૦,૦૦૦	૨,૦૫૬	૧૨	૯	૩	
૪		૫	૫	૩	૨૫૦	૪૦,૦૦૦	૨,૭૪૨	૩	૯	૦	
૫		૬	૧૦	૧	૦૬૩	૫૦,૦૦૦	૩,૪૨૭	૧૪	૮	૧	
૬		૮	૨	૨	૮૭૫	૧,૦૦,૦૦૦	૬,૮૫૫	૯	૪	૨	
૭		૯	૭	૦	૬૮૭	૨,૦૦,૦૦૦	૧૩,૭૧૦	૧૮	૯	૦	૦

 પૌંડના રૂપીઆ

શી. ૧-૪ પેન્સ ૭ાા આના					શી. ૧-૪ ૧/૩ ૫/૬ પેન્સ (૧-૪ાઆા)				
પેન્સ	રૂપાઆ	આ	પા.	દો	પૌંડ	રૂપૈઆ	આ	પા.	દો.
૧		૦	૧૧	૬૫૮	૪	૫૮	૪	૮	૧૦૬
૨		૧	૧૧	૩૧૭	૫	૭૨	૧૩	૧૦	૧૩૩
૩		૨	૧૦	૯૭૫	૬	૮૭	૭	૦	૧૫૯
૪		૩	૧૦	૬૩૪	૭	૧૦૨	૦	૨	૧૮૬
૫		૪	૧૦	૨૯૨	૮	૧૧૬	૯	૪	૨૧૩
૬		૫	૯	૯૫૧	૯	૧૩૧	૨	૬	૨૩૯
૭		૬	૯	૬૦૯	૧૦	૧૪૫	૧૧	૮	૨૬૬
૮		૭	૯	૨૬૮	૨૦	૨૯૧	૭	૪	૫૩૧
૯		૮	૮	૯૨૬	૩૦	૪૩૭	૩	૦	૭૯૭
૧૦		૯	૮	૫૮૪	૪૦	૫૮૨	૧૪	૯	૦૬૩
૧૧		૧૦	૮	૨૪૩	૫૦	૭૨૮	૧૦	૫	૩૨૮
શીલીંગ ૧		૧૧	૭	૯૦૧	૬૦	૮૭૪	૬	૧	૫૯૪
૨	૧	૭	૩	૮૦૩	૭૦	૧,૦૨૦	૧	૯	૮૬૦
૩	૨	૨	૧૧	૭૦૪	૮૦	૧,૧૬૫	૧૩	૬	૧૨૫
૪	૨	૧૪	૭	૬૦૫	૯૦	૧,૩૧૧	૯	૨	૩૯૧
૫	૩	૧૦	૩	૫૦૭	૧૦૦	૧,૪૫૭	૪	૧૦	૬૫૭
૬	૪	૫	૧૧	૪૦૮	૨૦૦	૨,૯૧૪	૯	૯	૩૧૩
૭	૫	૧	૭	૩૦૯	૩૦૦	૪,૩૭૧	૧૪	૭	૯૭૦
૮	૫	૧૩	૩	૨૧૧	૪૦૦	૫,૮૨૯	૩	૬	૬૨૬
૯	૬	૮	૧૧	૧૧૨	૫૦૦	૭,૨૮૬	૮	૫	૨૮૩
૧૦	૭	૪	૭	૦૧૪	૬૦૦	૮,૭૪૩	૧૩	૩	૯૩૯
૧૧	૮	૦	૨	૯૧૫	૭૦૦	૧૦,૨૦૧	૨	૨	૫૯૬
૧૨	૮	૧૧	૧૦	૮૧૬	૮૦૦	૧૧,૬૫૮	૭	૧	૨૫૨
૧૩	૯	૭	૬	૭૧૭	૯૦૦	૧૩,૧૧૫	૧૧	૧૧	૯૦૯
૧૪	૧૦	૩	૨	૬૧૯	૧,૦૦૦	૧૪,૫૭૩	૦	૧૦	૫૬૫
૧૫	૧૦	૧૪	૧૦	૫૨૦	૧,૫૦૦	૨૧,૮૫૯	૯	૩	૮૪૮
૧૬	૧૧	૧૦	૬	૪૨૧	૨,૦૦૦	૨૯,૧૪૬	૧	૯	૧૩૧
૧૭	૧૨	૬	૨	૩૨૩	૩,૦૦૦	૪૩,૭૧૯	૨	૭	૬૯૬
૧૮	૧૩	૧	૧૦	૨૨૪	૪,૦૦૦	૫૮,૨૯૨	૩	૬	૨૬૨
૧૯	૧૩	૧૩	૬	૧૨૫	૫,૦૦૦	૭૨,૮૬૫	૪	૪	૮૨૭
પૌંડ ૧	૧૪	૯	૨	૦૨૭	૧૦,૦૦૦	૧,૪૫,૭૩૦	૮	૯	૬૫૫
૨	૨૯	૨	૪	૦૫૩	૨૦,૦૦૦	૨,૯૧,૪૬૧	૧	૭	૩૦૯
૩	૪૩	૧૧	૬	૦૮૦	૪૦,૦૦૦	૫,૮૨,૯૨૨	૩	૨	૬૧૯

શી. ૧-૪ પેન્સ ૭ા આના						શી. ૧-૪ $\frac{૧૫}{૩૨}$ પેન્સ (૧-૪।૱।)					
પાઇ.	પાઉંડ	શી.	પે	ફાર.		રૂપીઆ	પાઉંડ	શી	પે	ફાર.	
૧				૦	૩૪૩	૮		૧૦	૧૧	૩	
૨				૦	૬૮૬	૯		૧૨	૪	૦	૯૭૫
૩				૧	૦૨૯	૧૦		૧૩	૮	૨	૭૫૦
૪				૧	૩૭૨	૨૦	૧	૭	૫	૧	૫૦૦
૫				૧	૭૧૫	૩૦	૨	૧	૨	૦	૨૫૦
૬				૨	૦૫૯	૪૦	૨	૧૪	૧૦	૩	
૭				૨	૪૦૨	૫૦	૩	૮	૭	૧	૭૫૦
૮				૨	૭૪૫	૬૦	૪	૨	૪	૦	૫૦૦
૯				૩	૦૮૮	૭૦	૪	૧૬	૦	૩	૨૫૦
૧૦				૩	૪૩૧	૮૦	૫	૯	૯	૨	
૧૧				૩	૭૭૪	૯૦	૬	૩	૬	૦	૭૫૦
આના. ૧			૧	૦	૧૧૭	૧૦૦	૬	૧૭	૨	૩	૫૦૦
૨			૨	૦	૨૩૪	૨૦૦	૧૩	૧૪	૫	૩	
૩			૩	૦	૩૫૧	૩૦૦	૨૦	૧૧	૮	૨	૫૦૦
૪			૪	૦	૪૬૯	૪૦૦	૨૭	૮	૧૧	૨	
૫			૫	૦	૫૮૬	૫૦૦	૩૪	૬	૨	૧	૫૦૦
૬			૬	૦	૭૦૩	૬૦૦	૪૧	૩	૫	૧	
૭			૭	૦	૮૨૦	૭૦૦	૪૮	૦	૮	૦	૫૦૦
૮			૮	૦	૯૩૮	૮૦૦	૫૪	૧૭	૧૧		
૯			૯	૧	૦૫૫	૯૦૦	૬૧	૧૫	૧	૩	૫૦૦
૧૦			૧૦	૧	૧૭૨	૧,૦૦૦	૬૮	૧૨	૪	૩	
૧૧			૧૧	૧	૨૮૯	૧,૫૦૦	૧૦૨	૧૮	૭	૦	૫૦૦
૧૨		૧	૦	૧	૪૦૬	૨,૦૦૦	૧૩૭	૪	૯	૨	
૧૩		૧	૧	૧	૫૨૩	૩,૦૦૦	૨૦૫	૧૭	૨	૧	
૧૪		૧	૨	૧	૬૪૧	૪,૦૦૦	૨૭૪	૯	૭		
૧૫		૧	૩	૧	૭૫૮	૫,૦૦૦	૩૪૩	૧	૧૧	૩	
રૂપીઆ. ૧		૧	૪	૧	૮૭૫	૧૦,૦૦૦	૬૮૬	૩	૧૧	૨	
૨		૨	૮	૩	૭૫૦	૨૦,૦૦૦	૧,૩૭૨	૭	૧૧		
૩		૪	૧	૧	૬૨૫	૩૦,૦૦૦	૨,૦૫૮	૧૧	૧૦	૨	
૪		૫	૫	૩	૫૦૦	૪૦,૦૦૦	૨,૭૪૪	૧૫	૧૦		
૫		૬	૧૦	૧	૩૭૫	૫૦,૦૦૦	૩,૪૩૦	૧૯	૯	૨	
૬		૮	૨	૩	૨૫૦	૧,૦૦,૦૦૦	૬,૮૬૧	૧૯	૭		
૭		[illegible]	૭	૧	૧૨૫	૨,૦૦,૦૦૦	૧૩,૭૨૩	૧૯	૨		

 (વીલાયતની હુંડી) **પૌંડના રૂપીઆ**

શી. ૧-૪ પેન્સ ૭ાા આના					શી. ૧-૪ ૧૫/૧૬ પેન્સ (૧-૪ાઆના)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો.	પૌંડ	રૂપીઆ	આ	પા	દો
૧		૦	૧૧	૬૪૭	૪	૫૮	૩	૯	૪૯૮
૨		૧	૧૧	૨૯૫	૫	૭૨	૧૨	૮	૮૭૨
૩		૨	૧૦	૯૪૨	૬	૮૭	૫	૮	૨૪૭
૪		૩	૧૦	૫૯૦	૭	૧૦૧	૧૪	૭	૬૨૧
૫		૪	૧૦	૨૩૭	૮	૧૧૬	૭	૬	૯૯૫
૬		૫	૯	૮૮૪	૯	૧૩૧	[illegible]	૬	૩૭૦
૭		૬	૯	૫૩૨	૧૦	૧૪૫	૯	૫	૭૪૪
૮		૭	૯	૧૭૯	૨૦	૨૯૧	૨	૧૧	૪૮૯
૯		૮	૮	૮૨૭	૩૦	૪૩૬	૧૨	૫	૨૩૩
૧૦		૯	૮	૪૭૪	૪૦	૫૮૨	૫	૧૦	૯૭૭
૧૧		૧૦	૮	૧૨૧	૫૦	૭૨૭	૧૫	૪	૭૨૧
શીલીંગ ૧		૧૧	૭	૭૬૯	૬૦	૮૭૩	૮	૧૦	૪૬૬
૨	૧	૭	૩	૫૩૭	૭૦	૧,૦૧૯	૨	૪	૨૧૦
૩	૨	૨	૧૧	૩૦૬	૮૦	૧,૧૬૪	૧૧	૯	૯૫૪
૪	૨	૧૪	૭	૦૭૫	૯૦	૧,૩૧૦	૫	૩	૬૯૯
૫	૩	૧૦	૨	૮૪૪	૧૦૦	૧,૪૫૫	૧૪	૯	૪૪૩
૬	૪	૫	૧૦	૬૧૨	૨૦૦	૨,૯૧૧	૧૩	૬	૮૮૬
૭	૫	૧	૬	૩૮૧	૩૦૦	૪,૩૬૭	૧૨	૪	૩૨૯
૮	૫	૧૩	૨	૧૫૦	૪૦૦	૫.૮૨૩	૧૧	૧	૭૭૧
૯	૬	૮	૯	૯૧૮	૫૦૦	૭,૨૭૯	૯	૧૧	૨૧૪
૧૦	૭	૪	૫	૬૮૭	૬૦૦	૮,૭૩૫	૮	૮	૬૫૭
૧૧	૮	૦	૧	૪૫૬	૭૦૦	૧૦,૧૯૧	૭	૬	૧૦૦
૧૨	૮	૧૧	૯	૨૨૪	૮૦૦	૧૧,૬૪૭	૬	૩	૫૪૩
૧૩	૯	૭	૪	૯૯૩	૯૦૦	૧૩,૧૦૩	૫	૦	૯૮૬
૧૪	૧૦	૩	૦	૭૬૨	૧,૦૦૦	૧૪,૫૫૯	૩	૧૦	૪૨૮
૧૫	૧૦	૧૪	૮	૫૩૧	૧,૫૦૦	૨૧,૮૩૮	૧૩	૯	૬૪૩
૧૬	૧૧	૧૦	૪	૩૦૦	૨,૦૦૦	૨૯,૧૧૮	૭	૮	૮૫૭
૧૭	૧૨	૬	૦	૦૬૮	૩,૦૦૦	૪૩,૬૭૭	૧૧	૭	૨૮૫
૧૮	૧૩	૧	૭	૮૩૬	૪,૦૦૦	૫૮,૨૩૬	૧૫	૫	૭૧૪
૧૯	૧૩	૧૩	૩	૬૦૫	૫,૦૦૦	૭૨,૭૯૬	૩	૪	૧૪૨
પૌંડ ૧	૧૪	૮	૧૧	૩૭૪	૧૦,૦૦૦	૧,૪૫,૫૯૨	૬	૮	૨૮૫
૨	૨૯	૧	૧૦	૭૪૯	૨૦,૦૦૦	૨,૯૧,૧૮૪	૧૩	૪	૫૭૧
૩	૪૩	૧૦	૧૦	૧૨૩	૪૦,૦૦૦	૫,૮[illegible],૩૬૯	૧૦	૯	૧૮૨

શી. ૧-૪ પેન્સ ૭ાા આના						શી. ૧-૪ ૩૧/૬૪ પેન્સ (૧-૪ાા)					
પાઈ.	પાઊંડ	શી.	પે.		ફાર	રૂપીઆ.	પાઊંડ	શી	પે.		ફાર
૧				૦	૩૪૩	૮		૧૦	૧૧	૩	૫૦૦
૨				૦	૬૮૭	૯		૧૨	૪	૧	૪૩૮
૩				૧	૦૩૦	૧૦		૧૩	૮	૩	૩૭૫
૪				૧	૩૭૪	૨૦	૧	૭	૫	૨	૭૫૦
૫				૧	૭૧૭	૩૦	૨	૧	૨	૨	૧૨૫
૬				૨	૦૬૦	૪૦	૨	૧૪	૧૧	૧	૫૦૦
૭				૨	૪૦૪	૫૦	૩	૮	૮	૦	૮૭૫
૮				૨	૭૪૭	૬૦	૪	૨	૫	૦	૨૫૦
૯				૩	૦૯૧	૭૦	૪	૧૬	૧	૩	૬૨૫
૧૦				૩	૪૩૫	૮૦	૫	૯	૧૦	૩	
૧૧				૩	૭૭૭	૯૦	૬	૩	૭	૨	૩૭૫
આના ૧			૧	૦	૧૨૧	૧૦૦	૬	૧૭	૪	૧	૭૫૦
૨			૨	૦	૨૪૨	૨૦૦	૧૩	૧૪	૮	૩	૫૦૦
૩			૩	૦	૩૬૩	૩૦૦	૨૦	૧૨	૧	૧	૨૫૦
૪			૪	૦	૪૮૪	૪૦૦	૨૭	૯	૫	૩	
૫			૫	૦	૬૦૫	૫૦૦	૩૪	૬	૧૦	૦	૭૫૦
૬			૬	૦	૭૨૭	૬૦૦	૪૧	૪	૨	૨	૫૦૦
૭			૭	૦	૮૪૮	૭૦૦	૪૮	૧	૭	૦	૨૫૦
૮			૮	૦	૯૬૯	૮૦૦	૫૪	૧૮	૧૧	૨	
૯			૯	૧	૦૯૦	૯૦૦	૬૧	૧૬	૩	૩	૭૫૦
૧૦			૧૦	૧	૨૧૧	૧,૦૦૦	૬૮	૧૩	૮	૧	૫૦૦
૧૧			૧૧	૧	૩૩૨	૧,૫૦૦	૧૦૩	૦	૬	૨	૨૫૦
૧૨		૧	૦	૧	૪૫૩	૨,૦૦૦	૧૩૭	૭	૪	૩	
૧૩		૧	૧	૧	૫૭૪	૩,૦૦૦	૨૦૬	૧	૧	૦	૫૦૦
૧૪		૧	૨	૧	૬૯૫	૪,૦૦૦	૨૭૪	૧૪	૯	૨	
૧૫		૧	૩	૧	૮૧૬	૫,૦૦૦	૩૪૩	૮	૫	૩	૫૦૦
રૂપીઆ ૧		૧	૪	૧	૯૩૭	૧૦,૦૦૦	૬૮૬	૧૬	૧૧	૩	
૨		૨	૮	૩	૮૭૫	૨૦,૦૦૦	૧ ૩૭૩	૧૩	૧૧	૨	
૩		૪	૧	૧	૮૧૩	૩૦,૦૦૦	૨,૦૬૦	૧૦	૧૧	૧	
૪		૫	૫	૩	૭૫૦	૪૦,૦૦૦	૨,૭૪૭	૭	૧૧	૦	
૫		૬	૧૦	૧	૬૮૮	૫૦,૦૦૦	૩,૪૩૪	૪	૧૦	૩	
૬		૮	૨	૩	૬૨૫	૧,૦૦,૦૦૦	૬.૮૬૮	૯	૯	૨	
૭		૯	૭	૧	૫૬૩	૨,૦૦,૦૦૦	૧૩,૭૩૬	૧૯	૭	૦	

(વીલાયતની હુંડી.) પૌંડના રૂપીઆ

શી ૧-૪ પેન્સ ૮ આના					શી. ૧-૪ ૬ પેન્સ (૧-૪ાા)				
પેન્સ	રૂપીઆ	આ	પા	દો.	પૌંડ	રૂપીઆ	આ	પ.	દો.
૧		૦	૧૧	૬૩૬	૪	૫૮	૨	૧૦	૯૦૯
૨		૧	૧૧	૨૭૩	૫	૭૨	૧૧	૭	૬૩૬
૩		૨	૧૦	૯૦૯	૬	૮૭	૪	૪	૩૬૪
૪		૩	૧૦	૫૪૫	૭	૧૦૧	૧૩	૧	૦૯૧
૫		૪	૧૦	૧૮૨	૮	૧૧૬	૫	૯	૮૧૮
૬		૫	૯	૮૧૮	૯	૧૩૦	૧૪	૬	૫૪૫
૭		૬	૯	૪૫૫	૧૦	૧૪૫	૭	૩	૨૭૩
૮		૭	૯	૦૯૧	૨૦	૨૯૦	૧૪	૬	૫૪૫
૯		૮	૮	૭૨૭	૩૦	૪૩૬	૫	૯	૮૧૮
૧૦		૯	૮	૩૬૪	૪૦	૫૮૧	૧૩	૧	૦૯૧
૧૧		૧૦	૮	૦૦૦	૫૦	૭૨૭	૪	૪	૩૬૪
શીલીંગ ૧		૧૧	૭	૬૩૬	૬૦	૮૭૨	૧૧	૭	૬૩૭
૨	૧	૭	૩	૨૭૩	૭૦	૧,૦૧૮	૨	૧૦	૯૦૯
૩	૨	૨	૧૦	૯૦૯	૮૦	૧,૧૬૩	૧૦	૨	૧૮૨
૪	૨	૧૪	૬	૫૪૫	૯૦	૧,૩૦૯	૧	૫	૪૫૫
૫	૩	૧૦	૨	૧૮૨	૧૦૦	૧,૪૫૪	૮	૮	૭૨૭
૬	૪	૫	૯	૮૧૮	૨૦૦	૨૯,૦૯	૧	૫	૪૫૫
૭	૫	૧	૫	૪૫૫	૩૦૦	૪,૩૬૩	૧૦	૨	૧૮૨
૮	૫	૧૩	૧	૦૯૧	૪૦૦	૫,૮૧૮	૨	૧૦	૯૦૯
૯	૬	૮	૮	૭૨૭	૫૦૦	૭.૨૭૨	૧૧	૭	૬૩૬
૧૦	૭	૪	૪	૩૬૪	૬૦૦	૮ ૭૨૭	૪	૪	૩૬૪
૧૧	૮	૦	૦	૦૦૦	૭૦૦	૧૦,૧૮૧	૧૩	૧	૦૯૧
૧૨	૮	૧૧	૭	૬૩૬	૮૦૦	૧૧,૬૩૬	૫	૯	૮૧૮
૧૩	૯	૭	૩	૨૭૩	૯૦૦	૧૩,૦૯૦	૧૪	૬	૫૪૫
૧૪	૧૦	૨	૧૦	૯૦૯	૧,૦૦૦	૧૪,૫૪૫	૭	૩	૨૭૩
૧૫	૧૦	૧૪	૬	૫૪૫	૧,૫૦૦	૨૧.૮૧૮	૨	૧૦	૯૦૯
૧૬	૧૧	૧૦	૨	૧૮૨	૨,૦૦૦	૨૯,૦૯૦	૧૪	૬	૫૪૫
૧૭	૧૨	૫	૯	૮૧૮	૩,૦૦૦	૪૩,૬૩૬	૫	૯	૮૧૮
૧૮	૧૩	૧	૫	૪૫૫	૪,૦૦૦	૫૮,૧૮૧	૧૩	૧	૦૯૧
૧૯	૧૩	૧૩	૧	૦૯૧	૫,૦૦૦	૭૨,૭૨૭	૪	૪	૩૬૪
પૌંડ ૧	૧૪	૮	૮	૭૨૭	૧૦,૦૦૦	૧,૪૫,૪૫૪	૮	૮	૭૨૭
૨	૨૯	૧	૫	૪૫૫	૨૦,૦૦૦	૨,૯૦,૯૦૯	૧	૫	૪૫૫
૩	૪૩	૧૦	૨	૧૮૨	૪૦,૦૦૦	૫,[illegible]૮૧૮	૨	૧૦	૯૦૯

[illegible] ૧-૪ પેન્સ ૮ આના						શી ૧-૪ ½ પેન્સ (૧-૪॥)				
પાઇ.		પૌંડ	શી	પે	દ.ર.	રૂપીઆ.	પૌંડ.	શી.	પે.	દ.ર.
	૧				૦૩૪૪	૮		૧૧	૦	૦
	૨				૦૬૮૮	૯		૧૨	૪	૨
	૩				૧૦૩૧	૧૦		૧૩	૯	
	૪				૧૩૭૫	૨૦	૧	૭	૬	
	૫				૧૭૧૯	૩૦	૨	૧	૩	
	૬				૨૦૬૩	૪૦	૨	૧૫	૦	
	૭				૨૪૦૬	૫૦	૩	૮	૯	
	૮				૨૭૫૦	૬૦	૪	૨	૬	
	૯				૩૦૯૪	૭૦	૪	૧૬	૩	
	૧૦				૩૪૩૮	૮૦	૫	૧૦	૦	
	૧૧				૩૭૮૧	૯૦	૬	૩	૯	
આના.	૧			૧	૦૧૨૫	૧૦૦	૬	૧૭	૬	
	૨			૨	૦૨૫૦	૨૦૦	૧૩	૧૫	૦	
	૩			૩	૦૩૭૫	૩૦૦	૨૦	૧૨	૬	
	૪			૪	૦૫૦૦	૪૦૦	૨૭	૧૦	૦	
	૫			૫	૦૬૨૫	૫૦૦	૩૪	૭	૬	
	૬			૬	૦૭૫૦	૬૦૦	૪૧	૫	૦	
	૭			૭	૦૮૭૫	૭૦૦	૪૮	૨	૬	
	૮			૮	૧	૮૦૦	૫૫	૦	૦	
	૯			૯	૧૧૨૫	૯૦૦	૬૧	૧૭	૬	
	૧૦			૧૦	૧૨૫૦	૧,૦૦૦	૬૮	૧૫	૦	
	૧૧			૧૧	૧૩૭૫	૧,૫૦૦	૧૦૩	૨	૬	
	૧૨		૧	૦	૧૫૦૦	૨,૦૦૦	૧૩૭	૧૦		
	૧૩		૧	૧	૧૬૨૫	૩,૦૦૦	૨૦૬	૫		
	૧૪		૧	૨	૧૭૫૦	૪,૦૦૦	૨૭૫	૦		
	૧૫		૧	૩	૧૮૭૫	૫,૦૦૦	૩૪૩	૧૫		
રૂપીઆ	૧		૧	૪	૨	૧૦,૦૦૦	૬૮૭	૧૦		
	૨		૨	૯	૦	૨૦,૦૦૦	૧,૩૭૫	૦		
	૩		૪	૧	૨	૩૦,૦૦૦	૨,૦૬૨	૧૦		
	૪		૫	૬	૦	૪૦,૦૦૦	૨,૭૫૦	૦		
	૫		૬	૧૦	૨	૫૦,૦૦૦	૩,૪૩૭	૧૦		
	૬		૮	૩	૦	૧,૦૦,૦૦૦	[illegible]૮૭૫	૦		
	૭		[illegible]	૭	૨	૨,૦૦,૦૦૦	૧૩,[illegible]૫૦	૦		

સમાપ્ત.